

બાળભૂતાવળી : પ્રથમ અંશી : ૧

# શ્રી રીખવદેવ

લેખક :

ધીરજલાલ ટોફરશી શાહ



સર્વલક્ષ સ્વાધીન

અભિયાઃ

જ્યોતિ કા ર્દી લ થ  
પાડાપોળ સાગે, ગાંધીરોડ,  
અ અ ડા વા ઈ.

આ પુસ્તક મુખ્યાં ચલાડા ડેલવર્ણી ભાતામાં તથા વડોદરા રાજ્યની લાયબેરીએ અને ઘનામ માટે મંજૂર થયેલું છે. તથા નૌ. શ્રી. મુ. પુ. એન્યુકેશન એર્ડ તરફથી કન્યાધોરણ પ્રથમમાં પાઠ્ય પુસ્તક તરીકે મંજૂર થયેલું છે.

### આ પુસ્તકની આવૃત્તિએ।

પ્રથમ આવૃત્તિ	૧૦૦૦	આસો સુદી	૮	૧૯૮૪
બીજી આવૃત્તિ	૫૫૦૦	કારતક સુદી	૧૩	૧૯૮૫
ત્રીજી આવૃત્તિ	૧૪૫૦	આવણુ વદી ૦)		૧૯૮૬
ચોથી આવૃત્તિ	૧૫૫૦	માણ સુદી	૧૫	૧૯૮૭
પાંચમી આવૃત્તિ	૧૧૦૦	ભાડરવા સુદી	૧	૧૯૮૮

સુધારાવધારા સાથે

### હિંદીમાં

પ્રથમ આવૃત્તિ ૧૦૦૦ દ્વારાણ ૧૯૮૮

### ભાગમાંથાવળીની પ્રકાશિત થયેલી કુલ પ્રતિએ।

સંવત ૧૯૮૮ ના ભાડરવા સુદી ૧

પ્રથમ શ્રેણી ૮૮૫૦, બીજી શ્રેણી ૪૭૦૦૦, ત્રીજી શ્રેણી ૪૦૦૦૦ ચોથી શ્રેણી ૨૧૫૦૦, પાંચમી શ્રેણી ૨૫૦૦૦, છુટી શ્રેણી ૨૫૦૦૦

હિંદી પ્રથમ શ્રેણી ૨૧૫૦૦

કુલ નકલ ૨૭૩૮૫૦

એ લાખ તહેતેર હજાર રૂપાંશે ને પચાસ.

સુધ્યક અને પ્રકાશક : ધીરજલાલ ટોકરથી ચાહ. ૧૩  
ન્યેતિ સુદ્ધાલય : ગાંધી રોડ : પાઢપોળ સામે : અમદાવાદ.

## પાંચમી આવૃત્તિ પ્રકટ કરતાં:-

---

**કો**ર્ણ તત્ત્વજ્ઞાન સામાન્ય જ્ઞનસમાજને પચતું નથી. એને તો એ તત્ત્વજ્ઞાન કથાઓ દ્વારા રજૂ થાય તો જ સમજમાં આવે. કદાચ એની સીધી અસર ન જાણ્યા તો પણ સુક્રમ રીતે એના સંસ્કારો મન પર પડે છે. આથી કૈન સાહિત્યનો વિશાળ પ્રદેશ આ કથાઓએ રોડ્સો છે. સમય તથા લોકાની ઇચ્છિ પ્રમાણે એ એ કથાઓમાં વિદ્યાન લેખકોએ શૈલિ તથા ભાષાનો ઉપયોગ કર્યો છે, છતાં કેમ ભાગના અનેક મણુકાઓ એક જ સૂતર્થી ગુંથાયેલ હોય છે તેમ આ કથાઓ એક શાંત રસ-વૈરાગ્ય ભાવનાની સિદ્ધિને માટે ગુંથાયેલી છે.

આ કથાઓનું લાક્ષ્ય મર્યાદમાં રહેલી પાણવર્ષતિને ઉસુકેરિને અધમ આનંદ આપવાનું નથી. એટથે એમાં બૃગાર વીર-કરુણ અહેભતાદિ અધા રહ્સાના "ખુટ્યા" ઉપયોગ હોયા છતાં

તેમને ગૌણું સ્થાન આપવામાં આવ્યું છે. આ કથાએનું સાધ્ય મનુષ્ય જીવનમાં રહેલા કષાયના અમ્રિને શાંત કરી આત્મરસનો અનુભવ કરાવવાનું છે. એમાં તેણે ધર્થી સફળતા મેળવી છે એ નિર્ણયાદ છે.

લિન લિન ભૂમિકાપર રહેલા મનુષ્યોને કથાએના લિન લિન સ્વરૂપે જ બોધી શકાય : એ મહાન સત્ય લક્ષમાં રાખીને આ કથાએની યોજના થયેલી છે. એમાં કેટલાક વાસ્તવિકતાને જ શોધવા મય્યતા સાહિત્યકારોને અસંભવિત કથાએ—અર્થધીન કથાએ બાગે છે. પણ તેઓ ભૂલી જાય છે કે વાસ્તવિકતાના મહાન પૂજારી પદ્ધિમના દેશોમાં પણ પ્રથમ ભૂમિકાને માટે પરીક્ષાર્થીએનો છુટથી ઉપયોગ થાય છે. બ્ધી કથાએ વાસ્તવિક હોણી જોઈએ એવું કંઈ જ નથી. કલ્પનાને પૂર્ણ છુટ આપવા માત્રથી એ વાતનું મહત્વ જરાયે એધું થતું નથી. બલ્કે જેને ઉદ્દેશને લખાઈ છે એ ઉદ્દેશ જેતાં વધે છે.

આજથી થોડાં વર્ષોં પહેલાં મુદ્રણુકળાનો પ્રચાર ન હતો ત્યારે આ વાતો કદાચ આજના કરતાં પણ વધારે પ્રમાણુમાં જતસમાજને પહોંચતી. તેનાં કારણો અનેક છે. જીવનવિગ્રહ ઉમ નહિ હોવાથી શાંત ભાવે વ્યાખ્યાનાદિનું અવણું થતું. પુરસદ્ધાના સમયમાં એ કથાએ અંગુણાએનાં કહેવાતી. સર્કારી ભાતાના ભાગકો ભાગ્યે જ એવાં હશે કે જેણે ભાતાની અક્ષિતભરી ને ભીડી લાણુથી આ મહાન વ્યક્તિએના ઉત્તમ ચરિત્રા નહિ સાંભળ્યા હોય; કેખકને તો એનો અપૂર્વ લાલ મળેલો છે. ને એણે

એવો લાલ બીજને ભર્તો જોયે છે. પરંતુ જીવનની દિશા અદ્વિતાની આજની ભાતાઓ ધર્મના સંકારમાં ઉત્તરી જાહેર છે. પોતાના ધર્મનું તથા આત્મા, કથા આદિનું સંગીત રોચાન હોય તેવી ભાવિતાઓ, આજે ભજુ થોડી મળશે. એટલે આજના ભાગને આ અમૃત્ય વારસાથી વંચિત થવાનો પ્રસંગ આપ્યે છે. આ પરિસ્થિતિ અસંખ્ય છે.

ધાર્મિક શિક્ષણું તરીકે જન્મારે જોળાંનો સહૃદાસમાં આવતાં મને જણાયું કે મહાનમાં મહાન વ્યક્તિના જીવનચરિત્રાં માટે એ એલ પણ દશ દશ વર્ષની ઉભ્મર સુધી તેમને મજ્યા નથી લારે એ સંબંધી ઘૂર્ણ લાગ્યું અને કોઈ પણ જાતની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં એ દિશામાં નાચ પ્રયાસ કરવા પ્રયત્ન કર્યો. આજે એ જાતના સાહિત્યના અર્થીત આગ્રાંથાવળીનાં ૧૨૦ પુસ્તકો તૈયાર થયાં છે. જેને કૈન સમાજના બધા નર્ગી હાર્દિક સત્કાર આપ્યો છે. એથી જ પાંચ વર્ષ જેટલા સમયમાં તેની લાખો નકલ પ્રસિદ્ધ કરવા શક્તિમાન થયો છું. ને આ, પુસ્તકની પાંચમી આવૃત્તિ પ્રગત કરવાનું બન્યું છે. આ સધળું જોતાં એટલું કહી શકાય કે મારો પ્રયત્ન કાંઈક અંશે સકળ થયો છે.

આજે જે કે કૈન ભાઇઓનો મોટો ભાગ વ્યાપારપ્રિય હોવાથી સાહિત્ય તરફ જેઠાં તેવું લક્ષ આપતો નથો, પણ હવે એ સમય આવી પહોંચ્યો છે કે જન્મારે એની ઉપેક્ષા બિલકુલ ચાલી શકશે નહિ.

ને ને બાધકોએ આજ સુધી આ અથાવળી તરફ  
પોતાની સહાયતૃતિ ને ભદ્ર દર્શાવ્યા છે તેમને એકં વિનંતી  
કે અવિષ્યમાં પ્રગટ કરવા ધારેલી જુદી જુદી અન્યમાળાઓમાં  
ખણું તે ભદ્ર કરે ને કૈન સાહિત્યનો પ્રવાર કરવામાં પોતાને  
યોગ્ય કર્ણા આપે. વંદે વીરમ્ભ

ભાદ્રપદ સુદી ૧ : ૧૯૯૨  
નાયુવટી ખીદીંગ : ગાંધીરોડ  
અભાવાદ.

લી.  
સંખ્યસેવક  
ધીરજલાલ

## શ્રી રીખવહેવ

: ૧ :

દુષ્ટા જુના સમયની વાત છે. જ્યારે  
આ દેશમાં નહોતાં ગામનગર કે નહોતાં પુર-  
પાઠણ. સથળે લીલી કુંભર આડી. જ્યાં જુઓ  
ત્યાં અમૃત જેવાં મીઠાં ફૂળ. જ્યાં જુઓ  
ત્યાં અમૃત જેવાં મીઠાં પાણી. માણુસો આવાં  
અમૃત ફૂળ ઘાય ને મીઠાં પાણી પીએ. જગ-  
લમાં હરે ફરે અને મળ કરે. નહિ તોઢિને કળ્યો  
કે નહિ તોઢિને કંકાસ.

જગલમાં એમ હરેકરે છે અને મળ  
કરે છે. એવામાં આવ્યા હાથીલાઈ. એમની સાથે  
એક માણુસને થઈ હોસ્તી. એટલે દરરોજ તે

હાથી પર ચડે ને જગતમાં ફરે. એ માણુસનું  
નામ વિમળવાહન.

કાળનો મહિમા અનજ્ય છે. ધીમે ધીમે  
ફળફળાહિ થયાં ઓછાં ને માણુસોએ માંડયું  
લડવા. એક કહે કે મારાં આડ અને બીજે કહે  
કે મારાં આડ. એક કહે એનાં ફળ હું લઉં ને  
બીજે કહે એનાં ફળ હું લઉં. એવામાં નીકળ્યા  
વિમળવાહન. તે હાથી પર ઘેઠા છે ને દેવ  
જૈવા શોભે છે. માણુસો લડતા લડતા એમની પાસે  
ગયા અને કચ્છું :

‘બાપજી ! અમારી તકરાર પતાવો. ’  
વિમળવાહન કહે. ‘આ આડ તમારાં ને આ આડ  
તમારાં. જાઓ કોઢ લડશો મા ! ખાઓ. પીઓ  
ને મોજ કરો. ’

વિમળવાહન આ ટોળીના—કુળના સ્વામી  
થયા એટલે ગણ્યા કુળકર.

આ વાતને વરસો વીતી ગયાં. વિમળ-  
વાહન ગુજરી ગયા ને તેમની છ પેઢીઓ પણ  
ચાલી ગઈ. સાતમી પેઢીએ થયા નાભિ કુળકર.  
તેમની ખીનું નામે મરુદેવા. તેમને રૂપ રૂપનાં

અંધાર ને કંચન જેવી કાયાવાળા હીકરો જત્યા.  
તેમનું નામ રીખવહેવ. તે લાડકોડે ઉછરે છે ને  
મોટા થાય છે.

: ૩ :

એક દિવસ દેવી જેવી એક બાળા વન-  
માં ફરી રહી છે. નથી બિચારીને મા કે નથી  
બિચારીને બાપ! બીજ માણુસો તેને રખડતી  
નેછિને લાવ્યા નાલિકુળકર પાસે. તેનું નામ  
સુનંદા.

નાલિ કુળકર કહે, ‘કન્વા ઘડુ સારી  
છે. રીખવને પરણુાવીશું. આ એક સુનંદા ને બીજ  
એક સુમંગળા.’

રીખવહેવને પરણુાવવાની ધામધૂમ ચાલી.  
ઘધી તૈયારીએ થઈ ગઈ ને રીખવહેવ સુનંદા  
તથા સુમંગળાને પરણ્યા. સધળે જોનેકાર થઈ  
રહ્યો. સહુ આનંદમાં વખત પસાર કરવા લાગ્યા

હવે સુમંગળાને થયું એક પુત્રપુત્રીનું  
બેડલું. એમનાં નામ પાડ્યાં ભરત અને પ્રાહી.  
સુનંદાને પણ થયું એક પુત્રપુત્રીનું બેડલું.

અમનાં નામ પાડ્યાં ખાડુભળી ને સુંહરી. સુમં-  
ગળાને બીજી પણ ધણા પુત્રો થયા.

: ૪ :

એ વાતને વર્ષો વીતી ગયાં.

હવે તો અમૃત જ્ઞેવાં કુળો યે ધટી ગયાં  
ને અમૃત જ્ઞેવાં પાણી યે મટી ગયાં. માણુસો  
પાંદડાં, કુળકૂલ ને જંગલમાં ઉગેલું અનાજ ખાય.  
પણ એ અનાજ પચે નહિ. આનાજ ખાય અને  
દુઃખી થાય. એક દિવસ ખધા રીખવહેવ પાસે  
આવીને કહેવા લાગ્યા.

‘હેવ! કોઈ ઉખાય બતાવો. અમને ખાદું  
કંઈ પચતું નથી.’

રીખવહેવ કહે, ‘અનાજને હાથથી મસળો,  
પાણીમાં પડાળો ને પડીયામાં લઈને ખાઓ તો  
અપચો નહિ થાય..’

માણુસો હવે તેમ કરવા લાગ્યા. પણ  
થોડા દિવસ થયા ને કુરીથી અપચો શરૂ થયો.  
શ્રીલે સહુ કહે, ‘ચાલો રીખવહેવ પાસે; અમના  
સિવાય આપણું કોણ છે?’

સહુ રીખવહેવ પાસે આવ્યા અને કહ્યું  
 ‘ભગવનું ! આપના કહ્યા પ્રમાણે કર્યું, પણ  
 અનાજ ખાદું પચતું નથી.’

રીખવહેવ કહે, ‘પલાળેલા અનાજને  
 મુઠીમાં રાખો ને પછીથી ખાલે.’

માણુસો કહે, ‘હાશ ! હવે નિરાંત  
 થછ.’ પણ થોડા હિવસ થયા ને ફરી પાછો  
 અપચો થવા લાગ્યો. ‘હવે કરવું શું !’  
 સહુ એ વિચારમાં પડ્યા. એવામાં થયો પવન !  
 શું પવન ? શું પવન ? સામસાભી ઝાડની  
 મોટી ડાળો અથડાય ને જરૂર કડાકા થાય.  
 જ્યાં જુઓ ત્યાં વા ને વેટોળીઓ. જ્યાં  
 જુઓ ત્યાં ડાળોના કડાકા. એમ ઝાડની ડાળો  
 ખૂબ ધસાળી એટલે થયો દેવતા. એ તો  
 ભડભડાટ સળગવા લાગ્યો.

બોળા બિચારા માણુસો કહે, ‘અલ્યા !  
 આ કંઈક લેવાજેવું આવ્યું. હવે કેવું અગે છે ને !  
 ચાલો એને ઉપાડી લઈએ.’ જ્યાં લેવાને  
 હાથ લંખાવ્યાં ત્યાં તો હાથ દાખલા. ‘એય  
 બાપરે ! આ તો અહુ ભુડો !’ એમ કહીને

સહુ બુમ પાડવા લાગ્યા. પછી ગયા રીખવહેવ  
પાસે અને કહેવા લાગ્યા :

‘ બાપુજી ! જંગલમાં કોઈક લૂત આવ્યો  
છે, તે બધાને બહુ હેરાન કરે છે. માટે એનું કાંઈ કરો.’

રીખવહેવ કહે, ‘ અને હાથથી અહશો  
મા. એની આસપાસની ધાસ કાઢી નાખશો ને  
તેના પર લાકડાં ધરજે. એવાં લાકડાં એકઠાં  
કરજે અને તમારું પલાળોલું અનાજ એનાથી  
રાંધને. એ અનાજ ઘાશો તો આપચો નહિ થાય.’

માણુસો સહુ જંગલમાં આવ્યા ને ધાસ  
કર્યું દૂર. ધીમે ધીમે સળગતાં લાકડાં એકઠાં  
કર્યાં ને બનાવ્યું મોટું તાપણું. પછી પલાળીને  
પોતાની મુઠીમાં રાખેલાં અનાજ તાપણામાં  
નાખ્યાં અને રંધાવાની રાહ જેતા એઠા. પણ  
અનાજ તે એમ રંધાતાં હશે ? થોડીવારમાં  
બધું બળીને રાખ થયું. પાછું તે શું મળે ?

માણુસો કહે, ‘ આ તો અલ્યા બહુ  
ભુડો ! જેટલું આપીએ છીએ તેટલું ખાઈ  
જય છે ને પાછું તો કાંઈ પણ આપતો નથી !’  
સહુ નિરાશ થઈને આન્યા રીખવહેવ પાસે.

શ્રીખ્વહૃતેવ હાથી પર એઠા છે ને દેવ  
જેવા શોલે છે. તેમણે કહ્યું : ‘લાવો માટીનો  
લીલો પીંડો. ’

થોડી વારમાં પીંડો આવ્યો. શ્રીખ્વહૃતેવે  
તે પીંડો હાથીના માથાપર સુકળો ને તેનાં  
સુંદર મજલનાં વાસણો અનાવ્યાં. એ વાસણો  
માણુસોને પ્રતાવીને કહ્યું કે ‘આવાં વાસણો  
અનાવો ને તેમાં અનાજ રાંધેા. ’

સહુએ હવે તેમ કરવા માંડયું.

: ૫ :

માણુસો વાસણુમાં રાંધે છે ને ખાય છે,  
પણ હવે વાસણો રાખવાં કયાં? હવે તો  
પાહુલકાંનાં જેવા શરીર પણ રહ્યાં નહિ. રાતવરત  
જગલી જનાવરોનો હુમલો થાય ને રક્ષણ કરવું  
પણ ભારે પડે.

શ્રીખ્વહૃતેવ વિચાર્યું : ‘આમને હવે ધર  
વિના નહિ ચાલે, માટે ધર બાંધતાં શીખવું.’  
એટાં થોડા માણુસોને ઘોલાવ્યા ને ધર બાંધતાં  
શીખવ્યું. ત્યારથી માણુસો ધર બાંધીને જગલમાં  
રહેવા લાગ્યા.

પણ ધર તે એમને એમ શાલે ? કંઈક ચિતરામણું હોય તો ટીક. શ્રી રીખવહેવે એથી કેટલાક માણસોને ચિતરતાં શીખવ્યું. પણ થોડા દિવસો ગયા ને બીજી ચિંતા ઉલ્લિ થઈ ! માણસોને નાગા રખડતાં શરમ લાગી. તેમણે વિચાર્યું કે શરીર ઢાંકવા મટે કંઈક હોય તો સારાં એથી ટાઢ તાપ પણ એછાં લાગે. શ્રી રીખવહેવે જાળ્યું કે હવે માણસોને કપડાં વિના નહિ ચાલે, એટલે થોડાને પ્રાલાવીને ઝાડની છાલનાં કપડાં બનાવતાં શીખવ્યું.

: ૬ :

આમ ધીમે ધીમે રીખવહેવે લોકોને કળા શીખવી. પણ હવે માણસોનાં મન થયાં મેલાં. જ્યાં જુંએ ત્યાં કળુંએ ને જ્યાં જુંએ ત્યાં લડાઈ. છેવટે માણસો લડી લડીને કંઠાળે અને આવે રીખવહેવ પાસે.

એક દિવસ કેટલાક માણસોએ આવીને કહ્યું : ‘હૃવ ! હવે તો આ કળુંએ—કંકાશ મટે એવું કરો તો સારાં. કેઈ કેઈનું માનસું નથી અને હમેશાં લડાઈ ટંટા ચાલે છે.’

રીખવહેવ કહે, ‘રાજ હોય તો આ બધું મટે.’

માણુસો કહે, ‘તમે અમારા રાજ. ’

રીખવહેવ કહે, ‘પિતાની રન સિવાય રાજ  
ન થવાય. તમે પિતાજી પાસે જઈને વિનંતિ કરો!  
એ કહે તેમ કરીશ.’

આથી ઘધા નાલિ કુળકર પાસે આવ્યા  
ને વિનંતિ કરી. નાલિ કુળકર કહે, ‘ભલે,  
રીખવહેવ તમારો રાજ થશે.’

પિતાની રનથી રીખવહેવ રાજ થયા. તેએઓ  
સહુથી પહેલા રાજ થવાથી આહિનાથ કહેવાયા.

:૭:

અત્યાર સુધી લોકો જગતમાં છુટાછવાયા  
રહેતા, પણ રીખવહેવ રાજ થયા એટલે એક  
સુંદર શહેર વસ્યું. શહેરના ફરતો મજબુત  
કોટ થયો. અંદર મોટાં મોટાં મકાનો ને મોટી  
મોટી શેરીઓ થઈ, મોટી મોટી બજરો અંધાઈ  
ને મોટા મોટા ચોક બન્યા.

આ ગ્રમાણે ઠેર ઠેર ગામ વસ્યાં, ને  
પુરપાણું થયાં. જેતનેતામાં દેશમાં સધળે  
સુધારો ઝૈલાયો.

હવે તો લોકો હાથથી એતી કરે અને અનાજ પકડે. પણ હાથથી તે એતી કેટલેણ વખત થાય? એટલે શ્રી રીખવહેણ લોકોને ગાય, ભેંસ, ધીડા ઇત્યાદિ જગતમાં રહેતાં જનાવરોને પાળતાં શીખવ્યું.

લોકો જનાવર પાસે એતી કરાવવા લાગ્યા, ને ગાય, ભેંસમાંથી દૂધ પણ મેળવવા લાગ્યા.

જનાવરની મહદ્દી એતી ખૂબ થવા લાગ્યી, ને પાક પણ ખૂબ થવા લાગ્યો. પછી તો એક ઘીજમાં માલની લેવડહેવડ થઈ ને વેપાર શરૂ થયો. વેપાર પણ જેતનેતામાં ધણો વધ્યો.

આ પ્રમાણે વ્યધી જતનો સુધારો શ્રી રીખવહેણ દાખલ કર્યો, એથી તેઓ આજની માનવજલિના પ્રથમ સુધારક ગણ્યાય છે.

: ૮ :

આદિનાથ રાજપાટ ભોગવે છે ને આનંદ કરે છે. એવામાં એમને વિચાર આવ્યો કે, લોકોને મેં કળાઓ તો શીખવી, પણ ધર્મનથી શીખવ્યો; માટે ધર્મ શીખવું. ધર્મની શરૂઆત દાનથી થાય એટલે રાજમહેલે દાન-

શાળા માંડીને એક વર્ષ સુધી અઠળક દાન દીધું. પછી એમણે પોતાના બધા પુત્રોને જુદા જુદા દેશનું રાજ્ય સૌંપી દીધું, ને પોતે બધો વૈભવ છોડી તહન સાહું જીવન શરૂ કર્યું. તહન સાહું જીવન ગાળનારને સાધુ કહેવાય. મતલખ કે શ્રી રીખવહેવ સાધુ થયા.

એમના શરીર પર એક જ કપડું. માથું ન પગ ઉધાડા. ન ગણે ટાઢ કે ન ગણે તહકો. બસ જ્યારે જુઓ ત્યારે ધ્યાન. લિક્ષા લેવા જય પણ માણસો જણે નહિ કે તેમને શું અપાય !

કોઈ કહે, 'આ ધરેણાં હ્યો,' કોઈ કહે, 'આ કંન્યા હ્યો.' પણ સાધુને એ શું કામનાં ? એમ કરતાં વરસ એક વીતી ગયું. રીખવહેવ ફરતા ફરતા હસ્તિનાપુર આવ્યા.

લોકોનાં ટોળેટોળાં એમનાં દર્શન કરવા ઉલ્લિપ પડ્યાં ને પોતાને ઘેર ભોજન લેવાનાં નોતરાં હેવા લાગ્યા. પણ રીખવહેવ કાંઈ બોલ્યા નહિ.

એમ કરતાં આવ્યા શ્રેયાંસકુમારના મકાન

આગળ. શ્રેયાંસકુમાર રીખવહેવના પુત્ર ખાડું-  
ખળીના પૈત્ર થાય. લોકો ચારે ખાનુંએ ટોળે  
મજ્યાં છે ને કોલાહલ થાય છે. શ્રેયાંસકુમારે  
આ કોલાહલ સાંભળી છઈદારને કહ્યું, ‘ખહાર  
જઈને તપાસ કર તો ! આટલો ખદો અવાજ  
શેનો થાય છે ? ’

છઈદારે ખહાર જઈને તપાસ કરી, અને  
પાછા આવીને જણાવ્યું : ‘ જ મહારાજ !  
શ્રી રીખવહેવ ભગવાનું જે આપના વડા દાદા  
છે. તેઓ પધાર્યા છે. તેમની આસપાસ લોકોનાં  
દોળે ટોળાં મજ્યાં છે. અને એથી આટલો ખદો  
અવાજ થાય છે. ’

શ્રેયાંસકુમાર આ સાંભળી એકદમ હોડયા  
ને પ્રભુના પગમાં માથું મૂકી દીધું. તેમનું  
હૈયું ભક્તિ અને આનંદથી ઉલરાઈ ગયું.  
આનંદના ઉલરામાં વિચાર કરતાં કરતાં તેમને  
ખખર પડી કે સાધુને કેવી લિક્ષા અપાય.

:૬:

આ વખતે શ્રેયાંસકુમારને ત્યાં શેરડીનો  
રસ આવેલો હતો. તેમણે શ્રી રીખવહેવને

વિનંતિ કરી કે 'ભગવાન મારે ત્યાંથી લિક્ષા લઈ મને પાવન કરો. આપને લેવા લાયક આ શેરડીનો રસ તૈયાર છે.'

આ સાંભળી શ્રી રીખવહેવે પોતાના બેહાથ ધર્યા. હાથ એ જ તેમનું વાસણું હતું. આમ એક વરસની આખરે શ્રેયાંસકુમારે શ્રી રીખવહેવને શુદ્ધ લિક્ષા આપી.

શ્રી રીખવહેવે એનાથી પારણું કર્યું, એટલે સધળા લોકો હરખાયા, તેમણે ઘધાએ શ્રેયાંસ-કુમારને ધન્યવાહ આપ્યો ને કહેવા લાગ્યા કે 'ધન્ય આવા સુપાત્રને ! ધન્ય આવા હાન હેનારને !'

આહિનાથ ભગવાન આ પ્રમાણે ધણું ફર્યા. ફરતાં ફરતાં તેમને દુનિયાનું સાચું અને પુરણ જ્ઞાન એટલે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે લોકોને ઉપદેશ દીધ્યા.

પોતાની ભૂલો સુધારી જીવનને પવિત્ર ઘનાવવું.

કોઈ જીવને મારવો નહિ.

સહુ સાથે હેતથી વર્તવું.

જુહું ઘાલવું નહિ.

ચોરી કરવી નહિ.

શીયળત્રત પાળવું.

સંતોષથી રહેવું.

વ્યસનો પાડવાં નહિ.

સંતોની સેવા કરવી વગેરે

ધણા લોકો આ ધર્મ પાળવા લાગ્યા.

જે લોકો ઉપર કહેલો ધર્મ પાળવા લાગ્યા  
તેમનો એક સંધ સ્થાપ્યો. એ સંધ તીર્થ પણ  
કહેવાય છે, તેથી આદિનાથ પહેલા તીર્થ કરનારા  
-તીર્થાંકર થયા.

આવી રીતે ધણો વખત ઉપહેશ આપીને  
તચ્ચા નિર્વિષુ પામ્યા. આજે પણ લોકો સવારમાં  
જાઈ તેમનું સ્મરણું કરે છે.

શ્રી રીખવહેવનાં ધણું તીર્થી છે.  
શત્રુંજય, આયુ, રાણુકપુર, કેશરીયાળ, અગડી-  
યાળ, વગેરે.

ઘાલો રીખવહેવ ભગવાનકી જે !

ઘાલો શ્રીઆદીક્ષર દેવકી જે !

બાળ અન્થાવળી : પ્રથમ શેષી : ૨

# નેમ-રાજુલ

: લેખક :

ધીરજલાલ ટોકરશી શાહ



સર્વ હજી સ્વાધીન

આષત્તિ પાંચમી : કુલ ૫૨૦૦ : સંવત ૧૯૬૧

મૂલ્ય સરવાચાનો.

પ્રકાશક :  
**ધીરજલાલ ટોકરકી શાહ**  
**જ્યોતિ કાર્યાલય**  
 રતનપોળ,  
 અ. મ. દા. વા. ૬.

પહેલી વાર	૧૨૫૦ કાર્સલક	૧૫'-૧૬૮૫
બીજી વાર	૧૧૦૦ ચૈત્ર વદ	૧'-૧૬૮૫
ત્રીજી વાર	૭૫૦ આવણું સુદ	૧૫'-૧૬૮૬
ચોથી વાર	૧૦૦૦ આસો સુદ	૧૫'-૧૬૮૭
પાંચમી વાર	૧૧૦૦ જેઠ વદી ૦))	-૧૬૯૧

જેમના સમૃદ્ધ કથાભંડાર  
 માંથી ચોડા કથારતનો  
 પામી શક્યો તે પૂજય  
 માતુશ્રીને આ બાળગંથા-  
 વળાની પ્રથમ એષ્ટીનું  
 દ્વિતીય પુષ્પ બક્કિ પૂર્વક  
 ચડાંદું છું.

# નેમ રાજુલ

: ૧ :

એક હતું મોહું શહેર. બરાબર જમના નહીને  
કિનારે. તેનું નામ શારિપુર. ત્યાં એક લદા રાજ  
રાજ્ય કરે. તેમનું નામ સમુદ્રવિજય. તેમની રાણીનું  
નામ શિવાટેવી. શિવાટેવીથી તેમને એક પુત્ર થયો.  
તેમનું નામ અરિષ્ઠનેમિ. તેમને ખધા નેમનાથ પણું  
કહેતા. શું નેમનાથનું જાન ! શું નેમનાથના ગુણ ! હોઠ  
અનું વર્ણન કરી શકે નહિ.

: ૨ :

રાજ સમુદ્રવિજયને નવ ભાઈઓ હતા. ખધા તેમનાથી  
નાના. તેમાં સહુથી નાના વાસુદેવ. નહિ તેમના  
ઇપનો પાર કે નહિ તેમના ગુણુનો પાર. એ ઇપગુણને  
કીધે તેમને ધણ્ણા રાજઓએ તથા શ્રીમતોએ પોતાની  
પુત્રીઓ પરણાવી. તેમાં રાહિણીથી ખળદેવ થયા  
અને હેવડીથી શ્રીકૃષ્ણ થયા. બંને ભાઈઓ ખૂબ  
પરાકર્મી હતા.

: ૩ :

શૌરિપુરથી યોડે છેટે મથુરા નામનું ગંગાવર  
શહેર હતું. ત્યાંનો રાજ કંસ હતો. તે ધણેણ કૂર હતો.  
પોતાના ખાપ ઉત્તેસેનને પણ કેદમાં પૂરી સત્તાવતો  
હતો. શ્રીકૃષ્ણ અને બળદેવે આ હુષ કંસને મારી  
નાખ્યો; અને ઉત્તેસેનને ફરી ગાડી આપી. કંસ  
મરાયો એટલે તેનો સસરો જરાસંધ ખૂબ ચીડાયો. તે  
ધણેણ મોટા રાજ હતો. શૌરીપુરનું રાજ્ય તેની સામે  
લઈ શક તેમ ન હતું. મથુરાનું ગંગ્ય પણ તેની સામે  
લઈ શક તેમ ન હતું. એટલે તેઓ પોતાના કુદુંખ-  
કખીલાને લઈને ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં તેઓ  
કાઠિયાવાડમાં આવ્યા. ત્યાં દરિયાકિનારે મોટી નગરી  
વસાવી. તેનું નામ દ્વારિકા. શ્રીકૃષ્ણ ખણ્દું પરાક્રમી  
હતા એટલે તેમને દ્વારિકાના રાજ ઘનાવ્યા.

: ૪ :

દ્વારિકાની શોભા ધણીજ હતી. તેમાં મોટા મોટા  
મહેલો ને મોટી મોટી બજરો બાંધી હતી. મોટાં મોટાં  
માંદ્દિરો ને મોટાં મોટાં ચોટાં બનાવ્યાં હતાં. કહેવા  
એસીએ તો કહેવાયજ નહિ ! તેમાં પણ શ્રીકૃષ્ણના  
શબ્દબંડારની તો વાતજ શી ?

એક દિવસ નેમનાથ મિત્રો સાથે ફરતા ફરતા શબ્દભંડારમાં આવ્યા. તેમણે બધાં હથિયારો જેયાં. તેમાં એક સુંદર શાંખ પણ જેયો. શાંખ બણોજ સુંદર એટલે તેને લઈને વગાડવાનો વિચાર કર્યો. જ્યારે તેઓ શાંખ લેવા તૈયાર થયા ત્યારે ત્યાંનો રઘેવાળ પગે લાગીને બોલ્યો : તમે છો તો શ્રીકૃષ્ણના ભાઈ. પણ તમારથી આ શાંખ ઉપડે તેમ નથી. એ તો શ્રીકૃષ્ણ મહારાજ જ ઉપાડે. માટે આપ નકામી મહેનત શા માટે કરો છો ?

આ સાંભળી નેમનાથ હસ્યા. તેમણે તો ઢાની માર્ક શાંખ જિપાડી લીધો ને જોરથી વગાડ્યો. શાંખનો અવાજ સાંભળીને લોડા બધા વિચારમાં પડ્યા. શ્રી કૃષ્ણ પણ આશ્ર્ય પાખ્યા ને વિચારવા લાગ્યા કે આ શાંખ ઢાણે વગાડ્યો હશે ? એવામાં શબ્દભંડારના રઘેવાળે આવી સમાચાર દીખા : મહારાજ ! શ્રી નેમનાથે રમત માત્રમાં શાંખ વગાડ્યો છે.

શ્રીકૃષ્ણ આ સાંભળી આશ્ર્ય પાખ્યા ને વિચારવા લાગ્યા : આટલું બધું બળ એનામાં હોય નહિ. ચાલ એની પરીક્ષા કરે.

: ૫ :

શ્રીકૃષ્ણ અને નેમનાથ મળ્યા. વાતચીત થઇ.  
શ્રીકૃષ્ણ કહે : ભાઈ નેમકુમાર ! ચાલો આપણે  
કુસ્તી કરીએ.

નેમનાથ કહે : ચાલો. પણ ભાઈ ! કુસ્તી કરીને  
ધૂળમાં આગોદીએ એના કરતાં એક બીજાનો હાથ  
લાંબા કરીને નમાવીએ તો ઠીક.

શ્રીકૃષ્ણ બોલ્યા : ભલે, તેમ કરો.

નેમનાથ કહે : તો લંખાવો આપનો હાથ.

શ્રીકૃષ્ણ હાથ લંખાંયો ને નેમનાથે તે જોત-  
જોતામાં નમાવી દીધો. ભાઈ ! હવે તમારો વારો.  
નમાવો આ હાથ. એમ કહીને નેમનાથે હાથ લાંબા  
કર્યો. શ્રીકૃષ્ણે ધણી મહેનત કરી પણ હાથ નમ્યો  
નહીં. તેથી તેમને ખાત્રી થઇ કે નેમનાથ જરૂર મારા  
કરતાં વધારે ખળવાન છે.

: ૬ :

નેમનાથ હવે જુવાન થયા છે. એક દ્વિવસ ભાતા-  
પિતાએ તેમને બોલાંયા અને કંધુંઃ પુત્ર ! હવે

તમે મોટી ઉમ્મરના થયા છો. એટલે પરણો તો અમને  
સંતોષ થાય.

નેમનાથે કહ્યું : માતાજી ! પિતાજી ! હું ડાઈ  
દેકાણે મારે લાયક સી જેતો નથી. લાયક સી મળશે  
ત્યારે પરણીશ.

આ સાંબળી માતપિતાએ બહુ આગ્રહ કરવો  
છાડી દીધો.

: ૧૭ :

પ્રાગણ્ય માસ આવ્યો છે. ખાખરે કેસુડાં ઘીલ્યાં  
છે. આથે અહોર અહેકે છે. રાયણુનાં જાડ લીલાં પાંદ-  
ડાંથી શોભે છે. ડાયક મીઠું મીઠું ટફુકે છે. સરોવરમાં  
હુંસે તરે ઉ. ગિરનાર પર્વત ખૂખ શોભે છે. કુદરતમાં  
સધળે આનંદ ફેલાધ રહ્યો છે. આવા વખતે હોણું  
આનંદ ન કરે ? શ્રીકૃષ્ણ મહારાજ તેમની પટરાણીએ  
સાથે આનંદ કરવા અહોં આવ્યા છે. સાથે નેમનાથ  
તથા દ્વારિકાના બીજા ધણા લોડા છે.

શ્રીકૃષ્ણ અને સત્યભામા વગેરે પટરાણીએ  
કુદરતની શોકા જેતાં જેતાં ત્યાંના કુંઝેમાં ફરે છે.

એવામાં શ્રીકૃષ્ણને નેમનાથનો વિચાર આંદોલન નેમનાથ લક્ષ કરે તો સારું. ગમે તેમ કરીને પણ એનું મન લમ્બમાં વાળું. એવો વિચાર કરીને શ્રીકૃષ્ણનું કૂલની સુંદર માળા ગૂંઠી. ને નેમનાથને પહેરાવી. આથી તેમની રાણીઓને લાગ્યું કે શ્રીકૃષ્ણ મહારાજ પોતાના ભાઈને લક્ષ માટે સમજાવી રહ્યા છે. તેથી તેઓએ પણ નેમનાથને લક્ષ કરવા ધયું. સમજાવ્યા. અને આપો દિવસ આનંદમાં પસાર કર્યો.

: ૮ :

એમ કરતાં ફ્રાગણ ગયો, ચૈત્ર પણ ગયો અને વૈશાખ માસ આંદોલન. તાપ બહુ પડે. ઉકળાટ ઘૂંઘ થાય. એટલે બધાયે ઠંડકને છાયે. ઠંડક સારું શ્રીકૃષ્ણ મહારાજ તેમની પટરાણીઓ. તથા નેમનાથ સાથે ગિરનાર આંદોલન આંદોલન.

ગિરનારના બગીચાઓમાં લતાના સુંદર માંડવાઓ છે. આડની લીલીછમ ધટાઓ છે. કાચ જેવા ચોકખા પાણીના હોજ છે.

ગરમી દૂર કરવા સહુ ઢોજમાં નહાવા પડ્યા. નહાતાં નહાતાં સત્યભામા વગેરે રાણીઓએ નેમનાથના

નહિ પરણવાના વિચારને હસ્તી કાઢ્યો. હેતભાવે ધણી મીઠી મશકરીએ કરી. લગ્ન કરવા ધથું સમજાવ્યા. શ્રીકૃષ્ણ મહારાજે પણ લગ્ન કરવા ખૂબ કહ્યું.

લગ્નનો આટલો ખદી આમણ જોઈ નેમનાથ વિચારવા લાગ્યા કે સગાંવહાલાંને શું મોઢ છે ને? તેએ જે જાતનું જીવન જીવે છે તેવું જીવન ગાળવાનો મને આમણ કરી રહ્યા છે. પણ મારે તો આ જીવનથી કાંઈક જિંયું જીવન જ જીવવું છે. છતાં અત્યારે આ સનહીએનું વચન સ્વીકારી લેવું ને તફ મળતાં જરૂર આત્માનું ભલું કરવું: આવો વિચાર કરીને તેમણે ખખાનું કહેવું માન્યું. સર્વેને ખૂબ આનંદ થયો.

: ૬ :

શ્રીકૃષ્ણે કન્યાની તપાસ કરવા માંડી. તેમાં રાજ ઉભેનની પુત્રી રાજુમતી ( રાજુલ ) બરાબર લાયક જણ્યાઈ. નેમનાથના રાજુલ સાથે વિવાહ થયા.

નેથીને બોલાવ્યા ને લખનો દિવસ જોવરાંયો. પણ ચોમાસામાં લખ આવે નહિ. ખખાએ નેથીને કહ્યું કે ગમે તેમ થાય પણ નજીક દિવસ શોધી કાઢો. આ કામમાં ઢીક કરી પાલવે તેમ નથી.

નોથીએ આવણુ સુદ છકુનો દિવસ શોધી કાઢ્યો.  
ખંડાએ તે કણૂલ રાખ્યો.

: ૧૦ :

નેમનાથના લભની તૈયારીએ થવા લાગી.  
વેવાઈએ ને ત્યાં તોરણો બંધાયાં. ધવળ મંગળ ગવાવા  
લાગ્યાં. શહેર આણું શાણુગારાયું ને લભનો દિવસ  
આવી પહોંચ્યો.

રાત વીતી ને વહાણું વાયું. વહાણું વાતાંજ મીઠા  
સાટે શરણાઈએ વાગવા લાગી. મંગળ ચોધાદિયાં પણ  
ગડગડવા લાગ્યાં. આ મીઠા સંગીતથી સહુ જગ્યા.  
શીએ મંગળગીત ગાવા માંડયાં. અને લભને માટે  
નેમનાથને તૈયાર કર્યો. માથે ધોળું છત્ર ધ્યું. એ બાજુ  
ધોળાં ચમરો વીજવા માંડયાં. કિનારીવાળાં એ સરેદ  
શુદ્ધ વસ્ત્ર પહેરાન્યાં. મોતીની માળાએ પહેરાવી.  
શરીરે જાંચી જતના ચંદનના લેપ કર્યો. સુંદર અદૃષ્ટ  
કોતરણીવાળો રથ તૈયાર કર્યો. તેને ધોળા ધોડા કોડ્યા.  
ને નેમનાથને તેમાં એસાહ્યા.

આગળ જનેયા ચાહ્યા. પડએ હાથી પર ચડીને  
અમીર ઉમરાવ ચાહ્યા. પાછળ રાજ સમુદ્રવિજય ને

તેમના ભાઇઓ ચાલ્યા. પાછળ પાલખીમાં એસીને  
મીઠાં ગીત ગાતી રાણીઓ ચાલ્યી. શું ચા જનની  
શોકા ?

જન ધીરે ધીરે ચાલવા લાગી. નગરનાં લોક  
જન જેવા ટોળે મજ્યાં છે. જેડી ને માળ બાળક તથા  
ભીઓથી ભરાયાં છે. બજરોમાં પુરુષોનો પાર નથી.

જન ધીમે ધીમે ઉત્ત્રસેન રાજના મહેલ પાસે  
આવવા લાગી.

અહિંયા રાજુલ પણ સોળે શાણુગાર સળને  
ગોખમાં એઠાં છે. અનને જેઈ રહ્યાં છે. દૂરથી નેમના  
થને જેઈ મનમાં હરખાય છે કે મારું નશીખ મોદું  
છે, નહિતર આવો પતિ ક્યાંથી મળે? એવામાં એમની  
જમણી આંખ ફરડી. જમણેા હાથ પણ ફરડ્યો. અને  
મનમાં શાંકા પડી કે જરૂર કાંઈ પોડું થશે. મોદું  
ફૂકું થઈ ગયું. પોતાની સહિયરોને વાત કહી. સહિયરો  
કહે: બહેન ! નકામી ચિંતા શા માટે કરો છે ? સહુ  
સારાં વાનાં થશે.

૧૧

જન ચાલતાં ચાલતાં ઉત્ત્રસેન રાજના ધર આગળ.

આવી. ત્યાં એકાએક જનાવરોને શોરખોડાર સંભળાયો.  
બિચારાં બકરાં, મેઠાં, હરણાં, તેતર વગેરે ખૂમાખૂમ  
કરે. નેમનાથે પોતાના સારથિને પૂછ્યું હે સારથિ !  
આટલો બધો અવાજ શાનો છે ?

સારથિ કહે, મહારાજ ! આપના લગ્નમાં  
જમણુ કરવાને આ બધાં જનાવરોને પકડયાં છે. તે  
બિચારાં ભરવાની બીક ખૂમાખૂમ કરે છે. આ સાંભળી  
નેમનાથે કહ્યું: સારથિ ! મારો રથ પ્રાણીઓ પાસે  
લઈ જ.

રથ પ્રાણીઓ પાસે ગયો. ત્યાં જુએ છે તો ડાઇને  
ગળેથી તો ડાઇને પગેથી બાંધિલાં છે; ડાઇને પાંજરામાં  
પૂર્યાં છે તો ડાઇને જળમાં નાંખ્યાં છે. આ જેઠને નેમ-  
નાથનું હૈયું દ્યાથી ભરાઈ ગયું. તેમને જગતનો વિચાર  
આંયો. ને જગતના બહારના ફેખાવનો મોહ જિડી  
ગયો. તેમનું મન આત્માનું તથા જગતનું સાચું  
સ્વરૂપ સમજવા માટે તલપાપડ થયું. એટલે તેમણે  
કહ્યું: સધળાં જનાવરોને છોડી મૂક્ણા ને મારો રથ  
પાછો કેરવો.

સધળાં જનાવરો છૂટી ગયાં ને રથ પાછો કેયો.

રથને પાછો પ્રરતાં જોયો કે તેમનાં માતાપિતા આવીને  
કહેવા લાગ્યાં ભાઈ ! એકાએક આ શું ? પ્રાણીએટાં  
કુઃખ તારાથી ન દેખાયું તો તેમને છાડી મુક્યાં.  
હવે ચાલ, પણ નેમનાથે કહ્યું : તમે મને જે  
સંબંધથી જોડવા માગો છો તેના કરતાં પણ વિશાળ  
ને શુદ્ધ સંબંધ બાંધવા મારી પ્રબળ ઈચ્છા થઈ છે.  
તેથી મને મારું કરો. આપ એ બાબતનો આગહ  
કરરો. નહિ.

આવી રીતે નેમનાથ ન પરણ્યા ને ખાળ અલ્લાચારી  
રહ્યા. ધન્ય છે તેમના અલ્લાચર્યને !

## ૧૨

રાજુલે ખખર સાંભળી કે નેમનાથ પાછા કર્યા. આ  
ખખર સાંભળતાંજ તેમને મૂર્છી આવી. ભાનમાં  
આવ્યાં લારે ખૂખ રડવા લાગ્યાં. તે નેમનાથને જ સંસારે  
અને રડયા કરે. આ જોઇને સહિયરોએ રાજુલને કહ્યું  
કે બહેન ! આવા પ્રેમ વિનાના પતિનો શોક શું કરો  
છો ? બીજે ચોંચ પતિ ચોડા જ સમયમાં શોધી  
કાઢીશું.

સહિયરોનાં આવાં વેણુ સાંકળતાં અછાચાતી રાજુલે કાને હાથ દીક્ષા અને કલ્યાંણ અરે ખણેનો! આવાં માઠાં વેણુ શું બોલો છો! પતિ તો તેજ. હવે નેમ વિના ભીજો પતિ હોય નહિ. તેના પગલેજ હું ચાલીશ ને મારે જીવન સરેળ કરીશ.

## ૧૩

હવે નેમનાથનો દૈરાગ્ય દ્વિવસે દ્વિવસે વધતો ગયો. એટલે એક વરસ સુધી તેમણે સોનામહેરાતું દાન દીધું અને છેવટે સાધુ થયા. સાધુ થયા એટલે મનથી પવિત્ર થયા. અને માતાપિતા તથા ભાઈઓનો સાથેનો સંબંધ વિશાળ કરીને દુનિયાના ખધા માણુસો સાથે હેતથી વર્તવા લાગ્યા.

તેઓ લુણું સૂકું નેવું મજ્યું તેવું અન્ન ખાય. લોંઘ ઉપર સૂવે. એકજ કૃપકું પહેરે. ટાઠ તાપ સહન કરી લે. અને એમ છતાં મનમાં સુખ્યુઃખ ન લાગે. મનમાં સહુનું લહું ઈચ્છા. બોલે તે પણ તદ્દન સાચું અને મીધું. આવી રીતે પવિત્ર જિંદગી જીવવા તેઓ એક ડેકાણેથી ભીજ ડેકાણે કરવા લાગ્યા.

૧૪

આ પ્રમાણે કરતાં થોડાજ દિવસોમાં તેમને ડેવ-ગજાન થયું. ડેવળજાન થયું એટલે જગતનું સાચું અને પૂરેપૂરું જ્ઞાન થયું. તેઓ બધી પૂજાવા લાગ્યા.

પોતાને ડેવળજાન થવાથી જે આનંદ થયો તે આનંદ દુનિયાના બધા માણુસોને ભળે તે માટે ઉપદેશ દેવા લાગ્યાઃ બધા સાથે મિત્રભાવ રાખવો. તહુન સાચું ને મીહું કહેવું. રજ સિવાય ડાઈની પણ વસ્તુ લેવી નહિ. શિયળત પાળવું. સંતોષથી રહેવું. જીવન દ્યાસય કરવું. ધર્મને જીવ જેવો વહ્નાદો કરવો. અને જરૂર પડે તો ધર્મને માટે જીવ પણ આપી દેવો વગેરે.

શ્રીકૃષ્ણ વગેરે ધણ્યાએ આ ઉપદેશ માન્યો. ડેટલાક પુરુષો અને સ્ત્રીઓએ સાધુજીવન શરૂ કર્યું. બીજ ડેટલાક પુરુષો અને સ્ત્રીઓએ ઘેર એઠાં પણ અને તેટલું પવિત્ર જીવન ગાળવાનું શરૂ કર્યું. આવાં બંને જલનાં સ્ત્રી પુરુષોનો એક સંધ સ્થાપ્યો. આવા સંધને તીર્થ કહે છે. તેથી તેઓ તીર્થ કરનારા થયા એટલે ડેટીર્થ કર થયા.

૧૫

મહાસતી રાજુલ પવિત્રતાનો ભંડાર હતાં. તેમને પણ સંસારની લાલચી વળગી ન હતી. તેમણે નેમનાથનું જીવન જોયું ને તે ખૂબ પવિત્ર લાગ્યું. તેમણે નેમનાથનો ઉપદેશ સાંભળ્યો ને તે ખૂબ સુંદર લાગ્યો. આથી તેઓ પ્રભુ નેમનાથની આગળ સાધ્વી થયાં. સાધ્વી તરીક ધર્યો વખત પવિત્ર જીવન ગાળીને તેઓ નિર્વાણ પામ્યાં.

પ્રભુ નેમનાથ પણ ધાયું જીવી ગિરનાર પર્વતપર નિર્વાણ પામ્યા. ગિરનાર પર્વત આ નેમ-રાજુલનાં પગલાંથી સહાને માટે પવિત્ર થયો.

બાદો બાવીસમા તીર્થંકર નેમનાથ કશવાનની જે !  
બાદો મહાસતી રાજુલની જે !

૪

જરૂર વાંચો—આ સરળ ને સુંદર

## જીવવિચાર પ્રવેશિકા

કિં. માત્ર સવા આનો : : પોસ્ટેજ બે પૈસા.

# શ્રી પાર્વનાથ

: ૧ :

ગંગાજ ધીમાં ધીમાં વહે છે. તેના કિનારે મોકું  
શહેર છે. તેનું નામ કાશી. ત્યાં અષ્ટસેન નામે રાખ છે,  
તેમની પટરાણીનું નામ વામાદેવી. બંને એક બીજાપર  
ઘૂંઘ પ્રેમ રાખે છે અને આનંદમાં વખ્ત પસાર કરે છે.

એક દ્વિસ અંધારી ધોરરાત છે. વામાદેવી પોતાના  
પલંગમાં સુતા છે. એવામાં પડ્યે થઇને કાળો નાગ  
નીકળ્યો. એક તો અંધાર અને તેમાં વળી કાળો નાગ.  
એ તે શે દેખાય? પણ આશ્ર્યું કે વામાદેવીએ એ  
કાળા નાગને કાળી રાનિએ જોયો. છતાં જરા પણું

ભયનું નામ નહિ. ખીજ દિવસે આ વાત અધિકસેન  
રાજને કહી. અધિકસેન રાજ કહે, ‘અધારી રાતે કાળો  
નાગ આપણું આંખે તો ન દેખાય. તમને એ દેખાયો  
તે પ્રભાવ નક્કી તમારા ગર્ભનો. મને લાગે છે કે જરૂર  
તમને મહાપ્રતાપી ખાળક જન્મશે.’

: ૨ :

સમય થતાં વામાદેવીને પુત્ર થયો. તેની કાન્તિ  
કહેવાય નહિ, ગુણ ગણ્યાય નહિ, શાન મપાય નહિ.

તેમનું નામ પાડ્યું પાર્વતી. રાજના કુંવરને રોની  
ઓટ હોય? તેમની સેવામાં અનેક દાસદાસી હાજર  
�ે. આનંદે ઉછરતાં પાર્વતીનું થયા મોટા. તેમના  
પરાક્રમનો પાર નહિ. કુનિયા આખી તેમનાં વખાણું કરે.

: ૩ :

આ વખતે કુશસ્થળ નામે મોહું નગર હતું. તેના  
રાજનું નામ પ્રસેનજિત. પ્રસેનજિતને એક કુંવરી  
હતી. તેનું નામ પ્રભાવતી. તે શાન ગુણ તથા ઇપનો:

ભાડાર હતી. તેના પિતાએ તેનો વિકાસ કરવાને ખૂબ મહેનત કરી હતી. તે બાળા મટી યુવતી થવા લાગી. હવે રાજરાણી વિચારે છે: ‘દેવી જીવી આ દીકરીને ક્યાં પરણાવીશું? આને લાયક પતિ ક્યાં મળશે?’ તેઓ લાયક પતિની ખૂબ શોધ કર્યા કરે. અનેક રાજરાજ્વાડા તપાસે. પણ હોઠ જગાએ લાયક પતિ મળે નહિ.

: ૪ :

એક દિવસ સહિયરો સાથે પ્રભાવતી ઉપવનમાં આવી. ત્યાં રંગઘેરંગી ઝૂલો છે, મીઠાં મીઠાં ફોણો છે, સુંદર લતાના માંડવા છે, નાના નાના હોજ છે. તેમાં રાજહુંસ તરે છે, કિનારે સારસ જિબા ચરે છે, આડ પર પંખી કલ્લોલ કરે છે.

પ્રભાવતી આ ખધી શોભા જુએ છે ને આનંદ પામે છે. એવામાં એક ગીત સાંભળ્યું:

( હાળ—અમર વાડીમાં ડાંડા વાગે છે. )

ધીમાં ધીમાં ગંગાનાં નીર જ્યારે !

એક કાશી સોણામણું શહેર ત્યારે ! ધીમાં ધીમાં. ૧

ત્યાં રાજ્ય કરે રૂડા રાજ્યારે !  
 જેના જશ જગતમાં ગાળ્યારે ! ધીમાં ધીમાં. ૨  
 રાજ્યપુત્ર ત્યાં પાર્વકુમાર છે રે !  
 રૂપગુણ તણ્ણા એ ભંડાર છે રે ! ધીમાં ધીમાં. ૩  
 નહિ જેડી જગતમાં જેમની રે !  
 કરે કવિ કથા શું એમની રે ! ધીમાં ધીમાં. ૪  
 જે પામે સ્વી એ ભરથારને રે !  
 ધન્ય ધન્ય તેના અવતારને રે ! ધીમાં ધીમાં. ૫

પ્રભાવતીને આ ગીત બહુજ ગમ્યું. તેમાં પાર્વ-  
 કુમારના પ્રભાવના ખૂબ વખાણું હતાં. આ વખાણું  
 સાંસળીને તેણે મનમાં નક્કી કર્યું ડે ‘પતિ હો તેઓ  
 આવોજ હોએ.’

: ૫ :

પ્રભાવતી હેઠે ચોણ્ય ડુભરની થદ છે. પતિની  
 ચિંતામંજ રબ્બા કરે છે. આ ચિંતાથી તેના શરીર પર  
 અસર થદ. સહિયરોએ પ્રભાવતીની આ સ્થિતિ જાહી  
 અને તે સ્થિતિ દૂર કરવા તે હક્કીકત પ્રભાવતીના  
 માતાપિતાને કહી. તેઓએ આ વાત જાણીને કહ્યું:

‘પાર્શ્વકુમાર પુરુષોમાં એછ છે ને પ્રભાવતી કન્યા-  
આમાં એછ છે. એણે પોતાને લાયકજ પતિ શોધો  
કાઢ્યો છે. આથી અમે ખૂબ હરખાયાં છીએ.’  
આતપિતાની આ વાત સહિયરોચે પ્રભાવતીને  
જણ્યાવી. પ્રભાવતીને એથી આનંદ થયો. પણ  
પાર્શ્વકુમાર વિના ગમે નહિ. બીજ થોડા દિવસ  
ગયા અને તેનું શરીર તદ્દન લેવાઈ ગયું. આ  
એછને માખાપે નક્કી કર્યું કે પ્રભાવતીને પાર્શ્વકુમાર  
પાસે મોકલવી. જે ખાળા જતે પતિને શોધી કાઢે અને  
પરણવા અથ તેને સ્વયંવરા કરે છે.

: ૬ :

પ્રભાવતી એટલે રૂપગુણ અને જ્ઞાનનો ભંડાર.  
તેના વખાણ દેશોદેશમાં થાય. અને એથી ભલભલા  
રાજ પણ તેને પરણવાને દરખ્ષે. કલિંગ દેશનો રાજ  
યવન બહુ જખરો હતો. તે પ્રભાવતીને પરણવાનો  
નિશ્ચય કરીને એઠો હતો.

એતનેતામાં સધળે વાત ઝેલાઈ ગાઈ કે પ્રભાવતી  
સ્વયંવરા થધને પાર્શ્વકુમાર પાસે અય છે. યવનરાજ

આ વાત સંભળીને ખૂબ ચીડાયો અને કહેવા લાગ્યોઃ ‘હું છતાં પ્રભાવતીને પરણુનાર પાર્વતીકુમાર ઢાણુ છે ? અને પ્રસેનજિતું રાજ પણ ઢાણુ છે હે અને પ્રભાવતી ન પરણું વેદે ? હું જેધશ હે પ્રભાવતી પાર્વતીકુમારને હેવી રીતે પરણુ છે ? ’

યવન રાજએ પોતાનું લશ્કર તૈયાર કર્યું અને કુશસ્થળ નગર પર ચડાઈ કરી. થોડાજ સમયમાં લશ્કર કુશસ્થળ આવી પહોંચ્યું ને તેને ફરતો ઘેરો ધાલ્યો. ઘેરો એવો સખત હે નગરમાંથી ઢાઈપણું બહાર નીકળી શકે નહિ.

: ૭ :

રાજ પ્રસેનજિતું ચિંતામાં પડ્યાઃ ‘આટલા મોટા લશ્કરની સામે શી રીતે બચાવ થાય ? જો ઢાઇ પણ રીતે રાજ અશ્વસેનની મદદ આવે તેણ બચાય. પણ તેને મદદનો સંદેશો ઢાણુ પહોંચાડે ? ’ વિચાર કરતાં પોતાનો મિત્ર પુરુષોત્તમ યાદ આવ્યો.

રાજ પ્રસેનજિતે પુરુષોત્તમને ઓલાંયો ને પોતાનો

વિચાર કલ્પો. પુરુષોત્તમ મિત્રનું કામ કરવાને તૈયારજ હતો. જીવની દરકાર કર્યા વિના રાતે તે છાનોમાનો નગરમાંથી બહાર નીકળી ગયો ને અને તેટલી ઝડપથી કાશી આવ્યો.

: < :

અસ્થસેન રાજ સભા ભરીને એઠા છે. ધર્મની વાતો ચાલે છે. એવામાં સિપાઠ આવ્યો. તે નમન કરીને બોલ્યો: ‘મહારાજ ! ખારણે ઢાઈ માણુસ દૂર દેશથી આવ્યો છે. તે આપને કાંઈક અરજ કરવા માગે છે.’ અસ્થસેન રાજ કહે, ‘તેને જદ્દી અંદર મોકલ્લો.’

પુરુષોત્તમ અંદર આવ્યો ને રાજને નમસ્કાર કર્યો પછી સધળી હૃકીકત જહેર કરી. આ વાત સાંભળતાં અસ્થસેન રાજ કોપાયમાન થયા અને બોલી ઉઠ્યાં ‘ધર્મન રાજના શા ભાર કેંકે તે પ્રસેનનિત્યને બીવરાવી શકે ? કું હમણું લરફર લઇને કુશસ્થળ જઉં છું.’

તરતજ લડાઈનાં નગારાં વાગ્યાં. લરફર બધું એકું થવા માંડયું.

પાર્થકુમાર ભિનો સાથે આનંદ કરતા હતા. તેમણે લડાઈનાં નગારાં સાંભળ્યાં; લશકરની ગરખડ સાંભળી; અને એકદમ રમત પડતી ભૂકી પોતાના પિતા પાસે આવ્યા. ત્યાં સિપાધએને લડાઈ માટે તૈયાર થયેલા જેયા. એટલે પિતાને પ્રણામ કરીને પૂછ્યું: ‘પિતાજ ! એવો ઢાણુ શત્રુ છે કે જેના માટે આપ જેવા પરાક્રમીને આવી તૈયારી કરવી પડે છે ? તમારાથી વધારે હે તમારા જેવો પરાક્રમી ડાઈ પણ માણુસ મારા જેવામાં આવતો નથી.’ પિતાએ પુરુષો-તમને બતાવીને કહ્યું: ‘આ માણુસના કહેવાથી પ્રસે-નન્જિત્ર રાજને ધર્મનરાંથી બચાવવા જવાની જરૂર પડી છે.’

પાર્થકુમારે આ સાંભળીને કહ્યું: ‘પિતાજ ! શુદ્ધમાં તમારી આગળ ડાઈ દેવ કે દાનવ પણ ટકી શકે તેમ નથી તો આ બિચારા ધર્મન રાજના શા ભાર છે ? પરંતુ તેની સામે આપને જવાની કાંઈજ જરૂર નથી. હુંજ લાં

જધશ અને બીજને નહિ ઓળખનારને શિક્ષા કરીશ. રાજ અધિકસેન કહે, ‘પુત્ર ! મુશ્કેલીથી ભરેલી લડાઈમાં તને મોકદ્વો તે મારા મનને ઢીક લાગતું નથી. હું જાણું છું કે મારા પુત્રનું બળ અથાગ છે. પણ તે ધરમાં રહી આનંદ વિનોદ કરે તેજ મને પસંદ છે.’ પાર્વતીમાર કહે, ‘પિતાજ ! યુદ્ધ કરવું તે મારે મન આનંદ વિનોદજ છે. તેમાં મને જરા પણ મહેનત પડવાની નથી. માટે આપ અહિંજ રહો ને મને લડાઈમાં જવાની આજા આપો.’ પાર્વતીમારના ઘૂંઘ આંદુથી રાજ અધિકસેને તેમની માગણી કચુલ કરી.

: = :

શુદ્ધ ચોધડીએ પાર્વતીમાર સૈન્ય લધ કુશસ્થલ તરફ ચાહ્યા. ત્યાં આવીને રાજરીત પ્રમાણે યવનરાજને એક સંદેશો મોકદ્વોઃ ‘હે રાજ ! આ પ્રસેનજિત્ર રાજ મારા પિતાને શરણે આવેલા છે. માટે તેમને સત્તાવવા છોડી દો. આરા પિતા યુદ્ધ માટે અહિં આવતા હતા પણ તેમને

મહામહેનતે રોકીને હું આવેલો છું. માટે અહિંથી  
પાછા ફરીને તમારે ઠેકાણે પાછા ચાલ્યા જવ. જે જણી  
જશો તો તમારા ગુન્હો માફ કરીશું.' પણ અભિમાની  
યવનરાજ શેનો માને? ઉલટો પાર્વતીકુમારને ધમકી  
આપવા લાગ્યો: 'જે પાર્વતીકુમારને જીવતા રહેવું  
હોય તો પાછા ફરે.' આ સાંભળીને યવનરાજનો  
એક ધરડો પ્રયાન બોલ્યો: 'મહારાજ! ગમે તેમ  
કરો પણ પાર્વતીકુમારને લડાઈમાં આપણે પહેંચી  
શકવાના નથી. વળી આપણી લડાઈ અભિમાનની છે,  
સાચી નથી. તો નકામી શા માટે માણુસોની ખૂનરેખ  
થવા દેવી? આ સંદેશો માની લેવો ને પાર્વતીકુમારના  
શરણે જવું તેજ ઠીક છે.'

યવનરાજને વિચાર કરતાં આ વાત સાચી લાગી.  
તે પાર્વતીકુમારને શરણે આવ્યો. હાથ જોડીને કહેવા  
લાગ્યો કે 'મારો ગુન્હો માપ કરો.'

પાર્વતીકુમાર કહે, 'હે રાજ! તમારું કલ્યાણું થાવ.  
તમે મારાથી બીરોનાં નહિ. તમારું રાજ્ય સુખેથી જોગનો.  
પણ ફરીવાર આવું કરશો નહિ.'

: ૧૦ :

કુશસ્થલ નગર ઉપરથી વેરો ઉઠી ગયો ને રાજ  
યવન ચાદ્યો ગયો. રાજ પ્રસેનજીતના હુરખનો પાર  
રસ્થો નહિ. એક તો શત્રુનો ભય ગયો ને ખીજું પાર્વતિ-  
કુમાર ધરને આંગણે મળ્યા.

તે પ્રભાવતીને લઈને પાર્વતીકુમારની છાવણીમાં  
આવ્યા અને પાર્વતીકુમારને હાથ લેડી વિનંતિ કરી:  
'આપે યવનરાજના ભયમાંથી બચાવીને મારા પર મોટા  
ઉપકાર કર્યો છે. પણ આ પ્રભાવતીની સાથે વિવાહ  
કરીને એવડો ઉપકાર કરો. એ આપનેજ ચાહે છે ને  
આપનેજ યાદ કર્યો કરે છે.'

આ સાંભળી પાર્વતીકુમારે કહ્યું કે 'હે રાજ! હું  
તો શત્રુથી તમારો બચાવ કરવા અહિં આવેલો છું.  
પરણવાને નહિ. મારું કામ પૂરું થયું છે. માટે હું પાછો  
કુરીશ.'

આ સાંભળી પ્રભાવતીના હુઃખનો પાર રસ્થો નહિ.  
તે મોટી ચિંતામાં પડી કે 'હવે મારું શું થશે?' રાજ

પ્રસેનજિતું પણ વિચારમાં પડયા. આખરે મનમાં નક્કી કર્યું હું પાર્વતુભાર પોતે તો આ વાત માનશે નહિ પણ અખ્યસેન રાજને મળવાનું બહાનું કાઢીનેહું પાર્વતુભારની સાથે કાશી અહં.’

પાર્વતુભારને વિદ્યાય આપી. વિદ્યાય આપતાં પ્રસેનજિતું રાજ બોલ્યાઃ હે ‘પ્રભુ! અખ્યસેન રાજના ચરણને નમવા હું તમારી સાથે આવીશ.’ પાર્વતુભારે ઘુશી થઈને હા પાડી એટલે રાજ પ્રસેનજિતું પ્રભાવતીને લઈ કાશી આવ્યા.

: ૧૧ :

પ્રસેનજિતું રાજએ અખ્યસેન રાજને રાજરીત પ્રમાણે નમરકાર કરી પોતાની બધી હક્કીકત કહી. રાજ અખ્યસેને આ સાંભળી કહ્યું: ‘આ ભુમાર ભૂળથીજ વૈરાગ્યપ્રિય છે. તેથી તે શું કરશે તે હજુ અમે જાણું શક્યા નથી; અમને પણ હેંશ છે કે ક્યારે તે ચોગ્ય કન્યા સાથે પરણે? જે કે તેને પરણું પસંદ નથી

છતાં તમારા આગુથી પ્રભાવતી સાથેજ તેનો વિવાહ  
કરીશું. ’

અશ્વસેન રાજ પ્રસેનજિત્ સાથે પાર્થદુમારને  
મળ્યા અને કણ્ઠિંડે ‘પુત્ર ! પ્રભાવતીને તારા માટે ધથુંજ  
મમતા છે. તને પરથુવા માટે તેણે ખૂબ સહન કર્યું છે.  
ઘરેઘર ! તારા માટે આથી વધારે લાયક કન્યા ડેઈજ  
નથી. માટે પ્રભાવતી સાથે લભ કર અને સુખી થા. ’

પાર્થદુમારે કહ્યું: ‘પિતાજી મને એજીવન પસંદ  
નથી.’ છતાં પિતાના અતિ આગુથી તેમણે પ્રભા-  
વતી સાથે લભ કર્યાં.

પ્રભાવતીના આનંદનો પાર રદ્દો નહિ. તે ગાવા  
લાગી હે:

‘ જે પામે ખી એ ભરથારને રે !  
ધન્ય ધન્ય તેના અવતારને રે ! ’

: ૧૨ :

એક દિવસ પાર્થદુમાર મહેલ ઉપર ચઢી ગોખમાં  
બેઠા છે. કાશી નગરીને જેઈ રદ્દા છે. એવામાં લોહાનાં

ટાળે ટોળાં કુલની છાખડીએ ભરી ઉતાવળાં ઉતાવળાં  
નગર બહાર જતાં હતાં તે જેયાં.

પાશ્વંકુમારે પાસેના માણુસોને પૂછ્યું હે ‘આજ  
શેનો તહેવાર છે હે લોઢા આટલા ખધા ઉતાવળા થઇ  
નગર બહાર જઈ રહ્યાં છે?’ માણુસોએ જણ્યાંથું હે  
‘કમઠ નામે એક મોટા તપસ્વી શહેરની બહાર  
આવેલો છે. તે પોતાની ચારે બાંજુ દેવતા સળગાવે છે.  
માથાપર સૂરજનો તાપ લે છે. એટલે હે પંચાંશિ તપ  
કરે છે. માટે લોઢા તેની પૂજા કરવાને જય છે.’

પાશ્વંકુમારને આખું કૌતુક જોવાની ઈચ્છા થઇ.  
તેઓ પોતાના માણુસો સાથે ત્યાં આવ્યા. ત્યાં જોયું તો  
કમઠે પોતાની ચારે બાંજુ મોટાં મોટાં લાકડાં ભૂકીને  
ધુણી ધખાવી હતી.

કુશળ પાશ્વંકુમારે પોતાના જ્ઞાનથી આ લાકડામાં  
એક મોટા સાપને બળતો જેયો. આ જેઠને તેમનું  
હૈયું દ્યાથી ઉભરાયું. તેઓ બોલી ઉઠ્યાઃ ‘અરે! આ  
કુટલી ખધી ગેરસમજ છે? કેવળ શરીરને કણ આપ-

વાથી તે તપ થતાં હશે? વગર સમજ્યે પશુની ભાડીક  
ટાઠ તાપ સહન કરવાથી શું લાભ વાર્દુ? તપ વગેરે  
ધર્મના અંગો અહિંસા વિના નકારા છે. અહિંસા  
એજ પરમ ધર્મ છે. ધર્મ સમજ્ઞને ધર્મ આચરવો  
નોંધએ. '

આ સાંભળી દેહદમનનેજ ધર્મ ગણુનારો કમઠ  
બાલ્યો: 'હે રાજકુમાર! ધર્મની આખતમાં તમે શું  
બણ્ણો? તમે તો હાથી ઘોડા ઘેલવી જણ્ણો. ધર્મ તો  
અમારા જેવા તપસ્વી જણ્ણો.'

આ સાંભળીને પાર્થકુમારને વિચાર થયો: 'અહો!  
માણુસનું શું અભિમાન છે ને? બિચારાને દ્યાની તો  
ખબર નથી ને ધર્મ કરે છે!' તેમણે પોતાના માણુસોને  
કહ્યું: 'આ લાકડું ધુણીમાંથી બહાર એંચી કાઢો  
ને સાચવીને તેના એ ભાગ કરો.' માણુસોએ તેમ કર્યું  
તો તેમાંથી મોટા નાગ નીકળ્યો. તેનું શરીર દાગયું  
હતું. તેને પીડા થતી હતી. પાર્થકુમારે-તેને માણુસ

ક્ષારા પવિત્ર શાખદો (નવકારમંત્ર) સંભળાયા. તે નાગ  
તરતજ મરણ પામ્યો.

કમઠ આ કોઈ ઉંખવાણેં પડી ગયો. તેને લાગ્યું  
કે પાર્વતીકુમારે ખધા વચ્ચે મારી ઇજેતી કરી. એથી  
ખૂબ ખીઅયો. એણે એ અતનું તપ ચાલુજ રાખ્યું;  
થાડા સમયમાં આવું તપ કરીને તે મરણ પામ્યો અને  
એક જાતનો દેવ થયો. તેનું નામ મેધમાળી. પેદો  
નાગ મરીને નાગરાજ થયો. તેનું નામ ધરણેંદ્ર.

: ૧૩ :

વસંત ઝતુ આવતાં વનની શોભા ખીલી હૃદી  
છે. ખધાં આડ નવાં પાંદડાંથી શોભે છે. કૂલનો પાર  
નથી. ખધ ચુસવા ભમરાચ્યો શુંભરવ કરે છે ને ચારે  
ખાળુ લમે છે. આડ પર પંખી મીઠાં ગીત ગાય છે.  
મીઠાં મીઠાં પાણીનાં ગ્રરણું ખળખળ કરતાં વહી રથાં  
છે. પાર્વતીકુમાર પ્રભાવતી સાથે આ વનની શોભા  
નેવા નીકળ્યા. તેચ્યા ફરતાં ફરતાં એક મહેલ  
આગળ આવ્યા. મહેલ ખૂબ રળીઆમણેં છે. જ્યાં  
નજર નાંએ ત્યાં કાંઈક સુંદર ડેટરણી. જ્યાં નજર

નાંખે ત્યાં કાંદક સુંદર કારીગારી. એ મહેલમાં પાર્વતી કુમાર તથા પ્રભાવતી આરામ કરવા દાખલ થયા. મહેલના દિવાનખાનામાં ચિત્રો જેતાં જેતાં તેઓ એક સુંદર ચિત્ર આગળ આવ્યાં. તેમાં નેમનાથની જન્મ ચીતરેલી છે. નેમનાથ પ્રલુનો પોકાર સાંભળે છે. તેમનું હૈયું દ્વારા ડુબરાય છે. તેઓ પશુને છોડાવી મૂકે છે ને રથને પાછો ફેરવે છે. પાર્વતી કુમારને આ જેઈ પોતાના જીવન સંબંધી વિચારો આવ્યા. જગતના મોજશોભમાંજ જીવન પસાર કરવું તે આ જીવનનો હેતુ નથી. જીવનનું સાચું સ્વરૂપ સમજ તેને આચરણમાં મૂકવું એજ થોડ્ય છે. એથી જગતના મોજશોભમાંથી તેમનું મન ઉઠી ગયું. જીંચું જીવન ગાળવા દૃઢ ધર્યા થિયા. આવી ધર્યાને વૈરાગ્ય કહે છે.

પાર્વતી કુદ્દારક હતા. મન વચન ને કાયાથી ઢોધ પણ પ્રાણીને કુદ્દારક ન થાય તેવું ધર્યાત્મક હતા. તેમનો વૈરાગ્ય વધતોજ ગયો. વૈરાગ્યની બહારની નિશાની તરીકે તેમણે એક વરસ સુધી સોનામહોરોતું ઘાન

શીંદું. છેવટે ત્રણું ઉપવાસ કર્યાં ને ભાતાપિતાનો ટૂંકો  
સંખ્યાંથી છોડી હુનિયા સાથેનો પ્રેમભાવથી વિશાળ સં-  
ખ્યાંથી બાંધ્યો. એટલે કે સર્વ જીવોનું હિત કરવા સાધુ  
થયા. બીજું પણ ભાણુસે તેમની સાથે સાધુ થયા.  
તેઓ સાધુજીવન ગાળતાં એક ઠેકાણુથી બીજે ઠેકાણું  
કરવા લાગ્યા.

: ૧૪ :

પાર્બ્રનાથ કૃતાં કૃતાં એક દિવસ શહેરની  
નજીક તાપસના આશ્રમ પાસે આવ્યા. સાંજ પડી  
ગઈ હતી ને રાતે કૃતું નહિ એટલે કૂવા પાસે એક  
વડ નીચે ધ્યાન લગાવીને જીભા.

મેધમાળીને પાર્બ્રનાથ પર વૈર હતું એટલે તે રાતે  
પાર્બ્રનાથને અનેક જતની સત્તામણી કરી. સિંહ તથા  
હાથીના ભય બતાવ્યા; રીછ તથા ચિત્તાના ભય બતા-  
વ્યા; સાપ ને વીંધીના ભય બતાવ્યા; એમ ધણું  
ધણું ભય બતાવ્યા. પણ પાર્બ્રનાથ જરા પણ  
ધ્યાનમાંથી ઉઘ્યા નહિ. છેવટે મેધમાળીએ  
ભયંકર વરસાદનું તોક્કાન કર્યું. આકાશમાં ધનદોર

વાદળાં થયાં. ચારે બાજુ કાનને ફોડી નાખે તેવો  
વાદળાનો ગડગડાટ થયો. વિજળી તો જણે પડી હે  
પહોં એમ ચમકવા લાગી. મૂશળધાર વરસાઠ શરૂ થયો.

આડો ઉઘડી પડ્યાં. પંખી ને જનવરો બિચારાં  
નાસકાગ કરવા માંડ્યાં. જ્યાં જુઓ ત્યાં જળજળાકાર.  
પ્રભુ પાર્થનાથની ચારે બાજુ પાણી કરી વળ્યું. જેત-  
બેતામાં પાણી દીંગણું સુધી આવ્યું. બીજી થોડી વાર  
થધ ને પાણી છેડ સુધી આવ્યું. પછી તો ગળા સુધી  
આવ્યું ને છેવટે નાક સુધી આવ્યું પણ પાર્થનાથ તો  
પેતાના ધ્યાનમાંથી સહેજ પણ ડગ્યા નહિ.

ધરણેંદ્ર નામે નાગરાજ આ જોયું ને તેણે પ્રભુના  
ઉપકારનો બદલો વાળવા જતે આવી એ સતામણી  
અંધ કરાવી. આ વખતે પણ પાર્થનાથ તો શાંત  
ભાવેજ જિભા હતા. તેમનેતો ધરણેંદ્ર પણ સરખો હતો  
ને મેધમાળી પણ સરખો હતો. ધન્ય છે. આવા સમ-  
ભાવી મહાત્માજ્યોને, જે મિત્ર. અને શનું તરરૂ પણ  
સમભાવ રાખી શકે છે !

૧૫ :

શ્રી પાર્બીનાથને આ બનાવ બન્યા પછી થોડાજ દિવસે ડેવળજ્ઞાન એટલે સાચું અને પૂરેપૂરે જ્ઞાન થયું. એટલે તેમણે ખંબા લોડાને પવિત્ર જીવન જીવવાનો ઉપદેશ આપ્યો. ધણ્યાં ઝીપુરુષો પવિત્ર જીવન જીવવા લાગ્યાં. આ પવિત્ર જીવન જીવનારનો એક સંધ સ્થાપ્યો. આવાં સંધને તીર્થ કહે છે. તેથી પાર્બીનાથ તીર્થ કરનારા એટલે તીર્થકર થયા.

તેમના માતાપિતા તથા પ્રભાવતી પણ આ પવિત્ર સંધમાં જોડાયા.

કુલ સો વરસનું આયુષ્ય ભોગવી શ્રી પાર્બીનાથ નિર્વાણ પામ્યા. એટલે સધણા કર્માના બંધનથી છુટી મુક્તિપદ પામ્યા.

ઓલો શ્રી પાર્બીનાથ ભગવાનઙી જે !

ઓલો શ્રી તેવીશમા તીર્થકર હેવડી જે !

# પ્રભુ મહાવીર

અગણિત વંદન હો પ્રભુ મહાવીરને.

હિન્દુસ્તાનનો બિહાર પ્રાંત ખૂબ રળિયામણેલું છે.  
તેની વર્ચ્યે થઈને ગંગાજી તથા ખીજુ નાની મોટી  
નદીએ વહે છે. જ્યાં જોઇએ ત્યાં ધાન્યભર્યા ખેતરો,  
સુંદર મનુનાં આંખાવાડિયાં તથા નાનાં ચોટાં ગામડાં  
ને શહેરો નજરે પડે છે. આજથી અઢી હજર વર્ષ  
પહેલાં આ ભાગ ભગધ દેશના નામથી ઓળખાતો  
હતો. તે વખતે એની જહોજલાલી જગમશફૂર હતી.  
કુનિયાભરના મુસારો એને જેવા માટે આવતા હતા.

આ દેશમાં ક્ષત્રિયકુંડ નામે એક સુંદર શહેર હતું.  
ત્યાં સિદ્ધાર્થ નામે જ્ઞાત વંશના એક ક્ષત્રિય રાજ હતા.

તેચો ખૂબ ધર્મિંઠ ને ન્યાચી હતા, તેમજ પ્રજને  
પાળનાર અને દીન-કુદ્દીને સહાય કરનાર હતાં.  
તેમને નિશલાદેવી નામે એક ખસુ પવિત્ર રાણી હતાં.

સમય જતાં નિશલાદેવી ગર્ભવતી થયાં. તે સમયે  
તેમને ચૌદ સુંદર સ્વરૂપેનો આવ્યાં. આથી તેમણે જાહેરું  
કે મારે મહાપ્રતાપી ખાળક થશે અને તેથી  
ખૂબ હરખાયાં.

આ દિવસથી તેમના કુળમાં ખન ધાન્ય ને આનં-  
દની વૃદ્ધિ થવા લાગી.

: ૨ :

ચૈત્ર સુદ તેરથની રાનિ છે. ચંદ્ર પ્રકાશી રથો  
છે. આકાશ સ્વર્ચછ છે. પવન ધીમો ધીમો વાય છે.  
પૃથ્વી આખીએ જાણે આનંદ્યી ઉભરાય છે. આ સમયે  
નિશલાદેવીએ એક અસંત તેજસ્વી પુત્રને જન્મ  
આપ્યો. તેજ કણે દુનિયામાં પ્રકાશ ને આનંદની રેલ  
છવાદ ગઈ.

દ્વોઽમે પુત્રનાં યરોગાન ગાયાં અને મોટા ઉત્સવો  
ઉજવ્યા. સિદ્ધાથેં રાખાએ ખસુ મોટા ઉત્સવ ઉજવ્યો.

આ પુત્ર ધનવાન્ય અને આનંદની વૃદ્ધિ કરનાર હતો।  
એટલે તેનું નામ રાખ્યું શ્રી વર્ધમાન.

વર્ધમાન કુમારનું ઝૂપ અપાર હતું. શરીરનો બાંધો  
ધણ્યોજ મજબુત ને ભાપસર હતો. તેમના મનમાં મેલ  
નહોતો, પેટમાં પાપ નહોતું. તેઓ હમેશાં ગુણમાં  
વર્ધતાજ જતા હતા.

તેમને એક મોટાલાઈ અને એક મોટી બહેન  
હતાં. તેમનાં નામ નંદિવર્ધન અને સુદર્શના.

વર્ધમાનકુમાર આનંદે ઉછરતાં મોટા થવા લાગ્યા.  
સાતેક વર્ષની ઉભ્યરે તેઓ એક વખત ભિન્નો સાથે રમવા  
ગયા. ત્યાં એક ગ્રાડ આગળ મોટા સાપ પડેલો હતો. બધા  
ભિન્નો આ જોઇને નાઢા પણ શ્રી વર્ધમાન કુમારે તેને  
પકડીને દૂર ફેંકી દીધો. બીકને તો તેઓ સમજ્યા જ  
નહોતા.

રમત રમવામાં તેઓ એક્ષા હતા.

આઠ વર્ષની ઉભ્યરે તેમને ભણવા ભૂક્યા. પણ  
ત્યાં ઉભ્યરના પ્રમાણમાં તેમને વિકાસ ધણ્યો લાગ્યો.  
તેમને ભણવવાની જરૂર જણાઈ નહિ.

શ્રી વર્ધમાન ભાતાપિતાના ખણું ભક્ત હતા.  
 કદી તેમનું મન દૂષવતા નહિ. સૌનું સુખ વિચારતા.  
 કદી ડાઈ પર છોધનહિ, કદી અભિમાનનો અંશ નહિ.  
 સદાયે સરળ, સદાયે સંતોષી. મુખ સદા શાંત અને  
 હસસુષું. બોલે તે પણ ચીહું. આવો સ્વભાવ ઢાને  
 ન ગમે ?

તેમને જગતના મોજશોખ લક્ષ્યાવી શકતા નહોતા.  
 શ્રી વર્ધમાન યોગ્ય ઉભ્મરના થયા ત્યારે ભાતા-  
 પિતાએ તેમનાં લક્ષ્ય યશોદા નામે રાજકુંવરીની સાથે  
 કર્યા. શું યશોદાના ગુણ ! શું યશોદાનાં રૂપ ! સમય  
 જતાં તેમને એક પુત્રી થઈ. તેનું નામ પ્રિયદર્શના.

શ્રી વર્ધમાનકુમાર અફાવીશ વર્ષના થયા. આ  
 વખતે તેમના ભાતાપિતા ધર્મધ્યાન કરીને મરણ પામ્યા.  
 શ્રી વર્ધમાને વ્યા હુઃખ શાન્તિથી સહન કર્યું પણ  
 નંદિવર્ધન અત્યંત શોક કરવા લાગ્યા. શ્રી વર્ધમાને  
 કહ્યું: ‘ભાઈ ! સમજો. શોક કર્યે શું યશો ? હૈયે હિંમત  
 રાખો.’ નંદિવર્ધન સમજ્યા અને શોક આછો. કર્યો.  
 હું પિતાની ગાડી ખાલી પડી હતી તેથી નંદિવર્ધન

કહેવા લાગ્યાઃ ‘વર્ષમાન। તમે રાજ્ય બોગવો.  
એને માટે ખરા લાયક તમેજ છો. ’ વર્ષમાન કહે,  
‘ ના રે ચોટાભાઈ ! આપજ ગાઠી શોભાવો. મારે આ  
રાજ્યનો ઘર નથી. ’ એથી બધાં બેગા થઇને નંદિ-  
વર્ષનને રાજ ઘનાયા.

: ૩ :

વર્ષમાનકુમારે હવે વિચાર્યુ કે માતાપિતા જીવતાં  
સુધી દીક્ષા ન લેવાની મારી પ્રતિક્ષા પૂરી થઇ છે. હવે  
તો આત્માને ઉદ્ઘારવાનો, જગતને ઉદ્ઘારવાનો સમય  
આવી પહેંચ્યો છે. માટે ચોટાભાઈની રજ લઇને  
તેમ કરે.

તેઓ નંદિવર્ષન આગળ આવ્યા ને દીક્ષા માટે  
રજ માગી. આ સાંભળતાં નંદિવર્ષનના દુઃખનો પાર  
રયો નહિ. તેઓ કહેવા લાગ્યાઃ ‘ નહાલા ભાઈ !  
હજ માતાપિતાનો વિયોગ ભને સાલે છે, એમાં વળી  
તારો વિયોગ ! મારાથી એ સહન નહિજ થાય.’

ચોટાભાઈના કહેવા પરથી વિચાર કરતાં તરતને  
માટે શ્રી વર્ષમાનને પોતાનો વિચાર મુલતવી રાખ-

વાતું ઢીક લાગ્યું. પણ આ કાણુથી પોતાના જીવનની રીતભાત તેમણે ખફલી નાંખી અને સાધુની એઠે રહેવા લાગ્યા.

અનેક જાતના સાધન સગવડથી ભરપૂર રાજમહેલ, ખરમા ખરમા કરતાં સેંકડો નોકરચાકર અને અત્યાંત ગુણવાળી રાણી યશોદા; એ બધાનો સહવાસ છોડી શ્રી વર્ધમાન રાજમહેલના એકાંત કાગમાં રહેવા લાગ્યા. અહો રહી તેમણે ભવિષ્યની તૈયારીએ કરવા માંડી. ધણેં ખરો વખત આત્મચિંતનમાં ગાળે અને જરૂર પડતાં શુદ્ધ અજપાણી વાપરે. આમ કરતી એક વરસ પસાર થયું. બીજા વર્ષથી તેમણે દાન દેવા માંડયું. પુછળ સોનામહોરાનું દાન દીધું. એથી અનેક ગરીખગરખાંની ભાવટ ભાંગી ગઈ. આ રીતે એક વરસ સુધી દાન દ્ધને તેઓ સાધુજીવન ગાળવા તૈયાર થયા.

આપણી કારતક વદ દશમનો દિવસ છે. આપું ક્ષત્રિયકુંડ નગર ઉત્સવ ઉજવી રહ્યું છે. નગરની ખાંડાર શાતરીલ નામે સુંદર બાગ છે. ત્યાં માણુસે વર્ધમાનકુમારના આવવાની રાહ જોઈ રહ્યા છે.

સમય જતાં હજર વળવાળો હેઠિદ્વબજ આંદો, પાછળ  
નગારાં અને વાળુંને આવ્યાં. પાછળ નંદિવર્ધનરાજ  
ને મંત્રીએ પવાર્યો. પાછળ સામંત ને શોઠ શાહુકારો  
પવાર્યો. તેની પાછળ સુંદર પાલખી આવી. એમાં  
શ્રીવર્ધમાનકુમાર ઐટેલા હતા. પાછળ અંતઃપુરની  
અને નગરની સીઁઓ ગીત ગાતી હતી. અહા ! શું  
તે વખતનો દેખાવ ? આંદે આંદું ને મહેંદ્રે ગીત !

વર્ધમાનકુમાર પાલખીમાંથી નીચે ઉત્થયો. શરીરે  
ખૂબ સુગંધી પઢાર્યો લગાડેલાં છે, વસ્ત્રાલંકારની શોભા  
અપાર છે. ગંભીરતાથી શ્રીવર્ધમાને એક પણી એક  
વસ્ત્ર અને અલંકાર ઉતારી નાખ્યા અને એકજ દેવતાએ  
વસ્ત્ર રાખ્યું. માયાના વાળ પોતાના હાથથીજ ચુંદી  
કાઢ્યા અને સાધુજીવનની મહાન પ્રતિષ્ઠા લીધીઃ  
આજથી હું કોઈપણ જલનું પાપકામ મન વચન  
ને કાયાથી કરીશ નહિ. મારી સંપૂર્ણ આત્મશુદ્ધિ  
અરીશ.

હવે શ્રીવર્ઘમાન ત્યાં પવારેલા સર્વે માણુસોને  
સંખેધીને બોલ્યા : ‘મહાનુભાવો ! મારું જીવન આજથી  
જુદી દિશામાં શરૂ થયું છે. હવે હું બીજે ર્થણે જવાની

રજ ભાગું ખું. આ સાંબળી સફુએ કુખી દીલે રજ  
આપી.

નીશ વર્ધના તથણુ રાજકુમાર શ્રી વર્ધમાન પોતાની  
આત્મશુદ્ધિ કરવા ચાલી નીકળ્યા.

મોટાભાઈ નંદિવર્ધન શ્રી વર્ધમાનની સાવના  
સમજ્યા હતા એટલે રજ આપી હતી. પણ તેમનું  
જ્ઞાલ અથાગ હતું. જ્યાં શ્રી વર્ધમાન ચાલવા લાગ્યા  
ત્યાં નંદિવર્ધનની આંખમાંથી દડદડ આસુ પડવા  
લાગ્યા. તેઓ મોટેથી ઝણ કરવા લાગ્યા. પણ શ્રી  
વર્ધમાનનું મન હવે જગતના મોહુ કે શોકમાં ધસડાય  
તેમ નહોતું. તેઓને જે મહાત સાધના કરવાની હતી  
તેનાજ તરફ લક્ષ રાખી તેઓ શાંત ચિત્તથી ચાલવા  
લાગ્યા.

: ૪ :

મહાત્મા તો ધણુ થયા પણ શ્રી વર્ધમાનથી છેઠા.  
એમણે ખુલુ આકરાં તપ આદ્યાં. ડોષ વખત કે  
ઉપવાસ તો ડોષક વખત ચાર ઉપવાસ. ડોષક વખત

પંદર ઉપવાસ તો ડોઈક વખત ત્રીસ ઉપવાસ. અરે !  
ઇ ઇ મહિનાના ઉપવાસ પણ તેમણે કરવા માંડયા.

શ્રી વર્ધમાન જૂથ ઉપવાસ કરે અને ધ્યાન ધરે.  
ધ્યાન પણ ડેવી જગાએ ? ડોઈ ખંડેરમાં ડે મશાણમાં.  
ડોધ જંગલમાં ડે ડોધ ખીણુમાં, ડોધ મંદિરમાં ડે ડોધ  
ભયંકર જગામાં.

ત્યાં ચાંચડ કરડે અને મચ્છર કરડે. મધ્યમાખ  
કરડે અને લભરા કરડે. પણ તેઓ શાંતિથી બધું  
સહન કરે. ગંગે તેવી સત્તામણી થાય પણ તેમનું ધ્યાન  
ચૂકનાહિ.

એક વખત તેઓ ચાલ્યા જય. રસ્તામાં જોવાળ  
મળ્યા. તેઓ કહેવા લાગ્યા : ખાપજી ! આ રસ્તે જશો  
નાહિ. આગળ જયંકર વન આવરો. ત્યાં કાળો મણુઝર  
નાગ છે. કુંઝડે ફોલી ખાય છે. માટે ખીંચ રસ્તે જવ.

પણ શ્રીવર્ધમાન તો લડવીર હતા. ડોધથી ગાંઝયા  
ન જય. જયંકર વન તે શું ખીંચરાવે ? કાળો મણુઝર  
નાગ પણ શું ખીંચરાવે ? એ તો ચાલ્યા આગળ. એવામાં  
આંધું એક ઘીર જંગલ. ત્યાં જતાં માણુસની છાતી

ન ચાલે. જ્યાં જુએ ત્યાં જગાંત્રાંખરાં. પાંદડાંનાં તો ઢોઢગ. એમાં મારગ પણ જ્યાંથી જડે? છતાં શ્રી વર્ધ્માન તો ચાલ્યા.

જંગલમાં એક રાફ્ટો. તેમાં કાળો નાગ બહુ બેરીનો. કુંક મારે તો ફાટી પડે. શું માણુસ કે શું ઢાર! એનું નામ ચંડકાશિયો.

ચંડકાશિયે શ્રી વર્ધ્માનને જેયા. પછી તો પૂછવું જ શું? મારવા માંડ્યા કુંપ્રાડા. કું-ઉં-ઉં-ઉં કું-કું. કું-ઉં-ઉં-ઉં-ઉં. પણ તેમને કાંઈ નહિ.

ચંડકાશિયો કહે, ‘મારે નહાલું! આ હોઠ અજખ લાગે છે. ઓર કેમ નહિ ચડતું હોય? લાંઘ ડસ્યું: તે હોડયો ને જમણાં અંગુઠે ડર્યો, પણ કાંઈ નહિ. તે તો સાચા સંત હતા.

સાપનું કાંઈ જોર ચાલ્યું નહિ. એટલે શ્રી વર્ધ્માન પોછ્યા : ‘ચંડકોશિક! કાંઈક સમજ! ’ આ તો મહાત્માની વાણી. બેરીનાં ઓર મદી ગયાં. ચંડકોશિક ડાંશો થયો. શ્રી વર્ધ્માન આગળ ચાલ્યા.

ચાલતાં ચાલતાં તેઓ. એક મોટા શહેરમાં આવ્યા.  
તેનું નામ રાજગૃહ. તેને હતું મોડું પડું. તેનું નામ  
નાલદા. ત્યાં એક વણુકરની વણુટશાળામાં શ્રી વર્ધમાન  
જિત્યો.

આગળ ચોમાસુ આવે. ચોમાસામાં એક ગામથી  
ખીલ ગામ ન ફરૈ એટલે ત્યાંજ રહ્યા.

ત્યાં આવ્યો. એક ચિત્રો બતાવનાર છોકરો. તેનું  
નામ ગોશાળો. તે ભારે અપલખણે ને ભારે અટકચાળો.  
લોકાને ચિત્રો બતાવીને તે ગુજરાન ચલાવે. તેણે વિચાર  
કર્યો : ‘લાંઘને આ સંતનો શિષ્ય થછ જહું કે કુમા-  
વાની બધી માથાકુટજ મટી જય.’ આથી વર્ધમાન  
ધ્યાનમાં ડિઝા હતા ત્યાં આવીને એ પોદ્યો : ‘ભગવાન !  
હું તમારો ચેલો. પણ ભગવાન તો ન પોદ્યા, ન ચાદ્યા.’  
ગોશાળો જ્ઞતે તેમનો ચેલો બન્યો.

ચોમાસું પૂરું થયું. શ્રી વર્ધમાને વિહાર કર્યો.  
આ ભાઈ પણ સાથે ચાદ્યા. કયાં ગુરુ ? કયાં ચેલો ?

શ્રી વર્ધમાન ધ્યાનમાં જ રહે. ગોશાળો લોકાનાં  
અટકચાળાં કરે ને માર ખાય. સાથે ગુરુને પણ માર  
ખવરાવે. જુઓ ચેલાનાં વર્ત્તન !

એક દિવસ શ્રી વર્ધમાન ચાલ્યા બય. ગોશાળે પણ તેમની સાથે હતો. એવામાં મારગે મજ્યા સિપાઈ. તેમણે સવાલ પૂછ્યો: ‘ડાણ છો તમે?’ શ્રી વર્ધમાન તો ધ્યાનમાં હતા એટલે કાંઈ એલયા નહિ. ગોશાળે પણ એ જોઈ ધ્યાન લગાવ્યું. તે પણ કાંઈ એલયા નહિ.

સિપાઈઓએ બન્નેને પકડ્યા અને નાંખ્યા હેડમાં. ખૂબ સત્તાવ્યા. પણ શ્રી વર્ધમાન તો સાચા સંત! સંતનાં પારખાં સિપાઈ શું કરે? થાડીવારમાં સિપાઈઓએ જાહુયું કે આ તો કોઈ મહાપુરુષ છે. બહુ માહું થયું. આપણે ઓળખ્યા નહિ. ચાલો એમની માઝી માળીએ. તેમણે શ્રી વર્ધમાન આગળ માઝી માંગી. શ્રી વર્ધમાન તો ક્ષમાના ભંડાર. તેમને છોધ જ કર્યાં હતો કે ક્ષમા આપવાની બાકી રહે?

એક વખત શ્રી વર્ધમાન જંગલી મુલકમાં ગયા. તેનું નામ રાઠ. ત્યાંના માણુસો બહુ જંગલી. તેઓ સાધુને જુચે તો મારવા દોડે, કુતરા કરડાવે અને બધા ઉપાય અજમાવે.

શ્રી વર્ધ્માનને પણ તેમણે જીવ સત્તાવ્યા. વળી ત્યાં ન મળે રહેવાનું સ્થાન કે ન મળે લિક્ષા. પણ તેમને તો વહીનું તપ. સદ્ગ તપ કરે અને ધ્યાન ધરે. ધણું માસ તેચ્યો અહીં કૃયા.

ગોશાળો આ વખતે સાથે નહોતો. તે જાણુંતો હુંતો કે રાઠ કેવો ભયંકર છે. એથી રાઠમાંથી શ્રી વર્ધ્માન પાછા કૃયા કે તરત તે આવીને ભેગો થયો.

એક વખત શ્રી વર્ધ્માન ધ્યાનમાં ભસ્ત થઈને જિબા હતા. રાત અંધારી ધોર હતી. ટાઠ તો કહે મારે હામ. એવામાં વેપાર માટે દૂર દેશાવર જતો એક કાડું આવ્યો.

એ રાતે કડકડતી ટાઠ પડી. એટલે તેમણે સળગાંયાં તાપણું. આપી રાત તાપ્યા. સવારે તેચ્યો આગળ ચાલ્યા. પણ પેલાં તાપણું તો સળગતાં જ રહ્યાં. એટલે તેમની પાસે ધાસ હતું તે પણ સળગણું.

શું એના ભડકા ? શું એનો તાપ ? એ અભિ તો આરે બાજુ વધવાજ લાગ્યો. વધતાં વધતાં તે જીવ વધ્યો અને આવ્યો ગુરુ-ચેલા આગળ.

સાચા સંત વર્ધમાન તો નહાલે કે ન ચાલે. પણ ગોશાળાથી તાપ સંઘાયો નહિ. તેણે પાડી ઘૂમઃ ‘ગુરુજી! ભાગો. આ કાળજુખે અદ્ધિ તો આતી પહોંચયો. હમણું બળીને ભર્તમ થઈ જઇશું.’

આટલું બોલીને ગોશાળો ભાગ્યો; પણ સાચા સંત શ્રી વર્ધમાન શાંતિથી જીવા રક્ષા. તેમના પગ બળવા મંડયા પણ તેઓ ધ્યાનથી ડગ્યા નહિ.

જ્યારે ધ્યાન પૂર્વં થયું ત્યારેજ તેઓ આગળ ચાહ્યા. પેલા ભાઇ પણ સાથે ચાહ્યા. પરંતુ પાછળથી એક વિદ્યા સાધવાં જુદા પડયા.

: ૫ :

શ્રી વર્ધમાન ધ્યાનમાં જીવા છે. એવામાં એક ગોવાળ આંદોલો. સાથે બળદ. એને ગામમાં જઈ પાછા પૂરવું. થોડી વાર માટે બળદ ઢાણું લઇ જય અને લાવે? એટલે તે એલોયો: ‘ચ્યા ભાઈ! જરા બળદ સાચવનો?’ શ્રી વર્ધમાન તો ધ્યાનમાં હતા એથી કાંઈ જવાબ મળ્યો. નહિ. પણ ગોવાળ સમજ્યો કે તેમણે સાચવવાનું

માન્યું છે. એટલે તે ગામમાં ચાહ્યો ગયો. અહીં ખળદ  
પણ ગામમાં ચાહ્યા ગયા. કહ્યું છે કે ધણી વિનાનાં  
ઢાર સુનાં.

ગોવાળ પાછો આવ્યો. જુઓ તો ખળદ નહિ. તે  
બાહ્યોઃ ‘અરે સાધુ મહારાજ ! મારા ખળદ ક્યાં ?’ પણ  
કાંઈ જવાબ મળ્યો નહિ. ગોવાળ ગુરુસે થયો. તેણે  
ઝીરીને પૂછ્યું: ‘અરે મહારાજ ! મારા ખળદ ક્યાં ગયા ?’  
તો ય કાંઈ જવાબ મળ્યો નહિ. આથી ગોવાળ બહુ  
ગુરુસે થયો.

તે ખરાડ્યોઃ ‘કુમ અહ્યા સાધુડઃ ! નથી સાંસ-  
ગતો ? તારા કાનનાં આ કાણું નકામાં છે કે શું ?’ છતાં  
કાંઈ જવાબ મળ્યો નહિ.

અહા ! આટઆટલું સંકટ પણ વર્ધ્માનના મુખ  
માંથી અરેકારો નહિ. શું ક્ષમા ! શું સહનશીલતા !

ધ્યાન પૂર્ણ થતાં તે ગામમાં ગયા અને ધેર ધેર  
ઝીરીને શીક્ષા લીધી. ત્યાં એ ચતુર ભિત્રોચ્ચે એમને જોયા.  
એમણે તરત પારખી લીધું કે આ મહાત્માના શરીરમાં

કાંઈક પીડા છે. પણ સાંત કાંઈ બોલતા નથી. એ તો પાછાં ગામ બહાર આવ્યા ને ધ્યાનમાં જોડાયા.

પેલા ભાઈખંધાથી આ હઃખ ન જેવાયું. તેઓ પાછળ પાછળ આવ્યા અને કુશળતાથી સળીએ એંચી કાઢી. પણ અહા પીડા ! સિંહસમા શ્રી વર્ષમાનના ભોડામાંથી પણ ચીસ નીકળી ગઇ. પરંતુ ધડીકમાં તે શાંત થઈ ગયા અને ધ્યાનમાં જોડાયા.

અહા ડેવી વીરતા ! આવી વીરતા કઠી બેધ નથી હું સાંસળી નથી. શ્રી વર્ષમાન આવી વીરતાથી જ મહાવીર કહેવાયા.

પ્રભુ મહાવીર, એક શાલના આડ નીચે ડાંગરના એતરમાં ધ્યાન લગાવીનેએડા છે. પાસે ધીમી ધીમી નરી વહે છે. દિવસનો ચોથો પહોર છે. પોતાને છકનું તપ છે.

આ વખતે તેમની મહાન તપશ્ચર્યા પ્રજી. ડેવળ-જ્ઞાન થયું. એટલે બધું બરાબર જાણવા લાગ્યા. સાચા સુખનો માર્ગ તેમને મળી ગયો.

આ વખતે હિંદમાં ધનધાત્ય ખ્રિસ્ટ હતાં, કલાકો-

શદ્ય ધણું હતું, પણ સાચો ધર્મ હુલ્લંબ હતો. લોડા હોમહવન ઘૂણ કરતા અને પ્રાણીઓનો ઘણું સંહાર થતો. આખણે તથા બીજ જિંચી અતના લોડા રદ્દને ધણી હુલકી દ્રષ્ટિએ જેતા. તે ડાઈ પણ અતનો અધિકાર લોગવી શકતો નહિ. બ્રીઓનું સ્થાન ધણું નીચું હતું. ધર્મશાસ્ત્રો વિક્રાનોની ભાષામાં જ લખાતાં, એટલે તેનો લાભ સામાન્ય લોડા ઉઠાવી શકતા નહિ. વળી અનેક સંપ્રદાય ને અનેક ધર્મો એ વખતે ચાલી રહ્યા હતા. પ્રભુ મહાવીર આ બધી સ્થિતિ ધ્યાનમાં લઈ ઉપરેશ દેવો શરૂ કર્યો:—

હિંસાથી ભરેલા હોમહવન ને કિયાકંડથી ખરે ધર્મ થતો નથી પણ આત્માની શુક્લ કરવાથી જ થાય છે.

જે સદ્ગુણીએ તે જ આખણું છે, જે દુરાચારી છે તે શૂદ્ર છે.

ધર્મનો ધનિરો કોઈ પણ માણુસનો હોઈ શકે નહિ. દરેક મનુષ્ય ધર્મ કરી શકે છે. શું આખણ ! શું શૂદ્ર ! શું પુરુષ ! શું સ્ત્રી !

અહિંસા એજ પરમ ધર્મ છે.૦

પૂરેપૂરો વિકાસ થાય તો આત્મા જ પરમાત્મા  
અને છે.

વस્તુની અધી આજુ જોવાથીજ તેનું સાચું  
સ્વરૂપ સમજય છે વગેરે.

પ્રલુબ મહાવીર સામાન્ય લોડાની ભાષામાંજ પોતાનો  
ઉપદેશ દેવા લાગ્યા. ડેવલજાન થયા પછી ત્રીસ વર્ષ  
સુધી તેમણે હેશના જુદા જુદા ભાગમાં ફરીને ઉપદેશ  
આપ્યો. ચારે વર્ષના સ્વીપુરુષો તેમના શિષ્ય થયા.  
દ્યદ્રભૂતિ ગૌતમ, સુધર્મા આદિ પ્રાણણો, ઉદાયી, મેધ-  
કુમાર આદિ ક્ષનિયો, ધત્તા, શાલિલદ્ર વગેરે વૈર્યો,  
મેતારજ, હરિદેશી વગેરે શુદ્રો પ્રલુના ત્યાગી શિષ્ય હતા.

વૈશાલિપતિ ચેડા મહારાજ, રાજગૃહપતિ શ્રાણિક,  
તેમનો પુત્ર ઢાણિક વગેરે ક્ષનિયો, આનંદ કામદેવ  
વગેરે વેપાર ને ઘેતી કરનાર વૈર્યો, શકડાલ ને દંક  
વગેરે કુંભારા પ્રલુના ખાસ ગૃહસ્થશિષ્ય હતા.

લાગી સીશિષ્યાએ માં ચંદ્રનભાળા તથા પ્રિયર્દ્ધર્ણના ક્ષત્રિય પુત્રીએ હતી. દેવાનંદા ખાંઝણી હતી. ગૃહસ્થ સી શિષ્યાએ માં રેવતી, સુલસા, જ્યેન્તી વગેરે વિદુષી ખાંધાએ હતી.

કુલ ૧૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધીએ પ્રભુ મહાવીરને હાથે દીક્ષા પામ્યા હતા. ગૃહસ્થ સી પુરુષો તો ધથાજ હતા.

પ્રભુ મહાવીરે આ ખખાનો સંધ સ્થાયો. આવો સંધ તીર્થ કહેવાય છે એટલે તેઓ તીર્થીકર કહેવાયા. એમના પણી બીજું હાઈ તીર્થીકર થયું નથી. એટલે તે ચરમ તીર્થીકર કહેવાય છે. તેમણે પોતાના રાગદ્વિષ પૂરેપૂરા જીતી લીધા હતા એટલે તેઓ જિન પણુ કહેવાય છે.

સડેલા સમાજ આગળ આદર્શ જીવન આળનારનો આ સંધ સ્થાપી પ્રભુએ જગતસુધારણાની ઘોખણા કરી. અનેક વહેમો ને અનેક કુરિવાને ઉખડી ગયા. લોહા અહિંસાનું રહસ્ય સમજવા લાગ્યા. જ્ઞાન અને સાચા ત્યાગનો ભારતવર્ષમાંથી ફરીથી પ્રકાશ થયો.

વિહાર કરતાં પ્રભુ મહાવીર પાવાપુરી ગયા. ત્યાં ધણ્યા રાખ્યો એકઠા થયેલા હતા. તેમને પ્રભુ મહાવીરે અમૃતવાળીથી દેશના દીવી. આ છેહી દેશના દ્વારા પ્રભુ મહાવીર નિર્વાણ પાડ્યા. આહ ! ભારતવર્ષનો સૂરજ આથળી ગયો. બદ્ધોએ તેમની ઓટ પૂરી પાડવા લાખો દીવા પ્રગટ કર્યો. આ દિવસથી દીવાળીનું વર્ષ શરૂ થયું.

ને મહાપુરુષે અનોદ જીવન ગુલારી આત્માનું અને જગતનું કલ્યાણ કર્યું તેના ગુણ ડોણું ગાધ શકે ? જગત જીવશે ત્યાં સુધી આ ઉપકાર યાદ કરશે અને એમના ઉપદેશને અનુસરી પોતાનું કલ્યાણ સાધશે.

અગણિત વંદન હો પ્રભુ મહાવીરને !

અગણિત વંદન હો એ માનવઅતિના ઉદ્ઘારકને !

## વીર ધનો

દક્ષિણ દેશમાં ગોદાવરી નામે ભનોહર નદી છે.  
તેના કિનારે એક મોઢું શહેર હતું. તેઠું નામ પૈંડણ.  
ત્યાં રહે એક શેઠ. તેમનું નામ ધનસાર. તેમને ડેલૈયા  
કુંવર જેવા ચાર દીકરા. તેમાં સહુથી નાનાતું  
નામ ધનો.

ધનામાં નામ પ્રમાણેજ ગુણુ હતા. તે જન્મ્યો ને  
ધનસાર શેઠના ધરમાં ધન વધવા માંડયું. બીજના  
ચંદ્રમાની માર્ક ધનો વધવા લાગ્યો. કહેવત છે કે  
પુત્રના લક્ષણુ પારણુમાંથી વરતાય. તે સુજખ ધનામાં  
ચતુરાઈ સાહસ વગેરે ગુણો નાનપણથીજ જણ્ણાવા  
લાગ્યા.

તે આઠ વર્ષનો થયો ત્યારે ભણુવા મૂક્યો. ત્યાં લખતાં શીખ્યો, વાંચતાં શીખ્યો, ગણ્યિત શીખ્યો, ગાતાં શીખ્યો, બીજું પણ ધણું ધણું શીખ્યો. શું ધત્તાની હેંશિયારી ! સહુ ડાધ તેની ઝુદ્ધિના વખાણું કરે. ધત્તાના મોટા ભાઈઓ આ સાંભળો અને દાઢે બળો. તેઓ અંદર અંદર વાતો કરે : ‘અહ્યા ધત્તાનાં આઠલાં બધાં વખાણું શાં ? એમાંયે બાપાજુની તો હુદ ! જ્યારે જુઓ ત્યારે એજ વાત કરતા હોય કે મારો ધન્ના આવો ને મારો ધત્તાના તેવો. પણ અહ્યા એ નાનડા શું કરે છે ? એ તો ખાય છે, પીએ છે ને ફરતો પરે છે, અને આપણે તો આપો દ્વિસ ભડેનતા મજૂરી ને વેપારમાંથી ઉંચા જ આવતા નથી. પૈસા આપણે પેઢા કરીએ ને વખાણું ધત્તાના થાય એ હેતું ?

ધનસાર શેઠ ધર્ણીયે વખત આવી વાત કાનોકાન સાંભળો. એમણે જાણું કે છોકરા છે દાઢીલા. પોતાનામાં ડહાપણ નથી ને બીજાનું ડહાપણ સંખાતું નથો, માટે એક વખત એમની પરીક્ષા લેવા દે.

: ૨ :

એક દ્વિસ સવારે ધનસાર શેઠ ચારે મુન્નોને

એકઠા કર્યા અને કહ્યું : ‘ દીકરાઓ ! આપણે વેપારી માણુસ છીએ. વેપારીના દીકરાને વેપારજ શોલે, તમે બધા એ વિદ્યામાં ડેટલા કુશળ થયા છો તે આજે ભારે જેવું છે. માટે દરેક આ સોનામહોરો હ્યો. તેનાથી ગમે તે વેપાર કરને ને એમાંથી થયેલી કમાળીમાંથી સાંજે ઘેર આવી સહુને જમાડનો.’

પિતાની પાસેથી સોનામહોરો લઈ ચારે જાઈએ વેપાર કરવા ચાહ્યા. સહુ જુદા જુદા વિખરાઈ ગયા. અતુર ધનો પરતો ફરતો બજરમાં આંધો. ત્યાં એક હુકાન આગળ જિબો રહીને વિચાર કરે છે ત્યાં સામે નજર પડી. એક શેઠ બેઠાં બેઠાં કાગળ વાંચે. ધનાને તેજા અવળા અક્ષરો હેખાય. પણ ધનો મહાયતુર ! અવળા અક્ષરોથી પણ તેણે આપો કાગળે વાંચી લીધો. એમાં લખેલું કે આજ રૈજ અસુક ઠેકાણે વણુઅરાની પોઠો આવશે. માંહિ મોંધામાં મોંધાં કરિયાણું ભરેલાં છે. અને તેને ખરીદવાથી ધણેલાં લાભ થાય તેમ છે માટે જદ્દી જનો ને બધાં કરિયાણું ખરીદી લેશો.

ધનો કહે, ‘ ચાલો, આપણે એડો પાર થયો. ’

તે બહારગામ ગયો ને વણુઆરાને મહુંચ્યો. ‘જુહાર ! શેઠ જુહાર !’ કહીને જિલ્લો રદ્દો. વણુઆરાએ કહ્યું : ‘કેમ શેઠજી ! શું કામ છે ?’ ધનાએ જરા પણ અચ્છાયા વિના કહ્યું : ‘કરિયાણું ખરીદવા છે.’ અને વાટાધાટ ચાલી. થાડી વારે સોઢો નક્કી થયો ને ધનાએ પોતાની પાસેની સોનામહોરો આપી કરિયાણું ખરીદી લીધાં. એવામાં ગામમાંથી પેલા શેઠ આવી પહોંચ્યા. તેમણે વણુઆરાને પૂછ્યું : ‘અરે ! ભાઇ વણુઆરા ! વેચશો કે કરિયાણું ?’ વણુઆરાએ કહ્યું : ‘શેઠ ! સોઢો તો થઈ ગયો. આ જિલ્લા ખરીદનાર.’ આ સાંભળી શેઠ તાજુખ થયા. ‘આ મારો ઠણાદો કથાંથી પહોંચ્યો ? એને શી રીતે ખખર પડી હશે ?’ ચાલો, થયું તે ખરું. હવે એની પાસેથી જ કરિયાણું ખરીદી લઈ.’ તેમણે પૂછ્યું : ‘કેમ ભાઇ ! વેચવા છે કરિયાણું ?’

ધનો—હા.

વેપારી—શું મૂલ્ય લેશો ?

ધનો—નક્કાની સવા લાખ સોનામહોર.

વેપારી—એમ તો એમ. પણ ભાઈ મને  
કસ્થિયાણું આપી દે.

ધનને સોનામહોરો લઇને કરિયાણું આપ્યાં  
અને ગામમાં આવ્યો. ત્યાં રસ્તામાંથી ભાતખાતની  
ભીઠાઈએ તથા નવનવાં વસ્તુ અને ધરેણું ખરીધાં.  
પછી ગયો ધર. આ વખતે બીજી ત્રણું ભાઈએ  
પણ આવી ગયા હતા. તેમાં એક લાંબો હતો  
વાલ, બીજો લાંબો હતો ચોળા ને ત્રીજો લાંબો  
હતો અડદ. ધનાની કમાણી જોઈ સહુ ઠરી ગયા.  
ધનાના પિતાને આથી બહુ આનંદ થયો ને બધી  
હક્કીકત પૂછી. ધનને જવી હતી તેવી હક્કીકત કહી  
સંભળાવી. આ સાંભળી પેલા ભાઈએ બોલી  
ઉક્ખાઃ ‘પિતાજ ! આ તો ઠગાઈ કરી, ઠગાઈ !  
અમારી પરીક્ષા તો વેપારમાં લેવાની હતી.  
બિચારા વણું આરાનો કાગળ વાંચી લીધી ને કસ્થિ  
યાણું ખરીદી લીધાં એ તે કાંઈ વેપાર કહેવાય !  
અમારી ખરી પરીક્ષા કરવી હોય તો વેપારમાંજ કરો.

ધનસાર શેઠ કહે, ‘તમે દાખીલા ન થાવ.

તમારી ઈરછા હશે તો વળી બીજ વાર પણ  
પરીક્ષા કરીશા.’

: ૩ :

ધન્નાની ચડતી કળા જોઈ તેના ભાઇઓ  
બહુ અદેખાઈ કરવા લાગ્યા. આ જોઈ ધનસાર  
શેઠ બધા છોકરાઓને બોલાવીને થાડી થાડી  
સોનામહોરો આપી અને કહ્યું: ‘આ વખતે  
હેશિયારીથી કામ લેલે. જો જે, પાછળથી કહેવાનુ  
ન રહે.’ બધા છોકરાઓએ કહ્યું: ‘વારુ, આ  
વખતે જરૂર પાણી બતાવી આપીશું.’ અને તેઓ  
અભરમાં ચાલ્યા ગયા. હૈયાના ઉહેલ વિના વેપાર  
થાડો જ થાય? બિચારા નણે ક્ષાઈઓ ખૂબ રખડયા,  
અથડાયા, કુટાયા પણ કંઈ દફુડો વજ્યો નહિ.  
આ બાજુ ધન્નો વિચાર કરતો ચાલ્યો અય છે ત્યાં  
ઘેટાનું એક ટોળું જોયું. તેમાં વાંકડી શીંગડીવાળો  
એક સંધલો ઘેટા બહુ મળનો. ધન્નાને વિચાર  
આવ્યો થયો કે લાભ, આ ઘેટાજ ખરીદું. એણે  
થાડી સોનામહોરો આપીને ઘેટા ખરીદ્યા. એ ઘેટા

લઈ તે રાજમહેલ ભણી ચાલ્યો. એ ગામના રાજકુંવરને ઘેટા લડાવવાનો ખણું શોખ. રસ્તામાંજ તેનો ભેટા થયો. રાજકુંવરે ધ૜નાની પાસે સુંદર ઘેટા જેઠ કહ્યું: ‘અહ્યા વાણિયા ! લડાવવો છે આ ઘેટાને ? ’ ધન્નો કહે, ‘ ધણી મુશીથી. ’ રાજકુંવર, ‘ પણ શરત છે ? ’ ધન્નો કહે, શું ? ’ રાજકુંવર કહે, ‘ હારે તે સવા લાખ સોનામહોર આપે ! ’ ધન્નો કહે, ‘ કખુલ છે. ’

જને ઘેટાની ત્યાં કુસ્તી થઈ, જેર જેરથી ધીડા લે ને સામસામાં શીંગડાં અક્ષણે. લોડા એ જેવા ટેળે મજૂયાં. થાડીવાર તો એક બીજથી ડાઇ ગાંજ્યું નહિ પણ પછી રાજકુંવરનો ઘેટા હારી ગયો. રાજનો કુંવર એ જેઠ આશિયાળો થઈ ગયો. ધ૜નાના આનંદનો પાર રહ્યો નહિ. તે સવા લાખ સોના મહોરો જીતી ગયો. રાજના કુંવરે એ ઘેટા ખરીદી લઈને બીજુ પણ સારી રકમ આપી.

સાંજ પડી એટલે બધા ભાઈઓ બેર આવ્યા. પણ ડાઈના મોાફપર હોશ નહિ. એક બીજ સામું આવાની

નેમ જેયા કરે. એવામાં હસતો હસતો ધન્નો ધેર આંધો ને ધનાની આગળ સોનામહેરની થેલીઓ રજુ કરી.

ધનસાર શેઠ એ જેઠ ખૂબ હરખાયા પણ ભાઇ-ઓના મહેં દેવાઈ ગયા. એક ભાઇએ પૂછ્યું: ‘ધના ! આ મહેરો જ્યાંથી લઈ આંધો ?’ ધનનાએ જેવી હતી તેવી વાત કહી સંભળાવી. એ સાંભળી બીજ ભાઇએ બોલી ઉઠ્યાઃ ‘ દયો, આ તો જુગાર રમ્યો જુગાર ! હોડ રમવી એ જુગાર નહિ તો બીજું શું ? અમારી પરીક્ષા તો વેપારમાં કરવાની હતી ! ’

ધનસાર શેઠ કહે, ‘ દીકરાઓ ! ગાંડા ન થાવ. ડોધને સારા જેઠને રાજ થઈએ. એની અદેખાઈ કરવાથી શું વળે ? આ સાંભળી પેલા ભાઇએ બોલી ઉઠ્યાઃ ‘ હા, ખાપા ! ’ અમે તો ગાંડા જ છીએ ! ફેંકત તમારો આ નાનકડો દીકરો જ હાથો છે ! ’

: ૪ :

ધનનાનાં વખાણુ તો ચારે ખાજુ થવા લાગ્યા.

સગા ઠાલામાં, નાત જતમાં ને વેપારી વર્ગમાં પણ તેની પ્રશ્નાંસા થવા લાગી. પેલા ભાઈએ આ સાંભળીને મનમાં બળી જાય ને કંકાસ કરે.

ધનસાર શેઠ કહે, ‘લાંય, હજ એક વખત પારખું લઇ.’ બધાને તેમણે બોલાવ્યા ને થોડી સોનામહોરો આપી કહ્યું: ‘આ વખતે ન ભૂલશો. સહુ ધ્યાન રાખજો. સાંજ ધેર આવજો ને કમાણી દેખાડજો.’ સહુ સોનામહોર લઇને ચાલ્યા. એક ગયો આમ. બીજો ગયો તેમ. સહુ પડ્યા છુટા.

ધન્નો ગયો બજરમાં. ત્યાં એક સુંદર ઢાલિયો વેચાય. પણ વેચનાર માણુસ જતનો લાગી. એટલે ડાઈ લે નહિ. ધન્ને વિચાર્યું: ‘આ ઢાલિયામાં નક્કી કાંઈ કરામત છે માટે એજ લેવા દે.’ તેણે એ ઢાલિયો વેચાતો લીધો.

પેલા ભાઈએ ખૂબ રખડયા પણ કાંઈ કમાયા નહિ. આખરે આવ્યા ધેર. ત્યાં પેલો ઢાલિયો જેવામાં આંદ્યો. એટલે તરતજ ઓલી

ઉઠ્યાઃ ‘ભાપા ! જુચ્યો તમારો ડાખ્યા દીકરો.  
આ તો મહદ્દાંનો ઢાલિયો છે. કોઈ અને લેતું  
નહું તે આ તમારો ડાખ્યા દીકરો લઈ આયો.  
અને તે ધરમાં ધલાય ? અમે નહિ રહેવા દઈએ.  
અમારું ધર અપવિત થાય.’ અમ કહુને તેઓ  
ઉઠ્યા ને ઢાલિયો પછાડ્યો. એટલે ઈસ ને ઉપળાં  
જુદ્ધાં પડ્યાં. એજ વખતે તેમાંથી ઝળળાટ કરતાં  
અમૂહ્ય રતનો નીકળી પડ્યાં.

આ જેઈ બધા લાઈ લોંઠા પડ્યા. તેઓ  
મોંમાં અંગળી ધાલીને જેઈ રહ્યા. શોઠ બોલ્યાઃ  
‘હમ અદેખાએ ! કરી ધનનાની પરીક્ષા ?’  
ભાઈએ કહે, ‘હા, ભાપા ! હા. અમે બધા અદેખા.  
એક તમારો ધનનો જ સારો ! અમને કોઈ દિવસ  
વખાણશો નહિ હો ! ! ! ’

: ૫ :

એક વખત ગોદાવરી નદીમાં કરિયાણ્યાથી ભરેલું  
એક વહાણુ ઘેંચાઈ આયું. પણ તેનો ધણી ભરી  
ગયેલો. એટલે રાજએ કખજી કર્યું. પણી બધા વેપારીને

હુકમ કર્યે કે કરિયાણાં તમે ખરીદી હ્યો. રાજનો હુકમ સાંલળી બધા વેપારી ભેગા થયા.

વનસાર શેડના ધેર પણ રાજનું કહેણ આંધું કે રાજનાં કરિયાણાં વેચાય છે ને સહુ ભાગ પડતાં લે છે, માટે તમારે ત્યાંથી પણ કોઈને મોકલો. એટલે ધનસાર શેડે મોટા છાકરાને કહ્યું: ‘ધનદાતા ! તું જ ને કરિયાણાં ખરીદી લાવ.’ ધનદાત કહે, ‘બાપુ ! વખાણ કરતી વખતે ધનનો ને કામ કરાવતી વખતે ધનદાત ! હું તો કાઈ જતો નથી. જરો તમારો હાથો દીકરો !’

શેડ બીજી પુનને કહ્યું. નીજને કહ્યું. પણ સહુનો સરખો જવાબ મળ્યો. એટલે થાકીને ધનનાને કહ્યું: ‘એઠા ! તું જ.’ ધનનો કહે, ‘જેવી બાપુની આજા.’ ધનનો તૈયાર થઈને કરિયાણાં ખરીદવા ગયો.

વહ્નાણું પર બધા ભેગા થયા હતા. તેમાંથી એક લીધું કેશર ને બીજાએ લીધી કસ્તુરી. નીજાએ લીધી ખરાસ ને ચોથાએ લીધું ફ્યૂર. પાંચમાએ લીધું સુખદ ને છુટાએ લીધું અગર. સહુએ સારાં કરિયાણાં લઈ લીધાં. પાછળથી રંધો ખારા જેવી માઈનો ઢગતો.

બધા કહે, ‘વળગાડો આ ધનનાને. તે છોકરો શું સમજવાનો છે !’ એક વેપારી બોલ્યો: ‘ધનના ! તું વેપારનું ઝુફુર્ત કરે છે. એટલે આ મીઠું લઈ જ. શુકેન બહુ સારા થશે.’ બીજે કહે, ‘ શેઠ ખરાખર કહે છે.’ ધન્નો મનમાં સમજ્યો: ‘આ બધા મને છેતરે છે, પણ ફીકર નહિ. જોઇશું હોણું છેતરાય છે !’ ધન્નો કહે, ‘ જલે. ભારા ભાગમાં આ ખારો.’

ધન્નો ખારો લઈને ઘેર આંદો. બધા ભાઈ બોલ્યો: ‘જુઓ તમારો ડાંદો ઢીકરો. ખરા વેપારમાં પારખાં થાય ! ગામે સારાં સારાં કરિયાણું લીધાં ત્યારે ભાઈએ લીધી માટી. શું હોશિયાર છે ને !’

શેઠ પણ પૂછવા લાગ્યા: ‘ધનના ! માટી કેમ લાવ્યો ? સાંડ કરિયાણું કાંઈ ન મળ્યું ?’ ધન્નો કહે, પિતાજ ! આ ન હોય માટી. આ તો છે તેજંતુરી. લોઙું કરીએ ગરમ ને માંહી નાંખીએ તેજંતુરી તો અની જય સોનું.’ તે પ્રમાણે કરી જોયું તો સોનું થયું. તેથી બધા બહુ રાજ થયા ને ધન્નો એકદમ માલદાર અની ગયો.

૬ :

પેલા ભાઇઓ અહેખાઈ છોડે નહિ. રોજ કંકાસ કરે. ધનો કહે, 'આ સારું નહિ. મારા લીધે બીજા દુલાય છે માટે પહેલા દે ધુટા. પરદેશ જઈશું ત્યાં કમાઈશું ને મજા કરીશું.'

તે એક દિવસ વહેલો ઉઠ્યો ને ધર ઘડાર નીકળી ગયો. ચાલ્યો ચાલ્યો દેશાવરમાં ગયો.

ત્યાં ધણું જેયું, ધણું ચાહ્યો. એમ કરતાં આંગ્યો એક મોટા શહેરની ભાગોળે. શહેરનું નામ રાજગૃહ. ત્યાં એક વાડી સાવ સૂકી. ધનો ત્યાં રાત રહ્યો. સવારે જુએ ત્યાં સૂકી વાડી લીલી બની ગયેલી! જ્યાં ભાગ્યથાળી જય ત્યાં શું ન થાય!

માળીએ શેઠને ખખર આપી. શેઠ ખહુ હરખાયા. ધનનાને તેડું મોકદ્યું. ધનો ત્યાં ગયો. શેઠ તેને જમાડયો અને ખૂબ માન આપ્યું. પછી વાતચીત કરી. તેમાં તેમને લાઘું કે આ પ્રતાપી પુરુષ છે. એટલે પરણાવી પોતાની ઢિકરી.

ધનો ખૂબ નશીખદાર. જ્યાં તેનાં પગલાં ત્યાં

ધનનાં ઠગલાં. એને તો અહીં પણ ખૂબ ધન મળ્યું.  
તે મોટા શેઠ થયો.

એક વખત રાજનો હાથી ગાડો થયો. ડાઇ વશ  
કરી શકે નાં. તેથી દંઢેરો પીટયો કે હાથીને જે વશ  
કરશે તેને મારી કુંવરી પરણાવીશ. ધન્નો ખૂબ સાહ-  
સિક. તેણે દંઢેરો ઝીળયો ને હાથીને કર્યો બાંસ. રાજ્યે  
તેને પોતાની કુંવરી પરણાવી. આ પરાકમથી ધનનાં  
માન આપા નગરમાં ખસુ વર્દ્ધ્યું.

તે નગરમાં ગોભર નામના એક શેઠ હતા. આપા  
નગરમાં સાહુથી તે પૈસાદાર. તેમને લાં એક વખત  
એક કાણીએ આવીને કહેવા લાગ્યો: ‘શેઠ ! દયો  
તમારા એક લાખ રૂપિયા ને લાવો. મારી ધરેણે મૂકલી  
આંખ.’ શેઠ કહે, ‘વાત તદ્દન ઓછી. એમ તે કદી  
ધનતું હશે ?’ પણ પેલો માણુસ શેનો માને ! એને તો  
ગળે પડતું હતું. એટલે તકરાર કરી. એને રાજ પાસે  
જઈ ન્યાય માગ્યો. રાજ્યે જાણ્યું કે આ માણુસ ઠગ છે  
પણ તેને ઓટા શી રીતે હરાવવો ? તે ખૂબ વિચા-  
રમાં પડ્યા.

ધનનાંએ એ વાત જણી. એથી રાજકુરખારમાં આવ્યો અને કહ્યું: ‘મહારાજ ! હુકમ હોય તો ન્યાય કરૂં.’ રાજ કહે, ‘તમારોજ પાડ. કરો ને એનોન્યાય.’

ધન્ને તો શેઠ અને ઠગ બંને બોલાવ્યા અને ન્યાય ચૂક્યો: ‘શેઠને ત્યાં ધણી આંદો ધરેણું પડી છે. તેમાં શી ઘયર પડે ડે કઇ આંખ ઢાની ! માટે આંખનો નસુનો લાવો અને તમારી આંખ લઈ જવ.’ પેલો ઠગ પછડાયો. આંખનો નસુનો ક્યાંથી આપે ? ઝીલ આંદો પણ આંખણો થાય. રાજએ તેને ઠગ જાહેર કર્યો ને શિક્ષા કરી.

ગોલદ્ર શેઠ આથી ઝૂભ ફરખાયા ને તેને પોતાની સુલદ્રા નામે પુત્રી પરણાવી.

: ૮ :

એક દિવસે ધન્નો ગોખે બેઠો નગરને જેઠ રહ્યો છે. તેમાં થોડા બિખારી જેયા. ભાણુસો બરાબર પોતાનાં કુદુંખ જેવા જ લાગ્યા. તે વિચારવા લાગ્યો: ‘માનું કુદુંખ આવી હાલતમાં ડેવી રીતે આવી પડ્યું હોશે ?’ તપાસ કરતાં વાત સાચી નીકળી.

તેણું પોતાના પિતાને વાત પૂછી. પિતાએ જવાખ દીધો : ‘ દીકરા ! નશીખની બલીહારી ! તું હતો ત્યાં સુધી લીલા લહેર હતી. તું ગયો એટલે ધન પણ ગયું. તારા જવાની રાજને ખખર પડી એથી અમને હેરાન કર્યા. ધન પડાવી લીધું : બિખારી થયા. કાંઈ ગામમાં એમ રહેવાય ? એટલે પરદેશ નીકળ્યા !’

ધન્ને એ બધાને સાથે રાખ્યા. તેઓને સારું સારું પહેરાને. સારું સારું ખવરાવે ને દરેક રીતે રાજુ રાખે. પણ ડાલસા કઢી ઉજળા થતા હશે ?

બધા કામમાં ધન્નાની સલાહ લેવાય અને પોતાનો તો ડાઇ ભાવ પણ ન પૂછે એથી તેમને અદેખાઈ આવી. એથી એક દિવસ પિતા પાસે જઈ તેમણે કહ્યું : ‘ બાપા ! અમારો ભાગ વહેંચી આપો. અમારે ધન્નાની સાથે નથી રહેવું.’

પિતા કહે, ‘ અદ્યા તમારો ભાગ શેનો ? શરીર પર પહેરવા કપડું ન હતું. આ તો બધી ધન્નાની મિંકત છે. તેના ભાગ નહિ પડે.’ પેલા ભાઇએ કહે, ‘ અમે બધું જાણીએ છીએ.

રતનો ચોરીને ધનો નાડો તે અહીં આવ્યો છે.  
આગ આપો નહિતર ફેલેતી થશે. '

ધનો કહે, ' આતો ફરીથી થયો કંકાસ. આપણે  
કંકાસ જોઈએ નહિ. ચાલો પરદેશ. ત્યાં કમાઈ શું ને  
મળ કરીશું. '

સવારમાં વહેલા ડી તેણે ચાલવા માંડયું. ચાલતો  
ચાલતો તે કૌશાખ્યી નગરીમાં દાખલ થયો. ત્યાં  
રાજદરખારે મણિની પરીક્ષા થાય. પણ કાઈ સાચી  
પરીક્ષા કરી શક નહિ. ધન્ને મણિની બરાબર પરીક્ષા  
કરી. રાખ્યે આથી પ્રસાન્ન થઇ પોતાની કુંવરી  
પરણાવી.

હવે ધનનાચે વસાંયું ધનપુર ગામ. ત્યાં ખંડી  
વાતે સુખ પણ પાણીનું મોકું કુંખ. એટલે એક તળાવ  
ઓદાવવા માંડયું.

તે હંમેશ તળાવ પર આવે ને ડેટલું કામ થયું  
તે જુએ. ત્યાં એક દિવસ પોતાનું કુંખંબ જોયું. તળાવ  
પર મજૂરી કરે અને ગુજરાન ચલાવે. ધન્ને વહેલા  
તો એળખાણ ન પાડી પણ પાછળથી એળખાણ

પાડીને ખંડી વાત પૂછી. પિતાએ કહ્યું: ‘ભાઈ ! તું ગચ્છો તેની રાજને ખખર પડી એટલે તેણે નકારે દીધો. અને અમારી આ હાલત થધ !’ ધન્નો આ વાત જાણી ખૂબ દીલગીર થયો. તેણે પરી કુદુંખને સાથે રાખ્યું અને સુખી કર્યું.

ધન્નો બીજુ પણ ચાર સ્થીએ પરહણ્યો. ખૂબ જાચા કુદુંખની. તેને કુલ આઠ સ્થીએ થધ. તે હવે રાજગૃહમાં રહેવા લાગ્યો. ત્યાં તેના માતા પિતા ઉપવાસ કરી મરણ પામ્યા.

: ૧૦ :

એક વખત ધન્નો એઠો નહાવા. સુભદ્રા વાંસે ચાળે. પણ આંખમાંથી ટપટપ આંસુ પડે.

તેણે પાછું જેયું તો સુભદ્રાને રડતી દીઠી. ‘પિયે ! આજે ઉદાસીન ડેમ ?’ ધન્નાએ કારણ પૂછ્યું. સુભદ્રા કહે, ‘ ભારા ભાઈ શાળિભદ્રને થયો છે વૈરાગ્ય. તે હંમેશાં એક એક સ્થીને છોડે છે. બનીશ સ્થીએને એ એ રીતે છોડવાનો છે. ધન્નો કહે, ‘ એ તો ખંડું કાયર.

એ તે કાંઈ વૈરાગ્ય કહેવાય ? બધી સ્ત્રીઓને સાથે  
કેમ નથી છોડતો ?'

સુભદ્રા કહે, 'સ્વામીનાથ ! એલવું સહેલ છે. પણ  
કરવું મુશ્કેલ છે.'

ધન્નો કહે, 'એમ ?'

સુભદ્રા કહે, 'હા.'

ધન્નો કહે, ત્યારે બધી સ્ત્રીઓ છોડી.'

સુભદ્રાએ જાણ્યું કે હાંસી કરતાં ખાંસી થઈ.  
તેણે બહુ બહુ સમજાયું. બીજી સ્ત્રીઓએ પણ ખૂબ  
સમજાયું પણ ધન્નો કેરો નહિ. એટલે સ્ત્રીઓએ  
કહ્યું: 'ત્યારે અમે પણ દીક્ષા લઈએ.' ધન્નો કહે,  
'બહુ આનંદની વાત.' એથી સ્ત્રીઓ પણ દીક્ષા લેવા  
તૈયાર થઈ.

તે આંધો શાળિભદ્રને વેર અને ઘૂમ મારી: 'અરે  
કાયર ! વૈરાગ્ય તે આવો હતો હરો ? હું તો આડ સ્ત્રીઓ  
સાથે આ ચાલ્યો. તારે પણ આવવું હોય તો નીકળ  
ધર બહાર. શાળિભદ્રના મનમાં ત્રત લેવાનો ઉંમગ તો  
હતોજ અને આ સાંભળ્યું એટલે વધારે થયો.

એવામાં સમાચાર મજ્યા કે પ્રલુ મહાવીર પાસેના ખણાડપર પવાર્યો છે. આ વાત સાંલળી બનેને ખૂબું આનંદ થયો. ધન્ને પોતાની જીવો સહિત લાં દીક્ષા લીધી. શાળિસદ્રે આવીને પણું દીક્ષા લીધી.

હવે ધન્ને તથા શાળિસદ્રે આકરાં તપ આદર્યો. કોઈ વખત માસના ઉપવાસ તો કોઈ વખત બે માસના ઉપવાસ. કોઈ વખત ત્રણ માસના ઉપવાસ તો કોઈ વખત ચાર માસના ઉપવાસ. આ પ્રમાણે એક વખતના મહાવિલાસી હવે મહાતપ્ત્વી થયા.

બન્ને મહાતપ્ત્વીઓએ ધણા વખત સુધી તપ કર્યું. પોતાના મન તથા વચનને ખૂબું પવિત્ર બનાવ્યાં અને મહાતપ્ત્વી તરીકે પોતાનું જીવન પૂણું કર્યું.

ધન્ય છે વીર ધનનાને ! ધન્ન છે વીર શાળિસદ્રને !

# મહાત્મા દુર્ગપ્રહારી

આલણનો એક છોકરો. તેનું નામ દુર્ધર. જાતનો એ આલણ પણ સ્વભાવે બહુ હલોડા. ભણું-ગણું ગમે નહિ. તોક્ષાન મર્સ્તીમાં હંમેશા ખફેલો. માખાપતું કથું માને નહિ. સામે થાય ને ગાળો દે. જુહું બાલે ને ચારી કરે. જોઠિયાચો સાથે લડે ને વાતવાતમાં લડાઈ લઈ આવે. હાઈને એકલો જુઓ કે અટ થપાટ લગાવે. કંઈ વસ્તુ પડેલી જુઓ કે અટ ખીસામાં સેરવી દે.

એ મોટા થચો અને નિશાળે મૂક્યો. પણ અને તે ભણું ગમે? હાઈ દિવસ પાઠ જ ન કરે. મહેતાજ ખૂબ ઠપકો દે ને માર મારે. પણ દુર્ધરને કથું ન થાય. માખાપ અને

સમજો. આખણુનો દિકરો ડેવો હોય એની વાત કહે પણ એના મનમાં કંઈજ ન ઉતરે. ડલટો રીસે બળો, ગાળો હે ને અપમાન કરી નાસી જય. ડાઈની શીખામણ પણ ન સાંસગે.

કુર્ધની ઉંમર વધી એમ એની કુટેવો પણ વધી. જુગાર રમવાની ટેવ પડી. નિશાળમાં ગોઠિયાઓ સાથે છાનો છાનો જુગાર રમે. ગામમાં પણ રમે. ધીરે ધીરે આ ટેવ વંતી ગઈ. તે પાડો જુગારી બની ગયો. પણ જુગારમાં તો પૈસા જોઈએ. એ લાવવા ક્યાંથી? એટલે કુર્ધરે ચોરી કરવી શરૂ કરી. પહેલાં ધરમાંથી પાઈપઈસો ઉઠાવવા માંડ્યો. પછી પાડોશીઓનાં ધરમાંથી લેવા મંડ્યો. ઘેર મહેમાન આંદ્યો ડે એણે ખીસામાંથી પૈસા ચોર્યાજ છે.

પણ જુગારમાં એટલા પૈસાથી પુરું ન પડે. એથી કુર્ધરે મોટી ચોરીઓ કરવા માંડી. તે ચાલાક જખરો એટલે બધે ઝાવી જય. ચોરી

કરી આવે પણ ડાઇ તેને પકડી ન શકે. કુચ્ચર  
આથી કૂલાયો ને જોઈ મોઈ ચોરીઓ કરવા લાગ્યો.

ગામમાં તેનો જુલમ વધવા લાગ્યો. લોડા  
તેના માટે ખૂબ ફરિયાદ કરવા લાગ્યા. રોજ  
ગામની રાડો આવવા લાગ્યી. કંં તો ડાઈને  
માર્યો હોય; કંં તો ડાઈની ચીજ ઉપાડી  
લીધી હોય. ડાઇ એનું નામ પણ લે તો માર  
માર્યો વગર એ ન ભુકે ! મન થાય તો ડાઇના  
ઢોર છોડી ભૂક. ઈચ્છા થાય તો ડાઇના તખેલામાંથી  
ઘોડા ઉઠાવી ને સહેલ કરી આવે. મરજી થાય  
તો ચીભડાં ને શાકભાજીની વાડીઓનો કર્ચર-  
ધાખુ કાઢી આવે. આથી ધીમે ધીમે તે લોડાને બહુ  
અળખામણો થર્થ પડ્યો.

ડાઇ ડાઢા ભાણુસોએ તેને શીખામણ દીધીઃ  
' ભાઇ નઠારી ટેવ છોડી હે ! તારી બુદ્ધિનો સારો  
ઉપયોગ કર ! તારી ચાલાકી સારા કામમાં

ચલાવ ! બ્રાહ્મણુના દીકરાએ ભાણું બેઠાએ, ધર્મ કર્મ શીખવાં બેઠાએ, હોમ હવન જાણવાં બેઠાએ. તું સુધરીશ તો તને પ્રાયદો છે ! તું સારા રસ્તે જધશ તો તારું કલ્યાણ થશે. માણુસો તને વખાણશે.. નાતનતમાં તું પંકાદશ ને તારું નામ થશે.' પણ કુર્બારને આ શીખામણુ પત્થર પર પાણી જીવી હતી. અને શીખામણુ ન ગમી. એ ગુસ્સે થયો. શીખામણુ આપનાર બિચારો ચૂપચાપ રસ્તે પડ્યો.

ચારી કરતાં જે ગોઠિયા મહ્યા તે બંધા બદમાશ. એટલે તે ખૂખજ બગડ્યો. હવે તો હારું પીએ, માંસ ખાય ને રંડીખાળ કરે.

લોકાને તેનાથી ખૂખ તાસ થયો. રાખને તેની જણ થઈ. એટલે હુકમ કર્યો: 'એ કુષ્ટને અવળે ગધેડે બેસાડો, માથે કરાવો મુંડો, તેના પર ચાપડો ચુનો, મોઢે ચાપડો ચેશ, ગળામાં નાંખો ખાસડાનો હાર અને વગાડો ખોખરાં હાંડલાં. પછી આખા ગામમાં ફેરવી કાઢી મૂકા ખણાર.'

રાજના અમલનો હુકમ થયો. કુર્ખનો  
વરધાડો નીકળ્યો. સાથે ડાંડી પીટાણી:  
'જ ડાધ કુર્ખના જેવું કરશે તેને આવું  
કુળ મળશે.' લોકોએ તેના ઉપર વિકાર  
વરસાયો. ભૂંડા હાલે ગામ બહાર કાઢી ભૂક્યો.  
નઠારાની આ હાલત થાય !

આથી કુર્ખ બજ્યો દાંડે. મનમાં વાળી  
ગાંડ. આ ગામનું વેર વાળું તોજ હું ખરો. વેર  
લેવાના વિચારમાં ને વિચારમાં તે આગળ ચાલ્યો.

: ૨ :

ચાલતાં ચાલતાં આંદોલા દુંગરી મુલકમાં.  
ત્યાં પર્વતની મોટી ઝીણુ. ધણી ઉંડી, ધણી  
વિકરાળ. કાચાપોચાની તાકાત નહિ કે ત્યાં  
હગદું પણ ભરે. પણ કુર્ખની છાતી બહુ મજબૂત  
એટલે અંદર હાખલ થયો.

આડી વધવા લાગી. તેમાં અનેક જતનાં  
ગાડ. અનેક જતના વેલા. વેલા આડે વીંટળાય

ને પાંજરા બનાવે. નીચે ઉગેલું ધાસ. માથાડું, માથાડું. રસ્તો ડાઇક ટેકાણે ભાચો, ડાઇક ટેકાણે નીચો. દુર્ધર આવો રસ્તો વટાવી આગળ ચાલ્યો.

રસ્તો અથી પણ ભયંકર આવ્યો. મોટા મોટા ઘડકો આવ્યા, ધોખમાર ઝરણું આવ્યાં. મહામહેનતે તે ખંડાં પસાર કર્યાં. ત્યાં આડી કહે મારું કામ. આકાશમાં સૂરજનારાયણ પ્રકાશે પણ અહીં અંધારું ધોર. ચાલતાં ચાલતાં સાંજ પડી.

દુર્ધર એક આડ પર ચઢ્યો. રાત ત્યાંજ ગાળવા વિચાર કર્યો. થોડી વારમાં જંગલી જનવરોના અવાજ સંગળાયા. ધડીકમાં સિંહની ગર્જના તો ધડીકમાં વાધની ત્રાડ. ધડીકમાં શિયાળની કિક્કિયારી તો ધડીકમાં ચિત્તાનો અવાજ. આખી રાત જંગલી પણ આવ્યા ને ગથા. દુર્ધરે એમને જેતાં જેતાં રાત પસાર કરી.

જ્હાણું વાયું. જંગલી જનવરો પોત-

પોતાની એડમાં ભરાયા. પંખીએ આડ પર  
ગીત ગાવા લાગ્યા. એટલે દુર્ધર નીચે ઉતર્યો.  
આગળ ચાલવા લાગ્યો.

થોડીવારમાં ભીલનાં જુંપડાં દેખાયાં.  
દુર્ધરને ખૂબ આનંદ થયો. તે અહીં આવવાજ  
નીકળ્યો હતો. જ્યાં થોડું ચાલે છે ત્યાં આંદ્રા  
કેટલાક ભીલ. રંગે કાળા ભૂત. કપડામાં  
એક લંગોઢી ને હાથમાં તીરકામઠાં. તેમણે દુર્ધરને  
પકડ્યો અને લઇ ચાહ્યા રાજ પાસે.

થોડું ચાલતાં એક અંધારી ગુપ્ત આવી.  
ત્યાં ભીલોનું ટાળું બેઠેલું. તેમણે આ દુર્ધરને  
નેયો એટલે રાજ થયા. માંહી માંહી વાતો  
કરવા લાગ્યા: ‘આ નવોદાહિયો જુવાન છે. માતાને  
ભોગ દેવામાં કામ આવશે.’

પેલા ભીલો દુર્ધરને લઇ ગુપ્તામાં પેઠા.  
અંધારામાં ચાલવા લાગ્યા. થોડી વારમાં અજવાળા  
વાળી જગા આવી. ત્યાં એક લષ્ટ ભીલ બેઠેલો.

જಣೆ ಜಮನೋ ಅವತಾರ. ತನೀ ಪಾಸೆ ಏಕ ಸೀ ಬೆಠೆಲೀ. ತೆ ಪಣು ಕಡ್ಡಾವರ. ತಣೆ ಶರೀರೆ ಏಕಜ್ ಕಪ್ಪು ಪಢೆರೆಳು. ಗಣಾಮಾಂ ನೆ ಹಾಯಮಾಂ ಪತ್ಯರನಾಂ ತಥಾ ಇಪಾನಾಂ ಧರೆಣಾಂ. ಆ ಖಂತೆ ಲೀಲಿನಾಂ ರಾಜರಾಣಿ.

ರಾಜಾಯೇ ಹುಂಟಿನೆ ಜೆಯೋ. ಏನು ಕಡ್ಡಾವರ ಶರೀರ, ಲಾಲ ಸುರಖ ಯಹೇರೋ, ಭೋಡು ಜಖಂಡ ಮಾತು. ಆ ಖಧಾಥಿ ರಾಜಾಯೇ ಪಾರಖ್ಯಂ ಡೆ ಆ ಮಾಣಸ ಚಾರಿಮಾಂ ಖೂಖ ಹೆಚಿಯಾರ ಛೇ. ಆಪಣನೆ ಬಹು ಕಾಮನೋ ಛೇ. ತಣೆ ಪ್ರಥಿಂಬುಂ: 'ಹೆಮ ! ತಾರೋ ಶು ವಿಚಾರ ಛೇ ?' ಹುಂಟಿ ಕಂಖುಂ: 'ಆಪನಿ ಸಾಥೆ ರಹೇವಾನೋ ನೆ ಆಪನೋ ಧಂಧೊ ಕರವಾನೋ.' ಲೀಲ ರಾಜಾಯೇ ರಾಜು ಥಿಂತೆ ತನೆ ಪೋತಾನಿ ಪಾಸೆ ರಾಖ್ಯೋ.

ಹುಂಟಿ ಖೂಖ ಜಖರೋ ನಿಕಣ್ಯೋ. ಚಾರಿ ಕರವಾಮಾಂಡ ಧರ ಫೂಡವಾಮಾಂ ತೋ ಏಕಡೊ. ಗಮೆ ತೆಟಲು ಚಾಲೆ ಪಣ ಥಾಡ ನಿಂ. ಗಮೆ ತೆಟಲೀ ಲಡಾઈ ಥಾಯ ತೋಯ ಥಾಡ ನಿಂ. ಅಂಧಾರೀ ವೋರ ರಾತ ತೋ ಏನೆ ಮನ ದಿವಸ ಜೆವಿ. ಜಯಾಂ ಕಂಡೊ ತಯಾಂ ಜರ್ಜ ಆವೆ. ನೇ ಕಾಮ ಕರವಾನಿ

ક્રાઈ હિંમત ન કરે તે કામ દુર્ધર કરે.  
ભલભલા ભડવીરો સામે એ ખાખડે. જેવા તેવાને  
તો અપટીમાં મસળી નાખે. રાજમહેલો લુંટવા એ  
તો એને મન રમત. રાજમહેલના ચોકીદારો જેતા  
રહે ને એ લુંટીને નાસી જય. દુર્ધરના હાથમાં જે  
આંધો એના પૂરા ભોગ મજ્યા સમજ લો.

દુર્ધર ધીરે ધીરે સહુને વહાલો થયો.  
એટલે ભીલ રાજએ તેને પુત્ર બનાઓ એને પોતાની  
બધી મિલકત સોંપી.

દુર્ધર મોટી મોટી ચોરીએ કરે. તેમાં  
ફાઇએ સામું થાય તો માર્યું જય. તેનો પ્રહાર  
કરીએ ખાલી ન જય એટલે તેનું નામ પડયું  
દુદ્રેક્ષણારી.

: ૩ :

એક વર્ષત મોટી ધાડ લીધી. ગયો  
કુશસ્થળ નગર લુંટવા. ત્યાં એક આશણતું  
કુંકુંખ. બિચારે ઘૂંખ ગરીખ. ધરમાં એક દિવસનાં  
પણ તોકડા નહિ. મુડીમાં એક વસુકેલી ગાય.

તેવામાં આંદોલનાર. એટલે છાકરાઓએ  
કર્યો કળાઓ: ‘ખાપા ! ખીર ખાવી છે.’  
આખણે તેમને ખૂબ સમજાવ્યા. પણ ખાળક  
શું સમજે ! એટલે તે થોડા ઘેર ઝર્યો. હું,  
ચોખા ને સાકર એકઠાં કર્યાં. તેની રંધાવી  
ખીર. પછી ઓને કહ્યું: ‘ખીર તૈયાર થાય એટલે  
ઉતારને. હું નદીએ નાહીને આવું શું.’ આખણું  
ગયો નહાવા.

એવામાં દૃઢપ્રથારીની ધાડ આવી. લોડા  
નાસ પામ્યા. નાસવા લાગ્યા. બધા ચોરો જુદા  
જુદા ડેકાણે લુંટવા લાગ્યા. એમાં એક ચોર  
આખણુંને ઘેર આવ્યો. ત્યાં લુંટવાનું શું મળે ?  
એવામાં બરાબર તૈયાર થયેલી ખીર નેથે.

ચોરે ખીર ઉપાડી. છાકરા કફળવા લાગ્યા.  
એવામાં આંદોલના પ્રાખણ. જુદે તો ચોરે ખીર  
ઉપાડેલી ને છાકરાં ઓભાં ઓભાં કર્યો. એથી તેને ચંડ્યો.  
બહુ છોધ. એટલે હાથમાં લીધી ભોગળ ( કમાડ  
આડી દેવાની ) ને મારવા દોડ્યો. ત્યાં થઈ સખત  
મારામારી.

આ બને મારામારી કરે છે ત્યાં આંદોલના  
દૃઢપ્રથારી. તેણે કર્યો તરવારનો એક ધાડે પ્રાખણનું  
માથું જુહું થયું. છાકરાઓએ ચીસ પાડી. સ્ત્રી ઓભાં

થરથરવા લાગી. ફૂળીમાં ખાંધેલી ગાય. તેનાથી આ ન ખમાયું એટલે આવી ઉક્રાંટ. તેણે પૂંછડું કર્યું જાંચું ને મારી દોટ. સીધી દુદ્રેગ્હારી સામે.

પણ દુદ્રેગ્હારી વજ છાતીનો. બીકને જંહગીમાં પણ નહિ ઓળખેલી. આવી ગાયથી તે શું બીએ? ગાય પાસે આવતાંજ તરવારનો ધા કર્યો એટલે ગાયનું માથું જુડું!

સ્થીથી આ જેયું ન ગયું. ગાળોનો વરસાદ વરસાવવા લાગી. ધમપણાડા કરતી તે સામી દોડી. બિચારીને શું ખખર ડ તેનું પણ મોત હશે! દુદ્રેગ્હારીને સ્ત્રી પર ખૂબ ગુર્સો થયો એટલે તેના પર પણ ધા કર્યો. વાગ્યો બરાખર પેટ પર. ગર્ભવતી સ્ત્રી ટગડો થઈ હેઠી પડી. સ્ત્રી ને બાળક બને ઠાર થયા!

થતાં તો થઈ ગયું. કોષમાં દુર્ધરે હત્યા કરતાં પાછું ન જેયું પણ પછી વિચાર થયો.

‘અરે! મેં આ શું કર્યું! કોષમાં આંખળો થઈ ગયો. મારે હાથે ચાર મહા હત્યા થઈ. પ્રાણણુને મારી મેં અણહત્યા કરી, ગાયને મારી મેં ગૌહત્યા કરી. પ્રાણણુની પત્નીને મારી મેં સ્ત્રી

હત્યા કરી ને તેના ગર્ભની હત્યા કરી ખાલ-  
હત્યા વહોરી અરેરે ! મેં પેટ ભરવા માટે જેત-  
જેતામાં ચાર હત્યા કરી નાંખી ?

કુધેર ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યો. એનું  
પત્થર જેવું દફ્ફય મીણું જેવું થછ ગયું. એ  
પોતાને નિંદ્વા લાગ્યો. જેણે પાપ કરતાં પાછું  
નહોતું જેયું, એને આજે ખૂબ વલોપાત  
થવા લાગ્યો.

તે લુંટ પૂરી કરી નગર ખહાર નીકળ્યો.  
પણ પેલી હત્યાઓ નજર આગળ તર્યાજ કરે.  
તેનું દફ્ફય ખૂબ વલોવાયું. જમ જવો દૃઢપ્રેહારી  
ઠડેગાર બની ગયો.

ચાલતાં ચાલતાં વનમા આવ્યો. ત્યાં જેથા  
એક સાધુ સુનિરાજ. તે સમતાનો ભંડાર, પ્રેમની  
મૂર્તિ. એમને જેતાંજ દટ્પ્રેહારીનું હૈયું ભરાઈ  
આંદું. તેમના ચરણમાં પડી મુશકે ને મુશકે  
તે રોવા લાગ્યો.

સુનિ બોલ્યા : ‘હે મહાતુભાવ ! શાંત થા.  
આટલો શોક શેનો છે ? ’

દટ્પ્રેહારી બોલ્યો : ‘પ્રલો ! હું મહાપાપી છું.  
મારે માટે જગતુમાં સ્થાન નથી.’

સુનિ કહે, ‘ભાઈ ! નિરાશ ન થા. પાપીમાં

પાપીને માટે પણ આ જગતમાં સ્થાન છે. કરેલી ભૂલો સંભારી રોદણું ન રૈ. શાંતિથી તારા જીવનનો વિચાર કર. અને તેનો અમલ કરવા લાગી જા.’

દદ્રમહારી કહે, ‘મુનિવર, હું મહાપાપી હું. જિંદગીમાં કદી પાપ કરતાં પાણું બેયું નથી. મેં હજરો માણુસોની હૃત્યા કરી છે. ડેટલાયના બંડાર લુંઠી લીધા છે. ડેટલીય ખીચાને વિધવા ઘનાવી છે. ડેટલાંય ખાળોડાને અનાથ ઘનાંયાં છે. હજરોનો રોટલો ઝુંટવી લીધા છે. વગર વાંડે ખીજને માર માર્યો છે. ડેટલાંય નિર્દેષોના જલ લીધા છે. છતાં મહારાજ ! કાલ સુધી મને હુંઘ નહોઠું. પણ ગર્દ કાલે જ મારા હાથે ચાર મહાહૃત્યાઓ થઈ. અલહૃત્યા, સ્ત્રીહૃત્યા, ગૌહૃત્યા ને ખાલહૃત્યા. આ હૃત્યાઓ કર્યા પછી જીવ જીપતો નથી. મનમાં કંદ ને કંઈ થયા કરે છે. આ હૃત્યામાંથી હવે હેમ છુટાય ? આ મારાં પાપો નાશ પામે તેવો ઢાઈ રસ્તો હશે ?’

મુનિએ શાન્તિથી કહ્યું: ‘ભાઈ ! પાપનું પ્રાયશ્ક્રિત કર ! તારો ધંધા છાડી દે ! તારી કાયા ઉપરથી મોહ હૂર કર ! જગતના સૌ જીવો પાસે ક્ષમા ભાગ ! મન, વચન અને

કાયાથી પાપંચાપારનો ત્યાગ કર ! સાધુ—  
જવનની દીક્ષા બે, કષ સહન કર. સંયમ અને  
તપનું આરાવન કર ! જરૂર જવને શાન્તિ થશે.  
તારું કલ્યાણ થશે. ’

આ સાંભળી દુદ્રેષ્ઠારીનું મન પીગળી ગયું. તેણે  
ત્યાંજ દીક્ષા લીધી. લુંટારાનો વેશ તજ સાધુ વેશ  
ધારણું કર્યો. કોધને તજ સમતા ધારણું કરી.  
અને બહુ આકરી પ્રતિજ્ઞા લીધીઃ ‘ પેલી ચાર હત્યાઓ  
યાદ આવે ત્યાં સુધી અત્રપાણી લેવાં નહિ. ’  
ક્ષણું વારમાં તો દુદ્રેષ્ઠારી શયતાન મટી સાચા સાધુ  
થઈ ગયા.

હવે દુદ્રેષ્ઠારી ધ્યાન ધરીને જિસા. ઐલા  
નગરના દરવાને. પહેલાં તો લોડા એમને જેઈને  
ગલ્ખરાયા. કંધ પ્રપંચ તો નહિ હોય, કંધ રમત તો  
નહિ રમાતી હોય. સૌ મનમાં ને મનમાં ગલ્ખરાવા  
લાગ્યા. પણ દુદ્રેષ્ઠારી તો શાન્ત લાવે જિસા રહ્યા.  
ન ડાઇ સામે જેયું કે ન ડાઈની સાથે  
વાત કરી.

આખા ગામે આ વાત આણી. સૌ જેવા  
આંધ્યા. લુંટારાને ચુપચાપ જાલેલો જેઈ પથરા  
મારવા લાગ્યાઃ ‘ એ મહાઙ્ઘણ છે. ભૂંડા કામોનો  
કરનાર છે. આપણુંને ખૂબ્ ત્રાસ આપ્યો છે.

હં, મારો એ હત્યારાને ! ' લોડા આમ બોલતા જય ને પથરા, ટંટ, કંકરા મારતા જય. પાસે જવાની તો કોઈનીએ હિંમત ન ચાલે ! કદાચ પ્રકડાધ જઈએ તો જીવતા ન છુટીએ ! આવેથી કોઈ લાકુડીએના ધા કરવા લાગ્યા. પણ દુઃપ્રેહારી શાન્તિથી જિભા રદ્દા.

થોડીવારમાં તો પથરા, ટંટ ને લાકડાનો ટગલો થઈ ગયો. શરીરમાંથી લોહી ટપકવા માંડયું. ટગલો વધતો વધતો ગળા સુધી આવ્યો. દુઃપ્રેહારીએ ધ્યાન પૂર્ણ કર્યું. ત્યાંથી ચાલીને બીજે દરવાજે આવ્યા. તેની પાસે જિભા રહી ધ્યાન આદ્યું.

લોડા અહીં પણ આવી પહોંચ્યા ને પથરા તથા ટંટાનો મારો શરૂ કર્યો. જેમ જેમ વધુ પથરા લાગે એમ એમ દુઃપ્રેહારી વધુ મક્કમ જિભા રહે. અહીં પણ ગળા સુધી ટગલો થતાં ધ્યાન પૂર્ણ કરી બીજે દરવાજે ગયા. એમ બંધા દરવાજે જઈને ધ્યાન ધર્યું.

આમ એક દિવસ નહિ, એ દિવસ નહિ,  
લાગલાગટ છ માસ સુધી સહન કર્યું. નિશ્ચયમાંથી  
જરા પણ ન ડયા. અન્તે લોડા થાક્યા.  
તેઓને સમજણું પડી. આ લૂંટારો નહિ પણ  
સાધુ છે. આજે પથરા મારવા બંધ કર્યા.  
ગાળો દેવી બંધ કરી. લોડા દુદ્રેષ્ઠારીને ખૂબ  
માનની નજરથી જેવા લાગ્યા. છ માસ વીતતાં  
તો બધે પૂજનીય થઈ પડ્યા. એમનો એક  
કુરમન ન રહ્યો. એ પણ કોઈના કુરમન  
ન રહ્યા.

હુને મહાત્મા દુદ્રેષ્ઠારી એક ટેકાણેથી બીજ  
ટેકાણે ઝરવા લાગ્યા. તેમણે ધણા લોડાને ઉપ-  
દેશ દીધી. ધણાના જીવન સુધાર્ય અને છેવટે  
નિવીણું પામ્યા.

ધન્ય છે સહનશીલ દુદ્રેષ્ઠારીને !

ધન્ય છે મહાત્મા દુદ્રેષ્ઠારીને !

# અભયકુમાર

વેણૂતટ નામે ગામ હતું. ત્યાં હતો એક  
ઓકરો. તેનું નામ અભય. તે બહુજ ચાલાક,  
બહુજ હેંશિયાર. શું લણવામાં ! શું રમવામાં !

તે એક દિવસ રમવા ગયો. ત્યાં હાવ માટે  
લડાઈ થઈ. તેમાં એક જણ બોલ્યો: ‘એસ,  
એસ નબાપા ! બહુ જેર શેનું કરે છે ?’  
અભય કહે, ‘વિચારીને બોલ. મારા પિતા  
એ રથા. શું ભદ્રશેઠને નથી ઓળખતો ?’  
પેલો કહે, ‘એ તો તારી માનો પિતા છે.  
તારો પિતા ક્યાં છે ?’

અભય ધેર આવી પોતાની મા નંદાને  
પૂછ્યા લાગ્યોઃ ‘આ ! મારા પિતાજી જ્યાં

છે ?' નંદા કહે, 'એટા ! તે કુકાને હશે. અભય કહે,  
એ તે તારા પિતા છે. પણ મારા પિતા કર્યાં ?'  
આ સાંભળી નંદા ગળગળી બની ગઈ. આંખમાં  
આંસુ લાવી કહેવા લાગીઃ

'સાંભળ ભાઇ ! એક આંધ્યા'તા  
મુસાપર. અહા ! શું તેમનું ઇપ ! શું તેમના  
ચુણું ! શું તેમનો પ્રતાપ ! બધી રીતે તે  
લાયક. એટલે પિતાજીએ તેમની સાથે મારા  
લભ કર્યાં. હજ લભને થોડા દિવસ થયા  
હતા એવામાં પરદેશથી સાંટણીએ આવી.  
તેમાંથી થોડા સવાર નીચે ઉત્તર્યા. તેમણે તારા  
પિતાને એકાંતમાં આવાંધ્યા અને કનમાં કાંદિક  
વાત કરી. એટલે તે જવા તરત તથાર થયા.  
તેમણે મને કહ્યું : 'મારા પિતા મરણ પથારીએ  
છે તેમને મળવા હું જડં છું. તું શરીર સાચવને  
ને સારી રીતે રહેને. એમ કહી તેમણે એક  
ચીકું આપી, અને આવેલા સવાર સાથે ચાહ્યા  
ગયા. તે ગયા તે ગયાજ. આજે ડેટલાં વરસનાં  
વહાણું વાયાં પણ ઠુઠાલા અભય ! તેમનો  
કાંઈજ પતો નથી !'

અભય કહે, ‘આ ! મને તે ચીછી ખતાવ.  
 કું જેણ તો ખરો હે એમાં શું લખેલું છે ?’  
 માતાએ ચીછી આપી. તે વાંચી અભય બોલ્યો :  
 ‘અહો ! ભારા પિતા તો રાજગૃહીના  
 રાજ છે. આ ચિંતા કરીશ નહિ. ’ નંદા કહે,  
 ‘શું ! તારા પિતા રાજગૃહીના રાજ છે ?’ અભય  
 કહે, ‘હા. આ ચીછીનો અર્થ એવોજ થાય છે.’  
 નંદા આ સાંભળી હરખાણી. સાથેજ આવા  
 પતિના વિચોગે ખૂબ ફુલ્લી થઈ.

અભયે નંદાને પહેલીજવાર આવી હુલી  
 જેઠ હતી. એટલે તેને ખૂબ લાગી આવ્યું.  
 તે કહેવા લાગ્યો : ‘આ ! તું જરાએ ચિંતા  
 કરીશ નહિ. ચાલ અહિંથી આપણે રાજગૃહી  
 જઈએ. ત્યાં જરૂર ભારા પિતાનો ભેળાપ થરો.’

: ૨ :

રાજગૃહી ભગવદેશની રાજવાની છે. તેની  
 શોભા અપાર છે. શું તેના મહેલો ! શું તેના  
 મંદિરો ! શું તેનાં બનારો ! શું તેના ચોક !

અભય અને નંદા રાજગૃહી તરરે આવ્યા.  
 એક માણુસને ધેર ઉતારો કર્યો. પછી અભય  
 ચાલ્યો શહેરની શોભા જેવા. લાં એક ચોકમાં

લોહાનું મોકું ટાળું જેણું. ‘આ ટાળું કેમ થયું હશે ? નકી કાંઈક જેવા જેવું હશે માટે લાગ્ય પૂછીને ખાતરી કરેં.’ અભયે વિચાર કર્યો અને તેણે ટાળામાં આવી એક ધરડા ડેસાને પૂછ્યું: ‘કેમ કાકા ! અહીં પતાસાં બતાસાં વહેંચાય છે કે શું ?’ તે ડેસો કહે, ‘ભાઇ ! તને પતાસાં બહુ જાવતાં જાગે છે ! પણ અહીં તો પતાસાંથી પણ કાંઈક વધારે વહેંચાય છે.’ અભયે પૂછ્યું કે અવું શું છે ? ઐલો ડેસો કહે, ‘મહારાજ શેણિકનું પ્રધાનપદ, જે, વાત એમ બની છે કે મહારાજ શેણિકને ચારસેનવાળું રાજ ચલાવનારા છે. પણ તેમાં ડોષ વડા પ્રધાનની જગા લે એવો નથી. એ જગાએ તો ખુદ્દિના લાંડાર જૈવોજ માણસ જેઠાએ. એટલે એવા માણસની શોધ કરવા ખાલી ફૂવામાં એક વીંટી નાંખી છે. અને જહેર રંધુ છે કે જે માણસ કાંઠે જિસો રહીને ફૂવામાંથી એ વીંટી કાઠશે તેને વડા પ્રધાનની જગા આપીશ.’

આ સાંભળી અભય ટાળામાં પેઠો અને

માણુસોને કહેવા લાગ્યોઃ ‘અરે ભાઈએ ! તમે બધા ચિંતામાં ડેમ પડ્યા છો ? ઝવામાંથી વીઠી લેવી એમાં શું સુશ્કેલ છે ?’ માણુસો કહે, ‘ભાઈ ! આ તમારી રમત ન હોય. આમાં તો ભલભલા બુદ્ધિશાળીની પણ બુદ્ધિ ચાલતી નથી.’ અભય કહે, ‘ભાઈ ! મારે મન તો આ રમતજ છે. પણ મારા જીવો પરદેશી આ વીઠી લઈ શક અરો ?’ માણુસો કહે, ‘એમાં શું ? ગાય વાળે તે ગોવાળ.’

અભય ઝવા આગળ આવ્યો. લોકો અંદર અંદર વાતો કરવા લાગ્યાઃ ‘આ છોકરો શું કરશો ?’ એટલામાં અભયે તાજું છાણું મંગાવી બરાબર વીઠી ઉપર નાખ્યું. પછી એક ધાસનો પૂળો મંગાવી તેને સળગાવ્યો. અને બરાબર છાણું ઉપર ફેંક્યો. ધાસના તાપથી છાણું સુકાધ ગયું. અને વીઠી તેમાં ચોટી ગઈ. પછી પાસેના એક પાણી ભરેલા ઝવામાંથી નીક ઘોડાવી. અને તે વાટે ખાલી ઝવામાં ગાણી ભરવા માંડ્યું. પાણી કંઠે આવતાં છાણું પણ

કંઠે આવ્યું. અભયે તેને લઈ લીધું અને  
વીણી અંદરથી કાઢી લીધી. ખંડા પોલી ઉક્ખા:  
'ખંન્ય છે આ છાકરાની બુદ્ધિને !'

ત્યાં રહેલા સિપાઠચોએ આ વાત  
રાજને જણાવી. એટલે રાજએ અભયને પોતાવ્યો  
અને પૂછ્યું: 'બાધ કર્યું તમારું ગામ ?  
શું તમારું નામ ?'

અભય—વેણુતટ મારું ગામ. અભય  
મારું નામ.

રાજ શ્રેણિક—ત્યાં ભદ્રશોઠને ઓળખો છો ?

અભય—હા, મહારાજ ! બહુ સારી રીતે.

શ્રેણિક—તેમની નંદા નામે પુત્રી ગર્ભવતી  
હતી. તેને શું અવતર્યું ?

અભય—મહારાજ ! તેને પુત્ર અવતર્યો.

શ્રેણિક—તેનું નામ શું પાડ્યું છે ?

અભય—સાંખ્યો મહારાજ ! તમે લડાઈમાં  
જંગ ભયાવતા હો તે વખતે શશુ તમારાથી ઘૃણી  
ભય. પછી ચોઢામાં તરણું લે અને આવે  
તમારી આગળ. તે વખતે તે શું માગે ?

શ્રેણિક — અભય.

અભય — મહારાજ ! ત્યારે એતં નામ પણ એજ. એને અને મારે બહુ ભિત્રાચારી છે. ડાઈ ભિત્રોનાં મન એકજ હોય પણ શરીર જુદાં હોય. પરંતુ મારાં ને તેનાં તો મન પણ એક છે ને શરીર પણ એક છે.

શ્રેણિક — ત્યારે તું પોતેજ એ અભય ?

અભય — હા, પિતાશ્રી ! આપણું ધારવું ખરાખર છે.

શ્રેણિક — ત્યારે નંદા જ્યાં છે ? અને તેને કેમ છે ?

અભય — પિતાશ્રી ! તે નગર ખહાર માલણું ત્યાં છે. આપના વિનેગે એ ખૂબ હુંઘી છે.

આ સાંભળી રાજ શ્રેણિક ખૂબ હરખાયા. ગાજતેવાજતે નંદાને ગામમાં લાવ્યા. પછી તેને બનાવી પટરાણી અને અભયને બનાવ્યો. વડો પ્રવાન.

: ૩ :

જ્યાં અભય જેવા યુદ્ધિશાળી પ્રવાન થાય ત્યાં શેનું હુંઘ રહે ? રાજ શ્રેણિકને

કાંઈ પણ મુશ્કેલી આવે હે અભય તૈયારજ હોય.  
પોતાની બુદ્ધિથી જરૂર તે મુશ્કેલી ફૂર કરે.

એક વખત બ્રેણિક ચિંતામાં બેઠા છે. ત્યાં  
આવ્યા અભયકુમાર. તેમણે પૂછ્યું: ‘પિતાજ !  
ચિંતામાં ડેમ બેઠા છો ?’ બ્રેણિક કહે, ‘વૈશાળિના  
ચેડા રાજએ મારું અપમાન કર્યું. તેને બે  
સુંદર કન્યાએ છે. તેમાંથી એક કન્યાનું મેં માગું  
કર્યું. એટલે તે બોલ્યાઃ ‘તમારું ઝળ મારાથી  
છલકું છે. મારે મારી કુંવરી નહિ મળે.’  
અભય કહે, ‘આહો ! એમાં શું મોટી વાત !  
ઇ માસની અંદર એ કુંવરી આપને પરણુવીશ.  
પિતાજ ! ચિંતા કરશો નહિ.’

અભયે ઘેર આવી સારા સારા ચિતારા-  
આને બોલાવ્યા અને તેમને કહ્યું: ‘મહારાજ  
બ્રેણિકની એક સુંદર છખી તૈયાર કરો. તમારી  
ખખી કળા વાપરને. તેમાં જરાએ કચાશ રાખશો  
નહિ.’ ચિતારાએ રાતદિવસ મહેનત કરીને  
સુંદર છખી તૈયાર કરી. અભયે તેમને ખૂબ ધન  
આપી રાજ કર્યા.

: ૪ :

અભયકુમાર એ છિંભી લઈ વૈશાળિ ચાહ્યો. ત્યાં ધનશેઠ નામે વેપારી બત્થો. અને રાજમહેલ પાસે હુકાન નાંખી. તેની હુકાને ભાતભાતનાં અત્તરકૂલેલ વેચાય. ભાતભાતની ખીણ વર્સુઓ પણ વેચાય. શું ધનશેઠની મીઠી વાણી ! ધરાક ભાલ લેવા આવે તો ઝુશ ઝુશ બની જાય. વળી ભાવ સરતો અને ભાલ સારો એટલે હુકાન થાડા વખતમાં અમી ગાધ. અંતઃપુરની દાસીઓ પણ તેની ધરાક બની.

ન્યારે દાસીઓ વર્સુ ખરીદ્વા આવે ત્યારે ધનશેઠ પેલી છિંખીની પૂજા કરે. એક વખત એક દાસીએ પૂછ્યું: ‘ધનશેઠ હેઠાની પૂજા કરો છો ?’ ધનશેઠ કહે, ‘અમારા દેવની.’ દાસી કહે, ‘શું એમનું નામ ?’ ધનશેઠ કહે, ‘શ્રેણીક.’ દાસી હેઠાની, ‘બધા દેવના નામ મેં સાંભળ્યાં છે. પણ એમાં ડોઈ શ્રેણીક નામના દેવ નથી. આ દેવ તો ડોઈ નવા બધા લાગે છે ?’

ધનરોઠ કહે, ‘હા, તમારા અંતઃપુરની ઓચ્ચે માટે મગબ દેશના મહારાજ એણિક નવાજ દેવ છે.’

દાસી કહે, ‘શું મહારાજ એણિક આટલા રૂપવાન છે? આંતું રૂપ તો હોઈ દિવસે મેળેયું નથી?’ એમ કહી તે ચાલી ગઈ.

તે દાસીએ આવી ચેટક રાજની પુત્રી સુજ્યેષણે વાત કરી. સુજ્યેષણે એ છબી જેવાનું મન થયું. એણે છબી મંગાવીને બેઠ અને એણિકપર તે મોહિત થઈ. તેણે ધનરોઠને કહેવડાંયું: ‘હોઈ પણ ઉપાયે મારા લક્ષ એણિક સાથે થાય તેવો ઉપાય કરો.’

અભયકુમારે શહેર બહારથી અંતઃપુર સુધી એક બોંઘરં ખોદાંયું અને ત્યાં એક રથ તૈયાર રાખ્યો. યોગ્ય સમયે રાજ એણિક લાં આવ્યા અને રથમાં બેઠેલી ચેટક રાજની પુત્રીને લઈ ગયા. તેનું નામ ચૈત્રણા. સુજ્યેષણે બદલે ચૈત્રણા હેમ આવી તેની હકીકત ‘રાખી ચૈત્રણા’ની વાતમાં આપી છે.

૪ :

એક વખત શ્રેણિકના બાગમાં ચોરી થઈ. ક્રાઈ સારામાં સારી ડેરીઓ તોડી ગયું. રાજુ કહે, ‘અભય ! આનો ચોર જફ્ફી પકડી લાવ.’ અભય કહે, ‘જેવી આજા.’

અભય વેશ બદ્ધાનીને ઝરવા મંડ્યો. એક વખત ઝરતાં ઝરતાં તે લોડાની મિજલસ આગળ આપ્યો. ત્યાં ખંચાયે અગ્રહ કર્યો કુભાઈ એક’ વાત માંડો. એટલે અભયે એક વાત માંડો : ‘એક કન્યા હતી. તેણે એક માળીને વચન આપ્યું કે હું ગમે ત્યાં પરણીશ પણ પહેલી રાતે તને મળીશ. થોડા વખત પછી તે કન્યા પરણી. એટલે માળીને ત્યાં જવા પતિની રણ માંગી. પતિએ પોતાની સ્ત્રીનું બોલ્યું પળાય તે માટે રણ આપી. એટલે સ્ત્રી ચાલી માળીને મળવા. રસ્તામાં મજ્યા ચોર. આંધ્યા લુંટવા. એટલે તે સ્ત્રી ચાલી : ‘લાઇ ! લુંટવી હોય તો મને લુંટને પણ માઝું એક વચન પાળવા હો. પરણીને પહેલી રાતે માળીને મળવાનું વચન છે.’ ચોર કહે, ‘આવું

આકર્ષં વચન પાળનારી જુહું ન બોલે. જવાદો એને. વળતી વખતે એને લુંટીશું. ’

તે સ્ત્રી આગળ આલી. ત્યાં મજબો એક રાક્ષસ. તે કહે, ‘તને ખાડા.’ સ્ત્રી કહે, ‘આવી હોય તો મને ખાને. પણ મારું વચન પાળવા ધો. જરૂર વળતી વખતે અહિં આવીથા.’ રાક્ષસ કહે, ‘ભલે ત્યારે. વળતી વખતે જરૂર આવને.’ પછી ગાઈ માળી પાસે. માળી કહે, ‘ધન્ય રે ધન્ય ! આવી વચન પાળનારી તો તને એકનેજ બોઈ. જ તારું વચન પણયું.’ એટલે તે પાછી ફરી. રાક્ષસ કહે, ‘વાહ ! આ તો ભારે સત્યવાદી. સત્યવાદીને ડાણ ખાય ?’ તે બોલ્યો: ‘ખફેન ! તને જીવતદાન છે.’ પછી મજયા ચોર. ચોર કહે, ‘આ તો ખરૈખરી સાચા-બોલી. સાચાબોલીને ડાણ લુટે ?’ તેમણે કહ્યું: ‘જ, ખફેન જ. અમારે તને નથી લુંટવી.’ તે સ્ત્રી ઘેર આવી.

હવે સીનો ધણ્ણી, ચોર, રાક્ષસ અને માળી એ ચારમાં ડાણ ચડે ? ડાઈ કહે, ‘માળી. કારણ હે રાતે જુવાન ખાઈ પાસે આવી તને ખફેન

સમાન ગણી. હાઈ કહે, ‘એનો ખલ્લી. કારણું કે વચન પાળવા આવી જતની રાજ આપી?’ હાઈ કહે, ‘રાક્ષસ. કારણું કે જીવાન ખાઇને છુવતી મૂડી.’ ત્યારે એક જણું કહે, ‘ચોર કે આવાં ધરેણુંગાંડાં લૂટવાના મજયાં પણ છોડી દીખાં.’

અભય કહે, ‘જરૂર આજ ડેરીનો ચોર.’ તેને તરતજ પકડયો. તે પણ માની ગયો કે હુંજ ડેરીનો ચોર છું.

: ૬ :

એક વખત રાજયણી પર ઉજણેણીના રાજ ચંડપ્રથોતે મોટી ચડાઈ કરી. અભયકુમારે વિચાર્યું: ‘આની સાથે લડાઈ કરવામાં સાર નથી. બંને બાજુનાં લાઘે માણસો ભરશે. છતાં હાણું છતશે તે કહેવાય નહિ. માટે એક ચુક્કિત કરવા હે.’ તેણે સોનામહોરોના ધડા ભર્યા. અને રાને છાનામાના શત્રુની છાવણીમાં દ્યાવ્યા. ભીજ દિવસે ચંડપ્રથોતને એક કાગળ લઈયો: ‘વડીલ માસાને માલમ થાયકે આપતું હેત ધડી પણ વિસરતું નથી. હાલમાં આપના પર એક મોટી આઇત આવી છે. તેથી આ પત્ર

સખ્યો છે. મારા પિતાએ ખૂબ પૈસા આપ્યા છે અટલે તમારું લશકર કૂટી ગયું છે. તમે તપાસ કરશો અટલે ખંડું જણાશો.’

ચંડપ્રદોતે છાવણીમાં તપાસ કરી. ત્યાંથી સોના મહોરાના ધડા મળ્યા અટલે તે સમજ્યો કે વાત ખરી છે. તરતજ લશકરને પાછા ફરવાનો હુકમ આપ્યો.

: ૭ :

ચંડપ્રદોતને થોડા વખત પછી ખખર પડી કે અભયકુમારે મને છેતર્યો. અટલે તેને ખૂબ ગુરસે થયો. તેણે પોતાની સભાને પૂછ્યું: ‘કું ઢાઈ તૈયાર જ અભયકુમારને જીવતો પકડી લાવે ?’ ત્યારે વેરયા ગોલી: ‘હા મહારાજ ! કું તૈયાર છું. અભયકુમારને જીવતો પકડીને આપણી પાસે હાજર કરીશ.’

તેણે એ દાસીઓ સાથે લીધી. આવી રાજગૃહી. ત્યાં બની એક આવિધા. આહો ! શું ધર્મિષ્ઠ હેખાય ? ખૂબ ઢાઈથી પ્રલુની પૂજા કરે, નત ઉપવાસ કરે. આપો દિવસ ધર્મની ચર્ચા કરે.

એક વખત અભયકુમાર દેહેરે પૂજા  
કરવા આવ્યા. ત્યાં આ શાવિકાની બહિત જેછ  
તે બહુ રાજ થયા. તેમણે પૂછ્યું:  
'બહેન ! તમે ઢાણ છો ? અને ક્યાંથી  
આવો છો ?' તે વેસ્યા બોલી: 'ભાઈ !  
ઉનજેણી મારું ગામ. ભદ્રા મારું નામ. પતિ  
મરણ પામ્યા. દિકરા પણ એ મરણ પામ્યા. એટલે  
દિકરાની બંને વઙ્ગને લઈ જતા કરવા નીકળી  
જું. કર્યાં કર્મ ભોગવ્યા વિના કાંઈ જુટ્ઠો છે ?  
અભય કહે, 'બહેન ! જમવાતું આજે મારે  
ત્યાં રાખજો.' ભદ્રા કહે, 'આજે તો  
અમારે ઉપવાસ છે. અભય કહે, 'તો પારણું  
મારે ત્યાં કરજો.' ભદ્રાએ તે કચુલ કર્યું.  
બીજા દિવસે તેણે અભયને નોતરં દીધું. અભયે  
પણ તે સ્વીકાર્યું.

અભયકુમાર બીજા દિવસે જમવા ગયા.  
ત્યાં ખૂબ પ્રેમથી શાવિકાએ જમાડયા. પણ  
જમણુમાં ઘેનની દવા નાંખેલી એટલે અભયકુમારને  
ઘેન ચહું. તે વખતે પેલી ધૂતારીએ તેને  
દ્વારડાથી ખાંધી લીધો અને નાંખ્યો રથમાં.

શાડા વખત પછી અભયકુમારનું ઘેન  
હતરી ગણું. તે જુઓ તો પોતે કેદીની હાલતમાં.  
તે તરતજ સમજ ગયો. કે ધર્મનો દેખાવ કરી આ  
ધૂતારીએ મને છેતરો છે.

પેલી વેરયાએ ઉજનેણી આવી અભય-  
કુમારને ચંડપ્રધોત આગળ હાજર કર્યો. ચંડપ્રધોતે  
તેને હૃદમાં પૂર્યો.

: ૮ :

પ્રધોત રાજને અનલગિરિ નામનો સુંદર  
હાથી હતો. તે એક વખત ગાંડો થયો. પ્રધોત  
રાજએ ધણા ધણા ઉપાય કર્યો પણ હાથી વરા  
થાય નહિ. હવે કરવું શું ? વિચાર કરતાં  
પ્રધોતને અભયકુમાર યાદ આવ્યો. એટલે તેને  
બાલાવીને કહ્યું : ' અભયકુમાર ! અનલગિરિને  
વશ કરવાનો ડોધ ઉપાય બતાવો.' અભય  
કહે, ' ઉદ્યન નામનો એક રાજ આપને ત્યાં  
કેઢી છે. તેની ગાયનવિધા અજખ છે. તેની  
પાસે ગાયન કરાવો તો હાથી વશ થઈ જશે.'  
રાજએ તેમ કર્યું એટલે હાથી વશ થયો.  
આથી પ્રધોત ઝુખ રાજ થયો. તેણે કહ્યું :

‘અભયકુમાર ! માગો, માગો ! છુટા થવા  
સિવાયનું ડાઇ પણ વચન માગો.’ અભય કહે,  
‘એ વચન હમણાં આપની પાસે રાખું છું.  
વખત આવ્યે માગીશ.’

અભયે બીજી પણ ત્રણ કામ કર્યાં. બધી  
વખતે પ્રધોતે વચન આપ્યાં.

કુલ ચાર વચન થયાં એટલે અભયે  
કહ્યું: ‘મહારાજ ! હવે મારાં વચન પાછાં માગું છું?’  
પ્રધોત કહે, ‘ખુશીથી માગો. પણ છુટા  
થવા સિવાયનું વચન માગજો.’ અભય કહે,  
‘ભલે તે પ્રમાણે માગીશ.’

તેણે કહ્યું: ‘આપ અને આપની  
શિવાટેવી રાણી અનલગિરિ હાથી ઉપર બેસેા.  
આપની બંનેની વચ્ચે હું બેસુ. પછી આપનો  
રત્ન ગણ્યાતો અભિભીર રથ ભગાવો અને તેની  
રચાવો ચિતા. તેમાં આપણે બધા સાથે બળી  
મરીએ. બસ આટલુંજ હું માગું છું?’ માગવામાં  
કાંઈ બાકી રાખી ?

પ્રધોત આ સાંસળી વિચારમાં પડી ગયો.  
છેવટ તેણે કહ્યું: ‘અભયકુમાર ! તમે આજથી

છુટા. અભય છુટા થયો. પણ અહીંથી  
જતાં જતાં તેણે પ્રતિજ્ઞા કરી: ‘પ્રદ્યોતને ધોળા  
દિવસે ઉજાણીમાંથી ઉપાડી લાવું તોજ હું  
અભય ખરો.’

: ૬ :

અભય પોતાની પૂરી કરવા એક  
વેપારી બન્યો. સાથે એ રૂપાળી સ્ત્રીએ લીધી.  
અને આંથો ઉજાણી. ત્યાં ધોરી રસ્તા ઉપર  
ધર લીધું.

પેલી સ્ત્રીએ ઢાઠમાઠથી હુરે ફરે ને  
લોકાના મનનું હરણું કરે. એક વખત પ્રદ્યોતે  
આ સ્ત્રીએને જેછ એટલે તેણે પોતાની દાસી  
સાથે છેલેવડાંયું કુ રાજ ચંડપ્રદ્યોત તમને  
મળવા છચ્છે છે. તે જ્યારે આવે?’ પેલી  
ખાઈઓએ કહ્યું: ‘અરે લાઈ! આવી વાત શું  
કરોડીએ? તમારા મોઢામાં આવી વાત શોબે?’  
દાસી તે દિવસે પાછી ગઈ.

ઓને દિવસ થયો એટલે દાસીએ ફરી પાછી  
આવી. ત્રીજ દિવસે પણ આવી. ત્યારે આ સ્ત્રીએએ  
કહ્યું: ‘બહેન! અમારી સાથે અમારો એક ભાઈ

છ. તે આજથી સાતમે દિવસ બહારગામ જવાનો  
છ. તે વખતે મહારાજ ભલે પખારે. પ્રધોત સાતમા  
દિવસની રાહ જેવા લાગ્યો.

અહીં અભયકુમારે એક માળુસને બના-  
યો ગાડો. ખાટલામાં બાંધીને હુમેશા વૈદને  
ત્યાં લઈ જય. તે વખતે પેલો પાડે ઘૂમઃ  
'હું પ્રધોત છું. મને આ લઇ જય છે. ડોઢ  
છોડાવોરે !' લોડા આ વાત સાંસળી હસે.

સાતમે દિવસે પ્રધોત અભયકુમારને ઘેર  
આવ્યો એટલે તેને પંકડીને ખાટલા સાથે બાંધા  
દ્વિધો. પછી ખાટલો ઉપાડી અભયકુમાર બહાર  
નિકળ્યો. પ્રધોત ઘૂમ પાડવા લાગ્યો: 'હું પ્રધોત  
છું; મને આ લઇ જય છે. ડોઢ છોડાવોરે !'  
લોડા આ સાંસળી હસવા લાગ્યા. તેઓ સમજતા  
હતા હું આ બિચારો ગાડો છે. એટલે ઘૂમ  
પાડ્યા કરે છે !

અભય પ્રધોતને રાજગૃહી લાવ્યો. પ્રધોતને  
નેતાંજ અણિંક ઘૂંખ ગુસ્સે થયા અને મારવા  
દોડયા. પણ અભયે કહ્યું: 'પિતાજી એ આપણા  
મહેમાન છે. તેમના ઉપર જરાએ ગુસ્સે ન થશો.

મારી પ્રતિજ્ઞા પાળવાજ તેમને અહીં લાંયો છું.  
હવે તેમને માન ભરતખાથી વિદ્ધાય આપો.' અભય-  
કુમારનાં આવાં વચન સાંભળી શ્રેણીક શાંત  
થયા અને પ્રધોતને માન ભરતખાથી વિદ્ધાય આપી.

: ૧૦ :

એક હતો કઠિયારો. તે ખૂબ ગરીબ.  
એક વખત તેણે મુનિનો ઉપદેશ સાંભળ્યો.  
એટલે તેને વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી તે  
પોતાના ગુરુ સાચે રાજગૃહી આંયો.

ત્યાં ડેટલાંક લોડા તેની પહેલાની હાલત  
જણુતા હતા. એટલે મરફરી કરવા લાગ્યા કે  
ભાધનું કયાંધ ડેકાલું ન પડયું એટલે સાધુ થયા.  
ખીજ રીતે પણ તિરસ્કાર કરવા લાગ્યા. એટલે  
તેમણે વિચાર કર્યો કે અપમાન થાય ત્યાં  
રહેણું નહિ.

આ વિચાર ગુરુને જણાંયો. ગુરુએ કહ્યું:  
'મહાનુભાવ ! તારો વિચાર સાચો છે. આપણે  
કાલે વિહાર કરીયું.'

અભય પ્રશ્ન મહાવીરનો પરમ ભક્ત હતો.  
પોતે રાજકોનમાં કુશાળ હતો તેનોજ ધર્મધ્યાનમાં  
પણ કુશાળ હતો. સદ્ગુરૂની પૂજા કરતો.

સાધુમુનિરાજને વંદન કરતો. તેને આ વાતની ઘઘર પડી એટલે ગુરુ આગળ આવ્યો અને વિનંતિ કરી: ‘એકજ દિવસ કૃપા કરીને રહી જાઓ. પણી સુખેથી વિહાર કરજો.’

બીજ દિવસે રાજસંડારમાંથી ત્રણુ મોંધા રતન લીધાં અને આવ્યો ચોકમાં. ત્યાં જહેર કર્યું કે લોકાને આ ત્રણુ મોંધા રતન આપવાના છે. એટલે લોકાનાં ટાળે ટાળાં એકઠાં થયાં અને પૂછવા લાગ્યા: ‘હે મંત્રીશર ! આ રતનો ડાને આપવાનાં છે ?’ અભય કહે, ‘ને ત્રણુ વરતુ છાડે તેને. એક ઠંડું પાણી, બીજું દેવતા ને ત્રીજું સ્ક્રી.’

માણસો કહે, ‘એ તો ખૂબ મુશ્કેલ છે. હુમેશા ગરમ પાણી પીવું, ડાઇ પણ જતનો દેવતા પોતાના માટે સળગાવવો નહિ અને સ્ક્રીની સાથેનો સંખ્યં છાડી હ્વો એ અમારાથી ન બને.’

અભય કહે, ‘ત્યારે આ રતનો કઢિયારા મુનિના થાઓ. જણે આ ત્રણુ વાનાં છાડ્યાં છે.’

લોડા સમજ્યા કે તે મુનિ ખરેખરા ત્યાગી છે.  
આપણે નાહક તેમની મંદિરી કરી ચીડાયા.  
પછી અભયે શિખામણ દીધીઃ ‘હુને ડાઈએ એ  
મુનિની મંદિરી કે તિરસ્કાર કરવાં નહિ.’

એક વખત એણિંક રાજએ પૂછ્યું: ‘મોંધામાં  
મોંધી વરતુ કઈ ?’ ડાઈએ કહ્યું: ‘હીરા.’  
‘ડાઈએ કહ્યું: ‘માણેક.’ ત્યારે અભયકુમાર કહે,  
‘માંસ.’ બધા કહે, ‘ઓટી વાત. તે તો સસ્તામાં  
સરતું છે.’ અભયકુમાર કહે, ‘ઠીક, વખત  
આંયે બતાવીશું.’

થાડા દિવસ થયા એટલે એક શેઠને  
ત્યાં ગયા ને કહ્યું કે રાજ એણિંક માંદાં  
પડ્યા છે. વૈદ કહે એ ડાઈ રીતે બચે તેમ  
નથી. પણ સવા તોઢો માણુસના કાળજાનું માંસ  
મળે તો રાજ બચે. માટે તે લેવા આંયો છું.’  
પેલા શેઠ કહે, ‘બાપુ ! પાંચ હજાર ઝપિયા  
લો પણ મને છાડો. બીજે ઠેકાણેથી મેળવી લેજો’  
એમ અભયકુમાર બધા અમીર ઉમરાવને ત્યાં ફર્યો.

પણ ઢાઈએ માંસ આંધું નહિ. સંજુ પૈસા આપી  
છુટી ગયા. અભયકુમારને વનના ઠગલા મળ્યા.  
ખીંડે દિવસે અભયકુમાર તે લઈ સભામાં  
આવ્યા અને કહ્યું: ‘મહારાજ ! આટલા,  
વનના ઠગલે પણ સવા તેલો માંસ મળતું નથી.’  
અવા શરમાદ ગયા. અભયે કહ્યું: ‘માંસ સરતુ છે  
પણ બીજાનું, પોતાનું માંસ તો મોંધામાં મોંધું છે.’

અભયકુમારની યુદ્ધિના આવા આવા અનેક  
ઢાખલાએ છે, તેથી લોકો આજે પણ એવી દૃષ્ટિઓ  
કરે છે કે અભયકુમારની યુદ્ધિ હજે.’

: ૧૧ :

શેખુંડ રાજે અભયને રાજ્ય માટે લાયક જોઈ  
આગહ કર્યો કે ‘હે પુત્ર ! તું આ રાજ્ય બોગવ.  
પ્રલુબ મહાવીર આગળ મારે દીક્ષા લેવાની મરજી  
છે.’ અભયે કહ્યું: ‘પિતાજ ! મારે રાજ્ય  
નથી જોઈતું. હું હુવે મારા આત્માનું કલ્યાણ  
કરવા છુંદું છું. પ્રલુબ મહાવીર આગળ મને પણ  
દીક્ષા લેવાનું ભારે મન છે. અને તે માટે આપ  
રજ આપો.’

શ્રીલિંગ રાજ્ય લેવા ખૂબ આગહ કર્યો પણ  
અભયકુમાર પોતાના વિચારમાં મઝ્જમ રહ્યા એટલે  
શ્રીલિંગ રાજુ થઈ રજ આપી.

ખુદ્ધિના ભંડાર અભયકુમાર સાધુ બની પવિત્ર  
જીવન ગાળવા લાગ્યા. સંયમ અને તપથી  
પોતાની શુદ્ધિ કરવા લાગ્યા. ડેટલોક સમય આવું  
જીવન ગાળી તેમણે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું.

લોકો આજે પણ એ અભયકુમારને ધણા  
માનપૂર્વક યાદ કરે છે !



આગામિથાવળી :: પ્રથમ શેષી :: ૮

# રાણી ચેષ્ટણ॥

∴ લેખક ∴

ધીરજલાલ ટેકરશી શાહ



સર્વ હક્ક રવાધીન

આરુતી ચોથી

પ્રત ૧૨૫૦

સંવત ૧૯૬૭

મુદ્ય સવા આને.

પ્રકાશક :

ધીરજાલ ટોકરશી શાઠ  
જ્યેતિ કાર્યાલય  
નમરશેડ મારકોટ, રતનપોળ,  
અ મ દા વા દ.

આ પુસ્તક મુખ્ય ધર્માકા કેળવણીભાતા તથા વડોદરા રાજ્ય  
કેળવણીભાતા તરફથી ધનામ-લાઘબેરા માટે મંજૂર થયેલું છે,  
તેમજ જૈન શ્વેત એનસ્યુક્ષેનલ એડની ધાર્મિક પરીક્ષાના  
બાળ ધોરણ પ્રથમ તથા કન્યા ધોરણ પ્રથમમાં પાઠ્યપુસ્તક  
તરીકે સ્વીકારયેલું છે. ધી. ટો. શાહ.

સુરક્ષા

મખુલાલ છગનલાલ શાહ.  
મુદ્રાસુરથાનઃ વીરવિજયઃ પ્રી. પ્રેસ  
કાળુપુર ટક્કેશાળ અમદાવાદ.

## રાણી ચેલલણા

: ૧ :

એક હતું મોકું શહેર. તેનું નામ વૈશાલિ. ત્યાં  
હતા એક રાજી. ન્યાયી અને પ્રભાને પાળનાર. પ્રતાપી  
ને ખૂબ બળવાન. તેમનું નામ ચેટક. પ્રભુ મહાવીરના  
એ મામા થાય.

તેમને સાત કુંવરીઓઃ પાંચ પરણેલી ને એ  
કુંવારી. તેમાં એકનું નામ સુજયેઠા ને બીજાનું નામ  
ચેલલણા. બંને અહેનો ખૂબ ગુણીયલ. બધી કળામાં  
પારંગત. ધર્મનું જ્ઞાન તો ધર્થુંજ ઊંડું.

તેમને ડેઢી વાતની ઓટ નહિ. રહેવાને સુંદર  
મહેલ. ફરવાને સુંદર અગીચા. પહેરવાને સુંદર કપડા-

લતાં. ખાવાને મનગમતા ભેવામીડાઈ. પણ આ બહેનો તેમાં ખુલ્લું ન દોબાય. તે તો સારું સારું વાંચે. સારું સારું ગાય. દેવદર્શને જય ને ધર્મની જવાતો કરે. આ બંને બહેનોનાં રૂપગુણ દેશેદેશમાં વખણ્યાય.

: ૨ :

રળિયામણેં ભગવં દેશ. તેના પર મહારાજ એણિક રાજ્ય કરે. તે પણ ખૂબ પ્રતાપી, ખૂબ ખળવાન. તેમણે આ કન્યાનાં રૂપગુણ સાંભળ્યાં. એટલે એક કન્યાની આગામી કરી.

રાજ એટકે જવાબ આપ્યો: ‘હે રાજ ! તમારું કુળ અમારાથી જિતરતું છે એટલે અમારી કન્યા નહિ મળે.’ રાજ એણિકને આ જવાબથી ખૂબ ઝોડું લાગ્યું.

: ૩ :

વસંતના દિવસો આવ્યા. કુદરત આનદે જિલ્લારાવા લાગી. ખન્ને બહેનો હિંડોળાપર બેહી છે. અંદર અંદર વાતો કરે છે. સુજયેઠા કહે, ‘ચેલલણું ! કેવા ઝડા વસંતના દિવસો છે ? ’ ‘ચેલલણું કહે ‘બહેન ! અમાં પૂર્ણાજ શું ? આખી કુદરત સંગીતથી જ જિલ્લ-

રાય છે. આ નોઈ મને એમજ થાય છે કે હું પણ આપો  
દિવસ ગાયાજ કરું. ’

સુજ્યેઠા કહે, ‘ વાહ ! હેવો સુંદર વિચાર !  
ચેત્તણું ! તારાં મીઠાં ગીતથી કુદરતનો આનંદ વધશે.  
માટે જરૂર એક સુંદર ગીત ગા. ’

ચેત્તણુંએ ગાવા માંડયું:-

સસ

દેશા—હું તો ઢોકે રમું ને હરિ સાંભરે રે.

સખિ ! આવ્યા વસંતનાં વધામણાં રે,  
મારાં હઠડાં કૂલી કૂલી જયરે—આવ્યાં.

થયાં ભૂરાં આકાશનાં આંગળાં રે,  
ત્યાં સૌનેરી સાથિયા પૂરાયરે—આવ્યાં.

સખિ ! આંબાનાં વન ઝડાં મેરિયાં રે,  
ત્યાં ડાયલ કરે ટહુકાર રે—આવ્યાં  
ખીલી જરૂર જૂઈ ને વળી માલતી રે,  
ત્યાં ભમરા કરે ઝંકાર રે—આવ્યાં.

સખિ ! ભર્યાં સરોવર શોભતાં રે,  
ત્યાં હંસ રથાં હરખાય રે—આવ્યાં.  
જ્યાં આવી વસંત ઉર ચિતરે રે,  
ત્યાં આનંદ પૂર રેલાય રે—આવ્યાં.

‘વાહ ! ચૈતુલ્લા વાહ ! કેવું મધુર છે આ ગીત !’

આમ નિર્દેખ આનંદ લંટી બને બહેનો જુદી  
પડી અને પોતપોતાના કામે વળગી.

: ૪ :

સુજયેઠા પોતાના ઓરડામાં આવી એટલે એક  
સખીએ વાત કરીઃ ‘બહેન ! આજે મેં એક અદ્ભુત  
છબી જોઈ. શું તેનું રૂપ ? મેં તો જાંદગીમાં એવું રૂપ  
કૃપાયે જોયું નથી.’ સુજયેઠાએ કહ્યું: ‘કયાં છે  
એ છબી ? ’

સખી—બહેન ! એક અત્તરના વેપારીની દુકાને.

સુજયેઠા—ડાની છે એ છબી ?

સખી—મગંગ દેશનાં મહારાજ એણિકની.

સુજયેઠા—તો બહેન ! લઈ આવ એ છબી.  
મને પણ જોવાનું મન થાય છે.

સખી વેપારી આગળથી એ છબી લઈ આવી.  
સુજયેઠા એ જોઈ છુફ થઈ ગઈ. ધારી ધારીને જોવા  
લાગી. આ જોઈ તેની સખીએ કહ્યું: ‘બહેન ! શું જુઓ  
છે ? આખા હિંદમાં આજે એને કોઈ રાજવી નથી.’

સુજયેઠાએ કહ્યું: ‘ સાચી વાત છે. આ છબી અહોં  
પડી રહેવા દે. ’ ‘ બહેન ! પાછી આપવાની શરતેજ  
આ છબી લાવી છું. એટલે અહોં તો કેમ રહેવા દેવાયા? ’  
એમ કહી સખી તે છબી આપવા ગઈ.

છબી પાછી ગઈ. સુજયેઠા તેનાજ વિચાર કરવા  
લાગી: ‘ અહો ! એણિકનાં વખાણું સાંભળ્યાં હતાં. પણ  
રૂપ જોયું ન હતું. અહો ! આટલા બધા તે રૂપવાન !  
પતાળએ કુળના અભિમાનમાં તેમનું અપમાન કર્યું.  
પણ આથી સારો પતિ કયાં છે ! પરણુવું તો જરૂર  
એમનેજ પરણુવું. ’

પિતાથી છાનું પરણુવું સહેલ નહિ. એટલે તે  
ચિંતામા પડી. આ બેઈ તેની સખીએ કહ્યું: ‘ બહેન !  
ચિંતા શું કરો છો ? એ વેપારીને હાથમાં લઈશું એ-  
ટલે બધું કામ થશે. ’ સુજયેઠા કહે, ‘ જા, એણિક  
સાથે લગ્ન થાય એવો ઉપાય શોધી કાઢો. ’

સખીએ વેપારીને મળી એક ઉપાય શોધી કાઢ્યો.  
નગર બહારથી રાજમહેલ સુધી નોંધ્યરું ઝોઢાવવું. ત્યાં  
અમુક દ્વિવસે એણિક આવે. સુજયેઠા ત્યાં તૈયાર રહે.  
એટલે એણિક લઈ જય.

બધી તૈયારી થઈ. દિવસ નક્કી થયો. શ્રેણિક થાડા બહાદુર યોજ્ઞા સાથે આવી ગયા. સુજયેઠા પણ જવા તૈયાર થઈ.

એવામાં સુજયેઠાને ચેલ્લણું યાદ આવી. તેનાથી વાત છાની ન રાખવી એવો વિચાર થયો. એટલે મળવા ગઈ. ચેલ્લણું કહે, ‘બહેન! આજે ઉદાસ ડેમ દેખાવ છા? ’ સુજયેઠા કહે, ‘તારા વિયોગના વિચારે.’ ચેલ્લણું કહે, ‘બહેન! મારો વિયોગ? હું’ અને તમે તો સાથેજ છીએ, અને સાથેજ રહીશું.’ સુજયેઠા કહે, ‘ચેલ્લણું લગ્ન નથી થયા ત્યાં સુધી. લગ્ન પછી તો છુટાંજ પડીશું.’ ચેલ્લણું કહે, ‘ના રે! સુજયેઠા! આપણે બંને એકજ પતિને પરણીશું. પછી છુટા ડેવી રીતે પડીશું? જા, તારો પતિ એજ મારો પતિ.’ સુજયેઠા કહે, ‘તો થા તૈયાર. મારા પતિ મારી રાહ નેદને જિભા છે.’ ચેલ્લણું પૂછ્યું: ‘ક્યાં?’ સુજયેઠા કહે, ‘ભોયરામાં.’ પછી બધી વાત કહી.

: ૫ :

શ્રેણિકરાજ બોયરાના ભોટે જિભા છે. સાથે પોતાના

બહાદુર યોજાઓ છે. તેઓ અંદર અંદર વાત કરે છે. ‘મહારાજ! શત્રુની રાજ્યાનીમાં બહુ વખત રહેતું સારું નહિ. હજુ સુધી ડાઇ જણાતું નથી. માટે જરૂર કાંઈ દગો હશે.’ શ્રિણુક કહે, ‘દગો ન હોય. ચેટક રાજની એ પુત્રી દગો કરે તેમ નથી.’ યોજાઓ કહે, ‘મહારાજ! આપ વિશ્વાસુ છો. અમને તો લાગે છે કે જરૂર કાંઈક દગો હશે.’ શ્રિણુક કહે, ‘થાડીવાર રાહ જોવા દ્વારા, સુજયેઠા આવે કે રથ ઉપાડીશું?’ શ્રિણુક રાજને ખખર નથી કે બંને બહેનો આવવાની છે.

ચેલ્દણું ને સુજયેઠા તૈયાર થયા. લોંઘરામાં ચાલવા લાગ્યાં. રથ થોડે દૂર રહ્યો એટલે સુજયેઠા પોલી. ‘ચેલ્દણું! ઉતાવળમાં મારો ધરેણનો દાખડો રહી ગયો.’ ચેલ્દણું કહે, ‘બહેન! તમે રથમાં એસો. હું લઈ આવું.’ સુજયેઠા કહે, ‘ના ચેલ્દણું! તું રથમાં એસ. હું દાખડો લઈ આવું છું.’

ચેલ્દણું આવીને રથમાં એઠી. સહુ સમજ્યા કે તે સુજયેઠા છે, એટલે રથ પવનવેગે ઉપાડ્યો.

અહીં સુજયેઠા આવી ને જૂએ તો રથ નહિ. તે સમજ કે મારા બદ્લે ચેલણાનું હરણ થયું અને હું રહી ગઈ એટલે તેણે ખૂમ પાડી : ‘ દોડો ! દોડો ! ચેલણાનું હરણ થયું .’

ચેટક રાજના યોદ્ધાઓ દોડયા પણ નિષ્ઠળ. શ્રેણીક ધણા દૂર નીકળી ગયા હતા.

સુજયેઠાને આ બાખતની લારે અસર થઈ. વિચાર કરતાં તેને લાગ્યું કે આના કરતાં વધારે જિયું જીવન જીવવાની જરૂર છે એટલે તેણે દીક્ષા લીધી.

: ૬ :

શ્રેણીકને ધણી રાણીઓ હતી. તેમાં ચેલણા સહૃથી વહાલી. રાજ શ્રેણીક ધણે વખત તેની સાથેજ ગાળે. ચેલણા પણ પોતાના પતિને ખૂખ ચાહે. રાજ રાણી આનંદમાં વખત પસાર કરવા લાગ્યા.

ચેલણાને પ્રભુ મહાવીરનો ઉપદેશ ખૂખ ગમતો; એટલે શ્રેણીકને પણ તે ઉપદેશ સમજાવવા લાગી. ચેલણાની સમજાવટથી પ્રભુ મહાવીર પર રાજ શ્રેણીકને ખૂખ શર્દી થઈ. અને આપરે તેઓ પ્રભુ મહાવીરના

પાકા ભક્ત બન્યા. બન્ય છે પતિને બર્મ પમાડનારી આવી સ્વીચ્છાને !

પતિની સાચી સેવા કરનાર ચૈત્રણ્યાને ગર્ભ રહ્યો. પણ તે વખતે તેને એક ખરાખ દુષ્ટા થઈ કે મારા પતિના કાળજાનું જ માંસ ખાડા. આવો ખરાખ વિચાર આવતાં જ ચૈત્રણ્યાને ગર્ભ તરફ તિરસ્કાર ધૂટચો. તે સમજ ગઈ કે આ ગર્ભ એના પિતાનો વેરી છે નહિતર આવો વિચાર ન આવો.

સવાનવ માસ પૂરા થયા. ચૈત્રણ્યાને એક તેજસ્વી પુત્ર જન્મ્યો. પણ તેજ વખતે તેણે દાસીને આશા કરીઃ ‘દાસી ! આ દુષ્ટ પુત્રને ડાઈક દૂર જગામાં મૂકી આવ. એ એના બાપનો વેરી છે. સાપને ઉછેર્યો સારો નહિ.’ દાસીએ આ બાળકને હાથમાં લીધો. ચાલી નીકળી દૂર. એક આસોપાલવના વન પાસે આવી. ત્યાં હતો એક ઉકરડો. તેમાં તેને મૂકી દીધો.

દાસી પાછી આવે છે ત્યાં શ્રેણિક મજ્યા. તેમણે પૂછ્યું ‘આમ કયાં ગઈ હતી ?’ દાસીએ જેવી હતી તેવી વાત કરી. એટલે શ્રેણિક એકદમ આસો-

પાલવના વન આગળ આવ્યા. ત્યાં એક બાળક રડી રહ્યો હતો. તેની કુણી આંગળી એક મરધીએ કરડી ઘાધી હતી. રાજ શ્રેણિએ આ જેઠ ખૂબ હુઃખ થયું. તેમણે તરત જ તે પુત્રને ઉપાડી લીધો. અને તેની લોહી-વાળી આંગળી મેંમાં નાખી લોહી ચૂસી લીધું ત્યારે બાળક શાંત થયો.

રાજ શ્રેણિક ઘેર આવી ચૈત્રણ્યાને ડપડા દીધો. ‘અરે ઉત્તમ કુળવાળી ! આવું કામ તને શોલે ?’ ચૈત્રણ્યા કહે, ‘સ્વામીનાથ ! આ પુત્ર તમારો વેરી છે. એના બંધુ લક્ષ્મેણ ખરાખ છે. એવા પુત્રને હું કેમ જિંદરી શકું । મારા સ્વામી કરતાં મારો પુત્ર વધારે નથી. ‘રાજ શ્રેણિક કહે, ‘ગમે તેમ હોય પણ તું એ પુત્રને જિંદર. આપણાથી એને તજ તો નજ દેવાય.’ શ્રેણિએ આજાથી ચૈત્રણ્યા તેને જિંદરવા લાગી.

આ પુત્રની એક આંગળી કુકડીએ કરડી હતી એટલે તે બુધિ થઈ. છોકરાએ આ જેઠિને ચીડવતા ફણિક ! ફણિક ! એટલે ડે બુધિ આંગળીવાળો ! બુધિ આંગળીવાળો !

ચૈત્રણીને બીજી પણ એ પુત્રો થયા. એકનું નામ હહ્ય  
અને બીજાનું નામ વિહૃત્ય. એ ત્રણે ભાઈ આનંદે ઉછરતાં  
મોટા થવા લાગ્યા.

: ૭ :

એક વખત રાજ રાણી સૂતાં હતાં. શિયાળાની  
રાત. ટાઠ કડકડતી પડે, એટલામાં ચૈત્રણીનો હાથ  
સોામાંથી બહાર નીકળી ગયો. એક તો ડામળ હાથ  
ને તેમાં કડકડતી ટાઠ. એટલે એકદમ તેને પીડા થઈ.  
પણ તેજ વખતે તેને એક વિચાર આવ્યો: ‘એક  
મુનિરાજ અત્યારે નદી કિનારે ઉલા છે. તેમણે એક  
પણ કષ્પકું ઓછાયું નથી. આવી ટાઠમાં એમનું શું  
થયું હશે?’

છેદ્ધિનું વાક્ય મોટેથી એલી જવાયું. ભરાખર તેજ  
વખતે ઐણિક રાજ અગતા હતા. તે સાંકળી વિચારવા  
લાગ્યા: ‘આ ચૈત્રણી અત્યારે ડાના વિચાર કરે છે!  
જરૂર એનું મન બીજા ડોઈમાંછે. જના તરરૂ હું આટ-  
આટલો પ્રેમ રાયું છું તે પણ બીજાનો વિચાર કરેછે.  
ઘસન જેદીઓ આ રાણીઓ.’ તેમણે આવાજ વિચારમાં  
રાત પસાર કરી.

વહાણું વાતાં પ્રવાન અભયકુમારને બોલાયા. અને તેમને આજા કરી કે ‘મારું’ અંતઃપુર બગડી ગયું છે. માટે તેને બાળી ભૂક. ખખરદાર ! માનો પ્રેમ વર્ચ્યે લાવીશ નહિ. ’ અભયકુમાર કહે, ‘ જીવી પિતાની આજા. ’ ખરાખર આજ વર્ષતે નગર બહાર બગીચામાં પ્રભુ મહાવીર પદાર્થ. એટલે એણિંક રાજતેમના દર્શાન કરવા ગયા.

અભયકુમારે વિચાર્યુઃ ‘ પિતાજ કાંઈક ગુર્સામાં આવી ગયા છે. નહિતર આવો હુકમ ન કરે ! મારી બધી માતાએ સ્વભાવથીજ સતીએ છે. તેમાં કલંક હોય નહિ. નક્કી પોતાની કાંઈક ગેરસમજ થઈ હશે. માટે સાહસ તો નજ કરવું. ’

તેણું હાથીખાના પાસેની થોડી આરડીએ સળગાવી અને ગામમાં પડાવી ખૂમઃ રાજતું અંતઃપુર સળગ્યું, અંતઃપુર સળગ્યું !

એણિંક પ્રભુને વંદન કર્યું. પછી સવાલ પૂછ્યો, ‘પ્રભુ ! ચૈત્રણ્યાને એક પતિ છે કે અનેક ? ’ પ્રભુ કહે, ‘ એક. હે એણિંક ! એ સતી પર ડેઢિપણું જતનોં

ઠેમ લાવીશ નહિ. ’ એણિકને પ્રજ્ઞના વચનમાં પુરી અંગ્રા હતી એટલે તે સમજ્યા કે પોતે ભારે ભૂલ કરી છે.

તે ઉતાવળા ઉતાવળા ગામભમાં આવ્યા. ત્યાં અભયકુમાર સામે મળ્યા. તેમને એકદમ એણિક પૂછ્યું: ‘અભય શું કર્યું?’ અભય કુમાર કહે, ‘બરાબર આપની આજ્ઞા ઉઠાવી છે.’ એણિક કહે, ‘અરે મૂર્ખ મારો અવિચારી હુકમ અમલમાં ઠેમ મૂક્યો? તારી માતાઓને બળતાં તારો જીવ ભલો ચાલ્યો।’ અભયકુમારે જાહ્યું કે પિતા પોતાની ભૂલ સમજ્યા છે. એટલે તેણે બધી હકીકત જહેર કરી.

હવે ચૈક્ષણ પર એણિકને વધારે પ્રેમ થયો. તેના માટે સુંદર મહેલ બાંધ્યો. સુંદર બગીચી ઘનાંયો. બંને જણુ આનંદથી ત્યાં રહેવા લાગ્યાં.

: ૮ :

ફણિક મોટા થયો એટલે તેને ગાઢીએ બેસવાની જૂથ દિશા થઈ. એણિક તેનેજ ગાઢી આપવાના હતા પણ ફણિકને તેમનાં જીવતાંજ ગાઢી લેવી હતી. એટલે

તેણે ખટપટ કરવા માંડી. તેમાં તે ક્ષાંયો. શું રાજ્યલોભ !  
પિતાને ડેઢમાં પૂરી પુત્ર ગાઢીએ બેઠો.

પણ એટલેથીજ ફ્રાણિક અટક્યો. નહિ. પોતાને  
પૂર્વ ભવતું વેર હતું એટલે તેમને બરાબર દુઃખી કરવાનો  
વિચાર કર્યો. તેણે ડેઢની આસપાસ સખત ચોકીપહેરો  
મૂક્યો. અને આજ્ઞા કરી કે ‘ખબરદાર ! હોઈ પણ માણુસ  
શ્રાણિક પાસે જય નહિ. ’ ચૈત્રણ્યાએ શરૂઆતથી ધારેલી  
વાતજ ખરી પડી.

ચૈત્રણ્યા પતિને પ્રાણુથી પણ વહાલા ગણે. તેનાથી  
આ નજ ખમાય. પણ રાજ્યની ખંડી સત્તા ફ્રાણિકના  
હાથમાં એટલે અનો ઉપાય શું ચાલે ? છતાં એણે નિશ્ચય  
કર્યો કે ફ્રાણિકના અન્યાયી હુકમને તાણે ન થશું.

તેહિભૂત ધરી ફ્રાણિકના ડેઢખાના તરફ ચાલી.  
ચૈત્રણ્યાનો પ્રમાવ એટલો અધ્યો હતો. ક સિપાઠઓ તેને  
અટકાવી શક્યા નહિ. લ્યાં પાંજરામાં રહેલા પોતાના  
પતિને મળી. આથી તેને આનંદ થયો. પણ સાથે જ  
તેમની હુદ્દાં જોઈ શોક થયો. તેણે અહીં જાણું કે  
પોતાના પતિને અન્તપાણી આપવાનું પણ બંધ કર્યું

છે. અને હુમેશાં સવારે ચાયુકના માર પડે છે એટલે  
પારાવાર દુઃખ થયું.

તેણે વિચાર કર્યોઃ ‘ભીજું ન બને તો કાંઈ નહિ  
પણ પતિનું આ દુઃખ તો જરૂર ઓછું કરવું.’

તેણે ફ્રાણિક આગળ બ્રેણિકને મળવાની રજ માગી.  
ફ્રાણિક ના કહી શક્યો નહિ. ચૈક્ષણ્યા હુમેશ મળવા  
બય. તે વખતે પોતાના વાળ દ્વારાવાળા પાણીથી ભીજવે  
અને અંઝોડામાં અડદો લાડુ ધાવે. તે અડદો લાડુ  
ભુખ્યા પતિને ખવરાવે ને અંઝોડા નીચોવીને પાણી  
પાય. આ પાણી પીવાથી બ્રેણિકને ધેન ચડે એટલે  
ચાયુકની પીડા ઓછી થાય.

: ૬ :

ફ્રાણિક પોતાના પુત્ર પર ખૂબ પ્રેમ રાખતો. એક  
વખતે તેણે ચૈક્ષણ્યાને પૂછ્યું, ‘માતા મારા જોંબો  
પુત્રપ્રેમ ડાઈને હશે?’ એટલે ચૈક્ષણ્યા બોલીઃ ‘અરે  
કુછ! તારો પુત્રપ્રેમ થું હિસાખમાં છે? તું ગર્ભમાં  
આંયો ત્યારથી મેં જાહેરું હતું કે તું તારા ખાપનો

વેરી છે. એટલે તારો જન્મ થતાંજ મેં તને ઉકરડામાં ફેંકી દીધી હતો. પણ તારા પિતાનો તારા પર અથાગ પ્રેમ એટલે તે દોડયા ને તને ઉંચકી દીધી. તે વખતે તારી કુક્કિએ કરડેલી લોહીવાળી આંગળી એમણે મોંબાં દીધી અને તને રડતો છાનો રાખ્યો. ત્યારખાદ અત્યાર સુખી તેમણે તારા તરરું અનહદ પ્રેમ બતાવ્યો. છે. રાજ્ય પણ તનેજ આપવાની ઈંચ્છા હતી.'

આ સાંભળી ઝણિકનું વેર શાંત થઈ ગયું. પોતાની ભારે ભૂલ ઘાલમાં આવી. હવે પિતાને ડેઢમાંથી જલદી છૂટા કરી તેમની ક્ષમા માગવાનો વિચાર આવ્યો. લુહા-રને બોલાવતાં વાર થાય એટલે પોતેજ હાથમાં લોઢાનો. દંડ લઈ જલ ભણી દોડયો.

ઝણિકને આ પ્રમાણે જોઈને ચોકીદારોએ એખિંકને ખખર આપ્યાઃ ‘ઝણિક હાથમાં લોઢાનો દંડ લઈને આવે છે. એટલે જરૂર આપતું મોત થશે.’

એખિંક વિચાર્યુઃ ‘ઝણિક ભાડં મોત બગાડશે. ભાડે હુંજ મારી જતે ભરી જવું તો ઢીક છે.’ એમ

વિચારી તેમણે પોતાની પાસે છુપાવી રાખેલું હળાહળ  
એર ખાંડું ને તત્કાળ મરણું પામ્યા.

ક્રેણિક આવીને જુઓ તો પિતાનું મહાદું. તે  
વિચારવા લાગ્યો: ‘અરરર ! આ શું ! પિતાની છેલ્દી  
મુલાકાત પણ ન થઈ. મને જ્યારે ભૂલ જણાઈ ત્યારે  
પિતાજી ચાલ્યા ગયા. હા ! હું જ મહાદુષ્ટ કે પિતાને  
કમોતે મરવું પડ્યું. પણ હવે શું થાય ?’ તેને ખૂબ  
શોક થયો.

ચેલ્દણાને જણું થઈ કે ક્રેણિક એર ખાંડ મરણું  
પામ્યા. એટલે તેને પારાવાર દુઃખ થયું. તે ખૂબ શોક  
કરવા લાગી. પણ એવામાં પ્રલુભ મહાવીર પંધાર્યા. તેમની  
અમૃતવાણી સાંસાગી એટલે તેનું મન શાંત થયું અને  
તેને સમજયું, ‘જ્યાં મોહ છે ત્યાં જરૂર શોક છે. માટે  
મોહ છોડ્યા વિના શોક કે દુઃખ કઢી આછાં નહિ થાય.’  
એટલે તેણે સધગો મોહ છોડી દીધો અને સાધુજીવ-  
નની પવિત્ર દીક્ષા લીધી.

ચેટક રાજની આ વિદ્વાન પુત્રી અને ભગવદેશની  
મહારાણી ચેત્તણું પવિત્ર જીવન ગાળવા લાગી. કે  
પ્રેમ શ્રેણીક તરફ હતો તેવો પ્રેમ જગતના સધણા  
જીવો પર દર્શાવવા લાગી. તેણે તપ અને સંયમથી  
પોતાના જીવનને ખુબ સુંદર બનાવ્યું. છેવટે પોતાનું  
આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામી.

ધન્ય હો સતી ચેત્તણાને !

ધન્ય હો ભારતવર્ષની ભૂમિને દીપાવનાર પવિત્ર  
આર્થિઓને !

### ૭૩૨ વાંચો

જગમંહિર પાવાપુરીનું સુંદર કાઠ્ય ત્રિરંગી

ચિત્ર અને ભીજ આલેખનો સાથે કિં. ૦-૨-૦

કુદરત અને કળાધામમાં વીસ દિવસ

સચિત્ર પ્રવાસી

૧-૮-૦

ઇલુરાનાં ક્રામંહિરો સચિત્ર

૦-૮-૦

# ચેંદળખાળા

: ૧ :

ચ્યંપાનગરીનાં રાજરાણી બહુ જલાં. દવિવાહન રાજતું નામ; ધારિણી રાણીનું નામ. ભાંગ્યાના તે બેઠું ને પ્રજાના તે પાળનાર. તેમના રાજ્યમાં અધે આનંદ વરતે. નહિ ચોરચખારનો લય. નહિ અધિકારીનો નાસ. ગંગાજ ખારે માસ રેલે ને કણકૂલના અંખાર દરે. દુકાળતું તો ત્યાં નામજ નહિ.

એમને ઘેર દેવી જીવી એક દીકરી અવતરી. કોમળ એની કાયા ને અમૃત શી એની વાણી. એને જેતાં આંખ ધરાયજ નહિ. નામ એનું વસુમતી.

વસુમતી સોનાની પૂતળીએ રમતી મોઢી થઈ. માખાપને તે ખૂબ વહાલી. સહિયરોનો તો જાણે પ્રાણ.

માખાપે જાણું કે વસુમતી હવે ખૂબ સમજણી થઈ છે એટલે તેના ભાઈ શિક્ષકો રાખ્યા. તેમની આગળ.

તે લખતાં શિખી, વાંચતાં શિખી. ગણિત શિખી, ગાતાં શિખી. ઇગ્રૂલ ઉછેરવામાં તે ખૂબ હોંશિયાર થઈ. વીજૂ સારંગી વગાડવામાં તો તેની એડ જ નહિ.

પછી તેના માટે ધર્મપંડિતો રાખ્યા. તેમની પાસેથી વસુમતીએ ધર્મસંબંધી ઊંડું જ્ઞાન મેળાયું. એક તો પૂર્વભવની સંસ્કારી ને તેમાં સહયુણી માતાપિતા મળ્યાં. વળી શિખવાની રૂચિ ને શિખવનાર હોંશિયાર. એટલે વસુમતીનો વિકાસ વણેાજ થયો.

તે હુમેશાં વહેલી ઊરી જિનેક્ષરતું નામ વે, પછી માતાની સાથે પ્રતિક્રમણ કરે. જ્યાં પ્રતિક્રમણ પૂરું થાય ત્યાં તો જિનમંહિરના વંટ સંભગાય. એટલે માતાપુત્રી બંને ચોક્કાં વન્ન પહેરીને મંહિરે અય. ત્યાં ભાવથી વંદન કરે અને વસુમતી પોતાની માતાને કહે: “ બા ! કુંસુંદર રથ્યા છે ! આપણા રાજમહેલમાં તો બધે ધમાલ ને દોડાદોડ જ, ત્યારે અહીં ડેવી પરમ શાંતિ છે ! મને તો એમજ થાય છે કાઅહી જ એસી રહું ને શાંતિના સાગર જર્વી આ પ્રતિમાન! દર્શન કર્યો જ કરું .”

એ સાંભળી ધારિયો કહે. “ એટા વસુમતી ! ધન્ય છે તને કે આવી ભાવના ઉત્પન્ન થાય છે. ખરે-

ખર ! આ રાજ મહેલના સુખવૈભવ ચાર ધડીનાં ચટકાં છે. ક્યાંથી હોય ત્યાં એ શાંતિ જે જિને ખર દેવના સુખ ઉપર દેખાય છે ! અહો ! તેમના નામ માત્રથી દુઃખના દરિયામાં દૂષેલાને પણ શાંતિ મળે છે. બેઠા ! એમનું પવિત્ર નામ કહી વિસરીશ નહિ.”

આમ માદીકરીની મીઠી મધુરી વાતો થાય, પણ ધેર આવી સારું સારું વાંચે ને આનંદમાં વખત પસાર કરે.

: ૨ :

એક વખત રાજરાણી વહેલાં ઊઠી દ્ધિદેવનું સમરણ કરે છે. ત્યાં સિપાઈએ દોડતા આવ્યા ને નમસ્કાર કરીને હાંક્ષિતા હાંક્ષિતા કહેવા લાગ્યા: “મહારાજ ! મહારાજ ! કૌશામ્ભીના રાજ શતાનિકનું લરકર ચડી આવ્યું છે. અમે નગરના દરવાજા બંધ કરી દીધા છે. હવે પ્રમાણો આજા ! ”

રાજ કહે, “વગાડો લડાઈનાં નગારાં ને થાએ લડવા તૈયાર.”

ધીનધીન, ધનધન, લડાઈનાં નગારાં વાગવા લાગ્યાં. જેતાની સહુને જાણ થઇ કે નગરને ધરેણ ધલાયો છે એટલે લડવાને તૈયાર થયા.

ઢવી રીતે તૈયાર થયા ?

શરીરે પહેંચી બખ્તર ને કમ્મરે લટકાવી ચક-  
ચકતી તરવારો. બ્ઝે બાંધી ઢાલો ને તીરનાં જાથાં.  
એક હાથમાં ધનુષ્ય ને બીજા હાથમાં પાણીદાર જાતા.

એ તો ચડયા નગરના ડોટ ઉપર ને ફૈંકવા  
માંડયા તીર. સખુણું સખુણું બાણનો વરસાદ વરસવા  
લાગ્યો.

બાણ વાગે ને માણુસ ભરે. પણ લશકર ધણું  
માદું. એ પાંચ મર્યાદા યે શું? એ તો પૂરપાટ દોડતું  
જ આવે.

થોડીવારમાં લશકર ડોટ આગળ આવ્યું. ડોટની  
આગળ આઈ. પાણીશી તે ભરેલી. પણ લશકર આગળ  
લાકડાના પુલ ને મોટી મોટી નિસરણીઓ. બાણના  
વરસાદમાં પણ આઈ પર પુલ મંડાયા. તેના પરથી  
નિસરણીઓ ડોટની રંગે અડી. ધણોયે બાણનો વરસાદ  
વરસે ને માણુસો ભરાય. પણ લડવૈયાઓ. તો નિસરણી  
પર ચડયેજ જય. ચડયેજ જય !

ડોટના ફાંગરે બાવતાં જાતાનો મારો ચર્ચ થયો.

માણુસો ટપેટપ હેઠા પડવા મંડયા, પણ તેણે બીજા  
માણુસો ચડયેજ જય, ચડયેજ જય.

એ તો થોડીવારમાં આવ્યા ઢાટ ઉપર! ત્યાં થધ  
તરવારની મારામારી. તેમાં કૌશામ્ભીતું લરકર જીત્યું.

કટલાક સિપાઈઓએ જઈને નગરના દરવાન  
દ્વારી નાખ્યા. એટલે લરકર બધું અંદર પેહું.

દ્વિવાહન જીવ લઈને નાડા. તેમનું લરકર  
પણ જીવ લઈને નાહું. તેઓ જાણુતા હતા કે શતાનિકના  
હુથમાં પડ્યા તો મર્યેજ છુટકો છે.

શતાનિક પોતાના લરકરને જહેર કર્યું: “નગરમાં  
લુંટ ચલાવો ને લેવાય તે લધ દ્યો.”

ગાંડાતુર બનેલા સિપાઈઓ લુંટ ચલાવવા  
લાગ્યા.

નગર આખામાં હાહાકાર મચી રઘો. ચારે ખાજુ  
દોડાદોડ-ચીસાચીસ થધ રહી.

ધારિણી ને વસુમતી રાજમહેલમાંથી નીકળીને  
નાડા.

આખા નગરમાં શતાનિક રાજએ પોતાની આણ  
વર્તાવી.

x

x

x

પછી ધારિણી ને વસુમતીનું શું થયું ?

તેઓ નગરમાંથી બહાર નિકળી ગયાં. પશુ અવામાં શતાનિક રાજના એક સાંધણીસવારે તેમને જોયાં. તેણે ખૂબ ઝપાળાં માદીકરીને એછ વિચાર કર્યો કૃચાનગરીમાંથી લેવા જેવી વસ્તુઓ તો આ છે ! અટલે અનેને પકડયાં ને ખાંખીને બેસાડયાં સાંધણી ઉપર.

સાંધણી મારી મૂક્ષી.

: ૩ :

સાંધણી ઝપાટાખંધ રસ્તો કાપી રહી છે. નથી ગણુતી નઢો નાળાં. નથી ગણુતી જળાંત્રાંખરાં. પવનવેગે રસ્તો કાપતી તે એક ધોર જંગલમાં આવી. બિહામણ્ણાં ત્યાંનાં આડો, બિહામણો લ્યાંનો રસ્તો. ભાણુસ તે ડાણ ત્યાં નજરે પડે ? પશુ પંખી હુરે ફરે ને મજ કરે !

અહીં ધારિણીએ પૂછ્યું : “તમે અમને લઈ જઈને શું કરશો ?”

સવાર : “ અરે બાઈ ! તું ડાઈ વાતની ચિંતા કરીશ નહિ. તને સારું સારું ખવડાવીશ, સારું સારું પહેરાવીશ અને મારી સ્ત્રી બનાવીશ. ”

આ સાંભળતાંજ ધારિણીને માથે જાહે વીજળી પડી. તે વિચારવા લાગીઃ “અહો ! કયું મારું કુળ ? કયો મારો ધર્મ ? આજ મારે આવું સાંભળવા વખત આવ્યો ! ધિક્કાર છે એ જીવ ! આવા અપવિત્ર શબ્દો સાંભળવા કરતાં આ શરીરને છોડી ડેમ ચાલ્યો જતો નથી ? શીયળભંગ કરીને જીવવા કરતાં અત્યારેજ મરી જવું હુઅર દરજને શેષ છે.”

આવા વિચાર કરતાં ધારિણીના હૃદયપર ખખ અસર થઈ. તે શબ્દ થઈને ધરણી પર ટળી પડી.

આ જેતાં જ વસુમતી ચીસ પાડી હૃઠીઃ “એ માતા ! એ વહાલી માતા ! લરજંગલમાં મને જમના હુથમાં મૂકી ક્યાં ચાલી ગઈ? રાજ રોળાયું ને બંધનમાં પડી ત્યાં મારે તારોજ આવાર હતો. તે તું પણ આજ ચાલી ગઈ !” એમ વિલાપ કરતાં તે બેબાન થઈ ગઈ.

પેલા સાંદળીસવારે આ જેઇ વિચાર્યુઃ “ મારે આવા શબ્દો આ બાઈને નહોતા કહેવા જેઈતા. પણ એર ! હવે આ કુંવરીને તો કાંઈજ ન કહેવું. નહિતર એ પણ એની માની ભાઇક મરણ પામશે.” આમ વિચારી તે વસુમતીની આગતાસ્વાગતા કરવા લાગ્યો.

વસુમતી ભાનમાં આવી એટલે તેને મીઠા શખદે  
બોલાવવા લાગ્યો : “ અરે બાળ ! ધીરજ ધર, જે  
થવાનું હતું તે થઈ ગયું. શોક કર્યો શું થશે ? શાંત થા !  
તને કાર્ધપણું જતની આંચ નહિ આવે. ”

આમ મીઠા વચને બોલાવતો બોલાવતો તે કોશા-  
અભી આગ્યો.

: ૪ :

કોશાઅભી શહેર તો જાણે માણુસનો દરિયો.  
અધિધધ ! શું રસ્તાપર માણુસની ભીડ ! દેશદેશાવરના  
માણુસો આવે. કાઝલા લાવે ને માલના અદલા બદલા  
કરે. ત્યાં બધી જતની વસ્તુઓ વેચાય. અનાજ ને  
કરિયાણું વેચાય, પણ પક્ષી વેચાય ને માણુસો પણ  
વેચાય !

પેલા સાંઠણીસવારે વિચાર કર્યો : “ આ કન્યા  
ખૂબ રૂપાળી છે. એને વેચીશ તો ખૂબ નાણું મળશે.  
માણ ચાલ આ બજરમાં તેને વેચી દઉં. ”

વસુમતીને તે બજરમાં લાગ્યો ને વેચવાને ઉલ્લી  
રાખી. એનું રૂપ અપાર હતું. જે જુઓ તે અંલાઈ

જય. એટલે બોડાનાં ટ્રાળેટાળાં એકડાં થયાં. તેનું મૂલ્ય પૂછવા લાગ્યાં.

વસુમતીને આ વખતે ડેવું થયું હશે? રાજમહેલમાં રહેનારી ને સેંકડો નોકરોની સેવા કેનારીને આજે ભરખભરમાં વેચાવાનો વખત આવ્યો!

વસુમતી નીચું મહેં રાખી જિલ્લી રહી છે!“ એ જગખન્ધવ! એ જગનાથ! જે બળો તમે મુક્તિ મેળવી તે બળ મારામાં પ્રગટો! મારા શિયળની સંપૂર્ણ રક્ષા થાઓ!” આવી સ્તુતિ તે કરી રહી છે.

એવામાં આવ્યા એક શેડ. તેમનું નામ ધનાવહ. પ્રેમની તે મૂર્તિ. દ્યાનો તે ભંડાર.

વસુમતીને જેતાંજ તેમનું હૃદય કંઈ જાયું. તે વિચારવા લાગ્યા : “અહો! આ ડેર્થ ડંચા કુળની ખાળા છે. બિચારી દુઃખની મારી આ પિશાચને હાથ પડી છે એટલે જરૂર ડાધ નીચના હાથમાં સપડાશે. માટે મોં માગી કિભૂત આપીને હું જ તેને ખરીદી લઇ. મારે લાં રહેશે તો વખતે તેનાં માખાપ મળશે ને બિચારી ડેકાણે પડશે.”

આમ વિચારી તેમણે માં માગી કિમત આપી  
વસુમતીને ખરીદી લીધી.

ધનાવહ શેડે પૂછ્યું: “ અરે બહેન ! તું હોની  
પુત્રી છે ? ”

વસુમતીને આ સાંસળી અલંત હુઃખ થયું.  
પોતાનાં માતાપિતા નજર આગળ તરવા લાગ્યાં. કયાં  
ચંપાનગરીની રાજકુંવરી ? કયાં કૌશામ્ભીના રાજ્ય-  
મારગમાં વેચાયેલી દાસી ? તે કાંઈ જવાખ આપી  
શકી નહિ.

ધનાવહે જાણ્યું કે આ બાળાનું કુળ ખૂખ ઉંચું  
હશે. એટલે તે કહી શકતી નથી. બિચારીને આ  
સવાલથી ખૂખ હુઃખ થયું જણાય છે. એટલે તેમણે  
પ્રરીક્ષી એ સંબંધી કાંઈ પૂછ્યુંજ નહિ.

ધેર આવી પોતાની સ્વી મૂળાને કહ્યું: “ પ્રિયા !  
આ આપણી પુત્રી છે, એને ખરાખર રાખજો. ” મૂળા  
તેને સારી રીતે રાખવા લાગી.

વસુમતી અહીં ધર ગણીને જ રહેવા લાગી.  
પોતાનાં મીઠાં વચ્ચેનોથી ધનાવહ શેડને તથા ખીઅંચ્યાને  
આનંદ આપવા લાગી. એનાં વચ્ચેનો ચંદ્ર જેવાં શીતળ  
હતાં એટલે શેડે તેનું નામ પાડ્યું ‘ ચંદ્રનભાળા. ’

ચંદ્રનથાળા ખરાખર જુવાન થઈ. ઇપાણી તો હતી જ અને જુવાન થઈએટલે તેનું ઇપ ખૂબ ખીલ્યું.

આ જેઠ ભૂળા શેડાણી વિચારવા લાગ્યાં : “ શેડ આને દીકરી કરીને રાખે છે પણ તેના ઇપથી મોહિત થઈને જરૂર તેને પરણુશે. અને જો તેમ થાય તો મારું જીવતર ધૂળ મળ્યું.” આવા આવા વિચારોથી ભૂળા શેડાણી ચિંતામાં પડ્યાં.

: ૬ :

શ્રીજમ ઝડુ આવો છે. માથું ફાડી નાખે તેવો તાપ પડે છે. ધૂળના ગોટેગોટ ઉડે છે. અંગારા જેવો પવન કુંકાઈ રહ્યો છે. જિચારાં પણુપક્ષીઓ પણ તાપથી નાસ પામી રહ્યાં છે.

આવા વખતમાં તાપથી કંટાળીને શેડ ઘેર આયા. આમતેમ જેયું પણ પગ ધીનારા ડોઢ નોકર હાજર નહિ. ચંદ્રનથાળા આ વખતે ત્યાં ઉભી હતી. તે સમજ ગઈ. ખૂબ વિનીત હોવાથી જતે પાણી લાવી પિતાના પગ ધીવા લાગી. પગ ધીતાં તેનો કાળો ભરમર ચોટલો છૂટી ગયો ને નીચે કાદવમાં પડ્યો. શેડે જેયું કે ચંદ્રનાના ચોટલો કાદવમાં પડ્યો છે એટલે તેને લાકડીથી જાંચો કર્યો ને પ્રેમથી બાંધી લીધો.

મૂળા શેઠાણી બરાબર ગોખે ઉસાં હતાં. તેમણે આ જેયું એટલે પોતાની ધારેલી શાંકા મજઘૂત થઈ. તે વિચારવા લાગ્યાં : “ શેઠે આનો અંબોડા બાંધ્યો એ જ પ્રેમની નિશાની છે. માટે મારે વેળાસર ચેતી જવું. જે આ બાખ્તને હુને વધવા દઈશે તો મનેજ લારે પડશે.” આવો વિચાર કરીને તે નીચે આવી ને શેઠને જમાડયા.

શેઠે જમીને થોડા આરામ લીધો અને ફરીથી પાછા બહાર ગયા.

આ વખતે મૂળાએ પોતાનું કામ શરૂ કર્યું. એક હજબને ષાલાવી યંદુનબાળાના સુંદર વાળ કાપી નંખાવ્યા. માથે કરાંયો મુંડો. પછી પગમાં નાંખી બેડીએ ને લઈ ગઈ દૂરના ઓરડામાં. ત્યાં ખૂબ માર માર્યો ને કમાડ કર્યાં બંધ.

પછી શું થયું ?

પછી બધા નોકરોને ષાલાવીને ધમકી આપી ડે ‘ ખખરદાર ! જે ડાઈએ શેઠને વાત કરી તો વાત કરનાર મુઓજ સમજજો.’ શેઠાણી બધા નોકરોને આવી-ધમકી આપી પહેંચી ગયાં પિયર.

સાંજ પડી એટલે શેઠ વેર આવ્યા. આડુંઅવળું જોયું પણ ક્યાંય ચંદ્રનાને ન જોઈ. એટલે પૂછ્યું : “ ચંદ્રના ક્યાં છે ? ” શેઠાણીની ધાક ભારે હતી. એટલે ડાઇએ ઉત્તર આપ્યો નહિ. શેઠે વાર્યું ડે આડી અવળી રમતી હશે.

બીજ દિવસે પણ ચંદ્રનાને ન જોઈ. એટલે નોકરોને લેગા કરી પૂછ્યું : “ ચંદ્રના ક્યાં છે ? ” તે વખતે પણ ડાઇએ ઉત્તર આપ્યો નહિ.

શેઠે વાર્યું ડે ક્યાંધક આડી અવળી રમતી હશે; પણ તીજ દિવસેય ચંદ્રનાને ન જોઈ ત્યારે બહુ ગુરુસે થયા. તેમણે નોકરોને વમકાવીને પૂછ્યું : “ અરે ! સાચું યોદો, ચંદ્રના ક્યાં છે ? જલ્દી કહી દો નહિતર તમને ભારે શિક્ષા કરીશ. ” ત્યારે એક વૃદ્ધ ડાશીએ હિંમત લાવીને બધી વાત કહી.

શેઠને આ સાંભળી પારાવાર દુઃખ થયું. તે યોદી હઠયા : “ અરે બતાવ તે જગા ! ક્યાં છે મારી વહાલી ચંદ્રના ? હત્રકુષ ઝી ! આવો કાળો કાળો શું સુઝ્યો ? ”

પેલી ડાશીએ આરડો બતાવ્યો. એટલે શેઠે તેનું બારણું ઉધાડી નાખ્યું. જ્યાં જુએ તો ચંદ્રનાના પગે બેડી ને માથે મુડો. મોઢે નવકાર અંત્ર ને આંખે ચોધાર

વહાણું વાતાં પ્રધાન અભયકુમારને પોલાવ્યા. અને તેમને આજા કરી ડે ‘મારું અંતઃપુર બગડી ગયું છે. માટે તેને બાળી મૂક. ખખરદાર ! માનો પ્રેમ વર્ચ્યે લાલીશ નહિ. ’ અભયકુમાર કહે, ‘ જીવી પિતાની આજા. ’ અરાધર આજ વખતે નગર બહાર બગડીયામાં પ્રલુબ મહાવીર પધાર્યો. એટલે એણિક રાજ તેમના દર્શન કરવા ગયા.

અભયકુમારે વિચાર્ય: ‘ પિતાજ કાંઈક ગુર્સામાં આવી ગયા છે. નહિતર આવો ફુકમ ન કરે ! મારી ઘંધી માતાઓ સ્વભાવથીજ સતીઓ છે. તેમાં કલંક હોય નહિ. નક્કી પોતાની કાંઈક ગેરસમજ થઈ હશે. માટે સાહસ તો નજ કરવું. ’

તેણે હાથીખાના પાસેની થાડી આરડીઓ સળગાવી અને ગામમાં પડાવી ઘૂમાં રાખતું અંતઃપુર સળગયું, અંતઃપુર સળગયું !

એણિક પ્રલુબને વંદન કર્યું. પછી સવાલ પૂછ્યો, ‘ પ્રલુબ ! ચૈક્ષણ્ણાને એક પતિ છે કે અનેક ? ’ પ્રલુબ કહે, ‘ એક. હે એણિક ! એ સતી પર ડાઈપણું જતનો

૪ :

આજે પાંચ માસ ને પચીસ દિવસ થયા  
કૌશાભીમાં ઢાઈ મહાયોગી બિક્ષા માટે કેરી રવ્યા છે.  
માણુસો બિક્ષા આપવા આવે છે પણ તે યોગી બિક્ષા  
દેનાર સામું બેઇનેજ પાછા કરે છે !

એમ હેમ ? શા માટે બિક્ષા નહિ લેતા હોય ?

તેમણે કાંઈક નિશ્ચય કર્યો હોય તેમ જણાય છે કે  
અમુક પ્રકારની જ બિક્ષા મળે તો લેવી. ”

એવો તે શો નિશ્ચય છે :

અરે ! ખસુ આકરો !

“ ઢાઈ સતી ને સુદર રાજકુમારી દાસી બનેલી  
હોય, પગમાં લોઢાની બેડીઓ હોય, માથે મુંડો કરા-  
યો હોય, ભૂખી હોય, રોતી હોય, એક પગ અંદર ને  
એક પગ જાંખરાની અહાર રાખી બેઠી હોય, તેવી જી  
સુપરાને એક ઝુણેથી જે અડદના બાકળા વહોરાને  
તોજ બિક્ષા લેવી.

અહા ! ફેટલો આકરો નિશ્ચય !

નગરમાં રાજરાણી ને સહુ લોક ઈચ્�ે છે કે હવે  
યોગીરાજને પારણું થાય તો સારું.

તેઓ આજે પણ નગરમાં બિક્ષાને માટે આવેલા  
છે. ચંદ્રના ઉપર પ્રમાણે વિચાર કરે છે ત્યાં તો યોગી-  
રાજ પધાર્યા. તેમણે જેયું તો ખંડી શરતો બરાબર  
પણ એક શરત અધુરી. ચંદ્રનાની આંખમાં આંસુ  
નહિ એટલે તે પાછા કર્યો.

ચંદ્રનાથાળાએ જેયું હું અતિથિ આવીને બિક્ષા  
દીધા વિના પાછા જય છે એટલે તેને ધયુંજ હુઃઘ  
થયું. આંખમાં આંસુ લાવીને બોલવા લાગી:  
“કૃપાનાથ ! પાછા ડેમ જાઓ છો ? મારા પર કૃપા  
કરો ! આ અડદના બાકળા અહણું કરો ! શું મને  
આટલો લાભ નહિ મળો ? ” તે યોગીરાજ જેયું  
હું ચંદ્રનાની આંખમાં આંસુ છે એટલે એમણે પોતાનો  
હાથ લાંબો કર્યો. ચંદ્રનાએ તેમને અડદના બાકળા  
વહોરાયા.

આ ગોળીરાજ તે ઢાણુઃ ?

મહાયોગી પ્રભુ મહાવીર.

આ જ ક્ષણે ચંદ્નખાળાની બેડીએ તૂટી ગઈ. માથે સુંદર ચોટલો થયો. કુદરતમાં સધળે આનંદ છવાયો.

શેઠ લુહારને વેરથી પાણ આવ્યા ત્યાં ચંદ્નખાળાને પહેલાંના જેવી જેઈ ખૂબ હરખાયા.

એટલામાં પિયર ગયેલાં ભૂણા શેઠાણું ત્યાં આવી પહોંચ્યાં. ને આ બધું જેઈ કિચારમાં પડ્યાં.

ચંદ્નખાળા બંનેને પગે લાગ્યાં. પછી ભૂણા માતાને કહેવા લાગ્યાં : “ માતા ! આપનો મારા પર મોટા ઉપકાર થયો. નણ જગતના નાથ પ્રભુ મહાવીરને મારે હાથે પારણું થયું. ”

નગરના લોડાને આ વાતની ખખર પડી. એટલે તેમનાં ટાળેટાળાં આવવા લાગ્યાં. રાઝરાણી પણ ત્યાં આવ્યાં અને ચંદ્નખાળાને ધન્યવાદ દેવા લાગ્યાં.

સહુ ધન્યવાદનો વરસાદ વરસાવે છે ત્યાં એક

સિપાઈ આવી ચંદ્રનાથાળાને પગે પડ્યો અને રડવા લાગ્યો.

સહુએ પૂછ્યું: “ અરે ! આનંદના વખતે તું રડે છે કેમ ” ? તે બોલ્યો: “ આ તો રાજકુમારી વસુભતી ! ચંપાનગરીના રાજ દ્વિવાહનની ધારિણી રાણીની પુત્રી ! કયાં તેનો વૈભવ ને કયાં આજની ગુલામી દરશા ! હું તેમનો સેવક હતો. ચંપા ભાંગી લારે શતાનિક રાજ મને પકડી લાવ્યા અને તેથી મને ખૂબ હુઃખ થયું. પણ આ રાજકુંવરી આગળ મારું હુઃખ શાહિસાખમાં છે ? ”

રાજરાણી આ સાંભળી આશ્ર્ય પામ્યાં. શતાનિક રાજની રાણી બોલીઃ “ અરે ! ધારિણી તો મારે બહેન થાય ! તેની પુત્રી એટલે મારી પુત્રી. ચાલ પુત્રી ! ચાલ ! મારી સાથે રહે ને આનંદ કર ! ”

ચંદ્રનાથાળા મુગાવતી સાથે રાજમહેલમાં ગયાં.

પણ ત્યાં વહાલી માતા યાદ આવી. તેની મધુરી

વાણી યાહ આવી. “રાજમહેલનાં સુખ તો ચાર દિવસનાં ચટકાં છે. તેમાં એ શાન્તિ ક્યાંથી હોય જે જિનેકરના સુખ ઉપર દેખાય છે. અહો! તેમના નામથી દુઃખના દરિયામાં ડૂષેલાને પણ શાંતિ મળે છે. એઠા ! એમતું પવિત્ર નામ કઢી વિસરીય નહિ !”

ચંદ્રનાણ રાજમહેલમાં રહે, પણ તેમતું મન મહા-  
વીરનાજ ધ્યાનમાં. ન ત્યાંના ધરેણું ગાંડામાં લોભાય, ન  
ત્યાંના મેવા મીડાઈમાં. ન ત્યાંના બાગબગીયામાં લોભાય,  
ન ત્યાંના નોકર ચાકરમાં. એ તો સદાયે સુખમાં વીર !  
વીર ! વીર !

તેમને વીરના જીવનનો રંગ લાગ્યો. પણ વીરને હજુ  
કેવળજ્ઞાન થયું નથી. એટલે ડાઇને ઉપદેશ દેતા નથી.  
ડાઇને શિષ્ય ફરતા નથી. ચંદ્રનાણ કેવળ જ્ઞાનની  
રાહ જોતાં પવિત્ર જીવન ગાળવા લાગ્યા.

થોડા વખત પછી પ્રભુ મહાવીરને કેવળજ્ઞાન થયું.  
એટલે ચંદ્રનાણાના મનોરથ પૂરા થયા. તેમણે પ્રભુ  
મહાવીરની આગળ દીક્ષા લીધી.

એજ પ્રશ્ન મહાવીરનાં પહેલાં ને સુધ્ય સાધ્વી.

તેમણે આકરાં તપ કર્યાં. દોષલાં સંજમ ધારણ  
કર્યાં. અને એમ કરીને મન, વચન, કાયાને પૂરાં  
પવિત્ર બનાવ્યાં.

અનેક રાજરાણીઓ અને બીજી ઝીઓ તેમની  
શિષ્યાખની. છત્રીસ હજર સાધ્વીઓમાંને વડેરાં બન્યાં.

આયુષ્ય પુરુ થતાં મહાસત્તી ચંદ્રભાગા નિર્વિષુ  
પાગ્યાં. ધન્ય છે તેમનાં શીયગ, તપ અને ત્યાગને !

એમના જેટલા ગુણ ગાઇએ તેટલાં એછાં છે.

દરેક બહેન ચંદ્રભાગાના જીવનને સમજે તથા  
આદરે અને એમની પેડે પોતાના આત્માનું કલ્યાણ  
કરે !



બાળ અન્ધાવળી : પ્રથમ શ્રેણી : ૧૦

# ધલાયીકુમાર

દેખક :

ધીરજલાલ ટોકરશી શાહ



સર્વ હક્ક સ્વાධીન :

આવृત્તિ ચોથી : કુલ નકલ ૪૫૦૦ : સં. ૧૬૬૧

મૂલ્ય સરાચાનો.

ઃ : પ્રમાણઃ : :

ધીરજલાલ ટોકરશી શાહ  
જ્યોતિ કા ર્યા લ થ  
રતનપોળ, અમદાવાદ.

---

આ પુસ્તક મુખ્ય ખલાકા કેળવણી  
ખાતા તથા વડોદરા રાજ્ય કેળવણી  
ખાતા તરફથી છનામ લાયથેરી માટે  
ઃ ; મંજુર થયું છે. : :

---

ઃ : સુદક : :

મહિલાલ છગનલાલ શાહ  
ધી ‘વીરવિજય’ પ્રો-ન્યાંગ પ્રેસ  
સાગરની ખડકી, રતનપોળ:  
અમદાવાદ.

# ઇલાચીકુમાર

: ૧ :

ઢીંગ ઢીંગ ઢમ, ઢીંગ ઢીંગ ઢમ, ડોલડ  
વાગવા લાગી.

પીઠિંદ્રિંજ પીઠિંદ્રિંજ પીઠિંજ શરણુંજ  
બોલવા લાગી.

થાડીવારમાં વાંસ ખોડાયા ને તે પર  
નટનાં દોરડાં બંધાવાં.

‘ એય ભલા ! એય ભલા ! ’ કરતાં  
નટ લોકા તેના ઉપર ખેલ કરવા લાગ્યા.

ઇલાવર્ધન નગરના લોકા આ ખેલ  
જોવા નગરના ચોકમાં ટોળે મજ્યા. આ ચોકના  
માથે મોટી મનોહર મહેલાતો છે. તેને સુંદર  
તર્ફા છે. નાજુક ગોખ છે. તેની બીતો ને  
છતો કારીગરીને ભંડાર છે. ધનથી છલકતો

ધનદાત શેડ તેમાં રહે છે. તેને એક નવજીવાન દીકરો છે. તેનું નામ ઇલાચી.

નટને મેડી નીચે રમતાં જેઠ ગોખમાં ડાક્યું કર્યું.

ત્યાં શું જેયું ?

એક નટે પગે જમૈયા બાંધ્યા છે. એ હાથે વાંસ પકડ્યો છે ને દોરડા પર ચાલી રહ્યો છે. નીચે નટનું ટાળું ' એય ભલા ! એય ભલા ! ' બાંદી રહ્યું છે. એ ટાળામાં એક નવજીવાન કન્યા છે. ઇપું ઇપનો તે ભંડાર છે.

ઇલાચી તેને જેતાં હરી ગયો. આ તે દ્વી હરો કે અપ્સરા ? આવું ઇપું તો મેં ભાઈ દિવસ જેયું જ નથી. ઇલાચી તેને ધારી ધારી જેવા લાગ્યો. અને મનમાં નક્કી કર્યું કે પરણું તો આ કન્યાને જ પરણું.

: ૨ :

જમવાનો સમય થયો પણ ઇલાચી આવ્યો નહિ. ધનદાત શેડ તપાસ કરવા જિઠયા કે ઇલાચી કર્યાં છે ?

ભાઈ એક ખૂણામાં જેમ તેમ સ્કૂતા છે. મોઢું તદ્દન જિતરી ગયું છે.

ધનદત શેઠ પૂછ્યું : ‘ઇલાચી ! છે શું ?  
આજ તું આટલો અધ્યા દ્વિલગીર ડેમ ? ’

તેણે દ્વિલ એલીને વાત કરીઃ ‘પિતાજ !  
ગામમાં નટ લોક રમવા આવ્યા છે. તેમને  
એક જુવાન કન્યા છે. અહા ! શું તેનું ઇપ ! તે  
મને પરણાવો.’

ધનદત શેઠ કહે : ‘ગાંડા ! આવી લત  
તે કયાંથી લાગી ? નટીને તે આપણું ધરમાં  
ધલાય ? કયાં આપણી નાત ! કયાં નટની  
નાત ! આપણી નાતમાં ધર્ણી કન્યાઓ છે.  
તેમાંથી તું કહે તેને પરણાવું.’

પિતાના આવા વિચાર સાંબળી ઇલાચી  
કાંઈ એલ્યો નહિ.

સાંજ ખાંડું ન ખાંડું ને જિઠી ગયો.  
રાતે નટને છાનામાના એલાચ્યા અને વાત  
કરીઃ ‘માગો તેટલું ધન આપું પણ તમારી  
કન્યા પરણાવો.’

નટ કહે, ‘ અનનદાતા ! કન્યાને અમે  
વેચવા નથી લાંયા. ધન તો આજ છે ને કાલ  
નથી. કાંઈ રતન જેવી દીકરી એમ અપાય ?  
વળી તમને કન્યા આપીએ તો અમારા કુળને  
એખ લાગે.’

ઇલાચી કહે, ‘એ હવી રીતે ? હું તો હું વાણિયો ને તમે છો નટો.’

નટ કહે, ‘ શેઠ ! તમે ગમે તેવા પણ કાયરની જત. ને અમે ગમે તેવા પણ સાહસિક. સાહસિકની કન્યા કાયરને ન મળો.’

ઇલાચી કહે, ‘ ડાઈ પણ રીતે તમારી કન્યા મને પરણુંબો ખરા ? ’

નટ કહ્યું: ‘ હા. એક રીત છે. તમે પણ અમારા જેવા નટ બનો. અને અમારી વિદ્યામાં કુરીણ થાઓ. પછી ઐલ કરીને ડાઈ રાજને રીતુંબો. તે જે ભેટ આપે તેનાથી અમારી નાતને જમાડો તો અમારી કન્યા આપીએ.’

ઇલાચી કહે, ‘ કષૂલ ! કષૂલ ! હું તે પ્રમાણે કરીશ ને તમારી કન્યા પરણુંશા.

: ૩ :

રાત ૫૩. સહુ જીવજંત જંપી ગયાં.  
સધજું સુનસુનાકાર થઈ ગયું.

ઇલાચી એ વખતે જોડ્યો. કપડાં

પહેરીને તૈયાર થયો. નથી ડાઇ બગતું કે નથી ડાઇ સસળતું.

જ્યાં જવા માટે ડગલું ભર્યું ત્યાં  
માખાપ યાદ આવ્યાં : ‘અહા ! વહાલી માતા !  
પ્રેમાળ પિતા ! તે જણશે કે ઇલાચી નાશી  
ગયો છે તો તેમને ડેવું ફુઃખ થશે ? માટે આવી  
રીતે ચાલ્યા તો ન જવું.’ તે પાછો ફર્યો. ત્યાં તો  
દ્વિસે એચેલી નટકન્યા યાદ આવી. ‘અહા ડેવું  
રૂપ ! ગમે તેમ થાય પણ આ કન્યાને તો  
પરણું. માખાપને થોડા દ્વિસ ફુઃખ તો થશે.  
પણ પણી બધું વિસરી જશે. ચાલ જઈને  
નટ લોડાને મળું !’

આમ વિચારી ઇલાચી ચાલવા મંડયો.  
નટના ટોળાને જધ મજ્યો. નટલોક વહેલા ઓઠી  
એ નગરમાંથી ચાલ્યા ગયા.

: ૪ :

ઇલાચીએ બધી પોશાક બદલી નાખ્યો.  
મલમલના ફંડકડતા અંગરખાની જગાએ ગળતું

અડું લક્ષ ડેડિયું પહેંચું. રેશમી ધોતિયાને બદ્દલે  
અડો મજનો ચોરણો પહેંચે. માયેથી મૂલવંતી  
પાંધડી જીતારી મોડું બદું ક્રીડલ વીટયું. ગળામાં  
નટ લોકો જેવી માળાએ પહેરી. ગાઈ કાલનો  
કોડાધિપતિનો પુત્ર આજે બરાભર નટ બની ગયો.

તેણે ધીમે ધીમે નટવિદ્યા શીખવા માંડી.  
જાંધી ને ચત્તી ગુલાંટા ખાવી. એકપગે ફુદકા  
મારવા ને પગે વાંસ બાંધીને ચાલવું. આ કાંધ  
જેવું તેવું કામ નહિ ! પણ ઇલાચીના દિલમાં  
કામ શીખવાનો લારે ઉમંગ છે. એટલે એક  
વરસમાં એ બદું શીખી ગયો. પછી શીખ્યો  
દોરડાની રમત. ડેવી સુંદર ! ડેવી અદ્ભુત !  
કોઈ પણ જતના ટેકા સિવાય દોરડા પર  
ચાલ્યા જવું ને મોટા મોટા ફુદકા મારવા !  
પગે શીંગડા કે જમૈયા બાંધીને દોરડા પર  
ચાલ્યા જવું ! ત્યાર બાદ જનાવરોને લડાવવાની  
તથા બીજી પણ ધર્હી રમતો શીખ્યો.

ગામે ગામ તે નટ લોકો સાથે ફરે છે.

ને પોતાની કળા બતાવે છે. પેલી નટકન્યા પણ સાથે જ છે.

ઇલાચીને તેના પર અપાર પ્રેમ છે. જણે જળ ને માધદી ! ચાતક ને મેહ ! અને જેથા વિના ધડી ચેન પડતું નથી ! નટકન્યાને પણ તેના પર અપાર પ્રેમ થયો છે. જણે પોતાને માટે ધરભાર છોડ્યાં, માતાપિતા છોડ્યાં, ધન વૈસવ છોડ્યાં, તેના પર પ્રેમ ડેમ ન થાય ? પણ હજુ તેમનાં લગ્ન થયાં નથી. થાય તેમ નથી. ઇલાચી જ્યારે ઢોઈ રાજને રીતવી નાત જમાડે ત્યારે જ લગ્ન થઈ શકે એમ છે !

આ વાતને ખાર ખાર વર્ષનાં વહાણું વીતી ગયાં. હવે ઇલાચીકુમાર રાજને રીતવી શકે એવી નટવિદ્યા શીખી ગયો છે. તેણે વિચાર કર્યો કે ‘લાવ, હવે એનાતટ નગર જાઉં ને લાંના રાજને રીતવું.’ અને બધા નટો ગામનગરો વટાવતા એનાતટ નગરે ગયા.

: ૫ :

ઇલાચીએ રાજની સુલાકાત લીધી.

રાજ કહે, ‘પધારો નાયક ! તમને જોઈ  
બહુ આનંદ થયો. અહીં તમારી અધી વિધા  
બતાવો. જે અમારું મન રીતવશો તો તમને  
મોકું ઈનામ આપીશ.’

દરખારગઢના ચોકમાં ઇલાચીએ એવની તૈયારી  
કરવા માંડી. પ્રથમ જમીન સાફ્ટસ્ક્રોફ કરી ને  
પણી એડયા વાંસ. તેના પર દોરડાં બાંધ્યાં.

ચોકની ચારે બાજુ કનાત અંધાણી ને એકેડા  
ગોઠવાણી. તેમાં રાજ એડા, દીવાન એડા; શાહુકાર  
ને શીમાંત એડા. અવિકારીએ પણ બના એકડા  
થયા. શું શેડ, શું નોકર ! શું નાનો, શું મોણો !  
શહેર આણું એવ જેવા ભેગું થયું. રાજની અધી  
રાણીએ ઉપર ગોખમાં એસી ગંધ.

ઇલાચીના દિકમાં હમંગનો પાર નથી. ખાર  
ખાર વર્ષી સુધી કરેલાં આકરાં તપ આજે જરૂર  
ફળશે એવો. તેને દૃઢ વિશ્વાસ છે. તેણે સુંદર  
પોશાક ધારણું કર્યો. ઇષ્ટદેવતું રમરણું કર્યું.  
પણી ચોકની વર્ચે આની પોતાનો એવ શરૂ  
કર્યો. ડેવી રીતે ?

તે દોરડા ઉપર ચઢ્યો. પછી પગે પહેરી પાવડી. પછી એક હાથમાં લીધી ઢાક ને બીજી હાથમાં લીધી તરવાર. અને દોરડા પર ચાલવા માંડયું. શોંકું ચાલીને અવળો પરી ગયો. લોકા અંદર અંદર બોલવા લાગ્યાઃ ‘વાહવાહ ! વાહવાહ ! ક્રો સુંદર ખેલ છે ને !’

ઇલાચીએ બીજો ખેલ શરૂ કર્યો. પોતાના માથે એક પછી એક એમ સાત બેઠાંની હેલ ચડાવી. પછી વાંસની બોડી પર લાંબો વાંસ બાંધ્યો. અને તે ઉપર ચડ્યો. ટાચે પડોંચી તેને હુલાવવા લાગ્યો. વાંસ આમ ડાલે તેમ ડાલે પણ ઇલાચીના ભાથા પર એકું આબાદ !

લોકા આ જોઈ આશ્ર્ય પામી ગયા. રાજ હમણુંં ઈનામ આપશે, હમણુંં ઈનામ આપશે એવી રાહ જોવા લાગ્યા. પણ રાજ કંઈ બોલે નહિ !

ઇલાચીએ નીજો ખેલ શરૂ કર્યો.

પગે બાંધી કટારો અને તે કટારોની અહીનેર દોરડા પર ચાલવા લાગ્યો.

લોકા આ જોઈ રાજ રાજ થઈ ગયા.

પણ રાજ ન એલે ઉં ડેન એલે ચું.

કેમ વાર્ઝ? શું આવા એલ રાજને પસંદ  
નહિ પડતા હોય?

ના રે! ના. રાજ તો આ વખતે બીજોજ  
વિચાર કરે છે. તેણે નીચે જભેલી પેદી નટકન્યાને  
અછ છે. તેના રૂપમાં મોહી પડ્યો છે. તે એમ  
વિચાર કરે છે કે આ નટ જે હોરડા પરથી  
પડે ને ભરી જય તો આ કન્યાને પરણી શકાય.  
માટે કરવા દો ને એલ. એમ કરતાં એઈએ પડે  
છે અને ભરે છે!

નટકન્યા નીચે જભી વિચાર કરે છે: ‘અહો!  
ઈલાચીએ મારા માટે માતાપિતાને છોડ્યાં. રિષ્ટિ-  
સિષ્ટિ છાડી. પોતાને હાથે અનેકને ઢાન દેતો  
તે આજે ઢાન લેવા હાથ લાંબો કરે છે. હવે  
રાજ પ્રસન્ન થઇને અને છનામ આપે તો સારું.  
મારા પિતા તેની સાથે જલ્દી મારાં લગ્ન કરે  
અને હું તેની સાથે સુખમાં રહી દિવસો પસાર કરું.’

ઈલાચી હોરડા પરથી નીચે જિતરી રાજને

પગે લાગ્યો. રાજ કહે: ‘ નટરાજ ! તમે બહુ અતુર છો, પણ મેં તમારો ખેલ જેયો નથી. મારું મન રાજકોણના વિચારમાં રોકાયું હતું.

ઇલાચી ઇરીથી ખેલ કરવા માંડ્યો. નટ લોડો જેરથી પોતાના ઢોલ વગાડવા લાગ્યા. ‘ એય ભલા ! એય ભલા ! ’ કહી તેને શૂર ચડાવવા લાગ્યા. ઇલાચીએ અદ્ભુત ખેલ કર્યો. પણી નીચે અતરી રાજને સલામ ભરી. રાજએ કહ્યું: ‘ નાયક ! તમે ખેલ કરવા માંડ્યો ને હું જરા વાતે વળ્યો. તમારો ખેલ જેવાયો નહિ. પ્રરી ખેલ કરો. આ વખતે ધ્યાનથી જોઈશ.’

ઇલાચી ત્રીજી વખત ખેલ કરવા લાગ્યો. પણ રાજ પ્રસન્ન થયો નહિ. રાજના પેટમાં પાપ હતું હે આ ડોધ રીતે ભરે છે એટલે તે શેનો વખાણે ?

ઇલાચી નિરાશ થયો. આ જોઈ નટરીએ કહ્યું: ‘ ઇલાચી ! નિરાશ ન થાયો. થોડા સારું બધું બગાડશો નહિ. એક વખત ઇરીથી ખેલ કરીને રાજને પ્રસન્ન કરો, નહિતર આપણાં લગ્ન નહિ થાય.’

ઇલાચી ચોથી વાર દોરડે ચડ્યો. અખયબી  
પમાડે તેવા ખેલ કર્યી છતાંથે રાજ રીત્યો નહિ !

ખવા માણુસોને વહેમ પડ્યો કે રાજના  
પેટમાં કાંઈક પાપ છે. પટરાણુને પણ વહેમ  
પડ્યો કે જરૂર રાજના મનમાં કાંઈક દગો છે.

ઇલાચીની નિરાશાનો પાર રહ્યો નહિ.  
નટડી આ જોઈ બોલી: ‘ઇલાચી ! હવે એક  
વખત ખેલ કરો. કિનારે આવેલું વહ્ણાણ દુખાવશો  
નહિ. મારી આતર પણ એક વખત ખેલ કરો.’

ઇલાચીએ પાંચમી વખત ખેલ શરૂ કર્યો.  
તે વાંસની ટાચે જઈને જિભો. આ વખતે તેણે  
એક બનાવ જેયો. એક ધરના બારણે ૩૫૩૫ના  
અંખાર જેવી એક બાઇ હાથમાં રૂપાનો થાળ લઈને  
જિલ્લી ભરી છે ભીડાધ ને બીજુ સુંદર  
વસ્તુઓ. તે આચહુ કરી કરીને એક મુનિરાજને  
વહેરાવે છે. પણ મુનિરાજ તે લેતા નથી, તેમ  
પોતાની આંખ પણ જંચી કરતા નથી.

આ જેઠ ઇલાચીને વિચાર આવ્યોઃ ‘આ !  
ધન્ય છે આ મુનિને ! જેખન વય છે,

આગળ આટલી રૂપવતી સ્વી બોભી છે પણ  
તેમનું દુંવાડું પણ ફરજિયાન નથી. અને હું ? હું  
તો એક નટડીને કાને ધરખાર, ધર્મધ્યાન બધું  
છોડીને દેશદેશાવર ભટકું છું. પેલા મુનિરાજને  
એ સ્વી આચહ કરી કરીને વહોરાવે છે પણ એ  
લેતો નથી. અને હું દાન લેવાને માટે જીવના  
લેખમે આ વાંસ પર ચડીને ખેલ કરું છું.  
અને તેમ છતાં યે દાન મળતું નથી.’

‘ખરેખર ! આ મોહમાં ફેસાઈ મેં મારો  
અમૂહ્ય વખત નકામો ગાજ્યો. હવે તો હું પણ  
એ સાધુરાજ જેવો થાડું. અને એમના જીવનનો  
આનંદ અતુલતું.’

આવા વિચારો કરતાં કરતાં ઇલાચીના મનની  
પવિત્રતા એકદમ વધી ગઈ. અને તેને ખાંજ  
જગત્તનું સાચું જ્ઞાન-કેવળજ્ઞાન થયું.

અહીં નટકન્યા પણ વિચારવા લાગીઃ ‘ખણ્યું  
આ રૂપ ! આ રૂપને મોહી ઇલાચીએ ધરખાર  
છોડ્યાં અને આટલાં હુઃખ ભોગવ્યાં. વળી આ  
રાજને પણ અવળી મતિ સૂઝી. હા ! આ જીવે  
જન્મનીને શું સારું કર્યું ? હવે કયાં સુધી આવું  
જીવન જીવતું ? ચાલ હવે તો મન, વચન ને

કાયાને જીતી ભારા આત્માનું કહ્યાણું કરું. 'આવા વિચારો કરતાં તેને પણ ડેવળજ્ઞાન થયું.

રાખરાણીએ આ બનેના જીવનમાં એક-એક ફેરફાર જેયો. અને તેમને પણ પોતપોતાના જીવન સંબંધી વિચારો આવ્યા. તે વિચારોથી હૃદ્ય તદ્દન પવિત્ર થતાં તેમને પણ ડેવળજ્ઞાન થયું.

આ ચારે ડેવળજ્ઞાનીએ લાંબા વખત સુધી આ હુનિયા પર ઈર્યા. તે દરમ્યાન તેમના પવિત્ર જીવનની ધણ્ણા ઉપર અસર થઈ. તેમના અમૃત શા ઉપદેશથી ધણ્ણાનાં જીવન પલટાઈ ગયાં.

પોતાનું આયુષ્ય પૂરું થતાં તે બધા નિર્વાણ પામ્યા.

ધન્ય છે ઇલાચી જવા સાહસિક નરવીરિને !

**શિવમસ્તु સર્વજગતः ॥**

દૂરેક શાળા, પાઠશાળા તથા કુદુંએ  
આહુક થવા યોગ્ય માસિક

## જૈન શિક્ષણપત્રિકા

તંત્રી : ધીરજલાલ ટોકરશી શાહ.

વાર્ષિક લવાજમ ફેફાર રૂ. ૧). આજેજ આહુક બને.

જ્યોતિ કાર્યાલય, રતનપેણ : અમદાવાદ.

આગામિંથાવળી :: પ્રથમ અણી :: ૧૧

# જૃખુસવામી

∴ કેખક ∴

ધીરજલાલ ટોકરશી શાહ



સવે હક્કે સ્વાધીન

આધૃતિ ચોથી

પ્રત ૧૨૫૦

સંવત ૧૯૬૧

મૂલ્ય સ્વભા આનો.

ગ્રાકાશક :

ધીરજખાલ ટોકરશી શાહ  
જયેષ્ઠ કાર્યાલય  
નગરસીઠ મારકોટ, રતનપોળ,  
અ મ દા વા દ.

આ પુસ્તક સુંખ્યા છલાકા કેળવણીખાતા તથા વડોદરા રાજ્ય  
કેળવણીખાતા તરફથી છનામ-લાધભેરી માટે મંજુર થયેલું છે.  
તેમજ જૈન શ્વેત એન્યુક્ષણલ બોર્ડની ધાર્મિક પરીક્ષાના  
ખાળ ધોરણું પ્રથમ તથા કન્યા ધોરણું પ્રથમમાં પાઠ્યપુસ્તક  
તરીકે સ્વીકારાયેલું છે.  
ધી. ટો. શાહ.

∴ સુદક∴

મણુલાલ છગનલાલ શાહ.  
મુદ્દખુસ્થાન વીરવિજય ગ્રી. પ્રેસ  
કાળુપુર ટંકશાળ ∴ અમદાવાદ.

## જંબુસ્વામી.

: ૧ :

સોળ વરસનો ડેલૈયો કુંવર છે. હેમની ડિડાળા ખાટે બેઠો છે. હાથમાં હીરની દોરી છે. કડાક કડાક હિંચકા ખાય છે. એતું નામ જંબુ.

કોડાધિપતિ ઝષભદ્ધતાનો તે પુત્ર છે. તેની માતાતું નામ ધારિણી.

એકનો એક પુત્ર છે. મોટી ઉભરે થયેલો છે એટલે લાડકાડમાં બાકી રાખી નથી.

શહેરની સારામાં સારી આઠ કન્યાઓ સાથે ચોડા વખત પહેલાંજ તેતું સગપણું થયું છે.

એવામાં લાં વનપાળે આવી વધામણી ખાખી.  
‘શેઠળ ! સુધર્માસ્વામી વૈભારગિરિ ઉપર પથાર્યો છે.’

સમતાના સરોવર ને શાનના સાગર ચુકુરાજની પખરામણીથી ઢાને આનંદ ન થાય ? જંબુકુમારતું હૈયું

હરખે જીકસરાયું. ડિડોળો બંધ રાખ્યો. ગુરુ આયાની વધામણી બદ્દલ ગળામાંથી મોતીની કંઢી કાઢી વનપાળને આપી. વનપાળ રાજ થઈ ચાલ્યો ગયો.

જંબુકુમાર એલયા : “ સારથિ ! સારથિ ! રથ જોડા વૈરારગિરિ પર ગુરુરાજ પધાર્યા છે. તેમના દર્શને જવું છે. ”

કાતરણીવાળો સુંદર રથ જોડાયો. તેમાં બેસી જંબુકુમાર વૈભારગિરિ તરફ ચાલ્યા. તે રાજગૃહીની તદ્દન નજીક એટલે થોડા વખતમાં ત્યાં પહોંચ્યા.

સુધર્માસ્વામી પ્રલુ મહાવીરના ગણુષર. આખા જૈન સંધના તે વખતના નેતા. એમના ઉપદેશમાં અમૃતના વરસાદ સિવાય બીજું શું હોય ?

જંબુકુમાર એમને વંદન કરી ઉપદેશ સાંભળવા લાગ્યા. જેમ જેમ ઉપદેશ સાંભળતા ગયા તેમ તેમ મન પલટાવા લાગ્યું. ઉપદેશ પૂરૈ થતાં તો જંબુકુમારનું હૈયું વૈરાગ્યથી ભરાઈ ગયું.

તે હાથ જોડીને એલયા : “ પ્રલો ! મારે દીક્ષા લેવી છે. માતાપિતાની રણ લઇને આવું ત્યાં સુધી દોકાવા કૃપા કરો. ” સુધર્માસ્વામીએ તે સ્વીકાર્યું.

રથમાં એસી જંયુકુમાર પાણા પ્રયો. જ્યાં નગરના દરવાજ પાસે આવ્યા ત્યાં લશ્કરની ઠઠ. હાથી, ધોડા ને પાયદલનો પાર નહિ. આવી લીડમાં તે શે જવાય : આટલું લશ્કર પસાર થાય ત્યાં સુધી અહીં થોખાય પણ કેમ? એટલે તે બીજ દરવાજે ચાલ્યા.

બીજ દરવાજની પાસે આવ્યા ત્યાં તો એક જખરદસ્ત લોઢાનો ગોળો ધખ લઈને પગ પાસે પડ્યો. સિપાઈએ લડાઇની તાલીમ લેતા હતા, ત્યાંથી ગોળો આવ્યો હતો. આ જેછ જંયુકુમાર વિચારવા લાગ્યા : “ અહો ! આ લોઢાનો ગોળો મારા પર પડ્યો હોત તો શી વલે થાત ? આવા અપવિન શરીરેજ હું હમણું ભરણ પામત, માટે ચાલ અત્યારેજ ગુરુ આગળ જઈ પ્રતિજ્ઞા લઈ આવું . ”

તે સુધર્માસ્વામી આગળ આવ્યા. હાથ જેડીને ચાલ્યા : “ સ્વામી ! જીવું લાં સુધી અભયર્થ પાળવાનું વ્રત આપો ! ” સુધર્માસ્વામીએ વત આપ્યું.

આ વ્રત લઈ ભનમાં હરખ પામતા જંયુકુમાર ધેર આવ્યા. માતાપિતા આગળ દીક્ષા લેવાની રાં માગી.

માણાપ બોલ્યાઃ “એઠા ! ચારિન લેવું ખૂબ દોષદું  
છે. વત ખાંડાની ધાર જેવું છે. તું તો હજુ આગારાન  
કહેવાય. તારાથી સાધુનાં આકરાં વતો ડેમ પળાશે ?  
વળી તારા વિના અમને ધડીયે ગોઠે નહિ. ”

જંયુકુમાર બોલ્યા : “ પૂજ્ય માતાપિતા ! ચારિન  
ખુબ દોષદું છે એ વાત ખરી. પણ તેનાથી તો  
કાયરજ ડરે. હું તમારી કૂઘે જનર્યો છું. વત લધને  
જીવ જતાં પણ ભાંગીશ નહિ. આપનું હેત મારા પર  
અપાર છે. એટલે મારા વિના આપને નજ ગોઠે. પણ  
એવા વિનેગતું હુઃખ સહન કર્યા વિના છુટકો નથી.  
માટે મને રાજ થધને આજા આપો ! ”

માણાપ કહે, “ પુત્ર ! જે તને સંજમ લેવાની  
ખૂબ ઇચ્છા હોય તોપણું અમારું માન રાખ. અમે  
પણ તારા વડીલો છીએ. તારા માટે જે કન્યાએ અમે  
સ્વીકારી છે તેની સાથે લગ્ન કર. પછી તારી ઇચ્છા  
હોય તો સુઝેથી દીક્ષા લેજ. ”

જંયુકુમારે કહ્યું : “ આપની આજા હું માથે ચડા-  
વીશ. પણ પછી મને દીક્ષાથી આપ રોકશો નહિ. ”

માણાપે કહ્યું : “ ખુબ સારુ. ”

: ૨ :

કુષાદતે આઠે કન્યાઓના પિતાને બોલાવ્યા.  
અને કહ્યું : ” અમારો જંયુ પરણુને તરત દીક્ષા લેવાનો  
છે. એ પરણે છે તે પણ અમારા આશુધીજ. માટે  
આપને જે કંઈ વિચાર કરવો હોય તે કરો ! પાછળથી  
અમને કંઈ કહેશો નહિ. ”

પોતાના પિતાને વિચારમાં પડેલા જેઈ તે કન્યા-  
આએ કહ્યું : “ પિતાજ ! આપને ચિંતા કરવાની કંઈ  
જરૂર નથી. અમે તો જંયુકુમારને વરી ચૂકી છીએ.  
હવે જેમ તે કરશે તેમ અમે પણ કરીશું. ”

કન્યાઓના આવો નિશ્ચય થયો એટલે સાત  
દિવસની વરધે લગ્ન છપાયાં.

જંયુકુમારના વિવાહમાં શી મણૂ હોય ?  
વિશાળ મંડપ બંધાયો. તેને અનેકઅતનાં ચિત્રો  
ને તોરણુ વગેરેથી શાણુગાર્યો. સાતમે દિવસ જંયુ-  
કુમાર ત્યાં ખૂબ ધામધૂમથી આઠે કન્યાઓને પરણ્યા.  
રાજયુહી નગરીમાં આટલા ઠાડથી બીજાં લગ્ન ખુલ્લુ  
આછાં થયાં હશે.

પરણ્યાની પહેલીજ રાતં, જંયુકુમાર પોતાની પત્નીએ સાથે રંગશાળા ( સુવાનો એરડો ) માં ગયા.

રંગશાળાનો અપડો કૃધિં કહેવાય નહિ ! અલભલાનાં તે ચિત્ત ચણાવી દે ! શું ત્યાંનાં ચિત્રો ! શું ત્યાંની મોજશોખની સામચ્રી !

જુવાન વય, રાત્રિની એકાંત ને પોતાની પરણ્યેલી જુવાન પત્નીએ પાસે ! પણ જંયુકુમારનું ચિત્ત ચળતું નથી !

: ૩ :

રાજગૃહીથી થાડે છેટે એક ચોટો વડલો છે. ધનધોર તેની છાયા છે. વડવાઠનો ત્યાં પાર નથી. તેની છાયામાં બરાબર સાંજ પડતાં એક પઢી એક માણુસો આવવા લાગ્યાં. બધાએ બુકાનીએ બાંધેલી. શરીર પર રાખોડી રંગનાં કપડાં એટલાં.

આ બધામાં કદાવર કાયાનો એક જુવાન. કરડી તેની આંખો. વિકરાળ તેનું ચેં. બધા માણુસો બેગા થયા એટલે તે બોલ્યો : “ દોસ્તો ! આજસુધી આપણે ધણી ચોરીએ કરી છે. છતાં જોઈએ તેટલા ફાંયા નથી. પણ આજ જખખર લાગ મજયો છે. ”

: ૨ :

મંડખલદતે આઠે કન્યાઓના પિતાને બોલાવ્યા. અને કહ્યું: ” અમારો જંયુ પરણીને તરત દીક્ષા લેવાનો છે. એ પરણે છે તે પણ અમારા આગ્રહથીજ. માટે આપને જે કંઈ વિચાર કરવો હોય તે કરો ! પાછળથી અમને કાંઈ કહેશો નહિ. ”

પિતાના પિતાને વિચારમાં પડેલા બેઈ તે કન્યા-ઓએ કહ્યું: “ પિતાજ ! આપને ચિંતા કરવાની કંઈ જરૂર નથી. અમે તો જંયુકુમારને વરી ચૂકી છીએ. હવે જેમ તે કરશે તેમ અમે પણ કરીશું. ”

કન્યાઓનો આવો નિશ્ચય થયો એટલે સાત દિવસની વરધે લગ્ન છયાયાં.

જંયુકુમારના વિવાહમાં શ્રી મણા હોય ? વિશાળ મંડપ બંધાયો. તેને અનેકઅતનાં ચિન્તા ન તોરણ વગેરેથી શાણગાર્યો. સાતમે દિવસ જંયુ-કુમાર ત્યાં ખૂબ ધામધૂમથી આઠે કન્યાઓને પરણ્યા. રાજગૃહી નગરીમાં આટલા ઠાડથી બીજાં લગ્ન ખુલ્લુ આછાં થયાં હશે.

માણાપ બોલ્યા : “ એટા ! ચારિત્ર લેવું ખૂબ દોષથું છે. પ્રતિ ખાંડાની ધાર જેવું છે. તું તો હજુ બાળારાનું કહેવાય. તારાથી સાથુનાં આકરાં પ્રતો ડેમ પળાશે ? વળી તારા વિના અમને ધરીયે ગોઠે નહિ. ”

જંયુકુમાર બોલ્યા : “ પૂજ્ય માતાપિતા ! ચારિત્ર ખસું દોષથું છે એ વાત ખરી. પણ તેનાથી તો કાયરજ ડરે. હું તમારી ફ્રેન્ઝે જનર્ભેયો હું. પ્રતિ લઘને જીવ જતાં પણ ભાંગીશ નહિ. આપનું હેત મારા પર અપાર છે. એટલે મારા વિના આપને નજ ગોઠે. પણ એવા વિનેગતનું હુઃખ સહન કર્યા વિના છૂટકો નથી. માટે મને રાજુ થધને આજી આપો ! ”

માણાપ કહે, “ પુત્ર ! જે તને સંજમ લેવાની ખૂબ ધર્યા હોય તો પણ અમારું માન રાખ. અમે પણ તારા વડીલો છીએ. તારા માટે જે કન્યાએ અમે સ્વીકારી છે તેની સાથે લગ્ન કર. પછી તારી ધર્યા હોય તો સુખેથી દીક્ષા લેજ. ”

જંયુકુમારે કહ્યું : “ આપની આજી હું માથે ચડા-વીશ. પણ પછી મને દીક્ષાથી આપ રોકશો નહિ. ”

માણાપે કહ્યું : “ ખસું સારુ. ”

રથમાં એસી જંબુકુમાર પાછા પ્રયો. જ્યાં નગરના દરવાજ પાસે આવ્યા ત્યાં લશકરની ઠઠ. હાથી, ઘોડા ને પાયદલનો પાર નહિ. આવી ભીડમાં તે શે જવાય : આટલું લશકર પસાર થાય ત્યાં સુધી અહીં થોભાય પણ હેમ? એટલે તે ખીજ દરવાજે ચાલ્યા.

ખીજ દરવાજની પાસે આવ્યા ત્યાં તો એક જખરદસ્ત લોઢાનો ગોળો ધખ લઈને પગ પાસે પડ્યો. સિપાઈએ લડાઇની તાલીમ લેતા હતા, ત્યાંથી ગોળો આવ્યો હતો. આ જેણ જંબુકુમાર વિચારવા લાગ્યા : “ અહો ! આ લોઢાનો ગોળો મારા પર પડ્યો હોત તો શી વિદે થાત ? આવા અપવિત્ર શરીરેજ હું હમણું મરણ પામત, માટે ચાલ અત્યારેજ ગુરુ આગળ જઈ અતિજ્ઞા લઈ આવું . ”

તે સુધર્મસ્વામી આગળ આવ્યા. હાથ જેડીને બાલ્યા : “ સ્વામી ! જીવું લાં સુધી પ્રભાર્ય પાળવાનું વત આપો ! ” સુધર્મસ્વામીએ વત આપ્યું.

આ વત લઈ મનમાં હરણ પામતા જંબુકુમાર ધેર આવ્યા. માતાપિતા આગળ દીક્ષા લેવાની રંજ માગી.

હરએ જિબરાયું. હિડેણો બંધ રાખ્યો. ગુરુ આંયાની વધામણી બદલ ગળામાંથી મોતીની કંઠી કાઢી વનપાળને આપી. વનપાળ રાજ થઈ ચાહ્યો ગયે.

જંબુકુમાર એલયા : “સારથિ ! સારથિ ! રથ જોડા ! વૈરારગિરિ પર ગુરરાજ પદ્ધાર્યા છે. તેમના દર્શને જવું છે. ”

ડેટરણીવાળો સુંદર રથ જોડાયો. તેમાં બેસી જંબુકુમાર વૈભારગિરિ તરફ ચાહ્યા. તે રાજગૃહીની તદ્દન નજીક એટલે થોડા વખતમાં ત્યાં પહોંચ્યા.

સુધર્માસ્વામી પ્રલુ મહાવીરના ગણુધર. આખા જૈન સંધના તે વખતના નેતા. એમના ઉપદેશમાં અભૂતના વરસાદ સિવાય બીજું શું હોય ?

જંબુકુમાર એમને વંદન કરી ઉપદેશ સાંભળવા લાગ્યા. જેમ જેમ ઉપદેશ સાંભળતા ગયા તેમ તેમ મન પલટાવા લાગ્યું. ઉપદેશ પૂરો થતાં તો જંબુકુમારનું હૈયું વૈરાગ્યથી ભરાઈ ગયું.

તે હાથ જોડીને એલયા : “ પ્રભો ! મારે દીક્ષા લેવી છે. માતાપિતાની રાજ લઇને આવું ત્યાં સુધી શકાવા કૃપા કરો. ” સુધર્માસ્વામીએ તે સ્વીકાર્યું.

## જંયુસ્વામી.

: ૧ :

સોળ વરસનો કેલૈથો કુંવર છે. હેમની હિડેળા  
આટ બેઠો છે. હાથમાં હીરની દોરી છે. કડાક કડાક  
હિંચકા ખાય છે. એતું નામ જંયુ.

કોડાધિપતિ ઋષભદ્રતનો તે પુત્ર છે. તેની  
માતાતું નામ ધારિણી.

એકનો એક પુત્ર છે. મોટી ઉમ્મરે થયેલો છે  
એટલે લાડકાડમાં બાકી રાખી નથી.

શહેરની સારામાં સારી આઠ કન્યાઓ સાથે થોડા  
વખત પહેલાંજ તેનું સગપણ થયું છે.

એવામાં લાં વનપાળે આવી વધામણી ખાધી.  
'શેઠળ ! સુધર્મસ્વામી વૈભારગિરિ ઉપર પધાર્યા છે.'

સમતાના સરોવર ને શાનના સાગર ગુરુરાજની  
પધરામણીથી ઢાને આનંદ ન થાય ? જંયુકુમારતું હૈયું

પ્રકાશક :

ધીરજલાલ ટોકરશી શાહ  
**નયોત્તિકાર્યાલય**  
 નગરશેડ મારકોટ, રતનપોળ,  
 અ અ દા વા દ.

આ પુસ્તક સુંબદ્ધ છલાકા કેળવણીખાતા તથા વડોદરા રાજ્ય  
 કેળવણીખાતા તરફથી છનામ-લાઇસેરી માટે મંજુર થયેલું છે.  
 તેમજ જૈન શ્વેત એન્યુકેશનલ એર્ડની ધાર્મિક પરીક્ષાના  
 બાળ ધોરણ પ્રથમ તથા કન્યા ધોરણ પ્રથમમાં પાઠ્યપુસ્તક  
 તરીકે સ્વીકારાયેલું છે.

ધી. ટો. શાહ.

∴ સુદ્રક∴

મણિલાલ છગનલાલ શાહ.  
 મુશ્યુસ્થાન વીરવિજય પ્રી. પ્રેસ  
 કાળુપુર ટંકશાળ ∴ અમદાવાદ.

બાળબંધાવળી :: પ્રથમ અણી :: ૧૧

# જુખુસવામી

∴ લેખક ∴

ધીરજલાલ ટોકરશી શાહ



સર્વ હક્ક સ્વામીન

આવતી ચોથી

પ્રત ૧૨૫૦

સંવત ૧૯૬૧

મૃહ્ય સબા આનો.

કાયાને જીતી મારા આત્માનું કહ્યાણુ કરું. 'આવા  
વિચારો કરતાં તેને પણ ડેવળજ્ઞાન થયું.

રાખરાણીએ આ બનેના જીવનમાં એક-  
એક ફેરફાર જેચે. અને તેમને પણ પોતપોતાના  
જીવન સંબંધી વિચારો આવ્યા. તે વિચારેથી  
દૃદ્ધ તદ્દન પવિત્ર થતાં તેમને પણ ડેવળજ્ઞાન થયું.

આ ચારે ડેવળજ્ઞાનીએ લાંબા વખત  
સુધી આ હુનિયા પર ફર્યા. તે દરમ્યાન તેમના  
પવિત્ર જીવનની ધણ્ણા ઉપર અસર થઈ. તેમના  
અમૃત શા ઉપદેશથી ધણ્ણાનાં જીવન પલટાઈ ગયાં.

પોતાનું આયુષ્ય પૂરું થતાં તે બધા  
નિર્વાણ પામ્યા.

ધન્ય છે ઇલાચી જવા સાહસિક નરવીરોને !

શિવમસ્તु સર્વજગતः ॥

દોરેક શાળા, પાઠશાળા તથા કુદુંઘે  
આહુક થવા ચોગ્ય માસિક

## જૈન શિક્ષણપત્રિકા

તંત્રી : ધીરજલાલ ટોકરશી શાહ.

વાર્ષિક લખાજમ ઇકલ રૂ. ૧). આજેજ આહુક બનો.

જ્યોતિ કાર્યાલય, રતનપોળ : અમદાવાદ.

આગામિંથાવળી :: પ્રથમ બેણી :: ૧૧

# જુખુરવામી

∴ લેખક ∴

ધીરજલાલ ટોકરશી શાહ



સર્વ હઙ્ગ સ્વાધીન

આવૃત્તિ ચોથી

પ્રત ૧૨૫૦

સંવત ૧૯૮૧

મૂલ્ય સરથા આનો.

પ્રકાશક :

ધીરજલાલ ટોકરશી શાહ  
જ્યોતિ કાર્યાલય  
નગરશેઠ મારકોટ, રતનપોળ,  
અ. મ. દા. વા. ૬.

આ પુસ્તક મુખ્ય ધલાકા કેળવણીભાતા તથા વડોદરા રાજ્ય  
કેળવણીભાતા તરફ્યો ધનામ-લાઘબેરી માટે મંજુર થયેલું છે.  
તેમજ નૈન શ્વેત એનયુકેચનલ એડની ધાર્મિક પરીક્ષાના  
બાળ ધોરણું પ્રથમ તથા કન્યા ધોરણું પ્રથમમાં પાઠ્યપુસ્તક  
તરીકે સ્વીકારાયેલું છે. ધી. દા. શાહ.

∴ સુદ્રક ∴

મધ્યલાલ જગનલાલ શાહ.  
મુદ્રણુરથાન વીરવિજય ગ્રી. પ્રેસ  
કાળુપુર ટંકેશાળ ∴ અમદાવાદ.

## જંબુસ્વામી.

: ૧ :

સોળ વરસનો ડેલૈયો કુંવર છે. હેમની ડિડાળા  
ખાટ બેઠા છે. હાથમાં હીરની દોરી છે. કડાક કડાક  
હિંચકા ખાય છે. એતં નામ જંબુ.

કોડાધિપતિ ઋપભદ્રતનો તે પુત્ર છે. તેની  
માતાનું નામ ધારિણી.

એકનો એક પુત્ર છે. મેટી ઉભ્રમરે થયેલો છે  
એટલે લાડડાડમાં ખાકી રાખી નથી.

શહેરની સારામાં સારી આડ કન્યાઓ સાથે થાડા  
વખત પહેલાંજ તેતું સગપણ થયું છે.

એવામાં લાં વનપાળે આવી વધામણી ખાધી.  
'શેઠજ ! સુખમાસ્ત્વામી વૈભારગિરિ ઉપર પધાર્યા છે.'

સમતાના સરોવર ને શાનના સાગર ગુરુરાજની  
પખરામણીથી ઢાને આનંદ ન થાય ? જંબુકુમારનું હૈથું

હરએ જિભરાયું. હિંડોળો અંધ રાપ્યો. ગુરુ આવ્યાની વધામણી બદલ ગળામાંથી ચોતીની કંઈ કાઢી વનપાળને આપી. વનપાળ રાજ થઈ ચાલ્યો ગયો.

જંયુકુમાર એલયા : “સારથિ ! સારથિ ! રથ જોડા વૈરારગિરિ પર ગુરુરાજ પદ્ધાર્યા છે. તેમના દર્શને જવું છે. ”

કોતરણીવાળો સુંદર રથ જોડાયો. તેમાં બેસી જંયુકુમાર વૈભારગિરિ તરફ ચાલ્યા. તે રાજગૃહીની તદ્દન નજીક એટલે થોડા વખતમાં ત્યાં પહોંચ્યા.

સુધર્માસ્વામી પ્રખુ મહાવીરના ગણખર. આખા જૈન સંધના તે વખતના નેતા. એમના ઉપદેશમાં અમૃતના વરસાદ સિવાય બીજું શું હોય ?

જંયુકુમાર એમને વંદન કરી ઉપદેશ સાંભળવા લાગ્યા. જેમ જેમ ઉપદેશ સાંભળતા ગયા તેમ તેમ મન પલટાવા લાગ્યું. ઉપદેશ પૂરો થતાં તો જંયુકુમારનું હૈયું વૈરાગ્યથી ભરાઈ ગયું.

તે હાથ જોડીને એલયા : “ પ્રભો ! મારે દીક્ષા લેવી છે. માતાપિતાની રજ લઇને આવું ત્યાં સુધી શેકાવા કૂપા કરે. ” સુધર્માસ્વામીએ તે સ્વીકાર્યું.

રથમાં એસી જંબુકુમાર પાણી પ્રયો. જ્યાં નગરના દરવાજ પાસે આવ્યા ત્યાં લશ્કરની ઠઠ. હાથી, ઘોડા ને પાયદલનો પાર નહિ. આવી લીડમાં તે રે જવાય છે. આટલું લશ્કર પસાર થાય ત્યાં સુધી અહીં થોલાય પણ કેમ? એટલે તે બીજ દરવાજે ચાલ્યા.

બીજ દરવાજની પાસે આવ્યા ત્યાં તો એક જખરદસ્ત લોઢાનો ગોળો ધખ લઈને પગ પાસે પડ્યો. સિપાઈએ લડાઇની તાલીમ લેતા હતા, ત્યાંથી ગોળો આવ્યો હતો. આ નેંધ જંબુકુમાર વિચારવા લાગ્યા : “અહો! આ લોઢાનો ગોળો મારા પર પડ્યો હોત તો શી વલે થાત? આવા અપવિત્ર શરીરેજ હું હમણું મરણું પામત, માટે ચાલ અત્યારેજ ગુરુ આગળ જઈ પ્રતિશા લઈ આવું.”

તે સુધર્માસ્વામી આગળ આવ્યા. હાથ નેહીને ઓછાં : “સ્વામી! જીવું લાં સુધી અધ્યક્ષચર્ચ પાળવાનું ત્રત આપો!” સુધર્માસ્વામીએ ત્રત આપ્યું.

આ ત્રત લઈ મનમાં હરખ પામતા જંબુકુમાર ધેરે આવ્યા. માતાપિતા આગળ દીક્ષા લેવાની રણ માળી.

માણાપ બોલ્યા : “ એટા ! ચારિન લેવું ખૂબ દોષદિલું છે. વત ખાંડાની ધાર જેવું છે. તું તો હજુ ખાળારાન કહેવાય. તારાથી સાધુનાં આકરાં વતો ડેમ પળાશે ? વળી તારા વિના અમને ઘડીયે ગોડે નહિ. ”

જંયુકુમાર બોલ્યા : “ પૂજ્ય માતાપિતા ! ચારિન ખુલ્લું છે એ વાત ખરી. પણ તેનાથી તો કાયરજ ડરે. હું તમારી ફૂફે જનમ્યો હું. વત લઇને જીવ જતાં પણ ભાંગીશ નહિ. આપતું હેત મારા પર અપાર છે. એટલે મારા વિના આપને નજ ગોડે. પણ એવા વિનેગતું હુઃખ સહન કર્યા વિના ધૂટકો નથી. માટે મને રાજુ થઇને આજા આપો ! ”

માણાપ કહે, “ પુત્ર ! જે તને સંજમ લેવાની ખૂબ ધર્યણ હોય તોપણ અમારું માન રાખ. અમે પણ તારા વડીલો છીએ. તારા માટે જે કન્યાઓ અમે સ્વીકારી છે તેની સાથે લગ્ન કર. પછી તારી ધર્યણ હોય તો સુખેથી દીક્ષા લેજો. ”

જંયુકુમારે કહ્યું : “ આપની આજા હું માથે ચડા-વીશ. પણ પછી મને દીક્ષાથી આપ રોકશો નહિ. ”

માણાપે કહ્યું : “ ખુલ્લું સારુ. ”

: ૨ :

અડખસહિતે આઠે કન્યાઓના પિતાને બોલાવ્યા.  
 અને કહ્યું: " અમારો જંયુ પરણુને તરત દીક્ષા લેવાનો  
 છે. એ પરણુ છે તે પણ અમારા આશ્રહથીજ. માટે  
 આપને જે કાઈ વિચાર કરવો હોય તે કરો ! પાછળથી  
 અમને કાંઈ કહેશો નહિ. "

પોતાના પિતાને વિચારમાં પડેલા જેઈ તે કન્યા-  
 એઓ કહ્યું: " પિતાજ ! આપને ચિંતા કરવાની કંઈ  
 જરૂર નથી. અમે તો જંયુકુમારને વરી ચૂકી છીએ.  
 હવે જેમ તે કરશે તેમ અમે પણ કરીશું. "

કન્યાઓના આવો નિશ્ચય થયો એટલે સાત  
 દિવસની વરધે લગ્ન છપાયાં.

જંયુકુમારના વિવાહમાં શી મણુ હોય ?  
 વિશાળ મંડપ બંધાયો. તેને અનેકઅતનાં ચિંતા  
 ને તોરણ વગેરેથી શાણુગાર્દી. સાતમે દિવસ જંયુ-  
 કુમાર ત્યાં ખૂબ ધામદૂભથી આઠે કન્યાએને પરણ્યા.  
 રાજગૃહી નગરીમાં આટલા ઢાડથી બીજાં લગ્ન બહુ  
 આછાં થયાં હુશે.

પરહુયાની પહેલીજ રાત. જંબુકુમાર પોતાની પત્નીએ સાથે રંગશાળા ( સુવાનો એરડો ) માં ગયા.

રંગશાળાનો લપદા કિંધિ કહેવાય નહિ ! ભલભલાનાં તે ચિત્ત ચળાવી હે ! શું ત્યાંનાં ચિત્રો ! શું ત્યાંની માજશોખની સામચી !

જુવાન વય, રાત્રિની એકાંત ને પોતાની પરણેલી જુવાન પત્નીએ પાસે ! પણ જંબુકુમારનું ચિત્ત ચળતું નથી !

: ૩ :

રાજગૃહીથી થાડ છેટે એક મોટા વડલો છે. ધનધોર તેની છાયા છે. વડવાઈનો ત્યાં પાર નથી. તેની છાયામાં બરાબર સાંજ પડતાં એક પછી એક માણુસો આવવા લાગ્યાં. બંધાએ બુકાનીએ બાંધેલી. શરીર પર રાખોડી રંગનાં કુપડાં એઠેલાં.

આ બંધામાં કદાવર કાયાનો એક જુવાન. કરડી તેની આંખો. વિકરાળ તેનું મોં. બંધા માણુસો ભેગા થયા એટલે તે એલોઃ “ દોસ્તો ! આજસુધી આપણે ધણી ચારીએ કરી છે. છતાં જેઈએ તેટલા ફોંયા નથી. પણ આજ જધ્યર લાગ મજ્યો છે. ”

“રાજગૃહી નગરીના ઝડપલદ્ધતરોડને ત્યાં લગ્ન છે. ધણુા શેડ શાહુકાર ત્યાં એકઠા થયા છે. જે ખરાખર હાથ અજમાવીએ તો જવીએ ત્યાં સુધી ચોરી કરવી પડે નહિ. માટે આજે ખરાખર તૈયાર રહેને ! ”

બધા યોલ્યા “ ‘તૈયાર છીએ ! તૈયાર છીએ ! આજ્ઞા ફરમાવે તે પ્રમાણે કરવા તૈયાર છીએ.’ ”

આ યોલનારતું નામ પ્રભાવ. મૂળ તો તે રાખનો પુત્ર ! પણ બાપે નાના ભાઈને ગાઢી આપી એટલે રિસાઇન ઘેરથી નીકળેલો. પછી ચડયે ચોરી ને લુંટના રહ્યે. તે એટલે જખરો થયો કે તેનું નામ સાંભળતાં માણસોના હોશ જડી જતા. તે પોતાના પાંચસો સાથીએને લઈને તૈયાર થયો. ખરાખર અધારું થતાં શહેરમાં દાખલ થયો, ને જંયુકુમારના મકાન આગળ આવ્યો. તેની પાસે બે વિધાએ હતી. એક જિંધ મૂકવાની ને બીજી ગમે તેવાં તાળાં ઉધાડવાની.

તેણે આવીને પોતાની વિધાએ અજમાવી. તરતજ બધા જિંધમાં પડ્યા. તિનેરીનાં તાળાં ટપોટપ જિંધડવા લાગ્યાં. ચોર લોકાએ તેમાંથી જોઈએ તેટલું ધન લઈ ગાંસડીએ બાંધી.

જ્યાં તેણો ગાંસડીએ બહાર લઈ જવા જય છે ત્યાં એકાએક થંભી ગયા. પ્રભવ ચારે તરફ જેવા લાગ્યો.. આ શું ? ત્યાં તેણે જંબુકુમારને જગતો જેણો. તેભારે વિચારમાં પડ્યો : આને ઉધકેમ નહિ ચડી હોય ?

જંબુકુમારનું મન ધણું મજબૂત હતું તેથી વિધાની અસર ન થઈ. જ્યારે ચોરો ચોરી કરતા હતા ત્યારે તે વિચારતા હતાઃ “ મને ધન પર કંઈમમતા નથી. પણ જો આજે મોટી ચોરી થશે ને કાલે દીક્ષા લઇશ તો લોકો શું કહેશે ? ધન બધું જીપડી ગયું એટલે લીધી દીક્ષા ! ” માટે ચોર લોકોને આમને આમ જવા તો નજ દેવા. એથી એમણે પવિત્ર મંત્રનો જપ કર્યો. અને ચોરો બધા થંભી ગયા.

પ્રભવ ગલરાયો. હાથ જોડીને બોલ્યો : “ શેઠળ ! મને જીવતદાન દો. મને અહીંથી પકડીને રાજુદર-ખાર મોકલશો. તો ડાણિકરાખ ગરદન મારશો. લો ! આપને હું બે વિધા આપું; બદલામાં તમે જીવતદાન આપો ને એક સ્તંભિની વિધા ( બધા અટકાવી રાખે તેવી ) આપો ! ”

જંબુ કહે, “ અરે ભાઈ ! ગલરાઈથિ નહિ ! તને

જીવતદાન છે. મારી પાસે વિધા કાંઈ નથી. એક ધર્મ વિધા છે, તે તને આપું.” એમ કહી પ્રભવને તેમણે ધર્મ સમજાયો. પ્રભવને જિંદગીમાં આવી વાતો સાંભળવાનો પહેલોજ પ્રસંગ હતો.

તેણે ધનની ગાંસડીએ ઉત્તરાવી નાંખી. જાંધ પાછી એંચી લીધી. અને હાથ જોડી બોલ્યો: “જંબુકુમાર ! ધન્ય છે તમને હે ધનના દગ્દા છોડી, અસરા જેવી સ્ત્રીએ છોડી દીક્ષા લો છો. હું તો મહાપાપી છું. ધન ચેળવવાને નીચમાં નીચ ધંધા કરું છું. પણ આજે મને આપા જીવનનું ભાન થયું. સવારે હું પણ ધંધા ચારો સહિત તમારી સાથે દીક્ષા લઇશ.”

આ વખતે બધી સ્ત્રીએ જગી ઉડી હતી. તે જંબુકુમારને દીક્ષા ન લેવા સમજવવા લાગી.

એક સ્ત્રી કહે, “સ્વામીનાથ ! આપ દીક્ષા લેવા તૈયાર થયા છો. પણ પાછળથી બદ ઐદૂતની માર્કે પસ્તારો.”

પ્રભવ કહે, “બદ ઐદૂતની શી વાત છે તે મને જણુંબો !”

તે સ્ત્રીએ વાત કહીઃ “ મારવાડમાં એક ઘેરૂને  
ધાન્યની ઘેતી કરી. પાછ બહુ સારો થયો. પછી એક  
વખત પોતાની દીકરીને ત્યાં ગયો. ત્યાં મજયા માલપુઅા.  
તે બહુ મીઠા લાગ્યા. એટલે પૂછ્યું: “ આ વરતુશી  
રીતે બને ? ” જવાબ મળ્યો કે “ ધડનો લોટ ને ગોળ  
હોય તો બને. ”

તેણે ધેર આવી ઘેતરમાં થયેલું બધું ધાન્ય ઉઘેડી  
નાખ્યું ને ધડં તથા શેરડી વાવ્યાં. પણ પાણી વિના  
બંને સુકાઈ ગયાં. મારવાડમાં તે એટલું પાણી કયાંથી  
મળે ? બિચારો તે ખૂબ પસ્તાયો. એ પ્રમાણે મળેલું  
ગુમાવીને ન મળે એવા માટે મહેનત કરે તેને પસ્તા-  
વાનો વખત આવે. ”

આ સાંભળી જંયુકુમારે જવાબ આપ્યો: “ હું  
પર્વતના વાનર જેવો નથી કે ભૂલ કરીને બંધનમાં  
સપડાડું. ”

પ્રભવો કહે: “ પર્વતના વાનરની શી વાત છે ? ”

જંયુકુમાર કહે: “ એ તો એક પર્વતમાં ધરડો  
વાનર હતો. તે ધણી વાનરીએ સાથે રહેતો ને આનંદ  
કરતો. પણ એક દિવસ ત્યાં ઢાઈ જુવાન વાનર આવ્યો.  
ને બંનેને લડાઈ થઈ, તેમાં ધરડો વાનર હાર્યો ને નાઠો. ”

ભિયારાને જંગલમાં ફરતાં ખૂબ તરસ લાગી. એવામાં તેણે શિલારસ ઝરતો જેથો. તે સમજ્યો હે એ પાણી છે એટલે તેમાં મોં નાંખ્યું. પણ તે તો તદ્દન ચાટી ગયું. હવે શું કરવું? પોતાનું મોહું ઉખાડવા એ હાથ પેલા રસ પર ઢાખ્યા અને મોં એંચવા લાગ્યો. એટલે મોં તો ઉખડયું નહિ પણ હાથ ચાટી ગયા. એ પ્રમાણે પગ મૂક્યા ને પગ પણ ચાટી ગયા. એથી તે ભિયારા દુઃખ ભોગવતો ભરણું પામ્યો. આ પ્રમાણે ખંડા મોજશોઅ શિલારસ જેવા છે. એટલે તેમાં ચાટી જનાર જરૂર નાશ પાણે છે.”

આ વાત સાંભળી એક સ્ત્રીએ કહ્યું: “ સ્વામી-નાથ! આપ આપનો લીધેલો વિચાર છોડતા નથી પણ ગંધ્યાપૂંછ પુકડનારની માર્કડ દુઃખી થશો.”

પ્રલબ્ધ કહે, “વળી ગંધ્યાપૂંછ પુકડનારની શી વાત છે?”

તે સ્ત્રી ઓલી “ એક ગામમાં એક આણણનો પુત્ર હતો. તે ધણેલા મૂર્ખ. તેની માંચે કહ્યું કે ‘પુકડેલું’ એડી દેવું નહિ, એ પહિતનું લક્ષણ છે.’ મૂર્ખીએ પોતાની માતું વચન મનમાં પકડી રાખ્યું. એક દિવસ ડાઈ

કુંભારનો ગધેડો તેના ધરમાંથી ભાગ્યો. કુંભાર તેની પછ્વાડે દોડ્યો. કુંભારે પેલા પ્રાકશના છોકરાને કહ્યું કે ‘અરે ! આ ગધેડાને પકડને ! ’ તે મૂર્ખાચે ગધેડાનું પૂંછડું પકડયું. ગધેડો પગની લાતો મારવા લાગ્યો. તો પણ તેણે પૂંછડું મૂક્યું નહિ. એ જેઈલોડા કહેવા લાગ્યા : “ અરે મૂર્ખ ! પૂંછડું છોડી દે ! ” ત્યારે પેલા છોકરાચે કહ્યું : “ મારી માચે મને એવી શિષ્યામણ આપી છે કે પકડેલું છોડવું નહિ. ” આ પ્રમાણે તે મૂર્ખી ઘૂઘ કુઃઘ પામ્યો.

જંયુકુમાર આ સાંભળી બોલ્યા : “ બરાખર ! તમે બધી તે ગધેડા સમાન છો. તમને પકડી રાખવી એ ગઢાપૂંછ પકડી રાખવા બરાખર છે. પણ તમો કુળવાન થઈને આવું બોલો છો તે ઢીક નથી. ”

આ પ્રમાણે પોતાની બ્રીઓ સાથે ધણી વાતો થઈ. તેમાં જંયુકુમાર સફળ થયા. બધી બ્રીઓ પણ તેમની સાથે દીક્ષા લેવા તૈયાર થઈ.

વહાણું વાયું. જંયુકુમારે માખાપની આગળ રજી માગી. માખાપે વચ્ચન આપ્યું હતું એટલે તેમણે રજી આપી. પોતે પણ દીક્ષા લેવાને તૈયાર થયાં.

જંબુકમારની શ્રીઓ પોતપોતાનાં માખાપ પાસે ગઈ. અને દીક્ષા લેવા માટે તેમની રજ લીધી. માખાપોએ તેમને રજ આપી. તે બધા પણ દીક્ષા લેવા તૈયાર થયા.

રાજ ડેણિકને ખખર પડી હે જંબુકમાર દીક્ષા લે છે એટલે તેણે ખૂબ સમજાવ્યા. પણ જંબુકમાર પોતાના નિશ્ચયમાંથી ડગ્યા નહિં.

પ્રભવ પણ પોતાના પાંચસો સાથીઓ સાથે દીક્ષા લેવાને તત્પર થયો.

દીક્ષાનો મોટા ઓચ્છવ થયો. તેમાં જંબુકમારે પાંચસો ને સત્તાવીશ જણ્યા સાથે દીક્ષા લીધી. આવા ઓચ્છવો ધરતીના પડમાંથી બહુ ઓછા થયા હશે !

જંબુકમાર સોળ વરસની ઉભરે સુધર્માસ્વામીના શિષ્ય થયા. સંજમ ને તપથી પોતાનાં ભન, વચ્ચન અને કાયાને પવિત્ર કરવા લાગ્યા. ગુરુઆગળ તેમણે શાસ્ત્રોનો અલ્યાસ કર્યો ને થોડા વખતમાં તો તે બધા શાસ્ત્રોમાં પારંગત થયા.

સુધર્માસ્વામીનું નિર્વાણ થતાં તેઓ તેમની પાટ આંધ્યા. જૈન સંધના આગેવાન થયા. તેમણે પ્રભુ

મહાવીરના ઉપદેશનો ખૂબ પ્રચાર કર્યો. તપ ને ત્યાગનું  
વાતાવરણ ક્રેદાયું. અનેકોનાં કલ્યાણ કર્યાં.

જંબુસ્વામીને પોતાનું જીવન પૂરેપૂરું પવિત્ર  
થતાં ડેવળજીન થયું અને ડેટલાક વર્ષ પછી તેઓ  
નિર્વાય પામ્યા.

કહેવાય છે કે જંબુસ્વામી આ કાળમાં છેલ્લા  
ડેવળજીની છે. એમની પછી ડાઇડેવળજીની થયું નથી.

ધન્ય છે અઠળક રિદ્ધિસિદ્ધિ તથા ભોગ વિલાસોને  
લાત મારી સાચા સંત થનાર જંબુસ્વામીને !



# અમરકુમાર

કથારંભે પંચપરમેષિને નમર્સકાર કરીએ.

અરિહતોને નમર્સકાર.

સિદ્ધાને નમર્સકાર.

આચાર્યાને નમર્સકાર

ઉપાધ્યાયોને નમર્સકાર.

જગતમાં વિચરતા સધળા સાધુજનોને  
નમર્સકાર.

સાચા લાવે આ પાંચને નમર્સકાર કરે તો  
પ્રાણીનાં સધળાં પાતક ટણે.

નોધારાનો આધાર ને દુઃખિયાનો બેલી એવો  
આ નવકાર મંત્ર જે સાંભળો ને સાંભળાવે તે બનનેતું  
કદ્દયાણું થાય.

હે નાથ ! આ નવકાર ક્રેમ અમરકુમારને  
ઇજ્યો તેમ સહુને ફૂળાને.

રાજગૃહી નગરીમાં શૈલ્પિક રાજ રાજ્ય કરે છે.  
તેને એક વખત વિચાર થયો : ‘ લાભ, એક સુંદર  
ચિત્રશાળા કરાવું . ’

તેણે દેશદેશાવરથી સલાટો બોલાવ્યા. કુથળ  
એવા કારીગર બોલાવ્યા. થોડા વખતમાં મકાન  
થયું ને તેમાં સુંદર ચિત્રો ચિત્રરાબ્યાં. પણ એવામાં  
મુખ્ય દરવાને તૂટી પડ્યો.

કારીગરો ફરીથી કામે લાગ્યા. ધણી મહે-  
નતે દરવાને જોનો કર્યો. પણ તે પૂરો થયો ને  
તૂટી પડ્યો.

કારીગરો દરવાને ચણે ને પૂરો થતાં તે  
તૂટી પડે. રાજ મુંઅણ્ણો : ‘ હવે કરવું શું ? ’  
તેણે કહ્યું : ‘ જોશીને તેડાવો ને જોશ જેવડાવો.  
ચિત્રશાળાનો દરવાને તૂટી કેમ પડે છે ? ’

જોશી આવ્યા. કચેરી ભરાઈ. રાજ વિચાર  
કરે છે : રૈયત વિચાર કરે છે : જોશી શું

કહેશે ? જેશીએ ટીપણું કાઢ્યું, જેશ જેયા,  
અને માથું ધુણાવીને ટીપણું ખંખ કર્યું. રાજ કહે:  
'જેશી મહારાજ ! ડોકું કેમ ધુણાવો છો ? જે  
હોય તે સાચું કહી દો.' જેશીએ ફરી ટીપણું  
ઉધાડ્યું. ફરી જેશ જેયા. ડોકું ધુણાંયું ને ટીપણું  
ખંખ કર્યું. રાજ કહે: 'જેશી મહારાજ ! ડોકું  
કેમ ધુણાવો છો ? જેશમાં શું આવે છે ? શું  
કોઈ દેવ કોણા છે કે વરતીમાતા જોગ માગે  
છે ? જે હોય તે સાચે સાચું કહી દો.'

જેશીએ વિચાર્યું કે સાચું કહેવા દે. કણા વિના  
નહિ ચાલે. તે બોલ્યા : 'મહારાજ ! ચિત્રશાળાનો  
દરવાજે ખત્રીશલક્ષણો બાળ માગે છે. તેનો જોગ  
આપો તો ચિત્રશાળાનો દરવાજે રફે. નહિતર  
હરિ ! હરિ !'

આ સાંભળી સહુ ઠરી ગયા. કોઈ હાલે કે  
ચાલે. ચારે કોર સુનસુનકાર

રાજ કહે, 'નગરમાં દોઢેરો પીટાવો. જે ફાઈ  
ખત્રીસ લક્ષણો બાળ આપશે તેને બાળકની ભારોભાર  
સેનામહોર આપીશ.'

નગરમાં છેટેરા પીટાણ્ણા.

: ૨ :

એજ નગરમાં ઋષભદત્ત નામે એક આશણ છે. બિચારાને નથી એક ટંકનું ખાવા કે નથી પૂરતું ઓઢવાપહેરવા. સવારે મળ્યું તો સાંજે ન મળે ને સાંજે મળે તો સવારે ન મળે. જ્યારે માણસની વેળા બદ્લાય લારે કાંઈ બાધી રહે છે? બિચારા આપો દિવસ બિક્ષા માળીને જેમ તેમ પેટ ભરે છે.

એને સી પણ ડલારની ભળી છે. આપો દિવસ મહેનત મુજૂરી કરીને ઘેર આવે ત્યારે એ ગાળોનો વરસાદ વરસાવે: ‘હે દરરદ્રિ! એસી શું રહે છે? જણ્યાને જીવાડવા તો ખરા ને! આ ચાર દીકરા ને એક દીકરી. એમને મારે શું ખવરાવવું? નથી ધરમાં મીઠું કે નથી ધરમાં તેલ. દી ગોળની વાતજ શી? બિચારાં શિયાળામણી નાગા જેવાં રખડે! હોઠ વાર-પરએ ય ચોડું પામે છે!’

આશણ બિચારા નીચું ચોડું કરીને બધું

સાંભળી લે. વળી પ્રાણણી આગળ ચલાવે: ‘આ વસ્તારથીયે હું કંટાળી ! એમને નિય નવાં મન થાય. એમાંયે તાનકા અમરે તો મને અહું પજવી. મારાથી એતું પૂરું નથી પડતું.’

ટેટકેટલાં વરસ આમ વીતી ગયાં, પણ આ પ્રાણણુંનું કુદુંખ એવું ને એવું ગરીબ રહ્યું.

એવામાં પ્રાણણીએ શ્રેણિક રાજને! દઢેરો સાંભળ્યો. તેને વિચાર થયો: ‘લાવને આ અમરને આપી દઉં. ચાર દીકરાના ત્રણ દીકરા હતા એમ ગણીશ. પણ આ હંમેશનું બિખારી-પણું તો જય.’

તેણે ઋપદદાતાને કહ્યું: ‘સાંભળી આ ડાંડી પીટાણી તે ? આપણે અમરને આપી દો. ભારોકાર સોનું મળશો. સહાની ભાવટ ભાંગશો.’ પ્રાણણ બિચારે વિચારમાં પડ્યો.

ચી પ્રરીથી એલી: ‘એમાં વિચાર શું કરો છો ? એ છાકરો તો મને આંખના પાઠા જૈવો લાગે છે. આપી દો રાજ શ્રેણિકને ને લાવો ભારોકાર સોનું.’

બિચારા ઋપભદ્રતે ગળગળા સાદે સિપાધચ્ચાને  
હંખું : ‘ભાઈચ્ચા ! અત્રીશલક્ષણેં ફેલૈયો કુંવર હું  
આપીશ.’

અમરકુમાર ઋપભદ્રત જેવા બિખારીને ત્યાં  
જી-ચ્ચો હતો પણ અત્રીશલક્ષણેં હતો. તેની બોલી-  
ચાલી, તેની રીતમાત સહુને વહાલી લાગતી. પણ  
માને પૂર્વભવતું વેર એટલે તેને કદી વહાલજ  
આવે નહિ.

અમરને નાનપણુથી સંતસમાગમ બહુ ગમે.  
તે જણે ડેડાઇ સાધુસંત આંધ્રા છે તો તેની પાસે  
પહેલો પહેલ્યા. તેમની સેવાભક્તિ કરે. તેમનો ઉપદેશ  
સાંભળો.

એક વર્ષને નગરમાં એક જ્ઞાની સાધુ  
પધાર્યા. અમરકુમારે એ સાંભળ્યું એટલે ચાલ્યો  
તેમના દર્શાને. સાધુ મહારાજ ઉપદેશ દેતા  
હતા. ‘નમસ્કાર ભંત્ર સકળ શાસ્ત્રનો સાર  
છે. એને જે સાચા ભાવે સમરે તેનાં સધળાં  
હુઃખ ટળો.’

ઉપદેશ પૂરો થયો. સાંભળનારા બધા જવા લાગ્યા, એટલે અમરકુમાર તે સાધુ પાસે ગયો. ચરણમાં પડી વંદન કર્યું. પછી હાથ જોડી બોલ્યો: ‘પૂજ્ય મુનિરાજ ! મારા પર કૃપા કરો. મહામંગળકારી નમસ્કારમંત્ર શીખવો।’

મુનિરાજે અમર સામે જોયું. એમને લાગ્યું કે બાળક તેજસ્વી છે. તેમણે નમસ્કારમંત્ર શીખ્યો. અમર હુંમેશાં તેનો પાઠ કરે. આવો બાળક ઢોને ન ગમે ?

: ૩ :

શ્રેણિક રાજના સેવકો તો ઋપદ્ધતને ધીર આવ્યા અને કહ્યું: ‘લાવો તમારો પુત્ર ને લો આ ધન.’

આકણી કહે, ‘અમર ! થા તૈયાર ને જ આ સિપાઈઓ સાથે.’

અમરની એક આખમાં શાવણ ને એક આંખમાં કાદરવો. તે બોલ્યો: ‘પિતાજ ! મને બચાવો. આ સિપાઈઓને સોંપશો નહિ.’

ऋપદ્ધત કહે, ‘હું શું કરું ? તારી માતા તને આપી દે છે. એમાં મારું કાંઈ ચાલે તેમ નથી.’

અમરે ભાતાને કહ્યું: ‘ માડી ! મારું વેચાણ કરશો નહિ. ધન તો આજ છે ને કાવે નથી. મને બચાવો. ’

મા કહે, ‘ તારા લખણે જ તું મરે છે. કામકાજ કરતું નહિ ને સારું સારું ખાવાને જોઈએ. તને રાણીને હું શું કરું ? ’

અમર ધાણું કરગયો પણ માની વજ છાતી પીગળી નહિ.

ત્યાં પાસે કાકા કાકી ઓસાં હતાં. તેમને અમરે કહ્યું: ‘ કાકા ! મારા માબાપ મને વેચે છે. તમે મને બચાવો. તમારે ત્યાં રાખો. ’

કાકા કાકી કહે, ‘ તારા માબાપ તને વેચે એમાં અમારું શું ચાલે ? અમારાથી તને રખાય નહિ. ’

માડી ઘણેન ત્યાં એઠી હતી. તે આંખમાંથી આંસુ સારતી હતી. પણ તેય શું કરી શકે ?

અમરકુમારને હાથે પકડીને સિપાઈએ લઈ ચાહ્યા.

ગામ આખામાં હાહાકાર થયો. લોડા  
કહેવા લાગ્યા: ‘ ચંડાળ માખાપે પૈસા માટે  
પોતાનો પુત્ર વેચ્યો ! ’

અમરકુમાર છાતીશ્વાર ઝુદ્ધન કરે. જે સામું  
મળે તેને વિનંતિ કરે. પણ તેને ડાણ છોડાવી  
શકે : સહુ એકજ જવાખ આપે: ‘ લાઈ ! તારા  
માખાપે તેને ધન લઈ વેચ્યો તેમાં અમે શું કરી  
શકીએ ? ’

: ૩ :

અમરકુમારને ચિત્રશાળાએ. લાગ્યા. ગંગા  
જળે તેને નવરાંયો. ગળે કુલની માળા નાંખી.  
કૃપાળે ડેશરચંદ્ન ચર્ચાં. આલાણે. મંત્ર ઓદવા  
લાગ્યા. હવનમાં ધીની આફુતિએ આપી અભિની  
જવાળાને વધારે મોટી બનાવવા લાગ્યા.

અમરકુમાર જિબો જિબો વિચાર કરે છે :  
‘ અરે ! આ જગતમાં સહુ સ્વાર્થનાંજ સમાં

છે. શું મા ! શું બાપ ! શું કુદુંખકળીલો !  
 શું નાતઅત ! હોઠિયે મને બચ્ચાંયો નહિ ! હવે  
 કું શું કરું ? ' એવામાં તેને યાદ આંધુઃ લીડ-  
 ભંજનો નમરેકારમંત્ર છે તે લાવ રમરું.  
 તેણે નમરેકાર જરૂરો શરૂ કર્યો.

નમો અરિહંતાણું

નમો સિદ્ધાણું

નમો આયરિયાણું

નમો ઉવજાયાણું

નમો લોએ સર્વસાહૂણું

એસો પંચ નમુક્કારો, સર્વપાવપ્પણાસણો;

મંગલાણું ચ સર્વેસિં પદમં હવઈમંગલં.

છું સવાહા ! છું સવાહા ! કરતાં પ્રાક્ષણ્યોએ  
 અમરકુમારને હુવનના લાડભડતા અધિમાં પવરાંયો.  
 પણ અમરકુમારનું ચિત્ત હવે પરમેષ્ઠિના સમરણુમાં  
 ચીટયું છે. સતતું બળ તેના હૈયામાં ઉસરાઇ  
 રહ્યું છે. સત્ત આગળ અસતતું શું ચાલે ? સાપ હોય

તેય કુલમાળા થાય. અહિન હોય તેય હિમાળો ઘની જથ.

ખરેખર ! તેમજ થયું. બડલડાટ કરતો અહિન ઠંડેગાર થઈ ગયો. ધ્યાનમાં એટલો અમરકુમાર હોઈ ચોગી જવો દેખાવા લાગ્યો. તેની કંચનવરણી કાયાને કયાંઈ ડાઢો યે લાગ્યો નહિ. રાખ ધરણીપર છળી પડ્યો. મોંચે લોહીના ડોગળા આવ્યા. કુદ્દરતેય અન્યાય હેટલો સાંચે ?

સહુને અચરજ થઈ. દોડી દોડીને બાળકના ચરણમાં પડ્યા. વિનંતિ કરવા લાગ્યા: ‘ કૃપા કરીને રાખને જિનો કરો. બનવાની વાત ઘની ગઈ. પણ તમને ડોય ધટે નહિ. ’

અમર કહે: ‘ સહુને સંમતિ આવો. સહુંઠું કદ્યાણુ થાવ. મારે હોઈ સાથે નથી હોધ, નથી વેર.’ પાણીની અંજલિ ભરી રાખને છાંટી એટલે રાખ જિનો થયો.

રાજ અમરકુમારને કહેવા લાગ્યો: ‘માગ !  
માગ ! માગ તેટલું ધન આપું.’

અમર કહે, ‘મારે ધનનું કામ નથી.  
આ બધા અનર્થક ધનનો છે. હું તો હવે  
સાધુ થઈશ ને મારા આત્માનું કલ્યાણ કરીશ.’

તે ગયો નગર બહાર ને થાડે દૂર જંગલમાં  
ધ્યાન લગાવ્યું.

અહીં જંગલદાન ને તેની સ્ત્રી ભદ્રા તો  
ખાડા ઓદે છે ને ધન દાટે છે. મનમાં બેઠા  
વિચારો ધડે છે છે હવે આપણે મહેલ ચણુવીશું  
ને માલ કરીશું. બધા છોકરાને સારાં સારાં વાંચો  
પહેરાવીશું ને જમણ જમીશું.

એવામાં ફોઝેએ આવીને વાત કરી: ‘અમર-  
કુમાર તો સાધુ થઈને વનમાં ગયો.’ આ  
સાંભળી ભાતપિતાના હેશકોશ જિડી ગયા.  
‘અરર ! અમર પાછો આવ્યો માટે રાજ આ  
આપેલું ધન લઈ લેશો !’ તેમના મનમાં ક્ષણ પડી.

૪

ધુંધળી સાંજ પડી ને રાત થઈ. કિંધવાનો સમય  
થયો. પણ પ્રાબાણીને જિંધ આવે નહિ. તેને  
અમરકુમાર ઉપર ઢોંગ વરસી રખો છે. મનમાં  
તે બધડે છે: ‘આ સેતાન છાકરાને શું કરવું? દુનિયામાં ફૂલેત થયા ને હવે ધન પણ જરો? દ્વાણ  
જણે હવે શું યે થરો? માટે એને તો પૂરોજ કરવો.’

તેણે હાથમાં એક તીણી છરી લીધી ને રાક્ષસી  
જીવી વિકરણ થઈને મધરાતે ખરમાંથી બહાર નીકળી.

તેના કોધથી જણે ધડીલર વહેતો પવન પણ  
બંધ થઈ ગયો. વનચર પશુઓ પણ બોલતા  
બંધ થઈ ગયા ને સધળે સુનસુનાકાર થઈ ગયું.

ભયંકર ભૂમિમાં ધ્યાન લગાવીને અમર-  
કુમાર જિબા છે. પ્રાબાણી શોધતી શોધતી નજીક  
આવી પહોંચી. તેનો ઢોંગ માતો નથી. અંઘમાંથી અર્જિન  
વરસે છે. તેણે છરી ઉગામી. પણ હાથ થંબી ગયો.

અણે કાંઈ તેને પોકાર છરીને બોલાવતું હોય ને ઠપેડા  
દેતું હોય તેમ લાગ્યું. આશણીએ આડું અવળું જેયું  
પણ સાં ભયંકર શાંતિ છવાઈ રહો હતી. આડપાન  
પણ હાલતાં બંધ થઈ ગયાં હતાં. કાંઈ મનુષ્ય  
નજરે પડતું ન હતું. આશણી પરી સાવચેત થઈ.  
એવામાં થાડે દૂર એક શિયાળિયાની કીકિયારી સંભ-  
ળાઈ ને વાતાવરણ વિશેષ ભયંકર બન્યું. રાક્ષસી  
બનેલી માતાનો હાથ ઝરી ઉપડ્યો ને ક્ષણવારમાં  
ધ્યાનમાં જોનેલા અમરકુમારની છાતીમાં છરી ભોંકાઈ  
ગઈ. અમરકુમાર સમજ ગયા કે વેરણ માતાએ  
આ કારમો ધા કર્યો છે. પણ તેમણે મનને શાન્ત  
રાખ્યું.

ધર્મ માટે પ્રાણ આપનાર મહાત્માઓનું  
સમરણ કરવા લાગ્યા. અને છેદદી જીવના  
જીવવા લાગ્યા.

‘ સર્વે જીવોની ક્ષમા માગું છું. સર્વે  
જીવો મને ક્ષમા આપજો. જગતૂના સર્વ જીવો  
મારા મિત્ર છે. મારે ડાઈની સાથે વેર નથી.’

આવી શુભ ભાવના ભાવતાં તે ધરણી પર દળી પડ્યા.

જણે કે કુદરતને પણ આની વેદના થઈ હોય તેમ તરતજ ભયંકર ગર્જના થઈ. સિંહણુનો એ અવાજ હતો.

આખણું લાંથી દથ ડગલાં ચાલી, ત્યાં તો સિંહણ સામી દેખાણું. વનવગડામાં નાસે ક્યાં? સિંહણ આગળથી છટકે પણ ક્યાં? છતાયે ભરણ આવે તો છુટવાનું ઢાણ ન કરે? તેણે નાસવા માંડયું.

પણ સિંહણ એક તલપ મારી બરાબર આખણીના શરીર પર પડી. આખણું હેઠી ને સિંહણ ઉપર. ઘડી એ ઘડીમાં તો તેનાં હાડકંજ રહ્યાં. સિંહણ મોકું હવાવતી જંગલમાં ચાલી ગઇ.

અમરકુમાર શુભ ધ્યાનમાં ભર્યા એટલે કહે છે કે તે દેવલોક ગયા.

પાપિણી મા પાપદ્યાનમાં ભરી એટલે કહે છે કે  
તેની નરકની ગતિ થઇ.

આજે પણ અમરકુમારની સજાય વંચાય છે ને  
માણુસોની આંખમાંથી આંસુ પડે છે.

હે નાથ !

અમરકુમાર જેવી શક્તા મળને !

અમરકુમાર જેવાં મનોબળ મળને !



## શ્રીપાળ

: ૧ :

નવપદજ સહનું કલ્યાણ કરે. તેમના  
આરાધનનું જે ફળ શ્રીપાળ તથા ભયણાસુંદરીને  
મળ્યું તે સહને મળો.

અંગ દેશમાં ચંપા નામે નગરી છે.  
ત્યાં સિંહરથ રાબ છે. તેને કમળપ્રભા રાણી છે.  
તેમને મોટી ઉભરે એક કુંવર થયો. તેનું નામ  
પાડ્યું શ્રીપાળ.

શ્રીપાળ નાની ઉભરનો છે ત્યાં રાબ  
મરણ પામ્યા. રાણી બહુ શોક કરવા લાગ્યા.

પ્રધાને ધીરજ આપી ને બાળરાબની આણુ  
કેલાવી. પણ શ્રીપાળનો કંડા અજીતસેન ખદુ  
ખરપટી. તેણે કાવત્રાં કર્યાં ને લરકરને ફોડયું.  
અમલદારોને પણ ફોડયા. રાણી તથા કુંવરતું  
ખૂન કરવાનું નકી કર્યું.

રાણીને એ વાતની ખખર પડી. એટલે  
અખરાતે કુંવરને લાછ નાઠી. ચારે બાજુ અજીત-  
સેનના માણસો એટલે રહ્સતો જંગલનો લીધી.

અહા ! થું બિહામણું જંગલ ! ગાડ  
પર ગાડ ને જાળાંખરાનો પાર નહિ ! ભાંધી  
સાંજ યોલે ને સિંહ ધોરે. પણ શું કરે ?  
જવ ખચાવવા આવા જંગલમાં રાણી નાસે છે.  
બિચારીએ વર ખહાર કઢી પગ મૂક્યો નથી.  
તેને વનવગડામાં એકલું રખડવું પડે છે. તેના  
પગે લોહી નીકળ્યાં, વસ્તુ ખદાં પ્રાટી ગયાં.

ભીજ ડિવસનું સવાર થયું એટલે  
જંગલ પૂરું થવા આંદ્યું. અહીં શ્રીપાળ કહે,  
' ખા ! જુખ લાગી છે. દૂધ, સાકર ને ચોખા

આપ. ઉમળપ્રકા ચોધાર આંસુએ રડતી રડતી  
બોલીઃ ‘એટા ! ફૂલ, સાકર તથા ચોખાને ને  
આપણુને હજર ગાડિનાં છેટાં પડી ગયાં. હુને  
તો જરખાજરીની વેંસ મળે તો પરમાત્માનો પાડ.’

કુંવર ભુખ્યો થયો છે ને રાણી પાસે  
કશું ખાવાનું નથી. એમ કરતાં આવ્યા એક  
ડાઢિયાના ટોળાં પાસે.

સાતસો ડાઢિયાનું ટોળું ! શરીરે ભયંકર  
ડાઠ ને હાથે પગે ખોડાં. રાણી કહે, ‘ભાઇ !  
વખાના માર્યાં અમે તમારી પાસે આવ્યાં છીએ.  
આશરો આપો.’ એમ કહીને બધી વાત  
કરી. ડાઢિયાએ કહે, ‘માઝ ! અમને આશરો  
આપવામાં વાંદ્યા નથી. પણ અમારી સાથે  
રહેશે તેને ભયંકર ડાઠ થશે.’ રાણી કહે, ‘નેમ  
થવું હોય તેમ થાય. પણ અત્યારે જીવ બચાવવા ધો ?’

ડાઢિયાએ પોતાના ટોળામાં તેમને  
દાખલ કર્યાં. રાણીને ધોળી પહેઢી ઓઢાડી  
દીધી. એવામાં અજીતસેનના સિપાઈએ શોધપોળ

કરતાં આવી પહોંચ્યાં. તેમણે પૂછ્યું: ‘કોઈ બાધ તથા કુંવરને અહીંથી નાસી જતાં જેયાં? ’ ડાઢિયા કહે, ‘ડાણ જેણે ભાઈ, અમને કાંઈ ઉંભર નથી.’ સિપાઠએ ચાલ્યા ગયા. રાણી ને કુંવર બચી ગયા.

ડાઢિયાએ ભૂખ્યા કુંવરને ખાવાનું આપ્યું. કુંવરની ભૂખ ટળી. પણ ડાઢિયાનું અન્ન ખાવાથી ઉંભર જતનો કોઠ થયો. જેમ ઉંભરાના થડની ખાલ ફોટે તેમ શ્રીપાળકુંવરનું શરીર ફાટી ગયું. બધાએ તેતું નામ પાડ્યું ઉંભર રાણેલા.

માથી આ શે જેણું જય? રસ્તામાં ડાઢિએ વાત કરી કે કૌશામ્ભીમાં એક વૈઘ છે. તે ગમે તેવો કોઠ મટાડે છે. એટલે રાણી કૌશામ્ભી ચાલી નિકળી. તેણે સહુને કલ્યાં કે ઉજનેણી જઈને થાબજે. ત્યાં હું આવી મળીશ.

કોઢિયાનું ટોળું ઉજનેણી ચાલ્યું.

: ૨ :

ઉજનેણીમાં પ્રતિપાળ રાજ છે. તેને બે

કુંવરીએ છે. એકનું નામ સુરસુંદરી ને બીજાનું નામ મયણાં. બંનેને રાજીએ ખૂબ ભણાવી. પછી એક દિવસ પરીક્ષા કરવા રાજસભામાં ઓલાવી.

બંનેને પૂછ્યું: ‘ઓલો, તમે આપકર્મી હો આપકર્મી?’ સુરસુંદરી કહે, ‘આપકર્મી.’ મયણાં કહે, ‘આપકર્મી.’ રાજ સુરસુંદરી પર રાજ થયો. મયણાં પર ખીલયો. સુરસુંદરીને એક રાજના કુંવર સાથે પરણાવી. મયણાંને મારે ખરાખમાં ખરાખ વર શોધવાનો વિચાર કર્યો.

રાજ નગર ખાડાર ઝેરવા નીકળ્યા ત્યાં ડાઢિયાએનું ટાળું જેયું. જેતાંથે સહુને સુગ ચડે એવા એ માણુસો. રાજીએ તેમાંથી ઉંખર-રાણુને પસંદ કર્યો ને મયણાંને તેની સાથે પરણાવી. પછી રાજ કહે, ‘હીકરી ! હવે આપકર્મીપણું બતાવજો.’ મયણાં કહે, ‘ધણી જુશીથી પિતાજ ! જે મારામાં મારાપણું હશે તો કુઃખ ટળીનેય સુખ થશે. નહિતર આપનું આપ્યું કેટલી ધડી રફતાનું છે !’

મયણાં ને ઉંખરરાણો ચાહ્યા. મયણાં કહે, ‘સ્વામીનાથ ! ગામમાં ગુરુરાજ છે. નેધારાનો એ આધાર છે. કુઃખ્યાના ઐલી છે.’ બંને દર્શને ગયા. અક્ષિતભાવથી દર્શન કર્યા. પછી મયણાંએ પૂછ્યું: ‘ગુરુરાજ ! કૃપા-કરીને કાંઈ ઉપાય બતાવો જેથી ભારા સ્વામીનો રોગ ટળો ને શરીર સારું થાય?’

શુલુ કહે, ‘નવ આંષેલ કરો ને નવપદ્જીને આરાધો. સાચા ભાવે એ આરાધના કરશો તો નખમાં એ રોગ નહિ રહે. ’

બંનેએ આંષેલ કરવા માંડ્યા. જ્યાં એક આંષેલ, એ આંષેલ ને ત્રણ આંષેલ થયા ત્યાં શરીરમાં ફેર પડવા માંડ્યો ને નવ આંષેલ પૂરાં થતાં તો બધો રોગ ફૂર થયો. કાયા કંચનવરણી થઈ. સાતસો ડ્રાટિયાઓએ પણ પ્રલુનાં નમણું લીધાં ને તેમના કોઠ ફૂર થયા.

મયણાંસુંદરીનો      ૬૨૪      માય      નહિ.

કમળપ્રભાને આ વાતની ખખર પડી એટલે  
રસ્તામાંથી પાછી ફરી ને ઉજાણુંમાં આવી મળી.

- ગામમાં મયણુંસુંદરીનું મોસાળ હતું.  
માગાને બધી વાતની ખખર પડી એટલે ગાજતે  
વાજતે નણેને ધેર તેડયાં. બહુ આદરમાન આચ્યાં  
ને રહેવાને જુદા રાજમહેલ આચ્યા.

: ૩ :

એક વખત શ્રીપાળકુંવર ધોડે બેસી  
ગામમાં પ્રરવા નીકળ્યા છે. ત્યાં એક માણુસે  
આંગળી ચીંધી કણ્ણું : ‘એ ધોડે બેસી રાજના  
જમાઈ અથ !’ શ્રીપાળે એ શબ્દો સાંભળ્યા  
એટલે તેમને એક વિચાર આંદોલનો :

ઉત્તમ આપ ગુણે સુણ્યા, મધ્યમ બાપ ગુણેણું;  
અધ્યમ સુણ્યા માઉલ ગુણે, અધ્યમાધ્યમ સસુરેણું.

અર્થાત्-પોતાના ગુણવડે ઓળખાય તે ઉત્તમ  
કહેવાય. બાપના ગુણવડે ઓળખાય તે મધ્યમ ગળ્યાય.

મામાના ગુણવડે ઓળખાય તે અધમ ગણ્યાય ને  
સસરાના ગુણવડે ઓળખાય તે તો અધમાધમ ગણ્યા.

‘બિકાર છે મને કે સસરાના નામથી  
ઓળખાડ’ કું. ચાલ જીવ, હવે સસરાના ગામમાં  
ન રહેલું.’ તે ધેરાભ્યા ને માત્થા ઝીની રજ માગી:  
‘અમે હવે પરદેશ જઈને ધન કુમાઈશું ને તેના ખ્યો રજ  
પાણું લઈશું. માટે રજ આપો.’ માત્થા ઝીને આ  
ગમે તો કયાંથીજ ? પણ આપણુંને ગમતુંજ ખંડું  
કાંઈ થાડું થાય છે ? વરસ ઠદ્વસે પાછા આવવાનો  
વાયદો આપી શ્રીપાળકુંવર ચાલી નીકળ્યા.

ગામ, નગર ને નઢીનાળાં પસાર કરતાં  
એક પઢાડ આગળ આય્યા. ત્યાં જંગલની અંદર  
એક માણુસ વિધા સાથે. તેને એક માણુસની  
જડર. સારો માણુસ સાચવનાર ન હોય તો વિધા  
ખરાખર સધાય નહિ. એટલે શ્રીપાળને પાસે  
રહેવાની વિનંતિ કરી. શ્રીપાળ ત્યાં રક્ષા ને પેલાની  
વિધા સિદ્ધ થઈ. એટલે તેણે રજ થઈને વે  
વિધાઓ આપી. એક જળતરણી ને બીજી શરૂ-

સંતાપહરણી. એકથી પાણીમાં ન કુખ્યાય ને  
બીજથી શરીરે ધા ન પડે.

શ્રીપાળ કુંવર અહીંથી ચાલી નીકળ્યા.  
ચાલતાં ચાલતાં ભર્યા બંદ્રે આવ્યા. અહીં  
ધવળ શેઠ નામનો એક જઘરદસ્ત વેપારી. પાંચસેં  
વહાણેં માલનાં ભરીને દરિયાની સરેરે જય.  
શ્રીપાળને દેશાવર જેવાની હોંશ એટલે મહિને સો  
સોનામહોરો ભાડું આપવાનું ટેરવી વહાણમાં એઠા.

પવન અતુકુળ વાયો એટલે વહાણ ઉપહયાં.

: ૪ :

વહાણમાં માલિમ એઠા પટ ને પુસ્તકો  
જુએ છે. સુકાનીએ સુકાન સંભાળે છે. ધ્રૂવ-  
તારો જેનારા ધ્રૂવતારો જુએ છે. નિશાનીએ  
પાણીનાં ઊંડાણુ માપે છે. કરાણીએ માલ સાચવે  
છે. માંજરીએ પવન જુએ છે. પહેરાયતો પહેરા  
ભરે છે. ખારવાએ સઠ ને દોર સંભાળે છે.  
હલકારાએ હલેસાં મારે છે. વહાણ ભર દરિયે  
ચાલ્યાં જય છે.

એવામાં એક માંજરી બોલ્યોઃ ‘ શેઠળ !  
 પવન મધુરો મધુરો વાય છે. આ બધબરહોટ  
 બંદર દેખાય છે ત્યાં વહાણુને ધડીક નાંગરો. એટલે  
 જેને મીઠું પાણી ને બળતથું લેવા હોય તે લધ  
 સે.’ ધવળ શેઠ કહે, ‘ વહાણ બધબર હોટ બંદરે  
 નાંગરો.’ વહાણ બધબર હોટ બંદરે નાંગરી.  
 ત્યાં રાજના સિપાઈઓએ દાણ માર્ગું. ધવળશેઠ  
 કહે, ‘ દાણ શેનું ? અમારે અહીં જ્યાં વેપાર  
 કરવો છે ?’ પણ સિપાઈઓ માન્યા નહિ. ધવળશેઠ  
 પણ માન્યા નહિ. એટલે રાજને લરકર મોકદ્યું.  
 લરકરે આવીને ધવળશેઠને પકડ્યા ને આડે  
 ઉંઘા માયે લરકાવ્યા. શ્રીપાળ કહે, ‘ કુંકું કામ  
 થયું. વાણિયે દાણ આપ્યું નહિ ને હવે ગરદન  
 મરાશો. વહાણ બધા જસ્ત થશે.’ એટલે તેમણે  
 લરકરને આની પડકાર હીધીઃ ‘ બધરદાર ! ધવળ  
 શેઠનો વાળ પણ વાંડા કર્યો તો ! તમે હજુ શ્રીપાળના  
 હાથની સુખી ચાખી નથી !’ એમ કહી લરકરની  
 સામે દોટ હીધી.

ત્યાં ભારે જંગ મર્યો. પણ શ્રીપાળને ધા પડે  
 નહિ. લરકરના માણુસો ટપોટપ હેઠા પડે. થાડી  
 વારમાં તો બધું લરકર છિન બિન થદ ગયું ને

શ્રીપાળે ધવળશેઠને ખચાવી લીધા. ધવળશેઠે પોતાનો જીવ ખચાવવા ખાતર અર્ધી વહાણું શ્રીપાળને આપ્યા.

બઘભરકોટના રાજને આ પરાકમી પુરુષની અખર પડી એટલે તેમનું સામૈયું કર્યું. ભારે આગતાસ્વાગતા કરી અને પોતાની કુંવરી પરણ્યાવી.

હવે ધળવશેઠ શોલ્યાઃ ‘શ્રીપાળજ ! રતનદ્વીપ હજ ધણે ફૂર છે, રોકાંતું પાલવે તેમ નથી. માટે અટ વિદ્યાય લ્યો.’ શ્રીપાળે પોતાની સ્ત્રી સાથે વિદ્યાય લીધી અને ધવળ શેઠે વહાણું હુંકારી મૂક્યા. ડેટલાક વખતે તે રતનદ્વીપ બંદરે જઈ પહોંચ્યાં.

અહીં ધવળશેઠ પોતાના તથા શ્રીપાળના કરિયાણાં લેચવા લાગ્યા. શ્રીપાળ આજુખાજુનો મુલક જેવા લાગ્યા. ત્યાં પાસેજ એક પછાડ હતો. તે પછાડપર મંદિરનાં કમાડ બંધ થઈ ગયેદાં તે ડાઇથી ઉધડે નહિ. ત્યાંના રાજુઓ નક્કી કર્યું હતું કે જેનાથી એ કમાડ ઉધડે તેને પોતાની કુંવરી પરણ્યાવરી. અદ્ભુત પરાકમી શ્રીપાળે તે કમાડ ઉધાડ્યા ને સાંના રાજુઓ કુંવરી પરણ્યાવી.

ધવળશેઠ પોતાના તથા શ્રીપાળના બંધાં  
કરિયાણું વેચી નવાં કરિયાણું ભરી લીધાં. પછી  
વહાણું પાછા હંકાર્યા.

શ્રીપાળ પોતાની બંને સ્ત્રીઓ સાથે ફૂવા-  
થંબના ગોખે બેસે છે ને આનંદ કરે છે.

અહીં ધવળશેઠ વિચારવા લાગ્યાઃ ‘આ  
શ્રીપાળ હાથે પગે આંદો હતો તેને આજ આટલી  
બધી રિદ્ધિસિદ્ધિ થધ. એ એ તો ઇપાળી ઓ  
પરણ્યો. અહા ! શું તેનું ઇપ છે ને ! જો  
શ્રીપાળને હું દરિયામાં ફેંકી દાંડં તો સ્ત્રીઓ  
પણ મારી થાય ને ધન પણ મારી થાય. અહીં બીજું  
ડોણું એનું છે ? પણ કામ બહુ ઘૂંઘીથી લેવું. આવો  
વિચાર કરી ધવળશેઠ શ્રીપાળની સાથે ઘૂંઘ હેતથી  
વાતો કરવા માંડી. પછી એક વખત વહાણુની  
ડારે માંચડો ખાંદ્યો. તેના પર ચડીને ધવળશેઠ ઘૂંઘ  
મારીઃ ‘શ્રીપાળજી ! આવો આવો ! જેવું હોય  
તો એક કૈતુક છે.’ શ્રીપાળકુંવરને મનમાં  
દ્વાની ગંધ પણ નહિં. તેઓ માંચડાપર આવ્યા..

ધવળશેડે તરતજ તેમને ધક્કો માર્ગે ને શ્રીપાળ દરિયામાં  
જઈ પડ્યા.

દરિયામાં કાળું અગ્રમર પાણી. મહાન  
નેવડાં તો માંહિ ચોલાં ઉછવે. ભગર ને બીજ  
ભથંકર પ્રાણીઓ બહાર ડેકિયાં કરે. શ્રીપાળજીએ  
પડતાં પડતાં નવપદળનું ધ્યાન ધરી લીધું ને દરિયામાં  
તરવા માંડ્યું.

જળતરણી વિધાના પ્રતાપે તે તરતાં તરતાં  
કાંકણું દેશના કિનારે જઈ પડેંચ્યા. થાકીને તે  
લોથપોથ થદ ગયા છે. એટલે પાસેના જગતમાં  
એક ચંપાના ઝાડ નીચે જઈને સુતા.

: ૬ :

કાંકણું દેશના રાજની કુંવરી જુવાન  
થઈ છે. સારા વરની ખૂબ શોષ કરે છે પણ  
જ્યાંઈ સારો વર મળતો નથી. એટલે બેશીને  
બ્યાલાવીને જેશ જેવડાંયા. બેશી પણ ખરાખર  
જેશ જેનાર. તેમણે કણ્ણું કે અમુક વાર ને  
અમુક તિથિએ અમુક વખતે દરિયા કિનારે

જબે. ત્યાં એક પ્રતાપી પુરુષ મળશે. તેને  
કન્યા પરણુવનો.

આજે ખરાખર તેજ તિથિ ને તેજ વાર છે.  
એટલે રાજના સિપાઠચો દરિયા કિનારે આવી  
પહોંચ્યા. જ્યાં જુઓ છે ત્યાં ચંપાના ગાડ નીચે  
એક મહા પ્રતાપી પુરુષ સુંતો હતો.

શ્રીપાળ કુંવર જગે થાં આજુખાનુ  
સિપાઠચોનું ટેણું. સિપાઠચોએ સલામ ભરીને  
કહ્યું: ‘પધારો રાજમહેલે. તમને રાજનાં  
આમંત્રણ છે.’ શ્રીપાળ રાજમહેલે ગયા. રાજ તેમને  
ઝર્ઝ પ્રસન્ન થયો. અને પોતાની કુંવરી પરણુવી.  
પછી તેમને એક હાદો સેંપ્યો : સભામાં જે ડોઢ  
નવીન માણુસ આવે તેમને પાનતું બીડું આપવું.

: ૭ :

શ્રીપાળ દરિયામાં પડતાં ધવળશેઠે નીચ  
પ્રયત્ન કરવા માંડ્યા. સતીઓનું સત્ર લુંટવા  
તેણે પ્રયત્નો કર્યી પણ તેમાં ફાંયો નહિ.

શ્રીપાળની એ સ્ત્રીઓ લુનેશ્વરનું નામ લે છે ને  
પોતાનો વખત પસાર કરે છે.

એમ કરતાં ધવળશેઠનાં વહાણુ ટોંકણુ દેશના  
કિનારે આવ્યા. તે મોટી લેટ લઈ રાખ પાસે ગયો.  
ત્યાં શ્રીપાળે પાનતું બીજું આપ્યું.

ધવળશેઠ આ જેઠ આશ્ર્ય પામ્યો. ભનમાં  
વિચારવા લાગ્યો: ‘મારો જ્ઞાનો આ અહો ક્યાંથી ?  
દરિયામાં નાખી દીધી તોય જીવતો નીકળ્યો ! ઠીક.  
બીજુ કાંઈ યુક્તિ કરવા હો.’

શ્રીપાળ તો હલકા કુળનો છે એમ ખતાવવા  
પ્રપંચ કર્યો. પણ આખરે પાપનો ધડો કુટી  
ગયો. રાખાયે જાણ્યું કે ધવળશેઠ મહાપાપી છે  
એટલે તેને ગરદન મારવા વિચાર કર્યો. પણ  
શ્રીપાળને ભનમાં થયું કે ગમે તેવા હોય તોય ધવળ  
શેઠ મને આશરો દેનાર છે. તેમને એવી શિક્ષા ન  
ધરો. તેમણે ધવળશેઠને છાડાવ્યા ને પોતાના  
મહેમાન ખનાવ્યા.

શ્રીપાળે ધવળશેઠ પર ધણી મહેરખાની  
કરી પણ ધવળશેઠના ભનમાંથી ઓર જય નહિ.  
તેમણે એક પાળેલી ચંદનધો જેળવી.

રાત પડી એટલે તેના પુંછદે દોરી બાંધી  
તે ધોને ઉપર ફેંકી. ધો જણે લોઢાનો ખીલો  
હોય તેમ ચોંઠી ગઈ. પછી ધવળશેઠે દોરીના  
આંધારે ચડવા માંડયું. જ્યાં અરધે પહોંચ્યા  
ત્યાં હૃથમાંથી દોરી સરકી ને ધવળશેઠ ભાડાંગ લેતાં  
પત્થર પર પટકાયા. બિચારાના ત્યાંજ રામ રમી ગયા.  
ધવળશેઠની બધી મિલકત તેમના મિત્રોને સોંઘી.

: ૮ :

રાજની એક કુંવરીએ એવી પ્રતિશા કરી હતી  
કે વીણા વગાડવામાં ભને જુતે તેનેજ પરણું. શ્રીપાળ  
તેને વીણા વગાડવામાં જ્યાં ને તેની સાથે લચ્છ કર્યા.

એક અદ્ભુત ઇપવાળી રાજકુંવરીએ સ્વયંવર  
રચાયો હતો. ત્યાં શ્રીપાળ પહોંચ્યા ને વરમાળા  
તેમના કંઠે પડી.

એક રાજની કુંવરીએ અમુક દૂઢા પૂરા કરી  
આપે તેને પરણવાનું નકી કર્યું હતું.  
તે માટે તેણે એક ખાસ મંડપ તૈયાર કરાયો

હતો. દેશપરદેશથી અનેક માણુસોએ ત્યાં આવી હુંડા પૂરા કરવા પ્રયત્ન કર્યો પણ કુંવરીને એક દુંડો પોતાના મનના ભાવ પ્રમાણે લાગ્યો નહિ શ્રીપાળકુંવર રાજકુંવરીની આવી પ્રતિજ્ઞા સાંકળી લાં ગયા અને સમયા પૂછી. રાજકુંવરીની મુખ્ય સખીએ કહ્યું: ‘મનવાંછિત ઈણ હોય’ એ હુંદાનું ચાથું ચરણ છે. એનાં પહેલાં તણ ચરણ પૂરાં કરી આપો.

શ્રીપાળે તરતજ નીચેનો હુંડો કષ્ટો:

અરિહંતાદિ નવપદો, સમરે જે મન ડાય;  
નિશ્ચય તે નર બ્રેષ્ટને, મનવંછિત ઈણ હોય.

આ રીતે બીજુ પણ ડેટલાક દુંડા પૂરા કરી આયા. એથી તે રાજકુંવરી શ્રીપાળ રાજને વરી.

એક રાજની કુંવરીને જેરી સાધ કરડ્યો હતો. શ્રીપાળે તેનું જેર ઉતાર્યું ને રાજે તેમને એ કુંવરી પરણ્યાવી.

એક જગાએ રાધાદેવ સાધે તેને કુંવરી પરણ્યાવવાની હતી. શ્રીપાળે રાધાદેવ સાધ્યો ને કુંવરીને પરણ્યા.

આ પ્રમાણે પરદેશમાં આડ સ્થીએ પરણીને ખૂબ ધન મેળવી લરકર સહિત ઉજ્જેણીની પાસે તે આવી પહોંચ્યા.

ઉજ્જેણીના રાજે જાણું કે ડાઇ મોટા રાજ ચડી આવ્યો છે એટલે તે શરણે આવ્યો. શ્રીપાળ પોતાની માતા તથા ભૃગુને ભર્યા ને ખૂબ રાજ થયા. આનંદનો ત્યાં મોટા આચ્છવ માંડ્યો.

ત્યાં નાટકીયાએની એક મંડળી નાટક કરવા લાગી. બધા નટો પોતપોતાના પાડ આનંદથી ભરવે છે ખળું એક નટી જલ્દી ન થઈ.

તેની આંખમાંથી ચોધાર આંસુ પડતાં હતાં. તપાસ કરતાં બધી હુકીકત જણાઈ. તે નટી સુરસુંદરી પોતે હતી. તેનો સ્વામી પોતાના શહેર જતાં લુંટાયો હતો અને લુંટારાએ તેને પકડીને વેચી હતી. આખરે તેને આ ધંધી કરવા વખત આવ્યો હતો.

આ રીતે રાજને આપકર્માપણાની ને ખાપકર્માપણાની સાચી પરીક્ષા થઈ ગઈ.

: ૮ :

હવે શ્રીપાળ પોતાનું રાજ્ય લેવા લરકર  
લઈને શુદ્ધ સુફુર્ટે ચાદી નીકળ્યા. ચંપાનગરી  
થાડે છેટ રહી એટલે સંદેશો કહેવડાંયો: ‘અ-  
જીતસેન રાજને ભાલમ થાય હે તમારો પુત્ર  
શ્રીપાળ જને તમે પરદેશ ઢાચિયાર થવા મોકદ્યો  
હતો તે ચાદી ગયો છે. તમે હવે ધરડા થયા  
છો તો રાજ્ય અમને સોંપી ને ધર્મધ્યાન કરો.’

અજીતસેન આ માન્યું નહિ. તેથી શ્રીપાળે  
તરતજ નગારે ધાવ દીધો ને મોટી લહાઠ થઈ. તેમાં  
અજીતસેન હાયો. શ્રીપાળ ચંપાનગરીની રાજગાઢીએ  
યેઠા. કાકાએ પોતાના પર જુલમ ચુઅયો હતો તે  
ભૂલી જઈને પણ તેમને માનભરી પદવી આપી.

મોટા માણુસોનાં દીલ ડેવાં ઉદાર હોય છે?

શ્રીપાળે રાજ્યમાં રૈયતને ખૂબ સુખ આપ્યું. અને  
નવપદળનો મોટા ઢાઠમાઠથી ઓચ્છવ કર્યો.

અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાઈય, સાધુ,  
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ નવ વસ્તુઓ.

મહીને નવપદ કહેવાય છે. આ નવે પદોને  
સુંદર ગોળ આકૃતિમાં ગોઠવીને તેની પૂજ કરવામાં  
આવે છે.

અજ્ઞતસેનને સમય જતાં વૈરાગ્ય થયો એટલે  
તેમણે દીક્ષા લઈને પવિત્ર જીવન ગાજ્યું.

રાજ શ્રીપાળ તથા મયણું વગેરે રાખ્યુંચો પણ  
જાયું જીવન ગાળી સહ્યગતિચે ગયાં.

આજે પણ નવપદજીની ઓળી થાય છે ને  
સહુના ભોડે શ્રીપાળ મહારાજનું નામ બોલાય છે.  
ધન્ય છે પરાક્રમી પુરુષોને ! ધન્ય છે સાચા ભાવે  
નવપદજીને આરાધનારને !

શિવમસ્તु સર્વજગતઃ ।

બાળ અન્યાન્યા : પ્રથમ શ્રેણી : ૧૪

# કુમારપાપ

લેખક :

ધીરજલાલ ટોકરશી શાહ



સર્વ હકુ સ્વાධીન :

આવતિ ચોથો : કુલ નકલ ૪૫૦૦ : સં. ૧૬૮૧

મુખ્ય સવાયાનો.

ઃ પ્રકાશક :

ધીરજલાલ ટેકરશી શાહ  
ચિત્રકાર, ખુક્સેલર એન્ડ પણ્ઠીશર  
હવેલીની પોળ રામપુર : અમદાવાદ

આ પુસ્તક સુંભવ ખલાકા કેળ રહ્યી  
ખાતા તથા વડોદરા રાજ્ય કેળવણી  
ખાતા તરફથી છનામ લાયબ્રેરી માટે  
૦૦૦ મંજુર થયું છે. ૦૦૦

ધી વીરવિજય પ્રીન્ટિંગ પ્રેસમાં  
શા. મણીલાલ જગનલાલે ખાખ્યું.  
કુ : રતનપોળ સાગરની ખડકી  
અમદાવાદ

## કુમારપાળ

: ૧ :

દેડો રઠિયાળો ગુજરાત દેશ. તેના ૫૨  
મહાપ્રતાપી સિંહરાજ જ્યસિંહ રાજ્ય કરે. તેમને  
અધી વાતે સુખ પણ એક વાતે હુઃખ. પેટ  
પુત્ર નહિ. તે ચિંતા કરવા લાગ્યા કે આવું  
ક્ષાલયું કુલયું ગુજરાતનું રાજ્ય ઢાના હાથમાં જરો ?  
તેમણે જેશીઓને બાલાંયા ને જેશ જેવડાંયા.  
જેશી કહે, ‘મહારાજ ! આપની ગાડી કુમાર-  
પાળને જરો.’

આ સાંભળી સિંહરાજ ઐહે પામ્યા. મનમાં  
વિચાર કર્યો: ‘કુમારપાળ હલકા કુળમાં જન્મેલો છે.

માટે ડોધ પણ ઉપાયે તેને ગાઢીએ ન આવવા હેવો.  
એ તે જીવતો હુશે તોજ ગાઢીએ આવશે ને? માટે  
ચાલ એને મારી નાંખાવું.' તે કુમારપાળને મારી નાંખ-  
વાનો લાગ શેઅવા લાગ્યા.

: ૨ :

કુમારપાળ દેથળીના ધર્મી નિભુવનપાળના પુત્ર.  
તેમની ઝીંઠું નામ ભોપાળદે. તેમને મહિપાળ ને  
ને કૃતીપાળ નામે એ ભાઇ હતા. પ્રેમળદેવી ને દેવળ-  
દેવી નામે એ બહેનો હતી. પ્રેમળદેવીને સિદ્ધરાજના  
સામંત કૃષ્ણદેવ સાથે પરણાવી હતી. દેવળદેવીને  
સાંભરના રાજ અણેરાજ સાથે પરણાવી હતી.

કુમારપાળને ઘખર પડી છે મહારાજ સિદ્ધરાજની  
મારા પર કરડી નજર છે. મને મારી નાંખવાનો લાગ  
શેધી છે. એટલે તે પરદેશ જવાનો વિચાર કરવા લાગ્યા.  
એવામાં સિદ્ધરાજ તેમના પિતાનું ખૂન કરાયું.

આ ખૂનની ઘખર પડતાં કુમારપાળ સમજ્યા  
કે હવે મારો વારો આંદ્યો એટલે રતોરાત પોતાનું  
કુદુંખ છાડીને ચાલી નીકળ્યા.

કુમારપાળ ખાવાના વેરો એક જગાએથી ભીજુ  
જગાએ રખ્ડે છે. કોઈ દ્વિવસ ખાવાનું મળે છે તો  
કોઈ દ્વિવસના ઉપવાસ પડે છે. એમ કરતાં કરતાં  
એજ વેરો એક વખત પાઠણ આવ્યા. ત્યાં મહાદેવના  
મંહિરમાં પૂજારી થયા.

‘ બાપુ વધાઈ ! ’ એક દ્વિવસ સવારમાં સિદ્ધ-  
રાજને તેમના જસુસે આવી સમાચાર આપ્યા.

‘ શું છે ? ’ મહારાજ સિદ્ધરાજે ગંભીરતાથી  
પૂછદું.

‘ કુમારપાળ જેવો જ એક માણુસ આજે મહા-  
દેવલના મંહિરમાં મેં નેયો. મને લાગે છે કે એ પોતેજ  
કુમારપાળ છે ! ’

મહારાજ સિદ્ધરાજ આ સાંભળી થાડીવાર વિચા-  
સમાં પડ્યા. પછી બોલ્યા : ‘ મારા પિતાજીનું પરમ  
દ્વિવસે આદ્ધ છે. માટે મંહિરનાં ખંદા પૂજારીએને જરાણ  
આપો. તેમને હું મારા હુથે જ દક્ષિણા આપીશ. ’

મહારાજ સિદ્ધરાજની આજી મુજબ મોઢું જમણુ  
ગોઠવાયું ને તે માટે જાત જાતનાં લોજનો તૈયાર થયાં.

વખત થયો એટલે પંગતો પડી ને બધા પૂજરીઓ  
પિતાંખર પહેરી જમવા એઠા. કુમારપાળ પણ એમાં  
સામેતું હતા.

એજ વખતે મહારાજ સિદ્ધરાજ લશકર લઈને  
આવી પહેંચ્યા.

કુમારપાળ મનમાં સમજુ ગયા કે નક્કી આજે  
મોત આવ્યું એટલે જમતાં જમતાં ડલટીનું બહાનું  
કાઢી મંદિરના પાછલા બારણે ગયા ને ત્યાંથી જીવ  
લઈને નાઠા. માથું ઉધાડું, પગ ઉધાડા, શરીર ઉધાડું  
ને ખરા બ્યોર પણ શું કરે ? જે નાસતાં વાર થાય  
તો સિદ્ધરાજના સિપાઈઓ પકડી પાડે ને ભૂંડા મોતે જ  
મરવું પડે.

મહારાજ સિદ્ધરાજની એઠક મંદિરના મુખ્ય  
દરવાજ પર ગોઠવાઈ હતી. તેમની આગળ  
સાનામહેરોથી ભરેલું એક વાસણ હતું. આસપાસ  
અધિકારીઓ ગોઠવાઈ ગયા હતા.

બધા પૂજરીઓને કહી દેવામાં આવ્યું કે જમી  
રથા બાદ મહારાજ પાસેથી દક્ષિણા લઇ જવી. જમી

રદ્ધા બાદ બધા પૂજરીઓ એક પછી એક ત્યાં આવવા લાગ્યા ને દક્ષિણા લઈ જવા લાગ્યા, પણ તેમાં કુમારપાળ કયાંએ જણાયા નહિ.

મહારાજ સિદ્ધરાજ અધિકારીઓને ઈસારો કર્યો : ‘ટોઈ હવે બાકી રહે છે ?’ અધિકારીઓ બધા રથળે ફરી વજ્યા પણ ટોઈ બાકી રહેલું જણાયું નહિ. એવામાં ટોઈએ કહ્યું કે અમુક પૂજરીને જમતાં જમતાં જલઠી થઈ હતી એટલે તે ઘહાર ગયેલ છે પણ હજુ સુધી પાછો આવ્યો નથી. એથી સિદ્ધરાજને વહેમ પડ્યો કે નક્કી કુમારપાળ છટકી ગયો. તેણે તરતજ ચારે બાજુ ઘોડેસવારો દોડાવ્યા.

કુમારપાળ નાસતાં નાસતાં બેએક ગાઉ દૂર નીકળી ગયા. પણ પાછળ ઘોડાની પડધીઓ સંભાળી. તેમણે વિચાર્યું : ‘હવે દોડયે પાર નહિ આવે. કયાંથી સંતાવા દે.’ ત્યાં નજર નાંખી તેં લીમસિંહ નામે એક બેદૂત કાંટાની વાડ કરતો હતો. કુમારપાળ તેની પાસે ગયા ને પોતાનો જીવ બચાવવા વિનંતિ કરી. બેદૂતને દ્યા આવી એટલે કાંટાના ભારાની નીચે કુમારપાળને સંતાડી દીધા.

થાડીવારમાં પગલું શોધતાં રાજ્વના સિપાઈઓ  
ત્યાં આવી પહેંચ્યા. તેમણે ભાલો મારી કાંટાનો ભારો  
તપાસી જેયો. પણ કાંઈ પતો લાગ્યો નહિ. એટલે  
શોધ કરવાનું છોડી દઈધેર ચાલ્યા ગયા.

રાતના વખતે લીમસિંહે કુમારપાળને બહાર  
કાઢ્યા. તેમનું શરીર કાંટા વાગવાથી લોહી-  
લુહીથું થઇ ગયું હતું. પીડાનો પાર નહોતો. પણ  
અહીં થોખવાનો વખત નહોતો એટલે ચોટા  
પરોઠિયે તેમણે નાસવા માંડયું. ભૂષ્યા પેટ ને  
કુઃખતા શરીરે નાસતાં તે ખૂબ થાકી ગયા. મર્દ્યાનહી  
સમયે તે એક ગ્રાડ નીચે આરામ લેવા બેઠા. ત્યાં એક  
કુતુહલ જોવામાં આવ્યું. એક ઉંદર દરમાંથી એક પણી  
એક એમ એકવીશ રૂપિયા બહાર લાગ્યો. પછી  
તેમાંથી અંદર લઈ જવા લાગ્યો. તે એક રૂપિયો  
પાછા લઈ ગયો કે કુમારપાળે ખાકીના વીશ રૂપિયા  
લઈ લીધા. ઉંદરે બહાર આવીને જેયું તો રૂપિયા  
નહિ એટલે તે માથું પરકીનેમરણ પામ્યો ! કુમાર-  
પાળ આ જેઈ દીલગીર થયા અને વિચારવા લાગ્યા:

‘અહો ! આ ગ્રાણીને પણું ધનપર ફેટલો બધો ચોઢું છે  
ને ?’ આ ધન લઈને તે આગળ ચાલ્યા.

આજે નીચે દિવસ હતો પણ હજુ કાંઈ ખાવાનું  
મખ્યું નહોંઠું. પગ લથડિયા ખાતા, આંખે  
અંધારાં આવતાં હતાં, શરીર આખું તૂકું તૂકું થઈ  
રહ્યું હતું. કુમારપાળ રસ્તા પરના એક ગાડ નીચે  
આરામ લેવા એઠા ડે નીચે પડી ગયા ને બેભાન  
જવા થઈ ગયા. તે હવે થાડીને લોથ પોથ થઈ ગયા  
હતા. એવામાં રૂમાનું કરતો એક રથ ત્યાંથી પસાર  
થયો.

શ્રીદેવી નામની એક દ્વારા બાઈ તેમાં બેઢી  
હતી. સાસરેથી પિયેર જવા દે નીકળી હતી. તેણે  
બેધું ડે ડાઈ મુસાઈર ભૂલથી નીચે પડી ગયો. છે  
એટલે તેને તેણે ખાવાનું આપ્યું. કુમારપાળને આથી  
કાંઈક શાંતિ વળી. તે બોલ્યાઃ ‘બહેન ! તમારો  
ઉપકાર હું કહી નહિ ખુલ્યું.’

અહીંથી કુમારપાળ પોતાના ખ્રામ દેખ્યાં ગયા.  
પણ સિદ્ધસજને ખખર પડતાં તરત જ ત્યાં લરફર

ચોકદ્યું. કુમારપાળને લરહરની ખખર પડી. તેથી છુપાવાની જગ્ગા શોધવા લાગ્યા. તે વખતે સજજન નામના કુંભારે તેમને પોતાના નિંબાડામાં સંતાડી દીધા. રાજનું લરહર આખું ગામ હુંઠી વખ્યું પણું કુમારપાળનો પત્તો ન મળ્યો. એથી તે નિરાશ થઈને પાછું ગયું.

: ૪ :

અહીંથી પોતાના કુદુંખને માળવા તરફ ચોકલી કુમારપાળ પરદેશમાં નીકળી પડ્યા. ત્યાં વોસિરી નામના એક આલણ સાથે દોસ્તી થઈ. વોસિરીને લાખ્યું હે આ ડોઈ પ્રતાપી પુરુષ છે એથી ગામમાંથી બિક્ષા માગી લાવીને કુમારપાળને ખવડાવે. પણ આ હાલત વધારે વખત રહી નહિ. વોસિરી છુટો પડી ગયો ને કુમારપાળ ખૂબ હુઃખી થવા લાગ્યા. તે રખડતાં રખડતાં ચિંથરેહાલ બની ભૂખથી પીડાતા ને હુઃખી રીખાતા ખંભાત આવ્યા.

અહીં હેમચંદ્રાચાર્ય નામે એક જૈન આચાર્ય હતા. તેમનું શાન અગાધ હતું. ચારિત્ર ખૂબ-

નિર્મણ હતું. તેમણે કુમારપાળના લક્ષણપરથી પારપ્યું  
કે ભવિષ્યમાં આ ગુજરાતનો રાખ થશે. એટલે ત્યાંના  
મંત્રી ઉદ્ઘાયનને ઘેર આશ્રય અપાઠ્યો.

આ વાતની પણ સિદ્ધરાજને જણું થઈ ગઇ,  
એથી કુમારપાળને પછી લાવવા લશ્કર મોકલ્યું.

લશ્કરે આવીને ઉદ્ઘાયનના મકાનની જડતી  
લેવા માંડી એટલે કુમારપાળ ત્યાંથી છટકી ઉપાશ-  
યમાં ગયા અને એક પુસ્તકના લાંડારમાં સંતાયા.  
લશ્કરી સિપાઈઓ ત્યાં પણ આવી પહોંચ્યા. પરંતુ  
કાંઈ પત્તો લાગ્યો નહિ એટલે પાછા ગયા.

અહીં શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળને કણ્ણું કે  
હવે હુઃખના દફ્ફાડા લાંઝો લખત નથી. થોડા  
વખતમાં તમને ગુજરાતનું રાજ્ય મળશે. કુમારપાળ  
પોતાની હાલત એછ બોલ્યા કે ગુરુ મહારાજ ! આ  
તે શી રીને મનાય ? ત્યારે આચાર્ય મહારાજે  
ખાત્રીપૂર્વક કણ્ણું. આ સાંભળી કુમારપાળ બોલ્યાઃ  
'જે આપનું વચન સાચું પડશે તો હું જૈનધર્મ'

પાણીશ.' પછી ઉદ્ઘાયન મંત્રો પાસેથી શેડી વાટખરીં લઇને દક્ષિણમાં ચાલ્યા.

આમ ધણું ધણું રખડોને પોતાના કુહુંખને ભળવા તેઓ આળવામાં ગયા. ત્યાં ઘખર પડી હે સિદ્ધરાજ ખૂબ માંદા છે. એટલે કુહુંખ સાથે ગુજરાતમાં આવ્યા.

: ૫ :

સિદ્ધરાજ આખર પથારીએ છે. તેમણે ઉદ્ઘાયન મંત્રીના પુત્ર ચાહડને દાટક લીધેએ છે. રાજ્ય કુમારપાળને ન ભળતાં ચાહડને મળે તેવો બંદોબસ્ત કરે છે. પણ બંદોબસ્ત પૂરો થતાં પહેલાં તે મરણ પામ્યા. આ સમાચાર સાંભળતાંજ કુમારપાળ પાટણ આવ્યા. રાજસભા કુમારપાળની લાયકાત સમજતી હતી. વળી તેમના ખનેવી કૃષ્ણાદેવે ખૂબ સહાય કરી એટલે ગાઢી તેમને મળી. આ વખતે તેમની ઉમ્મર પચાશ વર્ષની હતી.

કુમારપણને ગાઢી મળતાં તેમણે પોતાનાં બધાં ડિપકારી જનોને યાદ કર્યો. ભોપાળટેને પટરાણી ઘનાવી. લીમસિંહને પોતાનો અંગરક્ષક ઘનાયો. શ્રીદેવીના હાથે રાજ્યતિલક કરાયું ને ધોળકા ગામ ઈનામમાં આપ્યું. સજજનને સાતસો ગામનો સુષ્પો કર્યો. વેસિરીને લાટ દેશનો હોકેમ નિમ્નો. ઉદ્ઘાયન મંત્રીને પ્રધાન ઘનાય્યા. તેમના દીકરા વાગ્ખણને નાથથ દિવાન કર્યું. શ્રી હેમચંદ્રાચાર્યને ગુરુસ્થાને સ્થાપ્યા ને કહુક વાખ્યાને વડોદરા ગામ ઈનામમાં આપ્યું.

: ૬ :

કુમારપણ ગાઢીએ આવતાં ધણા રાજ્યો એમ માનવા લાગ્યા કે તે નિર્ભળ છે. એટલે ડાઇએ બંડણી ભરવાની ના કહી. ડાઇએ બંડ કરવા માંડયા. પણ કુમારપણ ખૂબ બહાદુર હતા; તેમણે પોતાના મજબૂત લશકરથી અજમેરના અંધેરાજને વશ કર્યો, માણવાના અલ્લાલને વશ કર્યો, ડાંકણુના મહિલકા-જીનને વશ કર્યો, સોરઠના સમરસિંહને વશ કર્યો.

બીજ પણ નાના મોટા ધણા રાજયોને જીત્યા ને  
અઠાર દેશમાં પોતાની આણુ ફેલાવી. કુમારપાળના  
રાજ્યની સરહદ ઉત્તરમાં પંથ સુધી ને દક્ષિણમાં  
વિધ્યાયળ સુધી હતી. પૂર્વમાં ગંગ સુધી ને પચ્છિમમાં  
સિંધુ સુધી હતી. એમના જટલો રાજ્યવિસ્તાર  
ગુજરાતમાં ડાઢ રાજ્યે કર્યો નથી.

તેઓ પોતાના ગુરુ શ્રી હેમયંડ્રાચાર્યની ખૂબ  
ભક્તિ કરતા ને દરેક કામમાં તેમની સલાહ લેતા.  
ગુરુરાજ પણ એવા હતા કે રાજને બરાબર સલાહ  
આપતા ને તેનું કલ્યાણ થાય તેમ કરતા.

કુમારપાળે આ ગુરુરાજના કહેવાથી જ વાંચીયાતું  
બન લેતું બંધ કર્યું. તેની સરેરાશ ઉપર જર લાખ  
હતી. પોતાની આણુમાં આવેલા અઠારે દેશમાં  
જવહિંસા નહિ કરવાનો હુકમ કાઠયો. સોમનાથ  
મહાદેવના મંહિરને સમરાયું. અને બીજ નાના  
મોટાં અનેક દહેરાસરો તથા પ્રજને ઉપરોગી કામ  
કર્યો.

તારંગા, ઈડર, વંધુકા વગેરેનાં છેરાં એમના  
બંધાવેલાં છે.

કુમારપાળનાં રાજ્યમાં નહાતો કુકાળ, નહાતો  
ચારચખારનો ભય. બધા સુખી ને આનંદી હતા.  
અદારે આલમ સંપીને રહેતી હતી. પશુપંખી પણ  
શિકાર બંધ થવાથી નિર્ભયપણે દરતા હતા.

કુમારપાળ દિવસે દિવસે પોતાનું જીવન પવિત્ર  
કરવા લાગ્યા ને છેવટે તેમણે પોતાના મન, વચન  
અને કાયાને ધણાં પવિત્ર બનાવ્યાં. આથી તેઓ  
મહિં કહેવાયા.

તેમણે કરેલા કામની કુંઠી ગણુની આ રહીઃ  
૧૪૦૦ જિનમંદિર બંધાવ્યા. ૧૬૦૦ જીણું  
મંદિરેનો ઉદ્ઘાર કરાવ્યો. સાત વખત તીર્થયાત્રા  
કરી. તેમાં પહેલી યાત્રામાં નવલખી પૂજા કરી.  
વાંતીયાનું ધન લેવું માત્ર કર્યું. પ્રતિવર્ષે એક કોડ  
ઇપિયા શુલ્ષ ભાર્ગમાં જર્યો. ૨૧ જ્ઞાનસંડાર  
કરાવ્યાં ને હાજરે પુસ્તક લખાવ્યાં. ૭૨ સામંત

પર પોતાતી આશા ચલાવી ને અઢાર દેશમાં  
અહિંસા પળાવી.

નીસ વર્ષ સુધી આ રાજપિંડે રાજ્ય કર્યું.  
તે દરમ્યાન તેમણે બધી જગાએ સુખશાંતિ ફેલાવી.  
પ્રભની ખૂબ આખાઈ કરી. પછી થોડા વખતે  
ગુરુરાજનો દેહ પડ્યો એટલે બહુ શોક થયો.  
આ શોકની તેમના શરીર પર બહુ અસર થઈ.  
હવે તેમની ઉભ્રમર પણ ૮૧ વર્ષની થઇ હતી.  
એટલે તે ભરણું પામ્યા.

કુમારપાળ જેવા રાજ ને હેમચંદ્રાચાર્ય જેવા  
ગુરુ આ કાળમાં ફોર્ઝથયા નથી. એમનાં જેટલાં  
વખાણ કરીએ તેટલાં ઓછાં છે.

કુમારપાળ જેવા અનેક રાજેએ થાવ ને  
જેન ધર્મનો વિજય પાવટા પ્રરકાવો.

**શિવમસ્તુ સર્વજગતઃ ।**

# પેથડકુમાર

નિમાડ દેશમાં નાંડુરી ગામ. ત્યાં પેથડ  
નામે એક આવક રહે. તેના પિતા દેઢાશાહ  
ધણુ પૈસાદાર. પણ તે ભરણુ પાખ્યા ને ધન  
આદ્યું ગયું. એટલે પેથડ ખૂબ ખરાબ હાલતમાં  
આવી પડ્યો. બિચારાને ન મળે પૂર્ણ ખાવા  
કે ન મળે પૂર્ણ ઓછવાપહેરવા. જેમતેમ  
કરીને પેટગૂજરા કરે. તેને પદ્ધિની નામે એક  
સ્ત્રી હતી, અંઝણુ નામે એક પુત્ર હતો. નણે  
માણુસ ખૂબ જલા ને ધર્મના અનુરાગી.

એક વખત ગામમાં ડાઇ વિદ્ધાન મુનિ-  
મહારાજ પધાર્યા એટલે બધા તેમનો ઉપદેશ  
સાંભળવા ગયા. પેથડ પણ ગયો. ત્યાં મુનિ  
મહારાજ અમૃત શી મીઠી વાણીથી પવિત્ર  
જીવન સમજાયું : અભયર્થનું પાલન કરો,  
સંતોષને ધારણું કરો, તપથી શરીર ને મનનો  
સંયમ ઢેળવો, પ્રભુભક્તિથી દૃદ્ધને પવિત્ર  
ઘનાવો. આ ઉપદેશની ધણાને અસર થઈ.  
કેદીએ અભયર્થનાં પત લીધાં, ડાઈએ અમુક જ  
માલમિલકત રાખી ખાડીની મિલકત સારા કામે ઘર્યો  
નાંખવાનાં પત લીધાં, ડાઈએ અમુક તપ  
કરવાનાં પત લીધાં ત્યારે પેથડ બિચારો પોતાના  
હુણી જીવનનો વિચાર કરતો એસી રહ્યો.

ચિંથરેહાલ પેથડને જેછ કટલાક મશક-  
રાએ મોહ્યાઃ ‘ગુરુ મહારાજ ! બધાને આપે  
કંઈ કંઈ પત ઉચ્ચરાયા પણ આ પેથડ તો  
રહી ગયો ! એને પરિમહ ( માલ મિલકત ) નું  
માપ ફરાવો ! એ પણ લાખ વરસે લખેસરી  
થાય તેમ છે !’

આ સાંભળી સાધુ બોલ્યા: ‘મહાતુ-  
ભાવો ! આવું બોલવું ઢીક નથી: ધનનો મહ  
કદી હોધાયે કરવોજ નહિ. ધન તો આજ છે  
ને કાલે નથી. હોણું જણ્યે છે કે કાલ સુવારે  
એ પેથડ તમારા સહુના કરતાં વધારે પૈસાદાર  
નહિ થાય !’

પછી સાધુએ પેથડને કહ્યું: ‘મહાતુ-  
ભાવ ! તમે પરિઅહનું ભાપ કરો.’ પેથડ  
કહે, ‘ગુરુહેવ ! મારી પાસે માલ મિલકત  
છેજ કયાં કે ભાપ કરવાનું હોય ?’ સાધુ કહે,  
‘આજ એવી હાલત છે ને કાલ સુખરી જય.  
માટે તમે પરિઅહનું ભાપ તો કરીજ દો.  
પેથડ કહે, ‘તો જેવી આપની આજા.’  
સાધુ મુનિરાજે પેથડને મત આપ્યું: ‘પાંચ લાખ  
ઇપિયા સુધીની મિલકત રાખી બાકીની ધર્મના  
કામમાં ઘર્યી નાંખવી.’

પેથડને લાગ્યું કે આ છુટ તો ધણી  
વધારે છે. જ્યાં પાંચ હજાર મળવાના સાંસા છે ત્યાં

પાંચ લાખની છુટ તે રખાય ? પણ ગુરજીએ  
એ છુટ આપી છે તે બહુ વિચાર કરીને આપી હશે।  
અમ જાણી પેથડ ધેર ગયો.

પેથડની હાલત દીવસે દીવસે બગડવા  
લાગી. એ ટંક ખાવાનું પણ મુર્ખેલીથી ભળવા  
લાગ્યું. એટલે તે પોતાનું ગામ છાડી કુદુંખ  
સાથે બહાર ગામ ચાલી નીકળ્યો.

એ વખતે ભાગવામાં માંડવગઢ નામે  
જખરજસ્ત શહેર હતું. ત્યાં હારો શ્રીમંત રહેતા  
હતા. લાખો ને કોડોનો વેપાર કરતા હતા.  
પેથડે ધાર્યું કે માંડવગઢ જવા દે. ત્યાં પેટગુઅરો  
સહેલાઈથી યદુ શકશે. એટલે તે માંડવગઢ  
આંદોલનો.

અહીં બાપ દીકરાએ ધીની દુકાન કરી.  
ગામડાની જરવાઠણો ધી વેચવા આવે તેમની  
પાસેથી ધી ખરીદે ને દુકાને તે વેચે. બાપ  
દીકરો ખંને વચ્ચનના સાચા, દાનતના ચોકખા.  
તેમની દુકાને નાનું આવ્યું તોયે એક લાવ ને

મોહું આવ્યું તોચે એક ભાવ. વળી માલમાં સેળબેળ નહિ. જેવો માલ ખતાવે તેવોજ માલ આપે. આથી થાડા વખતમાં તેમની છાપ ખડું સારી પડી.

એક વખત એક ભરવાડણું ધીનો ગાડવો લઈને પેથડની દુકાને આવી. તેણે પેથડને કહ્યું: ‘શોઠ ! રાખવું છે ધી ?’ પેથડે ધી જોગ્યું અહા ! શું સરસ ધી ? દાણાદાર ને ખૂબ સુગંધી. પેથડે કહ્યું: ‘હા બાઈ ! લાવો ધી.’ ભરવાડણું ધીનો ગાડવો ઉતાર્યો ને પેથડ તેમાંથી ધી જોખવા લાગ્યો. પેથડ ગાડવામાંથી ધી કાઢે પણ ધી ખૂટેજ નહિ. આ જેઈ તે વિચારમાં પડ્યોઃ ‘જરૂર આ ગાડવામાં કાંઈક કરામત છે.’ એટલે ગાડવો જાચ્યા કરીને જેયો તો નીચે એક વેલની ઈંઢાણી. તે પારખી ગયો કે નકી આ ચિત્રવેલી છે. તે સિવાય ગાડવામાં થી ફરી પરીને ભરાય નહિ. આથી તેણે ભરવાડણું પાસેથી ઈંઢાણી સહિત ગાડવો ખરીદી

લીધી. ભરવાડણું આવી ગઈ. પેથડ તથા આંગણું  
ખૂબ રાજુ થયા.

: ૨ :

ગરીબ પેથડનું નશીબ શાડા વખતમાંજ  
પલટાઈ ગયું. તેને પુષ્કળ ધન મળવા લાગ્યું.  
હવે આ આપદીકરો સહુને હેશિયાર લાગવા  
માંડ્યા. તેમના ખૂબ વખાણું થવા લાગ્યા. ત્યાંના  
રાજ જયસિહે આ વખાણું સાંભળ્યા એટલે  
તેમને બોલાયા ને તેમની ચતુરાઈની પરીક્ષા  
કરી. રાજને ખાતરી થઈ કે બંને મહા ચતુર છે  
એટલે પેથડને પ્રધાન ને આંગણુને નગરનો ડાટવાલ  
બનાયો. જુના પ્રધાનને પેથડની અદેખાઈ થઈ કે  
આ આજકાલનો વાણિયો શું માંડવગઢનો ભંતી  
બની જય ? એટલે તેણે રાજ આગળ આવી  
ચાડી કરીઃ ‘ મહારાજ ! આ પેથડ પાસે  
ચિનાવેલી છે. તે આપને બરાબર કામની છે.  
બે આપની પાસે એ આવે તો આપના

બંડાર કહી ખાલી ન થાય. રાજએ પેથડને  
બોલાવીને તે વિષે પૂછ્યું. પેથડે જેવું હતું  
તેવું કહી દીધું અને ઉમેર્યુઃ ‘મહારાજ! આજથી  
એ ચિત્રાવેલી આપને બેટ છે. રાજ બહુ  
હરખાયો.

પેથડમંત્રીએ પ્રજાના ધણા કર ઓછા  
કરાવી નાંખ્યા. રૈયતને બને તેટલી સુખી કરી.

એક વખત તેઓ થોડા વખતની રાજ  
લઈ જતાએ ગયા. જીરાવલા પાર્થનાથની યાત્રા  
કરીને આયુ ગયા. આયુના સુંદર મંદિર જેઠ  
તેમને અત્યંત આનંદ થયો.

આયુ પર અનેક જલની વનસ્પતિઓ ને  
જડીયુદ્ધીઓ થાય છે. એમ કહેવાય છે કે  
પેથડ મંત્રીને અહીંથી એવી વનસ્પતી મળી કે  
નથી સોતું બનાવી શકાય. ભાગ્યશાળીની  
અલિહારી છે કે ચિત્રાવેલી ગાંધ ને સુવણ્ણ—  
સિદ્ધિ મળી !

પેથડકુમારની રિદ્ધિસિદ્ધિ ખૂબ વધી ગાંધ. રાજ

મહારાજના ખજના પણ એની પાસે ગાંધ્યા પડે.  
જે માલ કોઈ ન ખરીદી શકે એ પેથડકુમાર ખરીદે  
એવી તો બજરમાં એમની આંટ.

એક વખત ગામમાં અતર વેચવાવણો આવ્યો.  
એની પાસે જિંચામાં જિંચું અતર. એની કિંમત  
સાંભળી ભલભલા ગલરાઈ જય. અતરવાળો ગામમાં  
ઘૂંઘ ફીર્યો પણ અતર ન વેચાયું. આખરે નિરાશ થઇ  
એ બીજે ગામ જવા તૈયાર થયો. એ વખતે કોઈએ  
પેથડકુમારનું નામ લીધું. અતરવાળને લાગ્યું કે  
જયારે રાજ અતર ન લઈ શક્યો ત્યારે એનું શું  
ગણું? પણ લોહોએ બહુ કંદું એટલે અતરવાળો  
પેથડકુમાર પાસે ગયો.

પેથડકુમાર નહાવા બેઠા હતા. ત્યાં અતરવાળો  
જઈ પહોંચ્યો. અતર કાઢીને આગળ મુક્યું.  
તેમણે અતરનો ભાવ પૂછ્યો. અતરવાળો હસી  
પડ્યો. પેથડકુમારે પૂછ્યું: ‘ભાઈ! કેમ હસે છે?’  
અતરવાળાએ કંદું: ‘આ ગામમાં ભાવ પૂછનારા ધણ્ણા  
છે પણ લેનાર કોઈ દેખાતું નથી.’ આ જવાબ સાંભળી

પેથડકુમારે આજા કરી : ‘તમારું ખંડું અત્તર આ  
પાણુંની કુંડીમાં નાંખી હે.’ અત્તરવાળો અભયથ થઈ  
ગયો. એણે ખંડું અત્તર કુંડીમાં ઢોળી દીધું. પેથડ-  
કુમારે એનાથી સનાન કર્યું. થાડીવારમાં ખલનચીએ  
હાજર થઈ અત્તરવાળાને મૂલ્ય ચૂકાવી દીધું. અ-  
ત્તરવાળાના આશ્રયનો પાર ન રહ્યો.

એક વખત નગરમાં એક વિદ્ધાન આચાર્ય  
પદ્ધાર્યી. પેથડકુમારે તેમને ભક્તિથી વંદન કરીને  
વિનયથી પ્રશ્ન કર્યો : ગુરુદેવ ! મારે પાંચ લાખ રૂપિ-  
યાનું માપ છે. હાલમાં ધન તેથી વધી ગયું છે. સારા  
કામમાં ખર્ચવાની મારી છચ્છા છે. તો આપ કહો  
કે કયા માર્ગમાં ખર્ચ કરું ? ’

સુનિ કહે, ‘ભાઈ ! આ સમયમાં જિને શરનાં મંદિરો  
ખાંડવાની જરૂર છે. તમારું ધન તે રસ્તે વાપરો॥

પેથડકુમારને આ વાત ગમી ગઈ. તેમણે પોતાના  
નોકરોને બોલાયા. દેરાસરની બધી સામચી તૈયાર  
કરવાની આજા આપી. દેશ દેશથી શિફ્પીએ બોલા-

વ્યા. દૂર દૂરથી હોંશિયાર કારીગરો નોતર્યા. જેત-  
નેતામાં હજારો મજૂરો ને કામ કરેનારાઓ હાજર  
થઈ ગયા. જમીનની પસંદગી થઈ. સારા દિવસે મુહૂર્ત  
થયું ને કામ જ્રપાટાખંધ આગળ ચાલ્યું.

શાડા વખતમાં માંડવગઢમાં મોકું દહેરાસરે  
બંધાછ ગયું. એની સુંદરતાની શી વાત ? દેશ દેશા-  
વરથી લોહા જેવા આવ્યા. જિનેશ્વર દેવનાં દર્શિન  
કરી પવિત્ર થયાં. પેથડકુમાર પણ ખૂબ હરખાયા.  
ધનનો સુંદર ઉપયોગ થયો. પેથડકુમારે એમાં અઠાર  
લાખ રૂપિયા ખર્યા.

હવે તો તેમના મનનો ઉમંગ વધ્યો. જ્યાં જ્યાં  
જિનેશ્વરનાં મંદિરો નહોતાં ત્યાં બંધાવવા માંડયાં.  
આવું એક દહેરાસર દેવગિરિ ઉપર બાંધ્યું. બીજાં પણ  
થણ્યાં દહેરાસર બંધાવ્યાં. કહેવાય છે કે તેમણે બધાં  
મળીને ચારાશી દહેરાં બંધાવ્યાં.

પેથડકુમારનું ધન વધ્યું તેમ શુણ પણ  
વધ્યા. જેમ પ્રણ આવે અને આંષે નમતો જાય  
તેમ પેથડકુમારમાં પૈસાની નાની વધતી

અધ. મનમાં જરાય મોટાઈ નહિ, જરાય અહુંકાર  
નહિ. ધર્મ ઉપર અટલ શ્રદ્ધા, જિનેશ્વર પર  
અત્યંત ભક્તિ.

પોતાના ધર્મબંધુઓ તરફ પણ ખૂબ પ્રેમ.  
કોઈને જરા હુઃખી જુએ તો પોતે હુઃખી થાય.  
કોઈને આગળ વધતો જુએ તો આનંદ પામે.  
કોઈ પણ સ્વધર્મી ભળે તો તેમને હરખ થાય.  
એ પોતે ઘોડે બેઠા હોય નેતે ભળે તો નીચે  
ઉતરે ને માન આપે. મોટાઈ તો ઇંવાડામાંય  
નહિ. કોઈ સ્વધર્મી ખરાખ રસ્તે ચાલતો હોય  
તો ખાનગીમાં યોલાવી સારી સલાહ આપે.  
કોઈ બીડમાં હોય તો શુપેત મદ્દદ કરે. કોઈના  
માથે આદીત આવે તો તરત પડ્યે જઈને  
જીબા રહે. જ્યારે જાણો ત્યારે પેથડકુમાર મદ્દદ માટે  
તૈયારજ હોય. પોતાનું બગાડિને પણ બીજાનું સુવારવાની  
તેમની ઈચ્છા. આ શુણોથી પેથડકુમાર બધી ખૂબ  
વખણું લાગ્યા. લોકો તેમને માન આપવા લાગ્યા  
ને સારા કામોદાં આગળ કરવા લાગ્યા.

પેથડકુમાર બત્તીસ વર્ષના થયા. આ વખતે તેમણે અભિવ્યક્તિનું પત લીધું. પત લઈને તેને દીપાંદ્રું. એવી શુદ્ધતા જગતી હું લોકોમાં અજય પ્રભાવ પડ્યો. કાઈ રોગી એમના બેર જય ને પેથડકુમાર હાથ અડાડે હું રોગી સારો થઈ જય. કાઈને કંઈ દુઃખ હોય હું તેમને ત્યાં પહોંચે. શીલના પ્રભાવે લોકોની અદ્વા ઝણવા લાગી. ધારેલા કામ સિદ્ધ થવાં લાગ્યાં. લોકોમાં ખૂબ વાહવાહ ઘોલાવા લાગી.

એક વખત જયસિંહનાં રાણી લોલાવતીને તાવ અથ્યો. તે એવો અથ્યો હું કેમે કરતાં ઉત્તરેજ નહિ. ભસ્યાલા વૈદ્યફૂરીનો આવી ગયા, ભૂવાસગત ધૂણી ગયા પણ કંઈ ન થયું. રાણીને શરીરે ખગતરા ચાલુજ રહી. આખું અંગ અણે શેકાઈ જય. ઉંધ કે આરામનું તો નામજ નહિ. રાણી ચીસો પર ચીસો નાખે.

એવામાં કોઈએ વાત કરી કે પેથડકુમારનું વસ્ત્ર લાવીને આડાડે. તરતજ શાન્તિ થઈ જશે. અને નોકરોને હુકમ થયો. પેથડકુમારનું વસ્ત્ર આંદ્રું

ને રાણીને આઠાડયું. ત્યાં ચમત્કાર જેવી વાત બની. રાણીની બળતરા સમી ગઈ! તાવ છતરી ગયો! આખું શરીર ઠંડુ પડયું ને થાડી વારમાં આંખ મીંચાઈ ગઈ. રાણી ધસધસાઈ ઉંખવા લાગી.

આ બનાવ જેઈ એક અદેખી હાસીએ રાજને ભંભેયો હે લીલાવતી પ્રવાન સાથે ઘારમાં છે. તેથી તે એમનું વખ્ત આઢીને સુઈ ગઈ છે.

રાજ આ સાંભળી ખૂખ ખુરસે થયા. મંત્રીને કેદ કર્યા. રાણીને જંગલમાં લઈ જઈ મારી. નાંખવાનો હુકમ કર્યો. રાજના એકાએક આવા હુકમથી સહુને નવાઈ લાગી.

મારાએ લીલાવતીને લઈ જંગલમાં ગયા. પણ મારતાં તેમની જગર ચાલી નહિ એટલે છાડી ભૂકી. રાણી વેશ પદ્ધટીને નગરમાં આવી. આંખણુકુમારે કુશળતાથી તેને પોતાના ધરમાં છુપાવી.

: ૫ :

એક વખત રાજના હાથીએ ખૂખ હાડ પીધી એટલે ગાંડો થઈ ગયો. થાડીનાર તોપાન

કરી બેસાન થયો ને ધરણી પર દળી  
પડ્યો. રાજને વહાલા હાથીની આ હાલત  
નોઈ ખૂબ કુઃખ થયું. ધણા ધણા ઉપાય  
કર્યા પણ હાથીને ઠીક થયું નહિ. એવામાં  
પેલી દાસીએ કહ્યું : ‘મહારાજ ! જો  
પેથડકુમારનું વસ્તુ લાવીને હાથીને ઓઢાડો તો  
હાથી જિસો થાય. રાજે તેમ કર્યું તો હાથી  
એકદમ સાંજે થયો. પછી દાસીએ બધી વાત  
કહી : ‘રાણી લીલાવતીને સર્વત તાવ આંયો  
હતો એટલેન આ વસ્તુ ઓઢાડયું હતું વગેરે.’

આ સાંભળી રાજને ખૂબ શોક થયો.  
તેમણે પેથડકુમારને ડેઢમાંથી છાડી ભૂક્યા ને મારી  
મારી. જયસિંહ હને લીલાવતીનો શોક કરવા  
લાગ્યા. આ નોઈ પેથડે કહ્યાં : ‘મહારાજ ! રાણી  
લીલાવતીને થાડા વખતમાં મેળવી આપીશ.  
આપ શોક કરશો નહિ.’ ‘શું રાણી લીલાવતી  
જીવતી છે ?’ જયસિંહ આશ્ર્ય પામ્યા. પછી  
પેથડે બધી વાત જણી હતી તે રાજને કહી.

રાજએ લીલાવતીને તેડાવી ને તેની શુદ્ધી આગી.

ત્યારખાં બને સુષેઠી રહેવા લાગ્યા.

: ૬ :

હુને પેથડકુમારને ધડપણું આવવાની ચરૂઆત થઈ. આ વખતે તેમનું મન વધારે પનિન બન્યું, વધારે સેવાભાવવાળું બન્યું અને તેમને સિદ્ધાચળનો સંધ કાઢવાની મરણ થઈ.

મોટા સંધ કાઢી તેઓ સિદ્ધાચળ ( શનુંજય ) ગયા. ત્યાં આહિનાથ પ્રભુની ખખ ભક્તિ કરી. ત્યાંથી તે ગિરનાર ગયા. ત્યાં એક સંધવી સાથે ચડસાચડસી થતાં પદ મણું સોનું બોલી ઢૂદ્ર-માળ પહેરી.

આ યાત્રા કરીને પેથડકુમાર ભાંડવગઢ પાછા આવ્યા. ત્યાં પોતાના જલકાદઓને ધણી મદદો કરી. વળી લાહુઆઓ બેસાડી અનેક પુસ્તકો લખાવ્યા ને તેના મોટા મોટા સાત ભાંડારો કરાવ્યા.

હુને પેથડકુમાર ધણો વખત પ્રભુભક્તિ-માંજ ગાળો. સવાર સાંજ પ્રતિક્રમણ કરે, નથુ

વખત પ્રશ્નપૂજા કરે. આમ કરતાં તેમને લાગ્યું  
કે હવે મારો ભરણુકાળ નજીક છે એટલે  
તેમણે તીર્થીકર દેવતું ધ્યાન ધરી લીધું અને  
શાંતિથી આયુષ્ય પૂરું કર્યું.

આયું માંડવગઠ મંત્રીશરના આ  
ભરણુથી દીકરાની થયું. અંગણકુમારના શોકનો  
પાર રહ્યો નહિં. તે શોક દૂર કરવાને તેમણે  
શરૂંજયનો એક મહાન સંધ કાઢ્યો. એ સંધમાં  
આર હજર ગાડાં ને પચીશ હજર પોડીયા  
હતા. બણા સાંધુ મુનિરાજ ને એ હજર તો  
ચોકી કરનાર સિપાધચ્ચા હતા.

આ બાપ દીકરાની જેડી ધર્મભાવનાથી  
ભરપૂર હતી. તેમણે પોતાના જીંચા જીવનથી  
જૈન ધર્મને દીપાંદ્રો છે. આવા અનેક રત્નો  
જૈન સમાજમાં પાડા ને જગતમાં શાંતિ ને ગ્રેમની  
સ્થાપના કરો.

## જૈન શિક્ષણ પત્રિકા

(માસિક)

તંત્રી : ધીરજલાલ ટોકરશી શાહ.

વાર્ષિક લવાજમ ઇકત રૂ. ૧). આજેજ આહુક અનો.

# વિમણ શાહ

૧

ગુજરાતના પહેલા રાજ વનરાજ થયા.  
તેમના સેનાધિપતિ લાહિર નામે આવક હતા.  
તે ખૂબ પ્રતાપી ને ખાડાફર હતા. તેમની  
નસેનસમાં કણિયનું લોહી વહેતું હતું. તેમને  
વીર નામે એક પુત્ર થયો. તે પણ ખૂબ  
સાહસિક ને શૂરો હતો. ખર્મ પર અત્યંત પ્રેમ  
રાખતો હતો.

તેને વીરમતી નામની કન્યા સાથે પરણાંયો. આ વીરમતીથી તેને એ પુત્રો થયા. એકનું નામ નેદ ને બીજાનું નામ વિમળ.

વિમળ અત્રીશલક્ષણો બાળ છે. બીજના ચંદ્રની માર્ક હંમેશ વધતો જય છે. તે પાંચ વર્ષનો થયો. એટલે પિતાએ તેને નિશાળમાં મુક્યો. ત્યાં થોડા વખતમાં તે ખૂબ સાંચ ભાણુને ઘેર બેઠો. પિતાએ જાણું કે પુત્રો હતે ચોગ્ય ઉમ્મરના થયા છે એટલે ધરનો બધો જાર તેને માથે નાખ્યો. અને પોતે દીક્ષા લઈને ચાલી નીકાય્યા. જતાં જતાં તેમણે શિખામણ આપી : ‘પુત્રો ! નિઃર થણે ને જીન અગવાનની આજા માથે ચડાવણે.’ વિમળને આ વચ્ચેનોએ ખૂબ અસર ફરી.

: ૨ :

બેબ વખત જય છે તેમ વિમળ ફરૈક રીતે ખીલતો જ જય છે. તેના શરૂઆતો આ જુઓ છે ને મનમાં બહુ દાઢે બળે છે.

માતા વીરમતીએ આ જાણું એટલે વિચાર કર્યો : 'વિમળના ફુરમનો આ નગરમાં ધણ્ણા છે. માટે તે ઉમ્મર લાયક થાય ત્યાં સુધી બીજે જઈને રહેવું?' તે નેછ તથા વિમળને લઈને પોતાના પિયર ગાધ.

પિયરમાં ગરીબાઈ ખૂબ છે. ધરડાં માણસો પણ ભહેનત ભજૂરી કરે છે ત્યારે પેટ-ગુબરે ચાલે છે. એટલે વીરમતી, નેછ તથા વિમળ આવ્યા તે ભાઈને ગમ્યું નહિ. પણ ભહેનને ના દુમ કહેવાય? એટલે તેણે આદર સત્કાર આયો. વીરમતી બંને પુત્રો સાથે ત્યાં રહેવા લાગી.

: ૩ :

પાઠણુના વીર મંત્રોનો વિમળ હવે ગરીબાઈમાં ડિછરે છે. ડોષ વખત તે ખેતરમાં જય છે ને મામાને ખેતીના કામમાં મદદ કરે છે. કોઈ વખત તે ઘોડી વછેરો કે ગાય-ભાસ લઈ જંગલમાં જય છે ને ત્યાં લેમને

ચારો ચરાવે છે. નથી તેને એ કામમાં જરાયે નહાનમ કે નથી જરાયે દીલગીરી. ઉલડું તેને તો એ કામમાં ખૂબ આનંદ આવે છે.

જંગલમાં ભય છે ત્યાં તીર કામઠા ઐલે છે ને વોડેસવારી કરે છે. આડ પર ચઢે છે ને તળાવમાં તરે છે. દ્વિવસભર આવો આનંદ માણુને સાંજ પાછો ધેર આવે છે.

આ જીવન જીવતાં વિમળતું શરીર ખૂબ કદાવર થયું. બાણુવિધામાં તે એકો થયો. ધીમે ધીમે તેની બાણુવિધાની પ્રશંસા સધ્ગો ઠેકાણે થવા લાગી.

: ૪ :

પાટણુના નગરશેઠ શ્રીદાતને શ્રી નામે એક જીવાન કન્યા છે. તેના માટે તે લાયક વર શોખી રસ્બા છે. તેમણે ધણું ધણું ઠેકાણું જોયાં પણ એક ગમણું નહિ. એવામાં તેમણે વિમળની પ્રશંસા સાંકળી એટલ તેની સાથે પોતાની કન્યાતું સગપણું કર્યું.

મામા હવે વિચારવા લાગ્યાઃ ‘આના લગ્નનું ખરચ શી રીતે થશે?’ વીરમતી હવે વિચારવા લાગ્યાઃ ‘વિમળનાં લગ્ન મારા ધરને છાંજે તેવાં કરવાં જોઈએ; લાહિર મંત્રીને એ પૌત્ર છે.’ પણ ભાઇની સ્થિતિ ઘ્યાતમાં હતી અટલે તેણે નિક્ષેપ કર્યોઃ ‘ જ્યાં સુધી પુરતું ધન ન મળો ત્યાં સુધી વિમળને પરણાવવો નહિં.’ તેણે વિમળને પોલાવીને કહ્યું : ‘પુત્ર! જ્યારે મને ધન મળશે ત્યારે તને પરણાવીશ.’ વિમળે શાંતિથી આ સાંભળી લીધું.

બીજા દિવસે ઢોરને લઈ વિમળ જગતમાં ગયો. ત્યાં એક આડ નીચે બેસીને ચિંતા કરવા લાગ્યો : ‘હવે ધન મેળવવું પડશે! શું કરેં? ડેવી રીતે ધન મળો?’ આમ વિચાર કરતાં કરતાં હાથમાંની લાકડી મૂળિયાના પોલાણુમાં એસી કે તરતજ ધખ ધખ ઢેક્યાં તૂઠી પડયાં. વિમળ તે ઢેક્યાં દૂર કરી જુએ છે તો માહિ સોનામહોરનો ચહું આ જેતાં વિમળના આ-

નંદનો પાર રહ્યો નહિ. તે ચર્ચ ઘેર લાગ્યો ને વીરમતીના ચરણે મુક્યે. વીરમતી આ જોઈને ખૂબ હુરખાણી ને થોડા વખતમાં તેણે વિમળનાં લગ્ન લીધાં. પોતાના કુદુંખને છાંજે તેવી રીતે ધણી ધામધુમથી લગ્ન થયાં. શ્રીદેવી ઘેર આવી.

વિમળ ને શ્રીદેવી બંનેની સરખે સરખી જોડ છે. ડાષ ડાઈનાથી ઉત્તરે તેમ નથી.

નેટના લગ્ન પણ એક ખાનદાન કુદુંખની કન્યા સાથે થયા.

વિમળ હવે શત્રુથી ડરે તેમ નથી એટલે તેઓ પાઠણુમાંજ રહેવા લાગ્યાં. અહીં વિમળે પોતાનું નથીબ અજમાવવાનું શરૂ કર્યું.

એક દિવસ તે ખજરમાંથી જય છે. ત્યાં રાજના યોજ્ઞાઓ નિશાન માંડી રહ્યા છે. સારા સારા યોજ્ઞાઓએ નિશાન માંડ્યાં પણ ડાઈ તાકી થક્કું નહિ. આ જોઈ વિમળ હસવા લાગ્યો ને જોટથી બોલ્યો : ‘સૈનિકો તો ખૂબ બહાદુર છે. મહારાજ ભીમદેવનું જતું રાજ્ય રાખે તેવા છે.’ આ સાંભળી તે ખૂબ ચીડાયા. એવામાં મહારાજ ભીમદેવ પણ આંદ્યા. તેમણે નિશાન માંડ્યું

ને તે પણ ચુકી ગયા. એટલે વિમળ હસીને  
બોલ્યો : ‘ બંધુ લોટજ લેગા થયા લાગે છે !  
આમના હાથમાં રાજ છે તે શું કરવાના ? ’

ભીમદેવના કાને આ શખ્ષ પડતાં તે  
અમફલ્યો. વિમળને પૂછ્યું : ‘ શેઠ ! કાઈ  
બાણુવિધા જણેનું છે ? જાણુતા હો તો આવો  
આ તરર્કી.’ વિમળ કહે, ‘ બાણુવિધા તો  
તમારા જેવા ક્ષત્રિય જણેનું. અમે તો વેપારી  
કહેવાઈએ. અમને એવું શું આવડે ? ’

આ સાંસથી ભીમદેવે જાણ્યું કે માણસ  
કોઈ બાણુકાર લાગે છે. જેઓ તો ખરો તેને  
કેવી બાણુવિધા આવડે છે. તેણે કહ્યું : ‘ શેઠ !  
વિધા ને ડળવે તેના બાપની. તમને ને બાણુ-  
વિધા આવડતી હોય તે બતાવો.’ વિમળ કહે,  
'આપને ને બાણુકળા જેવીજ હોય તો એક  
ખાળકને જમીનપર સુવાડો ને તેના પેટપર  
નાખરવેલનાં એકસોને આડ ખાન બુઝો. એ  
પાનમાંથી આપ કહો તેટલા ખાન બાણુથી

વિંધી નાણું. એમ કરતાં બાળકના શરીરને જરાએ વાગે નહિ. તમે કહો તેમાં એક પણ પાન ઓછુંવતું થાય તો આપની તલવાર ને મારે માથું. અથવા આપ કહો તો વલોણું વહોવતી સીના કાનની ઉખકતી જાલ વિંધું. એમ કરતાં જે સીના ગાલને જરા વાધસારે થાય તો આપને ચોણ્ય લાગે તે કરો. ’

એમ કહીને વિમળે પોતાની બાણુકળા ખતાવી. રાજ ભીમદેવ આ જોઈ ખૂબ ઝુશ થઈ ગયો. વિમળને તેણે પાંચસો થોડા આખ્યા ને દંડનાયક ( સેનાધિપતિ ) ની પદવી આપી.

વિમળ મહા ચતુર હતો. લર્દકરને કાણુમાં ડેમ રાખ્યતું, રાજ્યમાં પોતાની લાગવદ ડેમ વધારવી તે બરાબર જણુતો હતો. તેનો તાપ ધણ્ણો હતો. ગુજરાતના બંધુા ખંડીઓ રાજ તેનાથી બીતા હતા. થોડા વખતમાં વિમળ પોતાની ચતુરાધથી ભારે લાગવગવાળો બની ગયો.

હવે તે ખૂબ ભપકાથી રહેવા લાગ્યો. તેણે પોતાને માટે રાજના કરતાં પણ સુંદર મહેલ બાંધ્યો, સુંદર ધરદહેરાસર બાંધ્યું અને તેના ફરતો સુંદર કોટ બાંધ્યો. દેશ દેશાવરથી ઉત્તમ હુથી ધોડા મંગાવ્યા ને પોતાના લડવૈયાએ વધાર્યો.

જનેશ્વર તરફ વિમળની જાહીત અપાર હતી. તે પોતાની વીઠીઓં જિનેશ્વરની નાનીશી છખી રાખતો ને તેથી ઢાઈને પણ વંદન કરતાં પહેલું વંદન તેમનેજ થતું.

વિમળની આ સ્થિતિ જોઈ દુરમનો ભીમદેવને ઘોટી ભંભેરણી કરવા લાગ્યા: ‘મહા-રાજ ! વિમળશાહ આપનું રાજ્ય લેવા ઈચ્છે છે. તેણે ધણું લશકર તૈયાર કર્યું છે. તે જિનેશ્વર સિવાય ઢાઈને નમતો નથી. આ પ્રમાણે ખૂબ ભંભેરણી થઇ એટલે રાજ ભીમદેવને લાગ્યું કે વાત ખરી હશે. એટલે તેનું ધર જોવાને એક દિવસ રાજએ કહ્યું : ‘મંત્રીશ્વર ! તમારાં ધર એક વખત

બેયાં નહિ. અમને તે બેવાની ખૂબ હોંશ છે.'  
વિમળશાહના મનમાં કંધ કપટ ન હતું એટલે  
તે બોલ્યો: ' સ્વામી ! ધર આપનાં છે. પવારો,  
ચોજન ત્યાં જઈને કરીયું. '

રાજ થોડા ધોડેસવાર ને પાયદળ સહિત  
વિમળશાહના મકાને ચાલ્યો. ત્યાં દહેરાસરની  
ખાંધણી બેઈ ચક્કિત થઈ ગયો. મહેલના બીજ  
ભાગ બેઈને મોંમાં આંગળી નાંખવા લાગ્યો.  
અને મજબૂત કિલ્યો બેઈ ધારેલી શંકા ઘરી  
છે એમ માનવા લાગ્યો. તે મનમાં બોલ્યો:  
' અહો ! આ વિમળને આટલી બંધી રિદ્ધિસિદ્ધિ !  
મારો વૈભવ તેના આગળ શા હિસાખમાં છે ? '  
તે જમીને પાછો ગયો.

હવે તે બીજ પ્રધાનો સાથે વિચાર  
કરવા લાગ્યો કે વિમળને અહીંથી શી રીતે  
ફૂર કરવો. વિચાર કરતાં એક પ્રધાને યુક્તિ સુઅડી  
કે મહારાજ ! જ્યાં સુધી તે ગોળે મરે ત્યાંસુધી  
ઓરથી શું કામ મારવો ? એમ કરો કે કાલે

ખરાખર લોજન વેળાએ વાધને છોડી મૂક્ણા. એટલે તરત આખા શહેરમાં નાસ વર્તાઈ રહેશે. એ વખતે વિમળને ઉશ્કેરને. એટલે તે શાંત ઐસી રહેશે નહિં. તે વાધને પકડવા જરૂરો એટલે પૂર્ણજ થશે. રાજને આ વિચાર પસંદ પડ્યો.

ખીને દિવસ થયો એટલે રાજએ ખધી તૈયારી કરી રાખી. વિમળ આવ્યો ને રાજને નસુન કરી વાતો કરવા લાગ્યો. ખરાખર તેજ વખતે વાધને છોડી મૂક્યો. એટલે આખા નગરમાં નાસ ફેલાઈ ગયો. એક આવીને રાજ તથા વિમળશાહ બેઠા હતા ત્યાં ખખર આપી ઢે મહારાજ ! વાધ છુટ્યો છે ને નગર આખું નાસી ગયું છે. આ સાંભળી વિમળ એકદમ ઊભો થઈ ગયો. વાધને વશ કરવાને તૈયાર થયો. રાજને તો એ જેઈતું હતું.

ગામમાં ચારે કોર સુનસુનાકાર છે. કને જેભ પ્રાણ્યું તેમ ભાગીને ધરમાં ભરાઇ ગયા છે. વાધ એકદ્વા ગામમાં ત્રાડ હેતો ક્રૈં છે. એવામાં

વિમળ દેખાયો. વાધ એને જેતાં ધુરકયો. ફાળ ભરીને સામો આંદ્યો. વિમળ તેની ઘઘર લેવાને તૈયારજ હતો. તેણે એક થપાટ મારીને વાધના બંને કાન પકડયા. વાધ ધણે છંછેડાયો. પણ વિમળના હાથમાંથી છુટે તેમ ન હતું. વિમળે તેને લાવીને પાંજરામાં પૂર્યો.

આખા નગરમાં વિમળની જ્ય બોલાણી. ભીમદેવ વગેરે નિરાશ થયા. અ! તો વિમળને છેઠો પાડવા કર્યું ને ઉલટી તેની કીર્તિ વધી. હુકે કરવું શું? તેમણે ભીજે ઉપાય શોધયો: ‘રાજમદિન જેડે તેને કુસ્તીમાં ઉતારવો ને ત્યાં જ પૂરો કરાવવો.’ મહિને બધી વાતે વાકેદે કર્યો. થોડા દ્વિસ થયા એટલે રાજીએ કહ્યું: ‘મહેતા! આપણો મહિને પોતાના બળનું બહુ અલિમાન રાખે છે. માટે એની પરીક્ષા કરો.’

મહિને જેડે વિમળશાહે કુસ્તી માંડી. કુસ્તીના ધણું દાવ એદ્યા. તેમાં મહિને સખત પટ્ઠી આપી ને વિમળશાહે જીત મેળવી. બંધાનાં

મોઢામાંથી વાહવાહ વાહવાહના શબ્દો  
નીકળી પડ્યા.

રાજ ને પ્રધાન હવે માનવા લાગ્યા કે વિમળમાં હૈવી શક્તિ છે. એટલે તે ભરવાનો તો નથી. પણ તે દૂર થાય એવો કાંઈક ઉપાય શોધીએ. એથી તેમણે નક્કી કર્યું કે તેના દાદાના વખતનું ૫૬ કોડ ટંકા લેણું કાઢીને આગીએ. જે તે લેણું આપવાનું કચુલ કરશે તો ભીખારી થશે. જે નહિ આપે તો રાજ્ય છાડશે.

ખીલ દ્વિસે વિમળશાહ રાજકરણારે ગયા. ત્યારે ભીમહેવ પુંડ વાળીને બેઠા. વિમળ કહે, ‘આમ કેમ ?’ પ્રધાન કહે, ‘સાંકળો. રાજને હિસાખને માટે રીસ છે. કાંતો તમારા ખાતે નીકળતા ૫૬ કોડ ટંકા આપો કાંતો નવું ખાતું ખોલી આપો.’

આ સાંકળી વિમળમંત્રી સમજ ગયા કે રાજ કાચા કાનનો છે. તે ખીલની જલ્દેરણી-

થી છેડાયો છે. માટે તે કંઈ પણ ખરાન પગદુ  
ભરે તે પહેલાં હુંજ મારી જાતે ચાલ્યો જઉ.

આમ વિચારી તેમણે લાંથી ઉપડવાની  
તૈયારી કરી. સોણસો સાંઠ પર સોનું ભર્યું. હાથી,  
ઊંટ ને રથ તૈયાર કર્યા. પાંચ હજાર બોડા ને  
દશ હજાર પગપાળા સાથે લીવા. પછી ભીમહેવની  
રાજ લેવા ગયા. ત્યાંથી વિદ્ધાય લેતાં રાજને  
કહ્યું: ‘મહારાજ ! મને જેવી હેરાનગતી પહેંચાડી  
તેવી હેરાનગતી મહેરખાની કરી ખીજ કોઈને  
પહેંચાડશો નહિ.’

વિમળમંત્રી પોતાનો વૈભવ લઇને આયુ  
તરકી ચાલ્યા. તેની તળેટીમાં ચંદ્રાવતી નામે  
શહેર હતું. ત્યાંના રાજએ સાંભળ્યું કે વિમળ-  
મંત્રી પોતાના લરકર સહિત આવે છે એટલે  
વે નગર છાડી ચાલ્યો ગયો. વિમળમંત્રી અહીં  
ભીમહેવના દંડનાયક તરીકેજ કામ કરવા લાગ્યા.

અહીં રહી તેમણે ધણું વિજય મેળંયા.  
સિંહ દેશનો રાજ પંડિયો બહુ ગર્વિષ થઇ

ગયો હતો તેને સંજરડ હાર ખવરાવી. પરમાર રાજ ધંધુદેવ ને ભીમહેવની આણ માનતો ન હતો તેને આણ મનાવી.

વિમળે પોતાના પરાક્રમથી વિજય મેળોયો અને આણ રાજ ભીમહેવની ઝેલાવી. આથી ભીમહેવ સમજ્યો કે વિમળ મંત્રીને દૂર કરવામાં ચેં ચોટી ભૂલ કરી છે. તેને ઘૂણ પસ્તાવો થયો.

ચારે ખાળુ પોતાનો ઢાખ બેસાડીને વિમળશાહે ચંદ્રાવતીમાં રાજગાઢી ધારણુ કરી. આ વખતે ભીમહેવે પોતાના તરફથી છત્ર ચામર બેટ મોકલાવ્યાં. વિમળે પણ મનમાંથી રીસ કાઢી નાંખી તેનો રવીકાર કર્યો.

રાજ ખન્યા પછી વિમળશાહ એક દિવસ મહેલની અગાથી પર ચડીને નગરને જોવા લાગ્યા. પણ શહેર ખરાખર દેખાવડું લાગ્યું નહિ. એટલે તે ઝીરીથી વસાવવાનો નિશ્ચય કર્યો.

ચંદ્રાવતી ફરીથી બંધાયું. તેની બજરૈ સીધી ને સુરોકિત અની. તેના ચોક વિશાળ ને દેખાવડા બન્યા. તેમાં સુંદર ડાતરણીથી ભર-પુર આરસનાં અનેક જિનમંદિરો થયાં. શાંતિના પરમ ધામ ઉપાશ્રેષ્ઠ બંધાયા. વાવ ફૂવા તથા તળાવ પણ પુરતી સંઘામાં જણુવા લાગ્યા.

આ પ્રમાણે વિમળશાહ કુનિયાની બધી સંપત્તિ મેળવી આનંદ કરવા લાગ્યા. એવામાં એક વખત ધર્મધોષ નામના આચાર્ય આવ્યા. તેમણે પવિત્ર જીવન સમજીયું, ધર્મ સમજીયો અને વિમળશાહને કહ્યું: ‘વિમળશાહ! તમે આખી જંદગી વન ને સત્તા મેળવવામાં ગાળી છે. માટે હવે કાંઈક ધર્મકાર્ય કરો. કાંઈક પર-લોકનું ભાથું ખાંધો.’ વિમળશાહને ગળે આ વાત ઉતરી. પોતાની જંદગીમાં કરેલી અનેક ખૂનખાર લડાઈએ યાદ આવી. ખૂબ પશ્ચાત્તાપ થયો. છેવટે

તે ગુરુદેવ કંઠે વ્યોદ્યાઃ ‘ગુરુદેવ ! આપ પૂર્વ-  
માનો તે કરવા તૈયાર છું. મને આજી કરો.’  
ગુરુ કહે, ‘આખુ જેવા સુંદર પહાડ ઉપર  
એક પણ જૈન મંદિર નથી. માટે લાં જૈન  
મંદિર બંધાવો.’ વિમળે તે કષ્યુલ કર્યું.

વિમળશાહ દહેરાસર બંધાવવાને કુદુંબ  
સહિત આખુ ઉપર ગયા. ત્યાં આજીણેનું ખૂબ  
ઓર હતું. શિવમંદિરોનો પાર નહોતો. ફક્ત શિવ-  
મંદિરના પૂજારીઓ જ અગ્નાર હજાર હતા.  
વિમળશાહે તે જગાની મંદિરને માટે માગણી  
કરી. પૂજારીઓએ તેનો સારુ ધન્કાર કર્યો.  
વિમળશાહે તેમને ખૂબ ખૂબ સમજાવ્યા. આખરે  
પૂજારીઓએ કહ્યું: ‘જે તમારે આ જગા જોઈ-  
તીજ હોય તો સોનાના સિક્કા પાથરીને જમીન  
દ્યો.’ વિમળશાહે તે કષ્યુલ કર્યું અને સોનાના  
સિક્કા પાથરીને જમીન લીધી. જમીન મેળવ્યા

પછી દેશભરમાંથી કારીગરો બોલાયા. આરા-  
સણુપહાડમાંથી આરસ ખોઢાયો ને ત્યાંથી હાથી  
આરક્ષે આખુપર લાવવા લાગ્યા. કહે છે કે એ  
પત્થર લગભગ રૂપાની કિભૂતે પડવા લાગ્યો. વિમળ-  
શાહને ઉત્તમોત્તમ દહેરાસર બંધાવવાની લાવના  
હતી એટલે તેમણે સલાટોને કંઈંગ કે તમારી બધી  
કળા બતાવજો. પત્થરમાં ડાતરણી કરતાં જેટલો  
ભૂકા પડશે તેટલું હું રૂપું આપીશ. એ હજરે  
કારીગરો ચૌક વર્ષે સુધી કાને લાગ્યા. અદાર  
કોડ ને નીશ લાખ રૂપિયાના ખર્ચે એક લંબ્ય  
જિનમહિર તૈયાર થયું. ૧૪૦ કૂટ લાંબા અને ૬૦  
કૂટ પહોળા મંહિરમાં કળાની અદ્ભુત સુંધર  
બૃદ્ધી થણ. એના થાંકદાઓ ઉપર હાથી  
ઘોડાની હાર અને દેવદેવીઓનાં મનોહર નાચ  
બરાબર ઉત્તર્યા. સુખ્ય મંહિરની આસપાસ  
નાની નાની દહેરીઓ બાંધી તેની આગળે

છતમાં પણ બહુ સુંદર કામ કર્યું. દરેક  
છતમાં નવીજ ભાત ! એમાં ઢાતરેલાં કમળો તો  
જણે હાથ અડકતાંજ ટૂટી પડશે એટલાં ઢાણળ  
જણ્ણાતાં હતાં !

એ ઉપરાંત નેમિનાથની અન, વહાણુના  
દેખાવો અને બીજા પ્રસંગો પણ બહુ મનોહર હત્થ.

મુખ્ય મંદિરમાં શ્રી રીખવટેવ ખલુની મૂર્તિ  
સ્થાપી. આ દહેરાસર આજે પણ આચુ પર  
શોભી રહ્યું છે. હુનિયામાં તેની કારીગરીનો  
નોટો નથી. પ્રિય વાંચક ! જાંદગીમાં એક  
વખત તો આ અદ્ભુત દહેરાસરના દર્શન  
જરૂર કરનો.

વિમળમંત્રીએ જગતની આ સુંદર વસ્તુ  
તૈયાર કરીને સંધમે સોંપી. તેના ખર્ચો ચેટ  
કેટલાક ગામો આપ્યા. પછી ચંદ્રાવતી પાછા  
આપ્યા.

આરાસણુ અથવા કુંભારિયાજીનાં ફેરાં  
પણુ આ વિમળશાહનાં જ બનાવેલાં છે. થાડા  
વર્ષી વિમળશાહ કાળવર્મ પામ્યા.

ધન્ય છે વીર વિમળશાહને જે પોતાના  
બાઢુભળથી આગળ વધ્યા ને જેણે જગતને  
અમૃત્ય વસ્તુની લેટ આપી!

નૈનાનાં શિક્ષણુને લગતાં સર્વ પ્રક્રો ચર્ચાતી

## જૈન શિક્ષણ પત્રિકા

તંત્રી

### ધીરજલાલ ટોકેરથી શાહ

વાષ્પિંક લવાજમ ઇકા રા. ૧). પરદેશમાં રા. ૧-૮-૦.

દ્વેક નૈન કુંભમાં આ પત્રિકા આવરીજ જોઈએ

આજેજ મનીઓર્ડર કરો :—

જ્યોતિ કાર્યાલય, રતનપોળ : અમદાવાદ.

બાળ અન્યાયથી : પ્રથમ શ્રેણી : ૧૭

# વર્સ્તુપાળ-તેજપાળ

દેખક :


શ્રીજગદાલ ટોકરશી શાહ.



: સર્વ હક રખાઈન :

આવાજિ ચોથી : કુલ નકલ ૪૫૦૦ : સં. ૧૬૬૧

મૂલ્ય સવાચાનો.



ઃ ઃ પ્રકાશક ઃ ઃ

ધીરજલાલ ટોકરણી રાહ  
જ્યોતિ કાર્યાલય નગરશેડ માર-  
ક્ષીટ, રતનપોળ અમદાવાદ.

---

આ પુસ્તક સુંઘર ધ્લાકા કેળવણી  
ખાતા તથા વડોદરા રાજ્ય કેળવણી  
ખાતા તરફથો ધનામ લાયબેરી ભારે  
ઃ ઃ મંજુર થયું છે. ઃ ઃ

---

ધી 'વીરવિજ્ય' પ્રોન્ટીંગ પ્રેસમાં  
અણિલાલ છગનલાલે છાયું.  
સાગરની ખડકી, રતનપોળ :  
અમદાવાદ.

# વરસ્તુપાળ—તેજપાળ

: ૧ :

તેરમા સૈકાની વાત છે. જ્યારે  
ગુજરાતમાં સોલંકી રાજઘોણી સત્તા નથળી પડી  
ગઈ હતી અને રાણ્ણ વીરધવળની સત્તા  
અમતી હતી.

વીરધવળના એક મંત્રી આશરાજ આવક  
સુંહાલક ગામમાં રહેતા હતા. તેમને કુમારદેવી  
નામે એક ગુણીયકુંભ ખ્રી હતી. તેનાથી થયા

નણુ દીકરા ને સાત દીકરીએ. દીકરાના નામ ભવિદેવ, વસ્તુપાળ ને તેજપાળ. દીકરીના નામ બલહુ, માહુ, સાહુ, ધનદેવી, સોહગા, વયજુ ને પડ્યા.

આશરાજ અંતીએ બધા દીકરાદીકરીને સારી રીતે ભણ્યાવ્યા. એમાં વસ્તુપાળ ને તેજપાળ સહુથી વધારે જગ્યા. તેમને વિદ્ધા પર અથાગ પ્રેમ. કળા પર જાંડી પ્રીતિ. ધર્મ પર અઠગ અદ્ધા. આ બે ભાઈની બેલડી સહુના મનતું હરણુ કરતી. સહુના પર પ્રભાવ પાડતી.

તેઓ ઉમ્મર લાયક થયા એટલે પિતાએ શુણુવાન કન્યાએ પરણાવી. વસ્તુપાળને લલિતા ને તેજપાળને અનુયમા.

થોડા વખત પછી પિતા મરણ પામ્યા. પિતૃભક્ત પુત્રોને આથી ખૂબ કુદ્દ થયું.

તે કુદ્દ જુલવાને તેઓ માંડળ આવીને વસ્યા. માતાની ખૂબ સેવાભક્તિ કરવા લાયા. અહીં પોતાના સારા આચરણથી તેઓએ થોડા વખતમાં સારી નામના મેળવી.

થોડા વખત પછી પ્રેમાળ માતા પણ ગુજરી ગયાં એટલે તેમને બહુ શોક થયો. તે તે શોક દૂર કરવા તેઓ શરૂંજ્યની યાત્રાએ ગયા. પવિત્ર તીર્થ શરૂંજ્યની યાત્રા કરતાં ડેણું મન શાંત ન થાય? તેના પવિત્ર વાતાવરણે આ અન્ને ભાઈઓનો શોક દૂર કર્યો. ત્યાંથી તેઓ પાછા કૃર્યા ને રાજસેવાની ધર્માથી રસ્તામાં ધીળકા ગામે રોકાયા. અહીં તેમને રાજગોર સોમેશ્વર સાથે ભાઇખંધી થઈ.

: ૨ :

આ વખતે ગુજરાતની સ્થિતિ બહુ ડામડોળ છે. તેથી રાણેઓ વિરધવળ વિચાર કરે છે: ‘એ બાહોશ પ્રધાન ને બાહોશ સેનાધિપતિ મળી અય તો મારા મનોરથ ઈણે.’

રાજગોરે બાળું કે રાજુ પ્રધાન ને સેનાધિપતિને શોધવાની ચિંતામાં છે એટલે તે રાજ પાસે ગયા ને વાત કરીઃ ‘મહારાજ! ચિંતા દૂર કરો. જેની આપ શોધ કરી રહ્યા છો એવા બે રતનો આ નગરમાં આવેલાં છે.

તેઓ ન્યાય આપવામાં નિપુણ છે, રાજ ચક્રવર્ત્તામાં કુશળ છે. તેઓ જૈન ધર્મના ધારી છે પણ સર્વ પર સરખી પ્રીતી રાખનાર છે. માટે આપ આજી આપતા હો તો તેમને આપની આગળ હાજર કરે.''

રાજએ આજી આપી એટલે સોમેશ્વર આ બંને ભાઈઓને રંજસભામાં લઈ ગયા. ત્યાં રાજ આગળ સુંદર લેટા ભૂકીને બંને ભાઈઓએ વંદન કર્યું. રાજ વીરધવળે જેવું જાહેરું હતું તેવું જોયું. એટલે તે બોલ્યાઃ 'તમારી મુલાકાતથી હું બહુ ઘુશ થયો છું. આ રાજયનો સધળો કારકાર તમને સાંપુ છું.' બંને ભાઈઓ આ સાંભળી આનંદ પામ્યા. પછી વરતુપણે રાજને કહ્યું: ' મહારાજ ! અમારું અહોભાગ્ય હું આપની અમારા પર આવી કૃપા થઈ. પણ અમારે એક વિનંતિ કરવાની છે. તે આપ ધ્યાન દ્ધને સાંભળોઃ ' ન્યાં અન્યાય હશે ત્યાં અમારાથી હગલું ભરાશે નહિ. ગમે તેવા રાજકોનમાં પણ દેવગુરુની સેવા

ચુકાશે નહિ. અને રાજસેવા કરતાં આપની પાસે ડોધ ચાડી ચુગલી કરે ને અમારે જવાનો વખત આવે તો પણ અમારી પાસે જે ત્રણું લાખ ટંકા ધન છે તે રહેવા હેઠું પડશે. જે આપ આ બાખતોનું વચન રાજગોરની સાક્ષીએ આપો તો અમો આપની સેવા કરવા તૈયાર છીએ. નહિતર આપનું કદ્યાણ થાઓ.''

રાજએ તે પ્રમાણે વચન આપી વસ્તુપાળને ધીળકા તથા ખંલાતના મહામંત્રી બનાવ્યા અને તેજપાળને સેનાધિપતિ બનાવ્યા.

: ૩ :

વસ્તુપાળ મહામંત્રી બન્યા તે વખતે તિઙેરીમાં પૈસો ન્હોતો, રાજ્યમાં ન્યાય ન્હોતો. અમલદારો ભારે લાંચ લેતા ને રાજની ઉપજ પોતાનાજ ખીસસામાં મુકૃતા. તેમને દખાવી થઈ એવું ધળ ડોધનામાં ન્હોતું. આ બધી હડીકત ખરાખર ધ્યાનમાં લઇ વસ્તુપાળે પોતાનું કામ ચર્ચ કર્યું.

તેઓ સજજનોનો સતકાર કરવા લાગ્યા અને લાંચિયા અમલદારોને પકડી તેમનો દંડ

કરવા લાગ્યા. આ ફંડમાંથી થોડું ધણું બન મજ્યું એટલે ડેટલુંક લશકર તૈયાર કર્યું. પછી બધી રાજકારણાર થોડા વખત ભાટે તેજપાળને સોંઘો અને પોતે લશકર લઈને રાજની સાથે ચાહ્યા. જે જે ગામના મુખીઓ રાજ્યનું લેણું આપતા નહોતા તેમની પાસેથી વસુલ કર્યું. જે ઠડકારોએ ખંડણી ભરવી બંધ કરી હતી તેમની પાસેથી બધી ખંડણી વસુલ કરી. આ પ્રકારે આખા રાજ્યમાં ફરી રાજ્યની તિઝેરી તર કરી. સધળી જગાએ વ્યવસ્થા ને શાંતિ દાખલ કરી.

હવે વસ્તુપાળે મળેલા ધનથી મજબૂત લશકર તૈયાર કર્યું અને સરહદ પરના રાજ્યોને જીતવાની તૈયારી કરી.

તે વખતે કાઠિયાવાડમાં બદ્દું અંધાધુંધી ચાલતી હતી. રાજ્યો પણ યાત્રાળુંઓને લૂંટતા હતા. આથી વસ્તુપાળ સહુ પહેલાં કાઠિયાવાડ તરફ ચાહ્યા. ત્યાં ધણ્યાખરા રાજ્યોને વશ કરી લીધા. એમ કરતાં તેઓ વણુથલી આગળ આવ્યા. ત્યાં રાણું વીરધવળના સાળા સાંગણ ને

ચામુંડ રાજ્ય કરતા હતા. તેમના અભિમાનનો  
પાર નહોતો. તેમને ધણું સમજાયા પણ તેઓ  
તાએ ન થયા એટલે લડાઈ થઇ. તેમાં સાંગળું  
ને ચામુંડ માર્યા ગયા. વસ્તુપાણનો વિજ્ય થયો.  
વસ્તુપાણે તેના પુત્રોને ગાડી આપી. આમ આપા  
કાઢિયાવાડમાં વિજ્યનો ડાંડા વગાડી વસ્તુપાણ  
રાજ સાથે ગિરનાર ગયા. ત્યાં અક્ષિતપૂર્વક યાત્રા  
કરી તેઓ પાછા પ્રયો.

: ૪ :

ભદ્રેશ્વરનો રાણું લીમસિંહ વીરધવળનો  
ખંડીએ રાજ હતો. પણ હવે તેણે ખંડણી  
આપવા ના પાડી હતી. તેના લશકરમાં નણું  
ખાંડાદુર લડવૈયા હતા. એટલે તેને અભિમાન  
હતું ડે મને કંઈજ થનાર નથી. વસ્તુપાણ  
તથા રાણું વીરધવળે તેના પર ચડાઈ કરી.  
વીરધવળ આ લડાઈમાં હારી ગયા. પણ  
એવામાં વસ્તુપાણ લશકર લઈને આવી પહોંચ્યા.  
તે ઘૂંઘ કુશળતાથી લઈયા ને અંતે જીત મેળવી.

: ૫ :

વસ્તુપાળ આ આકરે વિજય કરીને  
 પાછા પ્રથ્યી. ત્યાં સાંભળ્યું હે ગોધરાનો રાજ  
 ધુધુલ ખૂબ છદ્દી ગયો છે. તે પોતાની પ્રભને  
 ગમે તેવો ત્રાસ આપેઃ છે. આથી વસ્તુપાળે  
 તેને કહેણું મોકલ્યું હે રાણુા વીરધવળને વશ  
 થાયો. તેણે તો એ સાંભળ્યું નહિ પણ ઉલડું  
 એક દૃત સાથે કાજળ, કાંચળી ને સાડી  
 વીરધવળને બેટ તરીક મોકલ્યાં. આવા અપમા-  
 નથી રાણુા વીરધવળ ખૂબ ચીડાયો. તેની  
 આંખમાંથી અભિ અરવા લાગ્યો. તેણે લાલચોળ  
 આંખે બધા સામું જેણું પણ ઢાઈ ધુધુલને  
 જીતી લાવવા તૈયાર ન થયું. તેની ધાક બહુ  
 હતી. આખરે તેજપાળ ઉઠ્યા ને ધુધુલને જીતી  
 લાવીશ એમ જણેર કર્યું. આથી રાણુા વીરધવળ ખૂબ  
 ઘુશ થયો.

પછી તેજપાળ મોકું લરકર લઈને ગોધરા  
 તરરે ગયા. ત્યાં ખૂનખાર લડાઈ થઈ. તેમાં  
 ધુધુલ પકડાયો. તેને પાંજરામાં પૂરી ધોળકા

લાવવામાં આવ્યો. અહીં તેણે બેટ મોકલવેલી કાંચળી ને સાડી તેને પહેરાવ્યા. પોતાનું આવું અપમાન થવાથી તેણે આપદાત કર્યો.

: ૬ :

ખંભાતમાં સિદીક નામે મોટા વેપારી હતો. તે ત્યાંના ધર્ષણીધારી જ્ઞે થછ પડ્યો હતો. તેણે એક વખત નજીવા શુન્હા ખદ્દલ નગરશેઠની માલ મિલકત લુંટી લીધી ને તેનું ખૂન કરાવ્યું. નગરશેઠના દીકરાએ આ જુલમની વસ્તુપાળ આગળ ફરિયાદ કરી. વસ્તુપાળે તેને ચોગ્ય સબ્લ કરવાનો નિશ્ચય કર્યો. સિદીકને એ ખખર પડી એટલે શાંખ નામનો એક રાખ તેનો મિત્ર હતો તેને તેડાવ્યો. બંનેને લડાઈ થછ તેમાં શાંખ માર્યો ગયો. વસ્તુપાળનો વિજય થયો. ત્યાર પછી ખંભાતમાં જાઘને સિદીકનું ધર ખોદતાં તેમને પુષ્કળ સોનું ને અવેરાત હાથ લાગ્યા. કંઈ છે કે એની કિભૂત ત્રણ અખ્યજ જેટલી થછ.

: ૭ :

એક વખત દિલહીને ખાદશાહ મોજુદીન.

ગુજરાત પર ચડાઈ લાગ્યો. આ ભાઇઓને ખરૂર પડતાં તે પોતાનું લર્હર લઈને આણુ સુધી સામે ગયા. ત્યાં ખૂનખાર લડાઈ કરી ને મોજુદીનના હાજરો માણુસોનો સંહાર કરી નાંખ્યો. બિયારો મોજુદીન હતારી થઈને પાછા ગયો. .

આ બધી લડાઈઓ પછી તેમણે સમુદ્ર કિનારા તરફ ચડાઈ કરી ને ત્યાં મહારાષ્ટ્ર સુધી પોતાની આણુ ફેલાવી.

આ પ્રમાણે બંને ભાઇઓએ નાના મોટાં ધણાં યુદ્ધ કરીને ગુજરાતની સત્તા ખરાખર જમાવી. ચારે બાજુ શાંતિ ને દ્યવરસ્થા સ્થાપી વિજયનો ડંડા વગાડ્યો.

: ૮ :

આ બંને ભાઇઓ લડાઈમાં ને રાજકોણમાં જેવા કુશળ હતા તેવાજ ધર્મમાં અડગ અદ્ધાવાળા હતા. તેઓ આઠમચૌદશનો તપ કરતા. સામાધિક પ્રતિકમણુ પણ નિયમિત કરતા. ધર્મબન્ધુ તરફનો પ્રેમ તો તેમને અથાગ હતો.

વરસ દિવસે એક કોડ ઇપિયા ધર્મબન્ધુઓને માટે ખર્ચવાનું તેમણે વત લીધું હતું.

તેમની ઉદારતાનો કાંઈ સુમાર નહાતો. તેઓ યુક્તિ હાથે ઢાન કરેંજ જતા હતા. અને બનતું પણ એમજ કે કેમ તેઓ ધન વાપરે તેમ ધન વધ્યાજ કરે. આથી બંને ભાઇઓ વિચાર કરવા લાગ્યા: ‘આ બનતું શું કરવું?’

તેજપાળની એ અનુપમાદેવી યુક્તિનો ભંડાર હતી. એટલે તેની સલાહ પૂર્ણી. તેણે જવાબ આપેયો કે આ ધન વડે પહોડનાં શિખરોને શોભાવો એટલે કે ત્યાં સુદર દહેરાં બંધાવો. આ સલાહ બધાને ગમી એટલે શરૂઆત, ગિરનાર ને આયુ પર લંબ્ય દહેરાં બંધાંયા. એમાં યે આયુનાં દહેરાસરો બંધાવતાં તો તેમણે ખર્ચ માટે પાછું વાળીને જેણું નહિ. તેમણે સારામાં સારા કારીગરો બોલાયા. ડાતરાણી કરતાં ભૂકા પડે તેટલું સોનું અને ઝુપું આપ્યું. આ દહેરાસરો જદ્દી પૂરા કરાવવા માટે પોતાના તરફથી રસોડું ઓલ્યું ને

શિયાળામાં દરેકની પાસે સગડી મૂકવાની ગોઠવણું  
કરી. આશરે બાર કોડ ઇપિયાના ખર્ચે એ  
દહેરાસર તૈયાર થયું જેનો બેટો આજે જગતમાં નથી.  
વિમળશાહના દહેરાની પાસેજ એ દહેરાસરો આ-  
વેલાં છે. પ્રિય વાંચક ! એ ટેલવાડનાં દહેરાં  
જંદગીમાં એક વખત તો જરૂર જેને.

આ ઉપરાંત તેમણે બીજા પણ ધણાં  
મંદિરો ને ઉપાશ્રો બાંધ્યાં. ધણા પુસ્તક-  
ભંડારો તૈયાર કર્યાં. શાંતંજ્ય ને ગિરનારના  
બાર વખત તો સંધ કાઢ્યા. એ સંધ એટલા  
માટા હતા કે આપણને તો તેનો ખ્યાલ પણ ન  
આવે. એક સંધમાં તો સાત લાખ માણુસ હતા.

એ ભાઈઓની સખાવત ડેવળ જૈન માટે  
કે ડેવળ ગુજરાતીઓ માટેજ નહોતી. તેમણે  
એક એક ધર્મવાળાને અને હિંદુસ્તાનકષરમાં  
સખાવતો કરેલી છે. ડેવારથી કન્યાકુમારી સુધી  
એવું એક પણ નાનું મોકું તીર્થ નથી કે જ્યાં આ  
ભાઈઓની સખાવત ન થઇ હોય. સોમનાથ પાટ-

ણુમાં દરવખેં દશ લાખ ને કાશી દ્વારિકા વગેરે  
ઠેકાણે એક લાખ ટંકા મોકલાવતાં. તેમણે શિવાલયો  
ને મરણહોં પણ ધર્યો ચણુાવી છે. વાવ, ઝ્વા ને  
તળાવ પણ બેસુમાર બાંધ્યા છે.

આ ખંને ભાઈઓના કુશળ કારબારમાં  
પ્રજ સુખી હતી. રાજ્યમાં ખંડોખસ્ત સુંદર હતો.  
અધા ધર્મના લોઢા પોતપોતાનો ધર્મ સારી રીતે  
પાળી શકતા. દેશમાં ફુકાળનું નામ નહોતું.

હવે રાણે વીરધવળ મરણુ પામ્યો. આ  
ભાઈઓએ તેની ગાઢી તેના પુત્ર વિસલદેવને  
આપી. પોતે પહેલાંની માર્ક રાજકારસાર કરવા  
લાગ્યા.

હવે અંતકાળ નજુક આવે છે એમ  
વસ્તુપાળને લાગ્યું એટલે તેમણે અધાની સાથે  
શનુંજયનો સંધ કાઢ્યો. રાજ વિસલદેવ અને  
રાજગોર સોમેશ્વર આંસુ પાડતાં જુદા પડ્યા.

રસ્તામાં એમને મંદ્વાડ થયો. અને તે  
મરણુ પામ્યા. તેમના શખને શનુંજય પર ખાળ-

વामां આંધ્રાં અને ત્યાં એક જૈન મંહિર બંધાંધું. લલિતાદેવી તેમની પાછળ અણુશાણુ કરી મરણ પામી. પાંચ વર્ષો તેજપાળ પણ ગુજરી ગયા ને અનુપમા દેવીએ પણ અણુશાણુ કરી પ્રાણ છોડ્યો.

જગતના મહામેંદ્રા રત્ન જવાથી ડાને ઢીલગીરી ન થાય? માનવજીતિના આભૂષણુ રૂપ આવી અનેક જેહીએ પાકો ને માનવજીતિને ઉળકાવો.

દરેક શાળા, પાઠશાળા તથા કુદુરે આહુક  
થવા ચોખ્ય માસિક

## જૈન શિક્ષણ પત્રિકા

તંત્રી : ધીરજલાલ ટોકરશી શાહ.  
ચાર્ચિક લવાજમ ફેફારી રી. ૧). આજેજ આહુક બનો.

જ્યોતિ કાર્યાલય, રત્નપોળ : અમદાવાદ.

# ખેમો—દેદરાણી

: ૧ :

ચાંપશી મહેતા ચાંપાનેરના નગરશોઠ.  
સાદ્વિલખાન ચાંપાનેરનો ઉમરાવ. અને એક  
દિવસ સાથે રાજકુલખારે જય. એવામાં હુક્કો  
ગગડાવતો બંભભાટ સામે મળ્યો. ઉમરાવને  
બેઇને બોલ્યો:

‘ધણું જ્વો સાદ્વિલખાન, ક્ષાત્રત્યાગ—  
નિઃકલંક પ્રધાન’ અને ચાંપશી શોઠ સામે  
બેઇ કવિત લલકાયુઃ

‘બરદ કહે દ્વાલદોહત્ય, રાયે બંધણ છોડ

સમર્થ;....કરણી કુશેર બીરદ અહુંધાર, વડહત્ય જગડૂ  
અવતાર.''

'હે શોઠ ! આપનું બિરુદ્ધ તો 'હુકાળ  
દ્વાહત્ય' ( હુકાળમાં ખૂબ મદદ કરનાર ) છે.  
આપ રાજયોને બંધનમાં નાંખવા કે છાડાવવા  
સમર્થ' છે.

'હે શોઠ ! આપની કરણી કુશેર કેવી  
છે. આપ ધણા ધણા બિરુદ્ધના ધારણું  
કરનાર છો અને મહાદાનેક્ષરી જગડુના  
અવતાર સમા છો.''

ચાંપશી મહેતાનાં આટલાં બધાં વખાણું  
સાંકળી સાદુલભાનને બહુ માદું લાગ્યું.

બંને રાજુદરખારમાં આંયા ને બાદશાહુ  
મહુમ્મદ બેગડાને સલામ કરીને એઠા. બાદશાહુ  
સાથે ફેટલીક વાતચીત કરી ચાંપશી મહેતા  
વિદ્યાય થયા. પાછળથી સાદુલભાને બાદશાહુના  
કાન કંલેર્યો: 'ગરીબ પરવર ! નેક નામદાર !

ભિખારી ભાટની જત આપનો ગરાસ ખાય  
છે અને વખાણું તો બકાલભાઈનાં કરે  
છે. આજ મારી સામેજ પેલા ખંખસાટે આપથી પણ  
વધુ વાણિયાઓનાં વખાણું કર્યા. માટે નામદારે તેની  
અખર લેવી જેઈએ. ’

બાદશાહ આ સાંભળી ચોક્યો. તેણે  
ખંખસાટને શૈલાની લાવવા સિપાઠ મોકલ્યા.  
ખંખસાટે આવીને બાદશાહને સલામ કરી  
તથા કવિત ગાઈ વખાણું કર્યાં. આ સાંભળી  
પાસે જિલેલા વળુરે કહ્યું: ‘બારોટ! આપ  
બાદશાહ સલામતનાં વખાણું કરો છો એ  
તો ઠીક છે પણ બકાલોનાં વખાણું કરો  
છો તેનું કાંઈ કારણું?’

ખંખસાટ કહે, ‘નામદાર ધણું જીવો! હું  
શાહ લોડાનાં વખાણું કરું હું કારણું કે તેઓ  
એ વખાણુને લાયક છે. એમના વડ-  
વાઓએ જે કામ કર્યા છે તે બીજ ફોણી  
થાય તેમ નથી.’

ખાદશાહ—શાહ તો ખાદશાહ કહેવાય.  
 ખાદશાહ ને ધારે તો દુનિયા આખીને  
 જવાડી રહે.

ખંલબાટ—જ હળુર ! આ શાહ  
 લોકોએ પણ એવાં કામો કરેલાં છે. તેરસો  
 પનરૈતરો ભયંકર દુકાળ પડ્યો ને કયાંઈ  
 ખાવા ધાન્ય રહ્યું નથી. ત્યારે જગડૂશાહે  
 દુનિયાને દાખેા પૂર્યો હતો. જગે જગે  
 અનાજના ભંડાર ભરાવ્યા હતા. રાજ મહારાજા-  
 એને પણ અનાજ ધીર્યું હતું ને ભોતના ભોદમાંથી  
 સૌને બચાવ્યા હતા. તે દિવસથી એમને ‘દકાલ  
 દોહૃત્ય’ નું માનવંતુ બિઝું મળ્યું છે. ’

ખાદશાહ કહે, ‘દીક. વખત આવતાં  
 પરીક્ષા થશે. અત્યારે જવ.’ ખંલબાટ રવાના  
 થયો. ખાદશાહે મનમાં ગાંઠ વાળી ડે ભાટનાં  
 વખાણું ઓટાં પાડવાં.

: ૨ :

ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો છે.

નથી મળતો ધાસચારો કે નથી મળતાં અજ વખ્ય. ઢારઢાંખર મરવાં પડ્યાં છે. માણુસોનાં ટોળાં ‘ અજ અજ ’ કરતાં રખડવા લાગ્યાં છે.

બાદશાહે આ અણું એટલે નક્કી કર્યું કે આ વખતે વાણિયાઓની પરીક્ષા લેવી. એટલે તેણે ભાટને બોલાયો ને કહ્યું: ‘ અયે ભાટ ! જો તું કહેતો હુતો એમ શાહ સાચા શાહ હોય તો આપા ગુજરાતને એક વરસ સુધી જીવાડે. નહિતર શાહ કહેનાર ને કહેવડાવનાર બંને ગુનહેગાર છે.’ ભાટ કહે, ‘ નામદાર ! કણૂલ. ’

તેણે આવીને ચાંપશી મહેતાને વાત કરી કે બાદશાહ સાંથે હોડ થઈ છે. જો ગુજરાતને આ હુકાળમાં એક વરસ સુધી જીવાડે તો શાહ ખરા. નહિતર શાહ કહેનાર ને કહેવડાવનાર બંને ગુનહેગાર છે. આ સાંભળી ડેટલાક જિચા નીચા થઈ ગયા પણ ચાંપશી મહેતાએ વિચાર કરી જણાયું: ‘ જે બિઝું ખાપદાદાઓએ મહામહેનતે મેળયું તેને આમ

છીડી તો નજ દેવાય. બાટનાં વખાણ જૂઠાં ન પડવાં  
નેથેએ. ભાટ ! એક મહિનાની મુદ્દત માગ.  
મહિનાની આપરે મહાજન કાં તો ગુજરાતને વરસ  
સુધી જીવાડવાનું માણે લેશે; કાં તો શાહ શાહ  
અટક મૂકી દેશે.'

ભાટે જઈને મહિનાની મુદ્દત માગી.  
ખાદ્યાડે તે મંજુર રાખી.

: ૩ :

ચાંપશી મહેતાએ મહાજનને એકદું કર્યું ને  
ખધી વાત વિસ્તારથી કહી સંભળાવી. મહાજન કહે,  
'કરો ટીપ.' ચાંપાનેરના ખધા શેડિયાઓના  
નામ ઉતાર્યો. એક પછી એક દિવસ  
ભરાવા લાગ્યા. ખધા દિવસ ભરાવી  
રહ્યા ત્યારે ચાર મહિના થયા. હવે ખીજ  
આડ મહિનાનું શું કરવું ? એટલે ખીજ ગામ  
જવા વિચાર કર્યો.

પાટણ તે વખતે મોકું શહેર. ત્યાં ધણા  
શેઠ-શ્રીમંત રહે. ચાંપશી મહેતા તથા ખીજ

થાડા આગેવાનો પાટણ ચાલ્યા. પાટણના મહા-  
જને તેમની બહુ સરભરા કરી ને મહાજનને  
ભેગું કરી ટીપ કરી. ત્યાં કે મહિના નોંધાયા.  
પછી ટીપ કરનારા ચાલ્યા ધોળકા. ધોળકામાં દશ  
દિવસ નોંધાયા.

આ ટીપ કરતાં કરતાં વીચ દીવસ તો ચાલ્યા  
ગયા. ફેરફાર દશ દિવસ ખાકી રહ્યા. દશ દિવસમાં  
ધોળકાથી ચાંપાનેર જવું એટલે મહાજન  
ગુરુપથી ધંધુંકે જવા નીકળ્યું. રસ્તામાં હૃડાળા  
ગામ આંદ્રું.

હૃડાળામાં એમો કરીને એક  
શાવક રહે. તેને ખખર પડી કે ચાંપાનેરનું  
મહાજન મારી ભાગોળે થઇને જય છે. એટલે  
તે દોડતો ગામ અહાર આંદ્રો ને હાથ જોઈ  
વિનંતિ કરવા લાગ્યોઃ ‘મારી એક વિનંતિ  
સ્વીકારો.’ ચાંપશી મહેતા તથા બીજ આ  
ચિંથરેહાલ વાણિયાને જોઇ મનમાં કચવાયા.

‘જ્યાં જઈએ ત્યાં આપણી પાસે માંગનારા તો  
ખરા જ. આને વળી શું વિનંતિ કરવાની હશે?’  
તે બોલ્યા : ‘શેઠ! અવસર એઈને જે માગવું હોય  
તે માગો.’

એમો કહે : ‘શિરામણી માટે મારે  
ત્યાં પવારો.’

ચાંપણી મહેતાને નિરાંત થઈ કે એને  
કંઈ મદ્દ માગવાની નથી. પછી તેમણે જવાખ  
આપ્યો કે ભાઈ ! અમારે ધડીકે રોકાવું પાલવે  
તેમ નથી. બહુ અગત્યના કાગે જવાનું છે.  
એમો કહે, ‘ગમે તેમ થાય પણ તમારા  
સ્વામીભાઈનું આંગણું પાવન કરો. બરાબર  
શિરામણી ટાંણે અહીંથી એમને એમ જવાય  
નહિ. ’

સ્વામીભાઈનું નોતરું પાણું ન ડેલાય. એટલે  
સહુ શિરામણી માટે એમાને ત્યાં ગયા.

એમાંચે ખાખરા દહીની શિરામણી કરાવી.  
એટલે મહાજન કહે, ‘હવે અમે જઈશું.’

એમો કહે, ‘શેઠળ ! હવે જમવાને  
થાડી વાર છે. થોડીવારમાં ગરમ રસોઈ તૈયાર  
થઇ જશે. માટે આપ જમીને ઘુશીથી પદ્ધારાને?’  
એમાંચે તો શીરાપૂરી બજ્યાં વગેરે ભિષાન  
કર્યાં ને મહાજનને ખૂબ હેતથી જમાડયું.

મહાજન જમી જિઠયું એટલે એમાંચે  
પૂછ્યું: ‘આપને શા કામે નીકળવું પડયું છે તે  
જણાવો.’ ચાંપશી મહેતાએ કહ્યું: ‘જુઓ શેઠ !  
અમે ચાંપાનેરથી ટીપ કરવા નીકળ્યા છીએ. બાદ-  
શાહે અમને હુકમ કર્યો છે કે એક વર્સ સુધી આ  
દુકાળમાં લોકાને જીવાડો નહિતર શાહુપદ છોડી દો.  
આપણા પૂર્વનેએ કેટકેટલાં કામ કરીને આ પદ  
ચેળ્યું છે ? એ પદ કાંઈ એમ છાડી દેવાય ?  
એટને મહાજને મહિનાની મુદ્દત માગી છે. ચાંપાને-

રમાં ચાર મહિના નોંધાઈ ગયા છે. પાટથુના  
મહાજને એ મહિના નોંધાવ્યા છે. ધોળકાના  
મહાજને દશ દિવસ નોંધાવ્યા છે. પણ હજુ પાંચ  
મહિનાને વીશ દિવસ બાકી રહ્યા! અને બાદશાહે  
આપેલી અમારી સુદૃતમાં હવે દસ દિવસજ બાકી રહ્યા  
છે. એમા શેઠ! શાસનદેવ બધાં સારાં વાનાં કરશે.  
પણ આ કારણે અમને જવાની ઉતાવળ છે માટે  
રજ આપો. તમે અમારી બજુ સેવાલક્ષિત કરી  
છે! હવે ડોઈ વખત ચાંપાનેર પંચારો! તો જરૂર  
અમારે ત્યાં આવનો.' એમાંચે આ બધી વાત  
સાંભળી કહ્યું: 'આપ આમ જવાની ઉતાવળ કરશો  
નહિ. મારા ધરડા પિતાએ તો હજુ તમારાં દર્શન  
પણ કર્યાં નથી. માટે એમને મળીને હું આવું છું.  
વળી આપની ટીપમાં પૂલ નહિ તો પૂલની પાંખડી  
પ્રમાણે હું પણ કંઈક લખાવવા ઈચ્છા રાખું છું.'

આ સાંભળી ચાંપણી અહેતા મૂછમાં હુસ્યા.  
બીજુ પણ અંદર અંદર ઇસારો કરવા લાગ્યા.

ખધાને લાગ્યું કે આ ચીથરેહાલ શાવક ટીપમાં શું  
ભરશે ?

એમા પોતાના ધરડા પિતા દેદરાણી પાસે  
ગયો. ત્યાં જઈને ખધી વાત કરી. દેદરાણી કહે,  
'એઠા ! ધન ડાઈની સાથે ગયું નથી ને જરો  
પણ નહિ. નાણું મળે છે પણ ટાણું મળતું  
નથી. આ તો ધેર એઠાં ગંગા આવી છે. આ તો  
ખાપદાદાની આખર સાચવવાની વાત છે. જરાય સંકાય  
કરીશ નહિ. લેવાય તેટલો લાલ લે.' એમાએ પિતાની  
પાસેથી પાછા આવી ટીપ માગી. અને તેમાં ૩૬૦  
દ્વિસ ભરી ટીપ ચાંપશી મહેતાના હાથમાં ઝૂકી.

આ નેંધ સહુ હેખતાઈ ગયા. ધડીભર  
વિચારવા લાગ્યા કે એમાને ગાંડપણું તો નથી  
આવ્યું ? ચાંપશી મહેતા કહે, 'એમા શેઠ ! જરા  
વિચાર કરીને લખો.'

એમા શેઠ કહે, 'બહુ થાડું લખ્યું છે.  
શેઠજી ! કૃપા કરીને એ રહેવા દો. શહેરમાં  
રહેનારાઓને તો આવા સારા કામના ધણું પ્રસંગ

મળો. પણ અમને તો કોઈ દુષ્પાડો મળો. માટે કૃપા કરો !’  
 પછી એમો મહાજનને પોતાના ઝૂંપડા જેવા દેખાતા  
 ધરની અંદર લઇ ગયો. ત્યાં ભોયરે હતું તેમાં  
 લઈ ગયો અને ત્યાં રહેલું ધન બતાઓ.

બધા તો મોંસાં આંગળી નાંખી જોઈજ  
 રહ્યાઃ ‘આટલા ધનનો માલિક આવા વેશો ? અને  
 આવા ધરમાં ? ધન્ય છે એમા ! આટઆટલું  
 ધન છતાં તારે નથી જરાએ માન કે નથી  
 જરાએ મોટાઈ !’

પછી બધાએ કહ્યું: ‘એમા શેઠ ! હવે  
 આ કપડાં કાઢી નાંખો ને સારાં કપડાં પહેરી  
 લો. કારણું કે તમારે બાદશાહની આગળ જવાનું  
 છે.’ એમો કહે, ‘બલે ! બાદશાહની આગળ  
 જવાનું હોય એમાં ભપકાદાર કપડાં પહેરવાની  
 શી જરૂર છે ? શેઠજ ! અમે તો ગામડિયા  
 આવા પોશાકમાં સારા. અમારે શાલકુશાલાનું  
 કામ નહિં.’

આંપશી મહેતા કહે, ‘ખરેખર ! શેઠ

તો તમે છો. અમે તો તમારા ગુમાસ્તા છીએ. ' પછી એમા શેઠને પાલખીમાં એસાડી ચાંપાનેર લીધા. બીજે દિવસે ચાંપશી મહેતા ને મહાજન એમા શેઠને લઈને કચેરીમાં ગયા.

એમા શેઠે તો એજ ફાટેલા તુટેલ અંગ-રણું ને ચિંથરિયા પાધડી બાંધિલી. હાથમાં એક નાની સરખી પોટલી.

બાદશાહે ચાંપશી મહેતાને જોઈ પૂછ્યું: 'કેમ મહેતા ! શું કરી લાવ્યા ? '

ચાંપશી મહેતાએ એમા શેઠને બતાવીને કહ્યું: ' ગરીબ પરવર ! અમારી ઢામના આ શેઠ આપા ગુજરાતને ૩૬૦ દિવસ સુધી ભર્ઝત અનાજ પુરું પાડયે. ' બાદશાહ એમાનો મેલોધેલો વેશ જોઈ ચમક્યા. તેણે એમાને પૂછ્યું: ' શેઠ ! કાંઈ મરકરી તો નથી કરતા ને ? '

એમો-જહાંપનાહ ! અમારી શી તાકાત કુઝુદ્વિંદની મરકરી કરીએ ? ચાંપશી મહેતાએ જે વાત કહી તે બરાબર છે.

બાદશાહ-તમારું નામ ?

એમો-એમો.

બાદશાહ-ક્યાં રહો છો ?

એમો-હડાળા ગામભાં.

બાદશાહ-તો આપ એક વર્ષનો બરાબર  
બદોખસ્ત કરી શકશો ?

એમો-જ હજુર ! મારા પિતાજની એવી  
આજા થઈ છે.

બાદશાહ-તો થું તમારા પિતા હજ જવે છે ?

એમો-જ હજુર.

બાદશાહ-તેમની ઉમ્મર થું છે ?

એમો-નવાજું વરસ.

બાદશાહ-અને તમારી ઉમ્મર.

એમો-ચેંશીભાં એ વર્ષ ઓછાં છે.

બાદશાહ-એટલી ઉમ્મર તમારા શરીર  
પરથી દેખાતી નથી. વારુ તમારે ડેટલાં ગામો છે ?

એમો-એ ગામો છે.

બાદશાહ-કયાં કયાં ?

એમો-પળી અને પાલી.

એ વખતે એમાચ્ચે પોતાની પાસેની નાની સરળી પોટલી છોડી અને તેમાંથી તેલ ભરવાની પળી અને અનાજ માપવાની પાલી કાઢી. બાદશાહ આગળ તે ખંને વસ્તુઓ રજુ કરીને કહ્યું:

‘આ પળી જરીને આપું છું ને પાલીથી લઈ છું.’ બાદશાહ આથી ખૂબ ખૂશ થયા અને એમાને ધન્યવાદ આપી કહ્યું: ‘શેઠ! તમારું જીવન સપ્રગળ છે. પૈસા તો ધણું બેગા કરી જાયે છે પણ આવી રીતે ડાઈને વાપરતા આવડતા નથી. ખરેખર તમે ‘શાહ’ પહીને લાયક છો.’ એમ કહી બાદશાહ મોતીનો કંઠો પોતાના હાથેજ એમા શેઠના ગળામાં પહેરાવ્યો.

એ વખતે ખંબલાટ પણ હાજર હતો. તેને જોઈને બાદશાહે કહ્યું કે ‘તમે કરેલાં વખાણું સાચાં પડ્યાં છે. માટે તમને ૧ ગામ, ૧ હાથી,

૨ ધોડા, અને ૨૦૦૦ ઝ્રો. રોકડા ઈનામ તરીકે  
આપું છું.

એમાશાહે એક વરસ સુધી આખા ગુજરાતને ભરત અનાજ વહેચું. લાઘો માણુસ ભૂખમરાથી ભરતા બચ્ચી ગયા. એમાશાહને આશીર્વાદ આપવા લાગ્યા.

ધન્ય છે એમાશાહની ઉદાર સખાવતને !

ગુજરાત હિનેખીમે દુકાળમાંથી ઉગયો  
એટલે એમાશાહે શાંજયની યાત્રા કરી. પછી  
પવિત્ર જીવન ગાળી પોતાનું આયુધ્ય પુરું કર્યું.  
આ દાનવીરના વખતથી એક કહેવત યાલતી  
આવે છે કે ‘ એક શાહ વાણિઓ ને ખીંલે શાહ  
બાદશાહ.’

ભારતવર્ષમાં આવા અનેક એમા-દેદરાણીઓ થાવ !



# જગડુશાહ

કરું દેશમાં લદ્રેથર ગામ. ત્યાં રહે એક શેઠ-  
શેઠાણી. શેઠનું નામ સોલક ને શેઠાણીનું નામ લખ્યાં.  
તેમને થયા ત્રણ દીકરા. એકનું નામ જગડુ, બીજાનું  
નામ રાજ ને ત્રીજાનું નામ પદ્મ. ત્રણે ભાઈ સાહ-  
સિક, બહાદુર ને હોશિયાર. પણ તેમાં જગડુ સંદૂચી  
એ.

સોલક શેઠનો વેપાર ધર્મધોકાર ચાલે. શું દેશ  
કે શું પરદેશ ! એથી અનેક આડતિયા એમને ત્યાં  
આવે ને જય. જગડુ એ બધાને બેઈ આનંદ પામે,  
તેમની પાસેથી નવી નવી વાતો સાંખળો. ધણી વખત

એ પોતાની ભાતાને કહે કે ‘મા હું ! મોટા થઈશ ત્યારે  
સો વહાણો લઈને સુસાફી કરીશ અને પુષ્કળ પૈસો  
કમાઈ લાવીશ.’

ભાતા એ સાંભળી તેને છાતી સરસો ચાંપી લે.

એમ કરતાં તણે ભાઇઓ ઉમ્મર લાયક થયા  
એટલે તણેને સારા ધરની કન્યાઓ પરણું વી. જગડુને  
યશોમતી, રાજને રાજદલદે અને પદ્ધને પદ્ધા.

દીકરા હજ પહેલી વીઠીમાં છે ત્યાં સોલક  
આવક ભરણું પામ્યા. તણે ભાઈને ખૂબ શોક થયો.  
પણ શોક કર્યે શું વળો ? જગડુએ ધીરજ ધરી ધરનો  
અધો કારકાર ઉપાડી લીધો.

તણે ભાઇમાં જગડુ ખૂબ હેઠિયાર. તેનું મન  
ધણું મોઢું. હૈચું હેતથી છલોછલ. દાનમાં તો તેની  
નેડીજ નહિ. કોધ પણ ગરીબગરણું કે માગણુંબિખારી  
આંદું તો જગડુના આંગણેથી પાછું ન જય.

જગડુ સમજતો! કે ધન તો આજ છે ને કાલ  
નથી. માટે તેનો લેવાય તેટલો લાલ લઘ લેવો. એટલે  
દાન દેવામાં જગડુ પાછું વાળીને જુવે જ નહિ.

ધન ધીમે ધીમે ધટવા લાગ્યું. જગડુને ચિંતા  
થવા લાગી કે ‘શું એવો વખત આવશે કે મારા આં-

ગણેથી ઢાઈને ખાલી હાયે જવું પડશે ? હે નાથ !  
એવો વખત લાવીશ નહિં.''

જગડૂ આવી ચિંતામાં રહે છે ત્યાં એક દિવસ તેના  
ભાગ્યે બેર કર્યું. ગામની લાગેલે તેણે એક બકરાનું  
ટ્યાળું બેધું. એ ટોળામાં એક બકરીના ગળે મણિ  
ખાંધિલો. તે ધણેાજ કિભૂતી પણું ભરવાડને એની શી  
ગમ હોય ? એણે તો કાચ માનીને બકરીની ડોક  
ખાંધ્યો હતો.

જગડૂએ વિચાર્યું કે આ મણિ હોય તો જગમાં ધાર્યું  
કામ થાય. માટે લાભ આ બકરીને જ ખરીદી લઇં.  
તેણું થાડા પૈસા આપી એ બકરીને ખરીદી લીધી.  
હેતે તેને ધનની ઘોટ રહી નહિં.

તેણે દેશદેશાવર વેપાર કરવા માંડયો. શું જમીન  
પર ! શું દરિયા પર ! જમીન કરતાં યે જગડૂશાહનો  
વેપાર દરિયામાં ખૂખ ચાલે. દુર્દૂરના દેશોમાં પણ  
જગડૂનાં વહાણું જય ને ત્યાં માલની લેવડટેવડ કરી  
પાછા આવે.

એક વખત જગડૂશાહનો જ્યાંતસિંહ નામે એક  
ગુમાસ્તો ઈરાન દેશના હોમ્ર્ઝ બંદરે ગયો. ત્યાં દરિયા  
કિનારે એક મોટી વખાર રાખી. તેની પાડાશની  
વખાર ખંબાતના એક મુસ્લિમાન વેપારીએ લીધી.

હવે એક વખત એવું થયું કે એ વખારો વચ્ચેથી  
એક સુંદર પત્થર નીકળ્યો. જ્યંતસિંહ કહે, ‘એ પત્થર  
આરો’ ને મુસલમાન વેપારી કહે, ‘એ પત્થરે ભારો.’ એમ  
કરતાં તકરાર થઇ.

મુસલમાન—આ પત્થર માટે હું અહીંના રાજને  
હાજર દિનાર આપીશ.

જ્યંતસિંહ—હું એ હાજર દિનાર આપીશ.

મુસલમાન—હું ચાર હાજર દિનાર આપીશ.

જ્યંતસિંહ—હું એક લાખ દિનાર આપીશ.

મુસલમાન—હું એ લાખ દિનાર આપીશ.

જ્યંતસિંહ—હું ત્રણ લાખ દિનાર આપીશ.

મુસલમાન વેપારી આખરે ઠડો પડી ગયો.  
જ્યંતસિંહે ત્રણ લાખ દિનાર આપી પત્થર લઈ  
લીધી. પછી તેને વહાણમાં નાંખી ભદ્રેક્ષર લાવ્યો.

કાઇકે જઈને જગડૂને આ સમાચાર કણ્ણા કે  
તમારો ગુમાસ્તો બહુ ધન કમાએ લાવ્યો. ત્રણ લાખ  
દિનાર દ્વારાં એક પત્થર લાવ્યો.

જગડૂ કહે, ‘ધન્ય છે એને કે મારી આખરૂ  
વધારી.’

પછી ધામવુમથી જ્યંતસિંહને તથા તે પત્થરને

ઘેર લાંયા.. જ્યાંતસિંહે બધી વાત કરી અને કહ્યું:  
 ‘આપની આખરું ખાતર મેં આટલા બધો પૈસા  
 ખર્ચ્યો છે. હવે આપને જે શિક્ષા કરવી ધટે તે કરો.’  
 જગડૂ કહે, ‘જ્યાંતસિંહ! ગાડો થયો કે શું? તેંતો  
 મારી આખરું વધારી એટલે તને તો મારે શીરપાવ  
 આપવો જોઈએ.’ એમ કહી એક કશથી પાધડી અને  
 મોતીની કંઠીનો શીરપાવ આપ્યો.

આ પત્થર તેણે ધરના અંગણુમાં જડ્યો. એક  
 વખત એક જેગી બાવા બિક્ષા લેવા આંયા.  
 તેમણે આ પત્થર જોઈને જગડૂને કહ્યું: ‘બચ્ચા!  
 આ પત્થરમાં કિમતી રતો છે, માટે એને તોડિને  
 લઈ લો.’ જગડૂએ તેમ કહ્યું. તને પૈસાનો પાર  
 રાખો નહિં.

: ૩ :

જગડૂશાહુને રિદ્ધિ સિર્દ્ધિ ખૂબ થધ પણ પુત્ર ન  
 થયો. એક દીકરી થઈ. તે પણ પરણાવતાંજ રાંડી.  
 આથી તેમને ખૂબ દુઃખ થયું. પણ એ હસના રોઢણું  
 ન રોતાં તેમણે ધર્મનાં કાર્યો કરવા માંડ્યાં અને  
 એથી પોતાના આત્માને થાંત કર્યો.

૪ :

એક વખત પાર દેશના પીઠદેવ રાજાએ ભદ્રેશ્વર પર ચડાઈ કરી ગામને ભાંગી નાંખ્યું. ધણી માલમત્તા હુટી લીધી. પછી તે પોતાના દેશ પાછો ફર્યો. આ નેથ જગડૂશાહે ભદ્રેશ્વરનો કિલ્લો ફરી બાંધવા માંડયો.

અલિમાની પીઠદેવે આ સમાચાર સાંભળ્યા એટલે જગડૂને કહેવરાયું: ‘અ ગધેડાને શીંગડાં ઉગે તોઝ તું એ કિલ્લો કરાવી શકીશ.’

જગડૂશાહ કહે, ‘ગધેડાને શીંગડા ઉગાડીને પણ એ કિલ્લો હું કરાવીશ. અને તેમણે પીઠદેવની દરકાર કર્યા વગર કિલ્લો કરાવવા માંડયો. કિલ્લાની હિવાલમાં તેમણે એક ગધેડો ઢોતરાયો. ને તેના માણે એ સોનાના શીંગડા મૂક્યા. હવે મોટા સાથે વેર થયું માટે ચેતતા રહેતું એમ વિચારી તે ગુજરાતના રાજ વિસલદેવને મળ્યા અને બધી હકીકિત કહી એક મોકું લર્કર લઈ આય્યા.

પીઠદેવને આ સમાચાર મળ્યા લારે તે ઠડો પડી ગયો. ગુજરાતના લર્કર સાથે લડવાની તેની હિંમત ન હતી. પણ તેને વિચાર થયો કે કિલ્લો અનાવવાનું કામ તો રાજાઓનું છે. વાણિયા લાઇએ

બંધાવેલા કિલ્લામાં થી ભલીવાર હશે? એટલે એક વખત અને નજરે જેવો. આમ વિચાર કરી એણે જગડુશાહને સંદેશો કહેવડાયો: ‘પહેલાંની વાતો ભૂલી હશે. હવે તો તમારી સાથે સંબંધ રાખવા ઈચ્છું છું.’

નિર્ભય જગડુશાહે તેનો સ્વીકાર કર્યો અને કહ્યું: ‘આપ ઝુશીથી પદારો.’

પીઠદેવ જગડુશાહનો જ મહેમાન થયો. જગડુશાહે તેની સારી રીતે ખરદાસ કરી. જોજન વગેરેથી પરવાર્યા પછી પીઠદેવે કિલ્લો જેવાની ઈચ્છા પ્રગટ કરી. જગડુશાહ પોતાના ભાણુસેં સાથે પીઠદેવને કિલ્લા પર લઈ ગયા. ત્યાં ફરી ફરીને બધી વસ્તુઓ બતાવી અને પેલો ગધિડો પણ બતાવ્યો!

પીઠદેવને આ જોઈ ઇવે ઇવે આળ લાગી ગઈ. પણ કરે શું? તે અહીંથી પાછો ક્ર્યા પછી બિમાર પડી ગયો ને મરણું પામ્યો.

: ૫ :

જગડુશાહ ચુસ્ત જૈન હતા. પણ દરેક ધર્મના સોઢા સાથે પ્રેરથી વર્તતા હતા! તેમણે શત્રુંભ્રય અને ગીરનારના ભાવ્ય સંધો કાઢીને યાત્રા કરી. અનેક મંદિરોનો અને તળાવોનો જણોછાર કરાયો. અને ધીબાળાનાં મંદિરોને પણ ચોણ્ય મદદ કરી.

તેમને ત્યાં દેશાવરથી મુસલમાન વેપારીએંબા આવતા તેમને નમાઝની અડચણ ન પડે તે માટે ખીમલી નામની એક ભરળું પણ ચણુંબા.

: ૬ :

એક વખત પરમદેવસૂરિ નામના આચાર્ય ભદ્રેશ્વર પદ્ધાર્યો. જગડૂશાહ તેમનું વ્યાપ્યાન સાંભળવા ગયા. તેમાં આચાર્યે દ્વાન ઉપર જ વ્યાપ્યાન ચલાયું. લોડા એ સાંભળી માથું ધુણુવવા લાગ્યા. આચાર્યે આ જેઈ વ્યાપ્યાન પુરું થયા પછી જગડૂશાહને એકાંતે બોલાવીને કહ્યું: ‘હે શેડ ! તમારી લક્ષ્મીને વાપરવાનો એક ખરો પ્રસંગ આવી રહ્યો છે, સેવાનું એ જોહું કામ છે. બોલો એ કરી શકશો ?’

જગડૂશાહે નમૃતાથી કહ્યું: ‘એમાં શું ? ગુરુદેવનું વચન શિર સાટે પણ હું કણુલ રાખીશ.’

‘પણ એ કામ લાખ બે લાખ રૂપીયાનું નથી !’ ગુરળુંએ ભૂળ વાત ઉપર આવવા માંડયું.

‘એ કામ ગમે તેટલું હોય તો પણ કીકર નહિ. મારી શક્તિનું તો છે ને ?’ જગડૂશાહે શાંતિથી ઉત્તર આપ્યો.

‘હા, તારી શક્તિનું તો જરૂર છે. ’

‘કીક, ત્યારે કરમાવો. ’

પરમદેવસ્તુરિએ તેને જણાયું કે સંવત ૧૩૧૩-૧૪ અને ૧૫ ની સાલમાં ત્રણુ વર્ષ ઉપરાઉપરી ભયંકર દુકાળ પડશે જેથી દુનિયા બેહાલ થઈ જશે. માણુસો કીડી મંડેડીની જ્ઞાન ભરવા માંડશે માટે અગમચેતીથી તારાથી બને તેટલું ધાન્ય તું લરી રાખ અને દુકાળમાં સહુને એ ધાન્યથી જ્વાડ. મનુષ્યસેવાનો આવો મણાન લાભ ફરી મળવો મુશ્કેલ છે.

શુક્રના જ્યોતિષજ્ઞાન પર જગડૂશાહને અચળ અછ્છા હતી. દ્વારયમાં પરોપકાર કરવાની વૃત્તિ પણ ભરપૂર હતી. જે વખતે દુનિયા માથે દુઃખ તૂઢી પડે તે વખતે પોતાનો પૈસો કામ આવે એવા સહભાગ્ય કયાંથી હોય? એ વિચારે જગડૂશાહે તરતજ પોતાની પેઢી પર કાગળો લખ્યા કે જે ભાવે જેટલું અનાજ મળે તે તમામ સંધરવા માંડો અને ત્યાંજ તેના ડોડાર ભરો.

આ વખતે જગડૂશાહની દુકાનો ઉત્તરમાં ગી-અની-કંદહાર સુધી, પૂર્વમાં બંગાળા સુધી, દક્ષિણમાં રામેશ્વર સુધી અને દરિયા પારના મુલકામાં પણ ઠેર ઠેર હતી. એ વખતે તે હિંદુસ્થાનના અલેહ શાહુસ્થાન સોદાગર લેખાતા. તેમની પેઢીઓને પત્ર મળતાં જ આ જતની ખરીદીએ શરૂ થઈ અને લાગલાગાઈ એ વર્ષ સુધી એ ચાલુ રહી.

જગડૂશાહના ધ્યાનના ડોડારો ભરાઈ ગયા. આ બધા ડોડારમાં જગડૂશાહે અફેક તાંખાનું પતરું નાંખાવ્યું અને તેમાં ફુકુત આટલાજ શરદ્દા લખ્યા :

“ આ કણુ ગરીબોને માટે છે. ”

જગડૂશાહે.

સંવત ૧૩૧૩ની સાલ હતી. એકુતોએ જમીનો એડીને તૈયાર રાખી હતી. મેધરાબની મહેર થવાની સહૃદ ડાઢ રાહ નેતું હતું પણ અખાડો મેહ આવ્યો નહિ. આવણુ ને લાદરવો પણ ખાલી ગયો. ખરેખર ભયંકર ફુકાળની શરૂઆત થઈ ! લોડા લમણે હાથ મુકી નિરાશ થયા અને આવતા વરસે તો ભગવાન કૃપા કરશે એમ આશા રાખી જેમ તેમ દિવસો પસાર કરવા લાગ્યા. જગડૂશાહે આ વખતે ડેટલીક સદાવત-શાળાએ ખોલી દીધી ને તદ્દન નિરધાર માણુસોને ફુકાળમાંથી ઉગારી લીધા. આ ઉડાઉડનો સમય મુશ્કેલીથી પસાર કરતા સંવત ૧૩૧૪નો જેઠ મહિનો આવ્યો અને અંધારિયાની શરૂઆત થઈ. પણ આકાશમાં વરસાદે ગોરંભો ધાદ્યો નહિ. લોડાના જીવ તાળવે ચાદી ગયા. હવે અખાડ તરફ મીટ માંડી. પરંતુ અખાડ પણ હગારો નીકળ્યો ! શાવણુ માસમાં પાણુના એ ચાર બુંદ નાંખી મેધરાબ રિસાઈ ગયા ને ફરી ન દેખાયા તે નજ દેખાયા ! !

કુકાળ ઉપર કુકાળ પડવાથી લોડા હિસ્તત  
હારી ગયા. એક વરસ તો મહા મુશીખતે  
પસાર કર્યું હતું પણ હવે ડેવી રીતે દિવસો  
ગુલ્ફરવા ? ખાવા અન્ન નહોતું અને આ કુકાળ  
દેશના એકજ ભાગમાં નહિ પણ આખાએ હિંકુસ્તા-  
નમાં હતો. એટલે બીજ ભાગમાંથી મદ્દ મળે તેમ  
નહોતી. કુકાળના આ નાસથી હજરો ગામડાં ઉજ્જવલ  
થઈ ગયાં ને ચારે ખાનુ લુંટ્પાટ થવા લાગી. અના-  
જના ભાવ ચારથી પાંચ ગણા થઈ ગયા છતાં જેઈતાં  
અનાજનાં સાંસા પડવા લાગ્યા. વેપારીઓના તમામ  
કોડારો પણ ઘલાસ થઈ ગયા હતા ! જગડૂશાહે આ  
વખતે પણ લોડાને ભારે રાહત આપી અને અનેક  
નવી સદ્ગતશાળાએ ખોલી દીધી. લોડા જગડૂશાહની  
આ ઉદ્ઘારતા જેઠ તેની પરમેશ્વરની જેમ પૂજા કરવા લાગ્યા  
પણ નિઃબિભાની જગડૂને એતું કાંઈ નહોતું. હજ  
ભયંકર આદતનું એક વર્ષ ભાડી હતું તે એ સારી  
રીતે ભણુતા હતા.

અને એ ભયંકર વર્ષ પણ ધીમે ધીમે આવી  
પહોંચ્યું. નિઃહુર મેધરાન્યે ૧૩૧૫ ની સાલમાં પણ  
દ્રગો દીધી. પાણીનું ઝુંદ મૂક્યું નહિ અને લોડાનાં  
હૃદ્ય ભયંકર ભવિષ્યના વિચારે ચિરાધ જવા લાગ્યા.  
અનાજનો ભાવ પાવલીના તેર ચણા પર જઈ પહોંચ્યો.

અને ખાવા માટે ઠેરઠેર હુલ્લાડો થબા લાગ્યા. વૃષ્ણીનાં  
પતાં તથા ધાસ સુદ્ધાં આ હુકાળિયાઓએ સપ્તાચટ કરી  
નાખ્યા! ડેટલેક ડેકાણે તો બાળકોને જુંછુને પણ  
લોકોએ ભૂખ મટાડી! કોઈ રાજના ડોઢારમાં પણ  
અનાજ રહ્યું નહિ! આ વખતે બધાની નજર જગડૂ-  
શાહ ઉપર પડી અને જગડૂશાહ પણ બરાબર  
દાતાર થયા.

ગુજરાતના મહારાજ વીસલદેવે જગડૂશાહને  
બોલાવ્યા અને કહ્યું: ‘જગડૂશાહ! તમે લોકાની જે  
સેવા કરો છો તેથી અમે બફુ રાજુ થયા છીએ પણ  
હવે અમારું પણ થોડું કામ પડશે.’ જગડૂશાહે  
નભ્રતાથી કહ્યું: ‘મહારાજ! એ શું બોલ્યા? સેવકને  
કોઈ પણ હુકમ કર્યાવો.’

વિસલદેવે કહ્યું: ‘અમે સાંભળ્યું છે કે આ  
પાટણમાંજ તમારા ધાન્યના ૭૦૦ ડાઢારો છે તો  
એમાંથી થોડું કંધાણ્ય અમોને પણ આપો.’

જગડૂશાહે કહ્યું: ‘મહારાજ! મારી વતીનું જરા  
પણ અનાજ આ પાટણમાં નથી. ખાતરી કરવી હોય  
તો એ ડાઢારો ઉધાડીને જુઓ.’ મહારાજ વીસલદેવે  
એક ડાઢાર ખોલાવીને જેયું તો અંદરથી નાંખાની  
તકતી નીકળી. તેમાં લઘ્યું હતું કે-

‘આ કણું ગરીઓ માટે છે.’

જગડૂશાહે.

જગડુશાહે આ દુકાળમાં જુદાજુદા રાજ્યાને  
આપેલા અનાજની સામાન્ય યાદિ નીચે મુજબ છે;—

	મણું
ગુજરાતના રાજ વીસલટેવને	૪૦૦૦૦૦
સિંધના રાજ હુમીરટેવને	૬૦૦૦૦૦
મેવાડના રાજને	૧૬૦૦૦૦૦
માળવાના રાજ મહનવર્માને	૬૦૦૦૦૦
કાર્યીના રાજ પ્રતાપસિંહને	૧૬૦૦૦૦૦
કંદહારના રાજને	૬૦૦૦૦
દિલહીના ખાદ્શાહ નાસિરદીનને	૧૦૫૦૦૦૦
	<hr/>
	૬૨૧૦૦૦૦

આ સિવાયના પણ નાના મોટા રાજ્યાને તેમણે  
ધણું અનાજ આપેયું હતું.

જગડુશાહ તરફથી નાની નાની સદાતનશાળાએ  
ધાર્યી ચાલતી હતી. પણ આ દુકાળને પહોંચી વળવા  
માટે તેમણે મોટી દાનશાળાએ નીચે મુજબ  
ચાલુ કરી હતીઃ

શ્વાકંઠા, સોરઠ અને ગુજરાતમાં	૩૩
મારવાડ, ધાર અને કંચિયાં	૩૦

મેવાડ, માળવા અને ઢાલમાં	૪૦
ઉત્તર ભાગમાં	૧૨
૧૧૫	

આ દાનશાળામાં ખખા થઈને હંમેશના પાંચ લાખ માણસોને લોજન આપવામાં આવતું હતું. એક પાટણની દાનશાળામાંજ હંમેશાં વીસ હબર ભાણુસાને જમાડવામાં આવતા હતા ! જગડૂશાહુ આ દુકાણમાં ૪૮૮૫૦૦૦૦ મણુ દાનશાળાઓમાં મરત વાપર્યું અને ૧૮ કોડ માસા એટલે ૪૩ કોડ રૂપિયા નગદ વાપર્યા ! મોટા મોટા રાજ મહારાજાઓ પણ જગડૂશાહની આ ઉદ્ઘારતા જોઈ તેની પ્રશંસા કરવા લાગ્યા અને તેને 'જગતના પાલનહાર 'તુ' બિકૃદ આપ્યું. આજે પણ ડાઈમહાન દાનેશ્વરીને જગડૂશાહની ઉપમા અપાય છે તે આટલાજ માટે.

સંવત ૧૩૧૬ ની સાલમાં વરસાદ સારો થયો અને દુકાણ મટી ગયો. આટલું ધન વાપર્યા પછી પણ જગડૂશાહને ધનની ખોટ નહોંતી પડી. લક્ષ્મી તો પ્રતિદિન વંતીજ જતી હતી.

: ૭ :

એક વખત ચાંચિયા લોકાને મીણુથી ભરેલું

એક વહાણું સમુદ્રમાંથી મળી આવ્યું. તેમને સમજ ન પડી હું એનું શું કરવું! બધા વિચારમાં પડ્યા. એવામાં એકને જગડૂશાહ યાદ આવ્યા એટલે તે બોલી ઉઠ્યો: ‘ચાલો જગડૂશાહ પાસે. આ વહાણું તેમને વેચીને ખન ભેળવીએ.’ બધાને આ વાત ગમવાથી જગડૂશાહ પાસે આવ્યા અને કહેવા લાગ્યા: ‘હે શેડ! અમને મીણુથી ભરેલું એક વહાણું મળી આવ્યું છે. આપને તે કામ લાગશે માટે ખરીદવાની ઈચ્છા હોય તો કહો.’

જગડૂશાહને મીણુની ખાસ જરૂર નહોતી પણ બિચારા પેતાનું નામ પૂછતા આવ્યા છે આટે નિરાશ ન કરવા એમ વિચારી એ મીણુ ખરીદી લીધું. એમાં મીણુના ૫૦૦ મોટા ચોરસા હતા.

કેટલાકને આ વાત ન ગમી પણ જગડૂશાહને કહેવાની હિંમત ઢાણું કરે? આ વાતને ત્રણ માસ પસાર થઈ ગયા. પછી એક વખત કામ પ્રસંગે સગડી સળગાવવામાં આવી અને તેમાં ડાઇએ રમતમાં પેલા મીણુનું ચોરસું ઝેંકયું. થોડીવારમાં મીણુ ઓગળી

ગયું ને અંદરથી સોનું છળકયું. જગડૂશાહે તપાસ કરી તો સોનું શુફ્ફ જણ્યાયું. એ પાંચસો ચારસામાંથી તેમને અઠળક ધન મળ્યું. જે હે તે બધું એમણે પરાપકારના કામોમાંજ ખરવી નાંખ્યું.

આ રીતે જગડૂશાહને વેપાર ઉપરાંત અણવાર્યા પ્રસંગોમાંથી અઠળક ધન મળેલું અને એથી એમને ધનની ઓટ પડીજ નહિ !

ભારતવર્ષના આ મહાન દાનવીરે પૈસો સારા ઢેકાણે વાપરી પૈસાદારોને જુદોજ માર્ગ બતાવ્યો. ડેટલાંક વર્ષ પછી જ્યારે તેમનું મરણ થયું ત્યારે દેશભરમાં શોક ઝેલાઈ ગયો. હજરો લોકો છુટા મોંચે રડવા લાગ્યા.

‘જગતનો પાલનહાર’ જતાં ઢાને હુઃઘ ન થાય ?  
જે હે જગડૂશાહનો પોતાનો વંશ ચાલ્યો નથી પણ  
જગતપર જ્યાં સુધી દાનનો મહિમા રહેશે ત્યાં સુધી  
એમનું નામ અમર રહેશે. જગતને આવા અનેક  
જગડૂશાહ પ્રાપ્ત થાય !

ભાગમંથાવળી :: પ્રથમ શેષી :: ૨૦

# ધર્મ માટે પ્રાર્થા આપનાર મહાત્માઓ

∴ લેખક ∴

ધીરજલાલ ટોકેરશી શાહ



સર્વ હક્ક રવાધીન

આવૃત્તિ ચોથી

પ્રત ૧૨૫૦

સંવત ૧૯૬૧

મૂલ્ય સર્વ આનો.

પ્રકાશક :  
 ધીરજખાલ ટોફરસી શાહ  
 જ્યોતિ કાર્યાલય  
 નગરશેઠ મારકોટ, રતનપોળ,  
 અ. મ હા વા દ.

આ પુસ્તક મુખ્ય ધલાકા ડેળવણીભાતા તથા વડોદરા રાજ્ય  
 કેળવણીભાતા તરફથી ધનામ-લાઘબેરી માટે મંજૂર થયેલું છે,  
 તેમજ નૈન રૂપો એન્યુકેશનલ ઓર્ડની ધાર્મિક પરીક્ષાના  
 ખાળ ધોરણું પ્રથમ તથા કન્યા ધોરણું પ્રથમમાં પાઠ્યપુસ્તક  
 તરીકે સ્વીકારાયેલું છે. ધી. ટો. શાહ.

∴ સુદ્રક ∴

મણિલાલ છગનલાલ શાહ.  
 સુદ્રાસ્થાન: વીરવિજય: ગ્રી. પ્રેસ  
 કાળુપુર ટંકશાળ ઃ અમદાવાદ.

## ધર્મરૂપિ આળુગાર.

: ૧ :

નાગિલા પ્રાણશીંચે ભાતભાતનાં બોજન કર્યાં.  
તીખાં તમતમતાં શાક કર્યો. તેમાં તુંખડાનું શાક કરતો  
કોઈચે તુંખડાં ચાખ્યાં નહિ. પછી તૈયાર થયેન્યાં ઠામ  
જિધાડીને એક પીતો લુને અડાડયો ત્યાં કડવો ઓર ।  
તે સમજ ગર્દ કે શાક કડવા તુંખડાનું થયું. કોઈથી  
આ ખવાશે નહિ. એટલે તે ખાજુચે મૂફ્યું. બોજનનો  
સમય થયો એટલે સહુ આવ્યા ને જમી ઉઠયા.

એવામાં ‘ધર્મલાભ’ કહેતા ધર્મરૂપિ નામના એક

સાધુ તેને ત્યાં બિક્ષા લેવા આવ્યા. એક માસના તે ઉપવાસી હતા. નાગિલાંચે વિચાર્યુઃ “ લાવ ! આ શાક આ સાધુનેજ આપી હઉં. કોણું ખાડાર નાખવા જય છે ! ખધું શાક સાધુને વહેરાંથું.”

ધર્મરૂપિ આ આહાર લઈ પોતાના ગુરુ ધર્મધોષ આગળ આવ્યા. ગુરુ આહાર સુધીને જ બોલ્યા: “ હે શિષ્ય ! આ આહાર વાપરીશ નહિ. નહિતર તારું મરણું થશે. જ્યાં જીવડાં ન હોય એવી ભૂમિમાં તેને પરઠવી આવ ! હવેથી આવો આહાર લાવીશ નહિ.”

ધર્મરૂપિ આહારને પરઠવવા ગામ ખાડાર ચાલ્યા. એવામાં શાકના રસનું ટીપું લોંય પડયું. એ ટીપાની સુગંધથી લોભાદ ડેટલીક કીરીએ ત્યાં આવી ને ચાટી ગઈ. તરત જ તે મરણું પામી. આ જેદ ધર્મરૂપિ મુનિએ વિચાર્યુઃ ‘ અહો ! આ શાકના એક ટીપાથી આટલા બધા જીવ મરણું પામ્યા તો આ બધા શાકથી ફેટલા જીવોનો સંહાર થશે ? માટે મનેજ મરવા દે. મારા મરવાથી ધણા જીવ બચ્યી નશે.’ એમ વિચારી બધું શાક ખાઇ ગયા. પછી ધ્યાન ધરી લીધું ને જગતના સર્વ જીવોની ક્ષમા મારી લીધી. થોડીવારમાં એરી શાકની

અસરથી સુનિરાજનું મરણ થયું. છેલ્દી ધડી સુધી શુભ આવના રાખવાથી તે દેવલોક ગયા.

આટલી હદ્દ સુધી અહિંસા પાળનાર કેટલા મહા-ત્માએ હશે ?

## ગજસુકુમાળ

: ૨ :

શ્રી નેમનાથ મધુર વાણીથી ઉપદેશ દેતા હતા. ત્યાં શ્રીકૃષ્ણ મહારાજના નાના ભાઈ ગજસુકુમાળ આવ્યા. તેમણે તે ઉપદેશ સાંભળ્યો ને વૈરાગ્ય થયો. એટલે પોતાની માતા દેવકીજીપાસે ગયા ને દીક્ષા દેવાની રણ માગી. દેવકીજીએ તેમને ધણું ધણું સમજલ્યા હે “પુત્ર ! તારી ઉભ્યર નાની છે. સંજમ ખૂબ દોષલો છે. તારાથી એનહિ પળાય.” પણ ગજસુકુમાળની આવના હૃદ હતી એટલે છેવટે રણ આપી. ગજસુકુમાળે દીક્ષા લીધી.

દીક્ષા લઈને તેમણે પ્રભુને હંદું હે “પ્રભો ! મોક્ષ જલદી મળો તેવો ઉપાય બતાવો !” પ્રભુ નેમનાથ હે, “ધ્યાન ધરીને ઉલા રહો. મન વચન ને કાયાને ખરાખર પવિત્ર કરો ! ”

ગજસુકુમાળે રમશાનમાં જઈને ધ્યાન લગાવ્યું.

આ વખતે ગજસુકુમાળનો સાસરો સેમિલ આણણું ત્યાં થઈને નીકળ્યો. તેણે ગજસુકુમાળને આ હાલતમાં જેયા. એટલે ખૂબ ચીડાયો. દાંત પીસીને બોલ્યો: “અરે ! તેં તો મારી ઢીકરીનો ભવ અગાડ્યો ! તારે જે એને નહેઠતી પરણવી તો સગપણ શા માટે કર્યું ?” આમ બોલતાં બોલતાં તેનો છોખ ખૂબ વધી ગયો. ગજસુકુમાળને શું કરી નાયું એવા વિચારમાં ખૂબ વાવા લાગ્યો. જ્યારે તેના છોખની હદ ન રહી ત્યારે ધગધગતા અંગારા એક ઘડાનો ઢીખમાં લાર્યા ને તે ઢીખ ગજસુકુમાળના માથે મૂકી.

ગજસુકુમાળનું હૈયું ક્ષમાનું સરોવર હતું. તેમનું શરીર દાંતે પણ મન દાંતે એમ હતું નહિ. એ તો ઉલટા વિચાર કરવા લાગ્યા કે “ ડાર્ઢ સસરા તો વીસ પચીસની પાંખડી બંધાવે પણ આ સસરાએ તો મોકા મળે એવી પાંખડી બંધાવી ! હે જીવ ! શાંતિથી આ પ્રસંગ સહન કરી લે. આવા પ્રસંગ ધડીએ ધડીએ નહિ. મળો.” એમ વિચાર કરતાં તેમના દૃદ્ધયમાંથી ક્ષમા ઓદા-

રાવા લાગી. સમતા છલડાવા લાગી. અને તેમને કેવળ-  
જ્ઞાન ઉત્પન્ન થયું.

અંગારાથી માથું તપતાં થોડીવારમાં તે મરણ  
પામ્યા ને ચોક્સે ગયા.

હે નાથ ! આવા ક્ષમાસાગરની ક્ષમા અમારામાં  
આવને !

## અવંતિસુકુમાળ

: ૩ :

ઉજ્જેણી નગરીમાં ખીલતા બેઘનનો એક ખાળ  
શ્રીમંત. અત્રીશ સ્ત્રીઓનો તે સ્વામી છે. અનેક મેડી  
મહેલાતોનો ધણી છે. તેના પિતા ધનદાત શેઠ ગુજરી  
ગયા છે. અને ભદ્રામાતા ધરનો બધો કારભાર ચલાવે છે.

એક વખત આર્યમહાગિરિ મહારાજ ભદ્રા શેઠા-  
ણીની પરશાળમાં ઉત્થાયો. ત્યાં એક વખત સધળા સાધુ  
નલિનીગુદમ વિમાનની સજગાય બણે. અવંતિસુકુમાળે  
એ સજગાય સાંભળી એટલે તેમને થયું કે જે કંધા-  
દિક આવું અનુભવ્યું છે. એટલે ગુરુ આગળ આવ્યા.

ને હાથ જોડી યાદ્યાઃ “ગુરુમહારાજ ! આતું સુખ શી  
રીતે ભણે તે સમજવો ! ” ગુરુમહારાજ કહે “ જે શુદ્ધ  
ચારિત્ર પાળે તે મોદ્દે જય. મોહસહિત ચારિત્ર પાળે તો  
દેવતોંડ જય.” અવંતિસુકુમાળ કહે : “તો આપ મને  
દીક્ષા આપો. ” ગુરુ કહે : “તમારી માતાની રજ લાવો  
તો દીક્ષા આપીએ. ” અવંતિસુકુમાળ માતા પાસે  
ગયા, ને દીક્ષા લેવાની રજ માણી. માતા ખૂબ હુઃખી  
થયાં. સ્થીએ ખૂબ હુઃખી થઈ. પણ આપરે સમજુને  
તેઓએ રજ આપી.

અવંતિસુકુમાળે દીક્ષા લીધી પછી ગુરુને કહ્યું કે  
“ ગુરુરાજ ! મારે તો જલદી મોક્ષ ભણે એવો રસ્તો લેવો  
છે. એટલે જે આપ આજા આપો તો કંથેરીના (થારના)  
વનમાં જઈને અનશન કરું.” ગુરુ કહે : ‘તમને સુખ  
હપને તેમ કરો. ’

અવંતિસુકુમાળ યાદ્યા. નગરથી થાડે દૂર કંથે-  
રીનું ભયાનક વન હુંતું ત્યાં ગયા. કંથેરીના વનમાં  
પેસતાં કઠોર કાંટા વાગ્યો. પગે લોહીની ધાર થઈ.  
પણ અવંતિસુકુમાળે મનમાં જરાપણ હુઃખ આણું  
નહિ. તેમણે અનશન શરૂ કર્યું.

હજુ અનશન શરૂ કર્યાને થોડીવાર થધ છે ત્યાં તો એક શિયાળ વોઢીની ગંધે આવી પહોંચી. તે નવી વીચાયેલી ને ભૂખી ડાંસ એટલે અવંતિસુકુમાળ મુનિના પગ કરડવા માંડ્યા. અહા ! ડેવું સંકટ ! પણ જેણું મન મજબૂત એને થું ? એ તો ધ્યાનમાંજ ઉભા રહ્યા.

શિયાળ બટાક બટાક બચકાં ભરતી આપો પગ ખાઈ ગઈ. પણ અવંતિસુકુમાળ ધ્યાનમાંથી ડગ્યા નહિ. થોડીવાર થધ એટલે બીજે પગ કરડી ખાદ્યા છતાં મનમાં જરાપણ દુઃખ ડેઅરેકારે નહિ ! ડેવળ શુભ ધ્યાન ! શુભ ચિંતવન ! શિયાળ તો આજ ખાડું ખાડું કરી રહી હતી. તેની ભૂખ કાંદ એટલેથી અટકી નહિ. તેણે પેટ ખાધું, છાતી ખાધીને માથું પણ ખાઈગઈ. સાંજ રાંખે ત્યાં ડેવળ હાંડકાં ખાકી રહ્યાં.

ભડવીર અવંતિસુકુમાળ અડગ ધ્યાનથી નલિની-શુભ વિમાનમાં ઉત્પત્ત થયા.

બીજ દ્વિસનું વહાથું વાયું એટલે ભદ્રામાતા તથા તેમની સ્ત્રીએ આર્યમહાગિરિ મહારાજના દર્શાને આવી. અવંતિસુકુમાળના ખખર પૂછવા લાગી. આર્ય-મહાગિરિ મહારાજ કહે, “ કંથેરીના વનમાં અવંતિ-

સુકુમાળે અનશન કર્યું છે." માતા તથા સ્ત્રીઓ તેમને  
વાંદવા કંયેરીના વનમાં ગયાં. પણ લાં શું જુઓ ?  
ક્ષેત્રયાઙું વરની જગાએ લોહી ખરડયાં હાડકાં પડેલાં  
દીઠ્યાં. ભદ્રા આ જેતાં બેબાન થઈ ગઈ. સ્ત્રીઓ કારમુ  
રહન કરવા લાગી પણ આ અધારી શું વળે ? આ  
ખનાવ પર વિચાર કરતાં તેમને પણ વૈરાગ્ય થયો ને  
માતા તથા ઉંસુકુમાળની દીક્ષા લીધી. કુક્ત એક  
ગર્ભવતી સ્ત્રી બાકી રહી.

આ ગર્ભવતી સ્ત્રીને એક પુત્ર થયો, તેણે પોતાના  
પિતાના યાદગાર મરણુની જગાએ મહાકાળ નામે  
સુંદર દહેરું આંધ્યું. આજે પણ ઉજનેણીથી યોડે છેટે  
અવંતિપાર્થનાથને નામે એ દહેરું એળખાય છે.  
હારો જ્ઞાનાળો. ત્યાં જઈને એ કથા સાંભળે છે ને  
સમતાના બંડાર અવંતિસુકુમાળનાં વખાણ કરે છે.

આપણાથી આ મહાપુરુષનાં ગુણ શી રીતે  
ગવાય ?

## મુનિશ્રી મેતાર્થ

: ૪ :

ખરા ખપોરનો સમય છે. અંગારા ક્રવો તાપ પડે છે. આ વખતે રાજયુહી નગરીમાં માસના ઉપવાસી એક સાધુ બિક્ષા લેવા કરી રહ્યા છે. ધીમે પગલે ને નીચી નજરે ચાલતાં તેઓ એક સોાનીના ધર આગળ આવ્યા. લાં સોાની સોનાનો હાર ધડે છે. તેના માટે સોનાનાં જવલાં તૈયાર કરે છે. સોની મુનિરાજને જોઈ ખૂબ હરખાણો. એ હાથ લેડી વિનંતિ કરવા લાગ્યો. “હે મુનિરાજ ! મારું આંગણું પાવન કરો. મારા ઘેરથી બિક્ષા લો.” ‘ધર્મલાભ’ બોલીને મુનિ-  
રાજ તેના ધરમાં દાખલ થયા.

સોની સોનાનાં જવલાં એમને એમ મૂકી રસો-  
ડામાં ચાલ્યો. લાં જઇ બિક્ષા આપવાની તૈયારી કરવા  
લાગ્યો. એવામાં ત્યાં એક છોંચ પક્ષી આવ્યું. તે સોનાનાં  
જવલાં ચરી ગયું. જવલાં ચરીને તે પાસેના ઝાડની  
ડાળીએ બેહું. મુનિરાજ આ જેયું.

સોની રસોડામાંથી બહાર આવ્યો. મોદક મિઠા-ઇનો થાળ લાવ્યો. ઉત્તમ ભાવે મુનિરાજને તે બિક્ષા વહોરાવી. મુનિરાજ ચાહ્યા. સોની દુકાને આવ્યો. જુઓ તો સોનાનાં જીવલાં નહિ! અરે! અહીંથી સોનાના જીવલાં કયાં ગયાં? તેના પેટમાં ફીણ પડી. અહીં જેયું, તહીં જેયું, પણ કયાંય સોનાનાં જીવલાં નહિ. તેને લાગ્યું કે જરૂર પેલા સાધુ આ જીવલાં જિપાડી ગયા. લાવ તેને પફકીને તપાસ કરું.

મુનિરાજ તો ભાસના ઉપવાસી હતા. એટલે હજી તો આંગણું છોડ્યું નહોતું. સોનીએ સાધુને પફકીને ઉભા રાખ્યા અને પૂછ્યું: “સોનાનાં જીવલાં કયાં છે?” મુનિરાજ વિચાર કર્યો. જો કૌંચ પક્ષીની વાત કહીશ તો બિચારનો જીવ જરો. માટે શાંતન રહેવા દે. તેમણે કાંઈ જવાબ આપ્યો નહિ. સોનીની થંકા મજબૂત થધ. તેણે એ ત્રણ વખત મુનિને પૂછ્યું પણ જવાબ મર્યાદા નહિ. આથી તે ખૂબ કોધે ભરાયો. પાસે આળું ચામડું પડ્યું હતું. તે કસકસીને મેતાર્ય મુનિના માથે બાંધ્યું. પણ મેતાર્ય મુનિ સમતાના ભંડાર. તે કાંઈ પણ બોલ્યા નહિ.

સોનીએ તેમને પકડીને તડકામાં બેસાડ્યા. છતાં તે શાંત રહ્યા. તાપથી ચામડું સંકોચાવા ભાંડયું ને ભાથામાં ચસકા આવવા લાગ્યા: “ હે જીવ ! આવેલું કુઃખ શાંતિથી સહન કરી લે ! દુઃખથી જરાયે ડરીશ નહિં.” આ વિચાર કરતાં તેમનું મન પવિત્ર થવા લાગ્યું ને યોડીવારમાં તે એટલી હદે પહેંચ્યું કે તેમને કેવળજ્ઞાન થયું.

અહીં તાપથી ચામડું ખૂબ સંકોચાણું ને મેતાર્ય મુનિની બંને આંખો બહાર નીકળી ગઈ. તેમની ઐપરી ફાટી ગઈ. સમતાના સાગર મેતાર્ય મુનિરાજ નિર્વાણ પામ્યા.

એવામાં ડાઢ કઠિયારણે આવી ધ્યાન લેતાં કાઢીનો ભારો પછાડ્યો. અચાનક ધ્યાનની કૌંચ-પક્ષી બીજું ને ચરકી ગયું. સોની જુણે તો ચરકમાં સોનાનાં જ્વલાં ! તરતજ તેને કમકમાટી છૂટી. મેં હુણે શું કર્યું ? નિર્દેખ મુનિરાજના પ્રાણું લીધા ! પણ હવે શું થાય ? રાજને ખખર પડશે તો ગરદન મારશે. એટલે તેણે એજ મુનિરાજનાં કપડાં પહેર્યાં ને સાધુ થર્ધ ચાલી

નીકળ્યો. પછી દોષલો સંજમ પાળ્યો ને આત્માનું  
કલ્યાણ કર્યું.

ખરેખર ! “ ભેતાર્ય મુનિવર ધન્ય ધન્ય તુમ  
અવતાર ! ”

## સુકોશલ મુનિ

: ૫ :

રાજર્ષિ કીર્તિધર ને તેમના પુત્ર રાજર્ષિ સુકોશલ  
બને એક બયંકર વનમાં થઈને પસાર થતા હતા. લ્યાં  
એકાએક વિકરાળ વાધણુ દેખાણી. કચો માણુસ આની  
આગળથી નાશી જઈને જીવ બચાવવાની મહેનત ન  
કરે ? પણ આ રાજર્ષિઓ તો નાસવાનો પ્રથતનજ  
કરતા નથી. તે તો જિલટી અંદર અંદર વાત કરે છે !

કીર્તિધર કહે, “ સુકોશલ ! તમે પાછળ રહો !  
પહેલાં મને સંકટ સહેવા દો. ”

સુકોશલ કહે : “ ક્ષમાશ્રમણ ! આવું શું બોલો  
છો ? સંકટને કઢી હું ગણુકારતો નથી. લડવા નીકળેલો  
બહાદુર લડવૈયો શું પાછો વળો ? માટે કૃપા કરી મનેજ  
એ ઉપસર્ગ સહેવાની તક આપો ! ”

સુકોશલ મુનિ આગળ આવીને ઉલ્લાસ રહ્યા. ઈષ્ટ-  
દૈવતું ધ્યાન ધર્યું. વિચારવા લાગ્યા. “અરે જીવ ! આ  
શરીરના મોહને લીધે તું ધણું કાળ સંસારમાં રખડ્યો  
છે માટે હવે તે શરીરનો મોહ છોડી દે ! અને સર્વ  
જીવોને સરખા ગણ્ણી તેમની ક્ષમા ભાગ ! ” પછી તે  
મનમાં એદ્યાઃ

ખામેથિ સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મે ।  
મિત્તી મે સવ્વભૂએસુ, વેરં મજ્જં ન કેણાં ॥

એટલે સર્વ જીવોની ક્ષમા ભાગું છું : સર્વ જીવો  
મને ક્ષમા આપને. મારે સર્વેની સાથે મિત્રતા છે.  
કોઈ પણ સાથે વેર નથી.

એવામાં વાધણું તરાપ મારીને સુકોશલ મુનિના  
શરીર પર કુદી. પોતાના ભયંકર પંચ ને વિકરાળ  
દાંતથી તેમના શરીરને પ્રાડવા લાગી. પણ સુકોશલ  
મુનિ શાંત દ્વારામાં છે. હૃદ્યને પવિત્ર કરી રહ્યા છે.  
યોડા વખતમાં તે પવિત્રતા છેલ્લી હુદે પહોંચ્યી.  
તેમને ડેવળજ્ઞાન થયું.

વાધણું તેમના શરીરનો લક્ષ કરી ગઈ. તે નિવીણું

પાભ્યા. જીતિંધર બચી ગયા. તેમણે આકરાં તપ કર્યો  
ને તેના પ્રલાવથી મોક્ષ મેળગ્યું.

ધન્ય છે ભડવીર સુડોશલને !

## ખંડક મુનિના પાંચસો શિષ્ય

: ૬ :

વીચમાં તીર્થીકર પ્રલુ મુનિસુત્ત આગળ રાજપુત્ર  
ખંડક પાંચસો માણુસ સાથે દીક્ષા લીધી. પછી ધર્મનો  
ઘૂંઘ અભ્યાસ કરવા લાગ્યા. થોડા વખતમાં તે મહા-  
જ્ઞાની થયા એટલે પ્રલુએ તેમને પાંચસો સાધુના  
આચાર્ય નીભ્યા.

એક વખત પોતાના બનેવીને બોધ આપવા  
તેમણે કુંભારટ નગરે જવાની પ્રલુ આગળ આજ્ઞા માળી.  
પ્રલુ કહે, “ ત્યાં જવામાં તમારા બધાના જીવનું બેખ્મ  
છે. ” ત્યારે ખંડકાચાર્ય પૂછ્યું, “ પણ એથી અમારું  
કદ્યાણ થશે કે નહિયું ? ” પ્રલુ કહે, “ તમારા સિવાય  
સહૃદું કદ્યાણ થશે. ”

ખંડકાચાર્ય કહે, “ તો મારું કદ્યાણ થયું

માનીશ. ” તે પાંચસો સાધુ સહિત કુંબારકટ નગરની  
પાસે આવ્યા.

કુંબારકટ નગરનો રાજ દંડક હતો. તેનો પ્રધાન  
પાલક હતો. એક વખત તે ખંડક મુનિના ગામ  
આવેલો. ત્યારે રાજકુમાર ખંડક સાથે ચર્ચા થયેલી તેમાં  
તે હારેલો. ત્યારથી તેને ખંડક પર વેર ખંધાયું હતું.  
તે મૂળથી સાધુઓનો શનું હતો. તેમાં વળી ખંડકા-  
ચાર્યને જેયા એટલે તેનું વેર તાજું થયું. કોઈ પણ રીતે  
આ સાધુઓનો ધાર ધડવા વિચાર કર્યો.

ખંડકાચાર્ય ને બાગમાં જિતરવાના હતા ત્યા ટેટ-  
લાંક હથિયાર ફાઠવ્યાં.

ખંડક મુનિ પોતાના શિષ્યો સહિત બાગમાં  
જિતર્યા. ત્યાં રાજ, પ્રધાન તથા ખંડી રૈયત તેમનો ડપ-  
દેશ સાંકળવા આવ્યાં. પછી રાતે પાલક પ્રધાને જઈને  
રાજને કહ્યું: “ મહારાજ ! ચાં ખંડક તો બડો ખગ-  
ભગત જણ્યાય છે. સાધુના વેશમાં સારામાં સારા લડ-  
વૈયાચ્યાને લાંયો છે. એમની મહદ્દ્યી તે આપણું  
રાજ્ય લેવા દુચ્છે છે. એની ખાત્રી કરવી હોય તો તે

સાધુએ જિતર્યા છે તેની નીચે ખોદાવો એટલે ખધું  
માલ્કુમ પડશે. ”

દંડક રાજ્યએ તેમ કર્યું તો ત્યાંથી હથિયાર નીક-  
જ્યાં. હથિયારને જોતાંજ દંડક રાજ ચિડાયો ને  
પ્રધાનને આજ્ઞા કરી કે “આ દુષ્ટોને ઠીક લાગે તે શિક્ષા  
કરો. એમના માટે મને કાંઈ પૂછશો નહિં. ”

પાલક પ્રધાનનો દાવ સર્જળ થયો. તેણે માણુસને  
મારવાની ધાર્ણી તૈયાર કરાવી અને તે બાગમાં ગોડવી.  
પછી ખંડકાચાર્યને હુકમ ફરમાયો કે રાજના ગુનહે-  
ગાર તરીક તમને ધાણીએ ધાલીને પીલી નાંખવામાં  
આવશે.

બસ ! હુકમ ફરમાવીને તેણે પોતાનું કરપીણ કામ  
શરૂ કર્યું. ખંડકાચાર્ય દરેક સાધુને છેવટની શાંતિ  
રાખવા માટે ઉપદેશ દે છે. દરેક સાધુ શાંતિને ધારણું  
કરી દૃષ્ટેવનું નામ લેતો ધાણીપર જઈને છબો રહે છે.  
પાલક પ્રધાન તેને પીલે છે ને રાજ થાય છે. આ  
પ્રકારે ચારસો નવાણું સાધુનો સંહાર કર્યો.  
છેવટે સહૃથી નાના એક સાધુને ધાણી આગળ લાવ-  
નામાં આવ્યા ને ખંડકાચાર્યનું હૈયું દ્યાથી જિલ-

રાઈ ગયું. તે પાલકને કહેવા લાગ્યા: “ મહાતુભાવ ! ખહેલાં મને પીલ જેથી આ બાળસાધુની હત્યા મારે જેવી ન પડે. મારું આટલું વચ્ચન માનીજા ! ” પાલક પ્રધાનને તો હુઃખ થાય તેમ કરવું હતું એટલે તેણે તે બાળસુનિને ધાણીએ ધાટ્યા ને ખંડકાચાર્યના દેખતાં પીલી નાંખ્યા. ખંડક સુનિ શુદ્ધ જાવે મરવાથી નિર્વાણ પામ્યા.

હવે આંદો આચાર્યનો વારો. તેમને તો છેલ્લી હત્યાથી રગેરગમાં કોષ વ્યાપી ગયો હતો. એટલે છેલ્લી ધડીએ માગી લીધું કે “ જો મારા જપતપતું ફળ હોય તો આ રાજ, પ્રધાન તથા આખા દેશનો નાશ કરનાર થાઉં.” ખંડક સુનિ ધાણીમાં પીલાયા. તે પરલોક ગયા. કહે છે કે તે અગિનકુમાર દેવ થયા. તેમણે દંડક રાજનો આપો દેશ બાળીને ભર્તમ કરી નાંખ્યો. ફાલ્યો કુલ્યો દેશ વેરાન થઈ ગયો. દંડકારણ્યને નામે હજી પણ તે આખાય છે.

ધન્ય છે ! ખંડક સુનિના પાંચસો શિષ્યને જેમણે મરી જણ્યું !

## ખંડક મુનિ.

: ૭ :

નમો નમો ખંડક મહામુનિ. ખંડક મુનિ ક્ષમાના ભંડાર હતા. શાવસ્તીના રાજ કનકેતુ તેમના પિતા ને ભલયાસુંદરી તેમની માતા હતી. એક વખત સાધુ મુનિરાજના હૃપદેશથી તેમને વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી. જેવી શુદ્ધ જ્ઞાનાચે દીક્ષા લીધી હતી તેવીજ તે પાળતા હતા. સદાચે આકરાં તાપ કરે. સંકટ આવ્યે હસતે ચોઢે સહુન કરે. એમ કરતાં એક દિવસ પોતાની બહેનના ચહેરમાં આવ્યા.

બહેન બનેવી ગોખે બેઠાં નગરની શોબા જુગ્યે છે. ત્યાં દૂરથી મુનિરાજ હેખાયા. બહેન ગોખમાં બેઠાં પારખ્યું ડે મુનિરાજ મારો માડીજયો વીર છે. તે સાધુ સામું જેઈ રહ્યી. દડ દડ તેની આંખમાંથી આંસુ સથાં.

આ જેઈ રાજ ચમક્યો. મનમાં વિચારવા લાગ્યો. આ તે કેવો સાધુ ડે જને જેઈને રાણીને રડવું આવે છે !

નકી રાણીને એની સાથે આડો સંબંધ હશે. ચાલ ! ત્યારે એ હુષ્ટની ખખર લઈ. રાજ ત્યાંથી છૂટો પડ્યો. પોતાના સેવકાને હુકમ કર્યો કે પેલા સાધુની જીવતાં ચામડી જિતારી લાવો. સેવકો દોડયા. અંધક મુનિ પાસે પહેંચ્યા અને તેમને જહેર કર્યું : “રાજનો હુકમ થયો છે કે તમારી જીવતાં ચામડી જિતારવી.” અંધક મુનિવર કહે : “ વાહ ! સમતાની કસોટીનો ધણ્યો. સુંદર પ્રસંગ મળ્યો. ભાઈ ! યુશીથી તમારા રાજનો હુકમ ખખલ્યો. પણ મને કહો કે હું કેવી રીતે હબો રહું જેથી તમને તમારું કામ કરતાં હરકત ન થાય.”

અમૃતતું સરોવર છલકાય એવી મુનિવરની વાણી ! આ સાંભળતાંજ સેવકાના હાથ ઢીલા પડી ગયા. પણ રાજનો હુકમ યાદ આંદોલાને પોતાનું કામ કરવા તૈયાર થયા.

રાજસેવકાએ પ્રસી તૈયાર કરી. અંધક મુનીથર શાંતબાવે મનમાં બોલ્યા :

ચત્તારિ સરણ પવજ્જામિ ।  
અરિહિંતે સરણ પવજ્જામિ ।

સિદ્ધે સરણ પવજ્જામિ ।

સાહૂ સરણ પવજ્જામિ ।

કેવળીપન્તું ધર્મં સરણ પવજ્જામિ ।

એટલે ચારતું શરણું અંગીકાર કરું છું. અરિહંતનું શરણું અંગીકાર કરું છું. સિદ્ધનું શરણું અંગીકાર કરું છું. સાધુતું શરણું અંગીકાર કરું છું. ડેવળી ભગવાને કહેલા ધર્મનું શરણું અંગીકાર કરું છું.

બસ આટલું ઓલોને ખંડક મુનિએ ધ્યાન લગાવી દીધું.

રાજસેવકા ફરસીથી તેમની ચામડી ઉતારવા લાગ્યા. ચડ ચડ ચામડી જિતરે પણ મુનીથર ધ્યાન-માંથી ડગે નહિ, મનમાં જરા પણ ઓટા વિચાર લાવે નહિ, સમતાનેજ ધારણું કરે! એમ કરતાં સમતા ભર-પૂર થઈ એટલે ત્યાંજ ખંડક મુનિને ડેવળજ્ઞાન થયું.

અહીં તેમના આખા શરીરની ચામડી જિતરી ગઈ એટલે તે નિર્વાણ પામ્યા.

આ હત્યાકંડની જગાએ સમડીએ જિડવા માંડી. ને માંસ ખાવા લાગી. તેમાંથી એક સમડીએ લોહી-

ખરડી સુહપત્તિ ને એધો માંસ જાણીને જિપાડયાં.  
અન્યું એવું કે થાડે જતાં સમડીના પગમાંથી તે સરકી  
ગયાં ને ખરાખર રાજમહેલની અગાશીમાં પડયાં.

અહેને આ જેયું ને જાહુયું એટલે ભૂચર્છી આવી.  
તેના દુઃખનો પાર રહ્યો નહિ. ભાન આવતાં તેને વૈરાગ્ય  
થયો ને તે સાધ્વી બની. લાંઘો વખત પવિત્ર જીવન  
ગાળીને તે નિર્વાણ પાખી.

વાંચક ! શાંતભાવે એકાદ વખત આ ખંડક  
સુનિની સજ્ઞાય ગાજે કે:

નમો નમો ખંડક મહાસુનિ,  
ખંડક ખીમા બંડાર રે !



વિવિધ પુસ્તકો માટે  
 તમારો લાયથ્રેસી ઓર્ડર  
 કૃથાં આપશો ?  
 વબોથી જાણીતા થયેલા

## જ્યોતિ કાર્યાલયમાંજ

કારણ કે

તેની

ત્રણ વિષેશતાએ છે :

નિયમિતતા

ચોણ્ય કમિશન

ચોક્કો વ્યવહાર

આજે જ લખો : જ્યોતિ કાર્યાલય.

નગરશીઠ મારકોટ, રતનપોણી-અમદાવાદ.